|| સનાતન પરમો ધર્મ ||

Dharm Patrika (MONTHLY) R.N.I. No.- MAHGUJ/2016/68522

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું મુખપત્ર

(Trust Regd. No. A-828 Nakhatrana Kutch Dt. 6-4-1965)

પ્રચાર પ્રસાર ... ઉજાગર

સનાતન ધર્મ પત્રિકા

Email : office@sanatandharmpatrika.com | Web : www.sanatandharmpatrika.com

VOLUME : 2 ISSUE : 16 MUMBAI DATE: 11 OCTOBER 2017 PAGES : 84 PRICE: 20/-

ભાવાંજલિ



ઉમર: ૮૩ વર્ષ

સ્વર્ગવાસ: ૨૮-૦૯-૧૯૭૦

સ્વ. રતનશીભાઈ ખીમજીભાઈ ખેતાણી

- જ્ઞાતિની પ્રથમ કેન્દ્રીય સમાજ ‘‘શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ‘‘ના સ્થાપક પ્રમુખ
- જ્ઞાતિમાં સનાતની વિચારધારાને વધારે જાગૃત કરવા માટે જ્ઞાતિજનોને પ્રેરકબળ પૂરું પાડવાના ઉદ્દેશથી પ.પૂ. સંત શ્રી ઓધવરામજી મહારાજને જ્ઞાતિજનોમાં ઓતપ્રોત કરાવી આપનાર
- પ.પૂ. સંતશ્રી ઓધવરામજી મહારાજની પ્રેરણાથી જ્ઞાતિમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ તરીકે પ્રસ્થાપિત કરવા શુરુઆતના અંદાજે ૬૬ મંદિરોની સ્થપના કરાવનાર
- પ.પૂ.સંત શ્રી ઓધવરામજી મહારાજની ભલામણથી ક.ક.પા. સનાતની સમાજજનોને એક સુત્રે બાંધવા માટે કુળદેવી શ્રી ઉમિયાં માતાજીનું મંદિર વાંઢાય ખાતે બનાવવા માટે શ્રીક.ક.પા સનાતની સમાજના પ્રમુખની રુહે મુખ્ય ભૂમિકા ભજવી, મંદિરની ધ્વજા રોહણ કર્યું અને માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી
- જ્ઞાતિની આર્થીક કમર તોડ માટે જવાબદાર ફરજીયાત ધાર્મિક લાગાઓ, કરો, દસોન્દો અને પ્રેત ભોજન જેવી કુરુઢીઓ અને કુરિવાજો ને બંધ કરીને જ્ઞાતિ જનોનો આર્થીક પાયો મજબુત કરવા પ્રયત્નશીલ રહેનાર.
- સમાજમાં કેળવણીનું સ્તર સુધરે તે માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રહેનાર
- પૂ. નારણજી રામજી લીંબાણી દ્વારા ચલાવવામાં આવેલ સનાતની ચળવળ વખતે ક.ક.પા જ્ઞાતિના પહેલા યુવક મંડળ ‘‘ કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ‘‘ના પ્રથમ મહામંત્રી
- જ્ઞાતિમાં સામાજિક, સનાતની ધાર્મિક, આર્થિક તેમજ કેળવણીના સ્થરે થયેલ ક્રાંતિનો પાયો નાખનાર

પરિવાર જનો

પુત્રવધુ પુત્રો	પુત્રીઓ	પૌત્રાવહુ પૌત્રાઓ	પૌત્રીઓ	પડ પૌત્ર-પૌત્રીઓ
દમયંતી-હિંમત રતનશી ખેતાણી	સ્વ. કુંવેરબેન લાલજી બાથાણી,	સિધ્ધિ - હેમાંગ કનૈયાલાલ ખેતાણી	કુ. ભક્તિ હિંમત ખેતાણી,	પહેલ હેમાંગ ખેતાણી
નંદિની-કનૈયાલાલ રતનશી ખેતાણી	સ્વ. જમનાબેન હરદાસ આણદાણી,	નમ્રતા - ચિંતન કનૈયાલાલ ખેતાણી	કુ. મીતાલી હિંમત ખેતાણી,	જતન ચિંતન ખેતાણી
રેણુકા-ચંદ્રકાંત રતનશી ખેતાણી.	સ્વ. મોંઘીબેન વાલજી નાકરાણી,		સૌ. હેતલ વિરલ ધોળુ,	
	સ્વ. ધનબાઈ દેવજી સાંખલા,		કુ. વિધિ ચંદ્રકાંત ખેતાણી,	
	સૌ. હેમલતાબેન કમલેશ લીંબાણી		કુ. રિયા ચંદ્રકાંત ખેતાણી	

વ્યવસાયિક પ્રતિષ્ઠાન : M/s. Ratanshi Khimji Patel, M/s. Ambika Saw Mill, Himkanchan Impex Pvt. Ltd. at : Ghatkopar, Mumbai

પત્ર વ્યવહાર : પ્રચાર પ્રસાર સમિતિ, મોહન ટીંબર કંપાઉન્ડ, મોહને રોડ, શહાડ(વે), કલ્યાણ -૪૨૧૧૦૩ | ફોન નં.: ૭૭૧૮૯૭૭૭૭૪

2017-10-11 -Unjha Judgement in SDP Newspaper (932)

See Page 40 to 45

Also see Pamphlet -Page 85 to 92

This is newspaper + pamphlet distrubuted by ABKKP Samaj

|| સનાતન પરમો ધર્મ ||

Sanatan Dharm Patrika (MONTHLY)

R.N.I. No.- MAHGUJ/2016/68522

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું મુખપત્ર

(Trust Regd. No. A-828 Nakhatrana Kutch Dt. 6-4-1965)

પ્રચાર પ્રસાર
જાગૃત ઉજાગર

સનાતન ધર્મ પત્રિકા

Email : office@sanatandharmpatrika.com | Web : www.sanatandharmpatrika.com

VOLUME : 2 ISSUE : 16 MUMBAI DATE: 11 OCTOBER 2017 PAGES : 84 PRICE: 20/-

ભાવાંજલિ



ઉંમર: ૮૩ વર્ષ

સ્વર્ગવાસ: ૨૮-૦૯-૧૯૭૦

સ્વ. રતનશીભાઈ ખીમજીભાઈ ખેતાણી

- જ્ઞાતિની પ્રથમ કેન્દ્રીય સમાજ "શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ"ના સ્થાપક પ્રમુખ
- જ્ઞાતિમાં સનાતની વિચારધારાને વધારે જાગૃત કરવા માટે જ્ઞાતિજનોને પ્રેરકબળ પૂરું પાડવાના ઉદ્દેશથી પ.પૂ. સંત શ્રી ઓધવરામજી મહારાજને જ્ઞાતિજનોમાં ઓતપ્રોત કરાવી આપનાર
- પ.પૂ. સંતશ્રી ઓધવરામજી મહારાજની પ્રેરણાથી જ્ઞાતિમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ તરીકે પ્રસ્થાપિત કરવા શુરુઆતના અંદાજે ૬૬ મંદિરોની સ્થપના કરાવનાર
- પ.પૂ.સંત શ્રી ઓધવરામજી મહારાજની ભલામણથી ક.ક.પા. સનાતની સમાજજનોને એક સુત્રે બાંધવા માટે કુળદેવી શ્રી ઉમિયાં માતાજીનું મંદિર વાંઢાય ખાતે બનાવવા માટે શ્રીક.ક.પા સનાતની સમાજના પ્રમુખની રુહે મુખ્ય ભૂમિકા ભજવી, મંદિરની દવજા રોહણ કર્યું અને માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી
- જ્ઞાતિની આર્થીક કમર તોડ માટે જવાબદાર ફરજીયાત ધાર્મિક લાગાઓ, કરો, દસોન્દો અને પ્રેત ભોજન જેવી કુરુઢીઓ અને કુરિવાજો ને બંધ કરીને જ્ઞાતિ જનોનો આર્થીક પાયો મજબુત કરવા પ્રયત્નશીલ રહેનાર.
- સમાજમાં કેળવણીનું સ્તર સુધરે તે માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રહેનાર
- પૂ. નારણજી રામજી લીંબાણી દ્વારા ચલાવવામાં આવેલ સનાતની ચળવળ વખતે ક.ક.પા જ્ઞાતિના પહેલા યુવક મંડળ " કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ"ના પ્રથમ મહામંત્રી
- જ્ઞાતિમાં સામાજિક, સનાતની ધાર્મિક, આર્થિક તેમજ કેળવણીના સ્થરે થયેલ ક્રાંતિનો પાયો નાખનાર

પરિવાર જનો

પુત્રવધુ પુત્રો	પુત્રીઓ	પૌત્રાવહુ પૌત્રાઓ	પૌત્રીઓ	પડ પૌત્ર-પૌત્રીઓ
દમયંતી-હિંમત રતનશી ખેતાણી	સ્વ. કુંવેરબેન લાલજી બાથાણી,	સિદ્ધિ - હેમાંગ કનૈયાલાલ ખેતાણી	કુ. ભક્તિ હિંમત ખેતાણી,	પહેલ હેમાંગ ખેતાણી
નંદિની-કનૈયાલાલ રતનશી ખેતાણી	સ્વ. જમનાબેન હરદાસ આણદાણી,	નમ્રતા - ચિંતન કનૈયાલાલ ખેતાણી	કુ. મીતાલી હિંમત ખેતાણી,	જતન ચિંતન ખેતાણી
રેણુકા-ચંદ્રકાંત રતનશી ખેતાણી.	સ્વ. મોંઘીબેન વાલજી નાકરાણી,		સૌ. હેતલ વિરલ ધોળુ,	
	સ્વ. ધનબાઈ દેવજી સાંખલા,		કુ. વિધિ ચંદ્રકાંત ખેતાણી,	
	સૌ. હેમલતાબેન કમલેશ લીંબાણી		કુ. રિયા ચંદ્રકાંત ખેતાણી	

વ્યવસાયિક પ્રતિષ્ઠાન : M/s. Ratanshi Khimji Patel, M/s. Ambika Saw Mill, Himkanchan Impex Pvt. Ltd. at : Ghatkopar, Mumbai

પત્ર વ્યવહાર : પ્રચાર પ્રસાર સમિતિ, મોહન ટીંબર કંપાઉન્ડ, મોહને રોડ, શહાડ(વે), કલ્યાણ -૪૨૧૧૦૩ | ફોન નં.: ૭૭૧૮૯૭૭૭૭૪


LG Hausys



|| સનાતન પરમો ધર્મ ||

Sanatan Dharm Patrika (MONTHLY)

R.N.I. No.- MAHGUJ/2016/68522

realpatidar.com

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું મુખપત્ર

(Trust Regd. No. A-828 Nakhatrana Kutch Dt. 6-4-1965)

પ્રચાર પ્રસાર

જાગૃત ઉજાગર

સનાતન ધર્મ પત્રિકા

Email : office@sanatandharmpatrika.com | Web : www.sanatandharmpatrika.com

VOLUME : 2 ISSUE : 16 MUMBAI DATE: 11 OCTOBER 2017 PAGES : 84 PRICE: 20/- | Page : 03

શુભ દિપાવલી..

આત્મીય જ્ઞાતિજનો......

વિક્રમ સવંત ૨૦૭૪ ના નવલા વર્ષના પ્રારંભે આપશ્રી તથા આપના પરિવારજનોને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા નુતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ. નવું વર્ષ આપ તથા આપના સમગ્ર પરિવારજનોને સુખદાયી, ફળદાયી અને સર્વાંગી વિકાસની ઉંચાઈને પ્રાપ્ત કરનારું અને યશસ્વી નિવડે તેવી કુળદેવી માં ઉમિયા અને ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ને નવલી પ્રભાતે પ્રાર્થના....

આપણા પૂર્વજો અને વડીલો દ્વારા વારસામાં મળેલા સંસ્કારોની વિરાસત થકી આપણે સમગ્ર ભારતભરમાં અને વિશ્વમાં વિસ્તર્યા પછી પણ આજે આપણે સૌ કચ્છી બાંધવો એક છીએ, નેક છીએ અને સર્વશ્રેષ્ઠ છીએ. આપણમાં રહેલી સાહસિકતા, સૌમ્યતા, શુરવીરતાના સદગુણોથી સંઘનિષ્ઠ અને જ્ઞાતિભાવ અખંડિત રહી છે. જેના ફલસ્વરૂપે અનેક પડકારો છતાં સનાતની મૂલ્યોનું જતન કરી રહ્યા છીએ. નવી પેઢીમાં પણ શુદ્ધ વૈદિક સનાતની સંસ્કારોનું સંસ્કરણ થાય અને તેના દ્વારા સમજણપૂર્વક આપણા સૌનો આધ્યાત્મિક વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવાની જવાબદારી આપણી સૌની છે.

આપણી કેન્દ્રિય સમાજની નવી વરાયેલી ટીમમાં

પ્રમુખશ્રીની કલમ



અબજીભાઈ વિશ્રામ કાનાણી-પ્રમુખશ્રી

મહામંત્રીશ્રીની કલમ



પુરષોત્તમભાઈ રવજી ભગત-મહામંત્રીશ્રી

વડીલોનો સેવા અનુભવ અને યુવાનોની સેવા તત્પરતાનો સુંદર સમન્વય થયો છે. જેથી કેન્દ્રીય સમાજની કાર્ય પ્રણાલીમાં ગતિ આવશે. કેન્દ્રીય સમાજ આગામી સમયમાં યુવાસંઘ અને મહિલાસંઘ ને સાથે રાખી જન-જન સુધી પહોંચવા માટે સમાજ વિકાસના કાર્યક્રમોનું આયોજન કરશે. જેમાં આપનો દિલથી સહયોગ અનિવાર્ય છે.

શ્રી સમાજની ઉમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એસયુવી ઈન્ટરનેશનલ સ્કુલનો દશાબ્દી મહોત્સવ આગામી તા. ૨૩,૨૪,૨૫ ડીસેમ્બર-૧૭ ના રોજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છીએ. આ દશાબ્દી મહોત્સવ એસયુવી

નુતન વર્ષાભિનંદન

નોલેજ કાર્નિવલની ઈવેન્ટોની જવાબદારી આપણાં યુવાસંઘને આપવામાં આવી છે. અને તેનો આખરી ઓપ પણ અપાઈ ગયો છે. તો સમાજના આ કાર્નિવલમાં આપનું સમપર્ણનું હોમ થાય તે ઈચ્છનીય છે.

ખાસ નોંધનીય બાબત એ છે કે વર્ષો પહેલાં આપણા વડીલો દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા નખત્રાણા ખાતે પાટીદાર વિદ્યાર્થી ભવનની સ્થાપના કરવામાં આવેલ. જેનો સમાજને ઘણો લાભ મળેલ, સમય સાથે બદલાયેલા સંજોગોમાં આધુનિક ઓપ આપવા પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા ખાતે શ્રી સમાજ દ્વારા વ્યવસાયિક તાલીમ કેન્દ્રશરુ કરવામાં આવેલ છે. આ તાલીમ કેન્દ્ર આગામી દિવસોમાં સમાજના આર્થિક અને સામાજીક વિકાસમાં મહત્વનું સોપાન બની રહેશે. સમાજના વ્યવસાયિક ભાઈ-બહેનોને આ તાલીમ કેન્દ્રનો વધુમાં વધુ લાભ લઈ પોતાના વિકાસ દ્વારા સમાજના વિકાસમાં સહભાગ બનવા અત્રેથી આહવાન કરવામાં આવે છે.

વિશેષમાં આ વર્ષમાં આપણા આધ સુધારક શ્રી કેશરા પરમેશ્વરાની ૨૫૦ મી જન્મ જયંતી સતસંગ સમાજ ધામધુમથી

અનુસંધાન પાનુ નં ૦૪

નુતન વર્ષાભિનંદન

પાનુ નં 03 થી ચાલુ

ઉજવવા જઈ રહ્યો છે. તેમજ આપણા ઉમિયા માતાજી સંસ્થાન-વાંઢાયને ૭૫ વર્ષ પુરા થતા હોઈ હિરક જયંતી મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે. તો આ બંને મહોત્સવ ઉજવવા શ્રી સમાજ બંને સંસ્થા સાથે રહી ધામધુમથી ઉજવણીમાં ભાગ લેશે. આપણે સૌ આ મહોત્સવમાં સહભાગી થઈ આપણું દાયિત્વ નિભાવીએ.

ગત વર્ષે દિવાળી બોણીમાં આપે અનન્ય સહયોગ આપ્યો હતો, જેના થકી નિરાધાર સહાય તેમજ જરૂરિયાતમંદોને સહાય કરી શક્યા છીએ. ટીપે-ટીપે સરોવર ભરાય, એ ન્યાયે આપની નાનકડી રકમ માંથી સેવાનો મહાસાગર ભરાય છે. આપ પણ દિવાળી બોણી ભેટના માધ્યમથી ઉમદા સમાજ સેવા કાર્યમાં નિમિત બનો છો. દિવાળી એટલે દિવડાનો ઉત્સવ, દિવાળી નિમિતે આપના રૂ. ૨૫૦/- નું દિવેલ આપણાં ભાઈ-બહેનોના અંધારિયા ઘરમાં ઝળહળતો પ્રકાશ પાથરે છે. માટે દિવાળી ભેટ દ્વારા આપણે આપણા ભાઈ-બહેનોના ઘરે સહયોગનું અજવાળું કરવાનું દીપ દાયિત્વનિભાવીએ.

શ્રી સમાજના સનાતન ધર્મ પત્રિકાના વિકાસ અને વિસ્તાર માટે આપ સૌ દ્વારા શક્યતમ્ વિશેષ પ્રયત્નો જરૂરી છે. તે માટે આપણે સૌ સનાતન ધર્મ પત્રિકાના આજીવન સભ્ય બની સહયોગ કરીએ. આ કાર્ય આપના જેવા જાગૃત લોકો દ્વારા જ થઈ શકશે.

દિવાળી એ નાના-મોટા સૌના ઉત્સાહમાં વધારો કરનાર તહેવાર છે. નવા વર્ષે સંકલ્પ કરીએ કે આપણે સૌ વ્યસન મુક્ત બનીએ, અંધશ્રદ્ધા ત્યજીએ, સામાજીક સંગઠનમજબુત બનાવવામાં પોતાનું યોગદાન આપી સમાજ ઋણ અદા કરીએ.

પુનઃ નવા વર્ષની હાર્દિક શુભકામના.

પ્રમુખ : શ્રી અબજીભાઈ વિશ્રામ કાનાણી,

મહામંત્રી : શ્રી પુરૂષોત્તમભાઈ રવજી ભગત

એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કુલ-વલથાણ (સુરત) ખાતે મળી ગયેલ શ્રી સમાજ-યુવા સંઘ વિચાર ગોષ્ઠી બેઠક

ગત તા.૧ ઓક્ટોમ્બર ૨૦૧૭ રોજ શ્રી સમાજની એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કુલ-વલથાણ (સુરત) ખાતે શ્રી સમાજના પ્રમુખશ્રી, અબજીભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને શ્રી સમાજ-યુવાસંઘ વિચાર ગોષ્ઠી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સમાજના સર્વાંગી વિકાસના વિઝનને સાર્થક કરવા યુવાસંઘે સર્તતા દર્શાવી હતી અને હંમેશાં સમાજના હિત-માં તમામ રીતે ઉપયોગી થવાય તેવો અભિગમ દર્શાવ્યો હતો. અને કેટલાક વિષયો પર ગહનતાપૂર્વક ચર્ચાઓ કરી યોગ્ય કરવામાં આવ્યું હતું.

શ્રી સમાજના ઝોન અને યુવાસંઘના રીઝીયન બાબતે સુવ્યવસ્થા પ્રસ્થાપિત કરવા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં યુવાસંઘ સમાજ સાથે રહી એકરુપતા જળવાય તેવા પુરતા પ્રયાસો કરવામાં આવશે.

યુવા સુરક્ષા કવચ યોજના બાબતે ચર્ચા કરતા આ યોજનામાં કેટલાક સુધારા સાથે આ યોજનાનો લાભ જન-જન સુધી પહોંચે તે અંગે શ્રી સમાજે આ યોજનાને વધુ વિશ્વસનીય અને પારદર્શક બનાવવા કેટલાક સુચનો કર્યા હતા.જે અંગે યુવાસંઘે સંપૂર્ણ તૈયારી દર્શાવી અને માળખાકીય વ્યવસ્થા અંગે શ્રી સમાજ સાથે મસલત કરી જ્યાં જરુરી જણાય ત્યાં સુધારા વધારા કરવા જનહીત માટે ઉત્સાહ પણ દર્શાવ્યો હતો.

ત્યારબાદ શ્રી સમાજના સુવિધા કેન્દ્ર બાબતે વેળાસર આગળ વધવા તેમજ આપણી સમાજની વસ્તી ગણતરી વહેલી તકે પુરી કરવા યુવાસંઘે શ્રી સમાજને ખાતરી આપી હતી. અને આ કાર્ય માટે ઝોન સમાજ પણ સાથે રહી વસ્તી ગણતરી પુરી કરવા વેબકોમ સમિતિને સાથ સહકાર આપશે.


શ્રી સમાજ દ્વારા બિઝનેશ કરતા ભાઈ-બહેનો માટે શરુ કરેલ વ્યવ-સાયિક તાલીમ કેન્દ્ર તથા સનાતન ધર્મ પત્રિકાનો વધુ વ્યાપ વધારવા યુવાસંઘ પોતાના મિશનમાં આવરી લઈ આ બન્ને યોજના જન-જન સુધી પહોંચે તે માટે પ્રયત્નશીલ થાય તેવા શ્રી સમાજના સંકેતને યુવાસંઘે સહર્ષ સ્વીકારી લીધો હતો. તે સિવાય સમાજમાં પ્રવર્તમાન કેટલીક સમસ્યાઓના ઉકેલ બાબતે તેમજ શ્રીસમાજના ભવિષ્યના વિઝનના મીશનને સાર્થક કરવા યુવાસંઘ હંમેશા શ્રી સમાજ સાથે રહેશે.

બીજુ એસ.યુ.વી. નોલેઝ કાર્નિવલ જેવા વિરાટ પ્રોગ્રામ દરમ્યાન સમાજને ગ્રિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નામાંકન કરવા આયોજન સમિતિએ જે પ્રયાસો કર્યા છે તેને શ્રી સમાજે બીરદાવ્યા હતા અને તેમાં સફળ થવા માટે ઝોન સમાજોને પોતાની ઘટક સમાજોમાં એસ.યુ.વી. નોલેઝ કાર્નિવલ અને વર્લ્ડ રેકોર્ડસ વિશે વધુ માહિતી આપી આ કાર્યક્રમમાં છેવાડાના ભાઈ-બહેનોની ઉપસ્થિતી રહે તેવી અપીલ કરી હતી.

આ વિચાર ગોષ્ટીમાં શ્રી સમાજના હોદેદારો, યુવાસંઘની ટોપ ટવેન્ટીના કર્ણધારો હાજર રહી આ વિચાર ગોષ્ઠી બેઠકમાં પોતાના વિચારો આપી અને શ્રી સમાજના દરેક કાર્યમાં તન-મન-ધનથી સહયોગ આપવા ખાતરી આપી હતી.

- મહામંત્રીશ્રી પુરષોત્તમભાઈ ભગત





sharpex®
forest & garden solutions

વિશ્વવસ્તરીય ગુણવત્તા આપતી
સર્વોત્તમ શાર્પેક્સ ચેઈન અને ગાઈડ બાર



મેઈન્ટેનન્સ ખર્ચમાં બચત • સમયની બચત • બહુઉપયોગી

પેટ્રોલ ચેઈનસો	ટુ મેન ચેઈનસો	વન મેન ચેઈનસો
		

સરળ, સુગમ અને ભારતનું સર્વશ્રેષ્ઠ શાર્પેક્સ ચેઈનસો

TRITON

લોન મોવર, ગ્રીન વેસ્ટ શ્રેડર, બ્રાંચ કટર, સાપ પકડવાના
કેચર જેવી અનેક પ્રોડક્ટ્સમાં સુપ્રસિદ્ધ નામ

ફેક્ટરી : પ્લોટ નં. 1-5, એલ ટાઈપ એસ્ટેટ, જી.આઈ.ડી.સી. ઓઢવ, અમદાવાદ 382 415, ગુજરાત.
સંપર્ક: +91-99982 22622

યુવાસંઘ તર્ફે દિપાવલીની શુભકામનાઓ

જય લક્ષ્મીનારાયણ, વંદે માતૃરમ,

સુજ્ઞ સમાજજનો ને નવલા નોરતા, વિજ્યા દશમી, શરદ પુનમ, દિપાવલી પર્વ, નુતન વર્ષ, સહિત તહેવાર શૃખંલાની શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ વતી શુભેચ્છાઓ.જોત જોતામાં વિક્રમ સંવત ૨૦૭૩નું વર્ષ પુરૂ થવા આવ્યું છે. પહેલેથી જ કઠિન સમયમાંથી પસાર થઇ રહેલા આપણે સૌને નવિન વર્ષ હજી વધારે કઠિન સમય લઇને આવી રહ્યું હોય તેવું વ્યતિત થઇ રહ્યું છે. પણ કુળદેવી માં ઉમિયા પરની શ્રધ્ધા અને ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણ ભગવાન પરની નિષ્ઠા આપણને તેમાંથી સુખરૂપ બહાર લઇ આવશે તેવી આશા રાખવી અસ્થાને નહિ ગણાય. કુળદેવી અને ઈષ્ટદેવ પરની આસ્થાને લીધે જ યુવાસંઘે વર્તમાન વર્ષમાં ઘણા કાર્યો પાર પાડ્યા છે, મિશન ૨૦૨૦ના લક્ષ્યાંકોની નજીક પંહોચ્યા છીએ, નવા કાર્યકરો તૈયાર કર્યા છે, જુના કર્ણધારોની વિદાયને પચાવી શક્યા છીએ.

દિવાળીના લેખા-જોખાં ને થોડી વાર પછી જોઇએ. પહેલા યુવાસંઘ અને **SUV** કાર્નિવલની ગતિવીધીઓ જોઇ લઇએ.

સર્વ પ્રથમ, યુવાસંઘ અને સમાજની ટીમે તાજેતરના સમયમાં ગુજરાતના અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓની મુલાકાત લીધેલ હતી. શ્રી વિજય રૂપાણી સાહેબ સાથેની મુલાકાતમાં આપણી ટીમે તેમને આગામી ચુંટણીઓ માટે શુભેચ્છાઓ આપી હતી. તેમજ ભુજ ખાતે આપણે જે હોસ્ટેલ બનાવવા જઇ રહ્યા છીએ તે માટે સરકારશ્રી જમીન સંપાદન અંગે આપણી સમાજને મદદ કરે તેવી વિનંતી કરી હતી. વિનંતી હકારાત્મક રહી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બાબતમાં જેટલી પણ મદદ થઇ શકશે તે કરવાનું વચન આપેલ છે. રાયપુર ખાતે યોજાયેલ સમાજ અને યુવાસંઘની એક ટીમ ત્યાંના મુખ્યમંત્રીશ્રી રમણસિંહની મુલાકાત લીધેલ હતી. તેમને આપણી ટીમ દ્વારા આપણી સમાજ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ **SUV** નોલેજ કાર્નિવલ માટે આમંત્રણ આપવામાં આવેલ.

બંને મુખ્યમંત્રીઓ પાસે આપણી સમાજને આશા છે કેરાજકીય ક્ષેત્રે આપણને વધુમાં વધુ પ્રતિનીધીત્વ મળે. આ માટેની હકારાત્મક અસર જોઇએ તો માંડવી, નખત્રાણા/અબડાસા, તલોદ/પ્રાંતિજ, અને ઓલપાડ (સુરત) ની વિધાન સભાઓમાં ભાજપના ઉમેદવારો માટે લેવાયેલી સેન્સમાં પાટીદાર ભાઇઓ આગળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત ભાજપ પક્ષ અને અન્ય પક્ષોમાં વિવિધ લેવલે જુદાજુદા હોદ્દાઓ પર આપણા ભાઇઓની નિમણુંક થઇ છે તે દર્શાવે છે કે યુવાસંઘના મિશન ૨૦૨૦ અંતર્ગત રાજકીય ક્ષેત્રે આપણે જે ગોલ નક્કી કર્યો છે તે આગામી ચુંટણી દરમ્યાન સિધ્ધ થશે તેવું પ્રતિત થઇ રહ્યું છે.

જો આગામી ચુંટણીમાં આપણી સમાજના સભ્યોને ટિકીટ મળે તો શ્રી સમાજના દરેક સભ્યોને અમારી અત્રેથી નમ્ર અપીલ છે કે વિધાનસભા મતક્ષેત્ર અને પક્ષ (ભાજપ/કોંગ્રેસ) ભલે ગમે તે હોય પણ આપણા ઉમેદવારો માટે તન-મન-ધનથી મહેનત કરીને તેમને જીતાડીને રાજકીય ક્ષેત્રે આપણું વજન વધારીએ.

હવે થોડી માહિતી શ્રી સમાજ દ્વારા ઉજવાઇ રહેલ **SUV** દશાબ્દી મહોત્સવ એટલે કે **SUV** નોલેજ કાર્નિવલ અંગે.

આગામી ૨૩, ૨૪, ૨૫ ડિસેમ્બરના રોજ વલથાણ સ્કુલ કેમ્પસ ખાતે યોજાવા જઇ રહેલ જ્ઞાનના મહાકુંભમાં આપ સૌને ભાગ લેવા, પધારવા, નિહાળવા, આમંત્રણ છે. આ નોલેજ કાર્નિવલમાં પહેલી વાર શ્રી સમાજના વિદેશમાં રહેતા સભ્યો ભાગ લેશે. આમ આપણું એક સ્વપ્ન હતું કે દરેક જગ્યાએ વસવાટ કરતા આપણા ભાઇઓ એક જગ્યાએ એકત્ર થાય એ સાચું પડવા જઇ રહ્યું છે.

વિક્રમ સંવતના નવા વર્ષમાંઆપણે ઘણુ કાર્ય કરવા જઇ રહ્યા છીએ. શ્રી સમાજ અને ટીમ યુવાસંઘ આપ સૌ જ્ઞાતિજનો પાસે ઘણી આશાઓ રાખી રહ્યું છે. વિશ્વાસ છે કે કુળદેવી અને ઈષ્ટદેવની કૃપાથી આપણે સૌ સાથે મળીને તેને પાર પાડીશું.

સર્વ જ્ઞાતિજનોને આગામી દિપાવલી પર્વ અને વિક્રમ સંવત ૨૦૭૪ના નુતન વર્ષ માટે શુભ કામનાઓ સાથે ટીમ યુવાસંઘ આપની પાસે થોડી પ્રતિજ્ઞાઓ લેવડાવવા માંગે છે. આશા છે કે આપ સૌ તેનું પાલન કરવામાં યથેચ્છ મદદરૂપ થશો.

વાઘ-બારસ : * હું મારૂ વાહન યોગ્ય ગતિ-મર્યાદામાં કાયદાઓનું પાલન કરીને ચલાવીશ *

આપણી સમાજના ઘણા આશાસ્પદ અને નવલોહિયા યુવાનો વાહન અકસ્માતમાં પોતાની જાન ગુમાવી ચુક્યા છે. મિત્રો, યાદ રાખશો તમારૂ જીવન માત્ર તમારૂ એકલાનું નથી. તમારા જીવન પર તમારા બાળકો, તમારા પરિવાર, તમારી સમાજ અને તમારા દેશ બધાનો હકક છે. તેને અતિ ઝડપના મોહમાં આવી વ્યર્થ વેડફી નાખશો નહિ.

ધન-તેરસ : * મારી પર લક્ષ્મી દેવીએ વરસાવેલ કૃપામાંથી હું અન્ય જરૂરિયાતમંદોને મદદરૂપ થઇશ *

આપણી સમાજમાં દાનવીર ભામાશાઓની કોઇ ખોટ નથી. છેક છેવાડાનો સભ્ય પણ તેનાથી થઈ શકે તેટલી મદદ કરે જ છે. પછી ભલે તે મદદ રૂપિયા-પૈસામાં ના હોય. આગામી વર્ષમાં પણ આપણે સૌ બીજા લોકોને યથાશક્તિ મદદ કરી શકીએ તેટલી શક્તિ ભગવાન આપણને આપે તેવી પ્રાર્થના.

કાળી-ચૌદશ : * હું ક્રોધ કરતા પહેલા બે વખત વિચારીશ. કોઇપણ સમસ્યાનો ઉકેલ શાંતિમય રીતે લાવવા માટે પ્રયત્નો કરીશ.*

મિત્રો, ક્રોધ/ગુસ્સોએ અધોગતિનું, વિનાશનું, સર્વનાશનું પહેલું પગથિયું છે એ વાત સદાય યાદ રાખજો. જીવનમાં કોઇ એવી સમસ્યા નથી કે જેનો ઉકેલ વાતચીત અથવા અન્ય શાંતિમય રીતે ના આવી શકે. ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે થઇ ગયું છે તે થઇ ગયું છે, તેને કોઇ રીતે પાછું નહી વાળી શકાય. તો પછી થઇ ગયેલ વાત પર વ્યર્થ ક્રોધ શા માટે કરવો?

દિપાવલી : * હું દરેકના જીવનમાં પ્રકાશ ફેલાવવા સદાય તત્પર રહીશ *

શુભેચ્છાના પ્રતિકરૂપ તહેવારમાં આનંદ અને સમૃધ્ધિ તમારા જીવનમાં વરસતા રહે. તમે અને તમારો પરિવાર સદાય ઉજાસમય રહો તેવી ટીમ યુવાસંઘ તરફથી હ્યદયની શુભેચ્છાઓ.

નુતન-વર્ષ : * હું મારા પરિવાર અને મારા સમાજની ખુશહાલી માટે દરેક જાતના વ્યસનોનો ત્યાગ કરીશ *

આપણી સમાજમાં વધતા જતા વ્યસનોના પ્રભાવથી પ્રભુ આપણને બચાવે અને આપણી સમાજને પ્રગતિ-શાંતિ-સુખાકારી-ઉજાસ તરફ અગ્રેસર કરે તેવી પ્રાર્થના.

નુતન વર્ષ ૨૦૭૪ માં આપ સૌ આર્થિક-શારિરી-સામાજીક -પારિવારીક-માનસિક એમ દરેક રીતે, દરેક ક્ષેત્રોમાં સ્વસ્થ રહો, વિતેલા વર્ષમાં થયેલા કડવા અનુભવોને ભુલી આગળ વધતા રહો તેવી ટીમ યુવાસંઘ તરફથી શુભેચ્છાઓ.

ભાઇ-બીજ : * આપણી સાંસ્કૃતિક/આધ્યાત્મિક ધરોહરને જાળવી રાખવા સદાય પ્રયત્નશીલ રહીશ *

સમય સાથે બદલાવવું એ પ્રકૃતિનો નિયમ છે. અને ઘણાખરા અંશે ઇચ્છનીય પણ છે. પરંતુ કેટલીક બાબતો એવી હોય છે કે જેમાં બદલાવ લાવવો ઈષ્ટ નથી હોતો. આપણી સમાજમાં પણ કેટલીક એવી પરંપરા છે જેમ કે પરિવારે સાથે બેસીને ભોજન કરવું, સુરધન બાપાને નમન કરવા, દરેક કાર્યમાં માં ઉમિયાને પ્રથમ યાદ કરવા વગેરે વગેરે. આવી પરંપરાઓને અટકાવવા અથવા બદલાવવા માટે કોઇ યોગ્ય કારણ નથી. આપણે સૌ સાથે મળી પ્રતિજ્ઞા લઇએ આપણે આપણી વિરાસતનું જતન કરીશું.

કાર્તિકી-ત્રીજ : * હું પોતે **YSK**નો સભ્ય બનીશ અને બીજાને પણ સભ્યપદ મેળવવા આગ્રહ કરીશ *

અપને લીએ નહિ, અપનો કે લીએના સુત્રને સાર્થક કરવા, પોતાના પરિવારને પોતાની સંભવિત ગેરહાજરીમાં આર્થિક સલામતી બક્ષવા, અન્ય પરિવાર પર આવી પડેલા આર્થિક સંકટમાં મદદરૂપ બનવા દરેક સભ્ય થશખથી જોડાય તે જરૂરી છે. એટલે જ ટીમ યુવાસંઘ દરેકને આગ્રહભરી વિનંતી કરે છે કે ઉપરોક્ત પ્રતિજ્ઞાનું પાલન કરશો.

વિનાયક-ચતુર્થી : * હું મારા પરિવારને વેબ-કોમ વડે આવરી લઇશ *

શ્રીસમાજની સાચી સંખ્યા જાણવા, સમાજની સંઘઠન શક્તિ વડે અન્ય જ્ઞાતિ, સરકાર, સંસ્થાઓ પર શ્રીસમાજનું વજન વધારવા, સગપણ સમસ્યાને મહદઅંશે નિવારવા આપણી સમાજનો દરેક પરિવાર વેબ-કોમ વડે કોમ્પ્યુટરાઇઝ્ડ થાય એવા શ્રી સમાજ અને યુવાસંઘના પ્રયાસોને સફળ બનાવવા આપ સૌ મદદરૂપ થશો.

લાભ-પાંચમ: * યુવાસંઘના મિશન ૨૦૨૦ ના લક્ષ્યોને હાંસલ કરવા હું સદાય પ્રયત્નશીલ રહીશ *

ટીમ યુવાસંઘ દ્વારા મિશન ૨૦૨૦ના જે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે, તેને સિધ્ધ કરવા માં હવે ઘણુ વધારે નથી ખુટતું. માત્ર આપનો થોડો સાથ અને ટીમ યુવાસંઘનો પ્રયાસ આપણને સિધ્ધીઓ તરફ દોરી જશે.

ટીમ યુવાસંઘને આશા છે કે આપ સૌ આ પ્રતિજ્ઞાઓનું પાલન કરીને આપણી સમાજને પ્રગતિ તરફ અગ્રેસર કરશો. કારણ કે અત્યારના પ્રચલિત સુત્રમાં કહેવાયું છે ને કે સૌનો સાથ, સૌનો વિકાસ. આપણે બધા સાથે મળી આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણી સમાજમાં, આપણા દેશમાં પ્રગતિમય ઉજાસ, આર્થિક સમૃધ્ધિ, સંપ સાથેની ખુશહાલી, વ્યસનમુક્ત તંદુરસ્તી, શાંતિમય માનસિકતા, લાવીએ તેવી પરમકૃપાળુ પરમેશ્વરને

અનુસંધાન પાનુ નં ૦૯



શ્રી અખિલ ભાતતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ તર્ફે નુતન વર્ષાભિનંદન



શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ દીપોત્સવી અને નવા વર્ષના પાવન પર્વ પર, પ્રકાશના પાવન પર્વ દીપોત્સવી આપ સૌના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ લઈને આવે. આપ સૌનું જીવન તેજોમય બને, ધર્મમય બને એવી મંગલ કામનાઓ. વિક્રમ સવંત ૨૦૭૪ નું નૂતન વર્ષ આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિની છોળો લઈને આવે. સત્કાર્યની સુવાસ લઈને આવે, આપના પારિવારિક જીવનમાં સંપ, સ્નેહ અને શાંતિ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવી છીએ.

નારી આદર્શોની સજીવ પ્રતિમા છે. નારી શક્તિનું અવતરણ છે, તેમાં અખુટ શક્તિ ભરેલી છે પરંતુ જરૂર છે તેને બહાર લાવવાની. નુતન યુગને અનુકુળ થવા સૌથી પહેલા નારીએ પોતાની માન્યતાઓ બદલાવી પડશે. દરેક સ્ત્રીઓએ સ્વિકારવું પડશે કે તેનો જન્મ માત્ર કેટલીક વ્યક્તિઓની ઉચિત, અનુચિત ઈચ્છા પૂર્તિ કરવા માટે નથી પણ કોઈ વિશિષ્ઠ ઉદ્ધેશ્ય માટે થયો છે. સ્વસ્થ, શિક્ષિત, સક્ષમ, સુયોગ્ય અને કુશળ સ્ત્રી વ્યક્તિગત, કૌટુંબિક, સામાજીક, આર્થિક, રાજનૈતિક વગેરે ક્ષેત્રોમાં ઉપયોગી થઈ શકે છે.

સમાજની પ્રવર્તમાન સમસ્યા જેમકે ભાગેડુ લગ્ન, સગપણ સમસ્યા, અંધશ્રધ્ધા બાબત હોય કે પછી ખોટા રીત રિવાજની બાબત હોય તેના નિરાકરણ માટે મહિલા સંઘ કટિબદ્ધ છે. તેના માટે ગામેગામ સંપર્ક યાત્રા દ્વારા મહિલાઓની સમસ્યાઓના નિરાકરણ કરવાના પ્રયાસો ચાલુ છે. હાલમાંજ નવરાત્રી દરમ્યાન ભુજથી માતાના મઢ સુધી સફાઈ મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા થઈ ગયું છે. શ્રી સમાજની ઉમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એસયુવી ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા શેક્ષણિક અને સામાજીક પાસાઓને સાંકળી લેતી ઈવેન્ટ એટલે એસયુવી નોલેજ કાર્નિવલ આગામી તા. ૨૩,૨૪.૨૫ ડીસેમ્બર-૧૭ ના રોજ સત્રાવાળા ઉમા વિદ્યાપીઠ, વલથાણ, સુરત ખાતે દશાબ્દી મહોત્સવમાં થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ આપસૌ ચૈતન્ય, સ્ફૂર્તિ, ઉત્સાહ રૂપી સ્પંદન આપવા અને જ્ઞાન શીલ એકતાની પ્રતિક કરાવવા અચૂક ઉપસ્થિત રહેવા વિનંતી. શ્રી સમાજ દ્વારા પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે જે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ મેનેજમેન્ટ, તેમજ ખેતી બાબતના કોર્સના વ્યવસાયિક તાલિમ કેન્દ્ર ની શરૂઆત કરવામાં આવેલ છે.

જેમાં રહેવાની, જમવાની સાથે આધુનિક તાલીમને અનુકુળ ઉત્તમ પ્રાથમિક સુવિધાઓ રાહત દરે પૂરી પાડવામાં આવે છે. આમાં મહિલા સંઘ આ કાર્યમાં શ્રી સમાજની સાથેજ છે. અને દરેક બહેનોને અનુરોધ કરીએ છીએ કે આ કોર્સની માહિતી સ્થાનિક મહિલા મંડળોમાં આપશો અને આપણી જ્ઞાતિના યુવા ભાઈઓને વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયત્નો કરશો.

વિશેષમાં શ્રી સમાજ દ્વારા જે કાર્ય સોપવામાં આવશે તેનો અમલ કરવાનું કામ યુવાસંઘ સાથે રહીને મહિલાસંઘ દ્વારા વધુમાં વધું કાર્યક્રમો થાય તેવા પ્રયત્નો કરીશું.

મહિલા સંઘે હાથ ધરેલ દરેક કાર્યમાં તમામ ગામોની મહિલા મંડળોએ અને સર્વે બહેનોએ ખુબજ ઉત્સાહપૂર્વક સાથ સહકાર આપ્યો છે, અને ભવિષ્યમાં પણ મળતો રહેશે. એવા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે ફરી એકવાર આપ સૌ પર માં ઉમિયાના આશિષ સદા સર્વદા વરસતા રહે અને આપ સૌનું જીવન સુખ સમૃદ્ધીમય બન્યું રહે તેવી માં ઉમિયાને પ્રાર્થના સાથે આપ સૌને નુતન વર્ષાભિનંદન.

પ્રમુખ : શ્રીમતી જશોદાબેન શાંતિલાલ નાકરાણી,
મહામંત્રી : શ્રીમતી રમીલાબેન ખેતશીભાઈ રવાણી

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ - કારોબારી સભા

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘની કારોબારી સભા તા. ૨૨-૧૨-૨૦૧૭ ને શુક્રવારના રોજ મહિલા સંઘના આદરણીય પ્રમુખ શ્રીમતી જશોદાબેન શાંતિલાલ નાકરાણીના અધ્યક્ષ સ્થાનેબપોરના ૩-૦૦ કલાકેસતરાવાળા ઉમા વિદ્યાપીઠ (એસયુવી ઈન્ટરનેશનલ સ્કુલ) વલથાણ, સુરત મુકામે મળશે. જેમાં ઉપસ્થિત રહીને કાર્યવાહીમાં ભાગ લેવા નમ્ર વિનંતી.

લિ. મહામંત્રી : શ્રીમતી રમીલાબેન ખેતશીભાઈ રવાણી

કારોબારી મંડળ ૨૦૧૭-૨૦૨૦

પ્રમુખ :-	શ્રીમતી	જશોદાબેન શાંતિલાલ નાકરાણી	ગોવા
ઉપપ્રમુખ :-	શ્રીમતી	કમળાબેન શિવજીભાઈ લિંબાણી	તલોદ
	શ્રીમતી	ગંગાબેન હરિભાઈ ધોળું	પેઠલાદ
	શ્રીમતી	ગંગાબેન લાલજીભાઈ રામાણી	નખત્રાણા
	શ્રીમતી	શીલાબેન બાબુલાલ ભગત	બેંગ્લોર
	શ્રીમતી	અમૃતાબેન જખુભાઈ લિંબાણી	બિદડા
મહામંત્રી :-	શ્રીમતી	રમિલાબેન ખેતસીભાઈ રવાણી	નાશિક
મંત્રી :-	શ્રીમતી	ઉર્મિલાબેન નાનજીભાઈ ડાયાણી	ધાવડા-મોટા
	શ્રીમતી	અનુરાધાબેન શાંતિલાલ સેંઘાણી	નખત્રાણા
	શ્રીમતી	કમળાબેન શંકરલાલ હલપાણી	નાગપુર
	શ્રીમતી	વિજયાબેન રતનસીભાઈ બાથાણી	રાયપુર
ખજાનચી :-	શ્રીમતી	જયશ્રીબેન ખીમજીભાઈ ધોળું	ભુજ
સહ ખજાનચી :-	શ્રીમતી	ગંગાબેન હરિભાઈ ધોળું	નાગલપર
આઈ.પી.પી. :-	શ્રીમતી	સોનલબેન ઈશ્વરભાઈ સેઠિયા	નખત્રાણા
સલાહકાર :-	શ્રીમતી	લક્ષ્મીબેન રવજીભાઈ ભાદાણી	હોસુર
	શ્રીમતી	રતનબેન માવજીભાઈ ભગત	ભુજ
	શ્રીમતી	ગંગાબેન હરિભાઈ સેંઘાણી	કોલકત્તા
	શ્રીમતી	પ્રભાબેન દામજીભાઈ માકાણી	ભુજ
	શ્રીમતી	ભાનુબેન વાલજીભાઈ સાંખલા	ભુજ
	શ્રીમતી	ઝવેરબેન ગંગારામભાઈ સાંખલા	નવી દિલ્હી
	શ્રીમતી	સુશીલાબેન કાંતિલાલ પાટીદાર	ભુજ
કારોબારી સભ્યો :-	શ્રીમતી	અનુસુયાબેન અમૃતલાલ છાભૈયા	મેરાઉ-માંડવી
	શ્રીમતી	અરુણાબેન હિંમતલાલ લિંબાણી	માનકુવા
	શ્રીમતી	ભગવતીબેન ખીમજીભાઈ પારસીયા	નાના-અંગીયા
કારોબારી સભ્યો :-	શ્રીમતી	ભગવતીબેન નારાયણભાઈ ઉકાણી	માંડવી
	શ્રીમતી	ભગવતીબેન સુરેશભાઈ પાંચાણી	નખત્રાણા-મધ્ય વિભાગ
	શ્રીમતી	ભાનુબેન મણીલાલ પોકાર	બેંગ્લોર
	શ્રીમતી	ભાવનાબેન જગદિશભાઈ ચૌહાણ	ખોંભડી
	શ્રીમતી	ચંપાબેન જયંતીલાલ ધનાણી	નાગપુર
	શ્રીમતી	છાયાબેન રવિભાઈ ધોળું	ગોવા
	શ્રીમતી	દક્ષાબેન પ્રહલાદભાઈ પટેલ	ચિક્લીમ-ગોવા
	શ્રીમતી	દેવકાબેન દામજીભાઈ સાંખલા	વિરાણી-નાની
	શ્રીમતી	ગૌરીબેન દિનેશભાઈ સાંખલા	ગાંધીધામ
	શ્રીમતી	ગીતાબેન વાલજીભાઈ મૈયાત	પલુસ
	શ્રીમતી	ગીતાબેન મણીલાલ માવાણી	વઝરડી
	શ્રીમતી	હંસાબેન જાદવજીભાઈ સાંખલા	આણંદ
	શ્રીમતી	હેમલતાબેન દિપકભાઈ લિંબાણી	દયાપર
	શ્રીમતી	હેમલતાબેન ગંગારામ ધનાણી	નખત્રાણા
	શ્રીમતી	હેમલતાબેન જીતેન્દ્રભાઈ રૂડાણી	વિથોણ
	શ્રીમતી	જશોદાબેન બાબુલાલ નાયાણી	પાલનપુર
	શ્રીમતી	જશોદાબેન શંકરલાલ સાંખલા	નખત્રાણા
	શ્રીમતી	જસવંતીબેન જયંતીલાલ રવાણી	ઔરંગાબાદ
	શ્રીમતી	જયશ્રીબેન હસમુખભાઈ સેંઘાણી	ઘડુલી
	શ્રીમતી	કલ્પનાબેન ધીરજકુમાર સુરાણી	નખત્રાણા-નવાવાસ
	શ્રીમતી	કાંતાબેન લીલાધર લિંબાણી	બેલગામ
	શ્રીમતી	કસ્તુરબેન બાબુલાલ પોકાર	સાયરા-યક્ષ
	શ્રીમતી	કસ્તુરબેન પ્રવિણભાઈ સોમજીયાણી	વિરાણી-મોટી

અનુસંધાન પાનુ નં ૦૯



SHREEJI Artica Inspired Creative

Colorup DIGITAL TILES

SIMEC VITRIFIED TILES

YOUR HOME IS AN ESSENTIAL PART OF YOU

UNIT-1: **SHREEJI CERAMIC INDUSTRIES** UNIT-2: **SHREEJI VITRIFIED PVT. LTD.** UNIT-3: **SHREEJI GOLD CERAMICS PVT. LTD.**

ADDRESS: 8-A, NATIONAL HIGHWAY, LALPAR, MORBI 363 642 (GUJARAT) INDIA. TEL: +91-2822 - 241499, 240032

FOR ANY INFORMATION CALL US ON:

WALL TILES: +91 98253 99797, +91 98253 09770

VITRIFIED TILES: +91 98258 27880, +91 98795 32709

Shreeji Ceramic - Tile store

ANDROID APP ON Google play | Available on the App Store

www.shreejicera.com

Stay connected on

2017-10-11 -Unjha Judgement in SDP Newspaper (932)

નુતન વર્ષાભિનંદન

પાનુ નં ૦૭ થી ચાલુ

કારોબારી સભ્યો :-

શ્રીમતી	કસ્તુરબેન પુરૂષોત્તમભાઈ કેશરાણી	નખત્રાણા
શ્રીમતી	લક્ષ્મીબેન કાંતિલાલ સાંખલા	નાશિક
શ્રીમતી	લક્ષ્મીબેન મણિલાલ ભાદાણી	તાજપુર
શ્રીમતી	લક્ષ્મીબેન રમણીકભાઈ રૂડાણી	દેવપર-યક્ષ
શ્રીમતી	લક્ષ્મીબેન શંકરલાલ લિંબાણી	જલગાંવ
શ્રીમતી	લતાબેન મોહનભાઈ છાભૈયા	રાયપુર
શ્રીમતી	લીલાબેન ભવાનભાઈ લિંબાણી	કોટડા-ચકાર
શ્રીમતી	લીલાબેન જી. રૂડાણી	દેશલપર-વાંઢાય
શ્રીમતી	લીલાબેન મોહનભાઈ ચોપડા	મુંબઈ
શ્રીમતી	લીલાબેન મોહનભાઈ	ઉગેડી
શ્રીમતી	મંગળાબેન અશોકભાઈ ભાવાણી	ધનસુરા
શ્રીમતી	મણીબેન ભાઈલાલ સુરાણી	વડાગામ
શ્રીમતી	મણીબેન જીવરાજભાઈ લિંબાણી	નખત્રાણા-પશ્ચિમ વિભાગ
શ્રીમતી	મણીબેન નારાયણભાઈ રૂડાણી	ભુજ
શ્રીમતી	મંજુલાબેન હરેશભાઈ દિવાણી	જંજાય
શ્રીમતી	મંજુલાબેન જવાહરલાલ સાંખલા	નવી દિલ્હી
શ્રીમતી	મંજુલાબેન માવજીભાઈ દિવાણી	નાશિક
શ્રીમતી	મોંઘીબેન મણીલાલ દિવાણી	જયસીંગપુર
શ્રીમતી	નર્બદાબેન શંકરલાલ રવાણી	જયપુર
શ્રીમતી	નર્મદાબેન બાબુલાલ સેંઘાણી	સુરત
શ્રીમતી	નર્મદાબેન હસમુખભાઈ છાભૈયા	નાશિક
શ્રીમતી	નર્મદાબેન કાંતિલાલ માકાણી	ચકાર કોટડા-આથમના
શ્રીમતી	નર્મદાબેન લાલજીભાઈ ભાવાણી	સુરત
શ્રીમતી	નીરૂબેન જયંતીલાલ માવાણી	નાશિક
શ્રીમતી	નીતાબેન ઘનશ્યામ ભાવાણી	કલ્યાણપર-મંઝલ
શ્રીમતી	પાર્વતીબેન દામોદરભાઈ દિવાણી	પુણે
શ્રીમતી	પાર્વતીબેન હિરાલાલ ભાવાણી	ધુલિયા
શ્રીમતી	પાર્વતીબેન પુંજાલાલ હલપાણી	હરિપુરા
શ્રીમતી	પાર્વતીબેન વિશ્રામભાઈ દિવાણી	સિકંદરાબાદ
શ્રીમતી	પુષ્પાબેન ભવાનભાઈ લિંબાણી	દયાપર
શ્રીમતી	પુષ્પાબેન નવિનકુમાર વેલાણી	દુર્ગાપુર
શ્રીમતી	રાધાબેન અરવિંદભાઈ પટેલ	નખત્રાણા
શ્રીમતી	રંજનબેન કૃષ્ણકુમાર વાગડીયા	પુણે
શ્રીમતી	રતનબેન કરસનભાઈ સેંઘાણી	સુરત
શ્રીમતી	રીનાબેન ગંગારામ ચૌહાણ	ભુજ
શ્રીમતી	રૂક્ષ્મણીબેન દામોદરભાઈ પોકાર	તલોદ
શ્રીમતી	સંગીતાબેન દિનેશભાઈ હલપાણી	ઘડુલી
શ્રીમતી	સરોજબેન પુરૂષોત્તમભાઈ સેંઘાણી	મામાય મોરા
શ્રીમતી	સાવિત્રીબેન ખેતારામ ચોપડા	મગવાના
શ્રીમતી	શાંતાબેન દેવસીભાઈ લિંબાણી	બેંગ્લોર
શ્રીમતી	શાંતાબેન ખીમજીભાઈ નાથાણી	કોટડા-જડોદર
શ્રીમતી	શાંતાબેન મગનભાઈ નાકરાણી	રાયપુર
શ્રીમતી	શાંતાબેન રતિલાલ સાંખલા	સાંગલી
શ્રીમતી	શોભાબેન મુકેશભાઈ સેંઘાણી	કોલકત્તા
શ્રીમતી	સુશીલાબેન જયંતીલાલ	દેવપર-યક્ષ
શ્રીમતી	ઉર્મિલાબેન અંબાલાલ પોકાર	ગાંધીધામ
શ્રીમતી	ઉર્મિલાબેન વાડીલાલ પારસીયા	નખત્રાણા-જુનાવાસ
શ્રીમતી	ઉર્મિલાબેન વિનોદભાઈ ખેતાણી	કોટડા-જડોદર
શ્રીમતી	વનિતાબેન મોહનભાઈ રૂડાણી	કોલકત્તા
શ્રીમતી	વનીતાબેન વિઠ્ઠલભાઈ પોકાર	માપસા-ગોવા
શ્રીમતી	વર્ષાબેન નરેશભાઈ દિવાણી	મુંબઈ
શ્રીમતી	વસંતાબેન રતિલાલ છાભૈયા	સિકંદરાબાદ
શ્રીમતી	વિજયાબેન અશોકભાઈ નાકરાણી	ગોવા

યુવાસંઘ તર્ફે દિપાવલીની શુભકામનાઓ

પાનુ નં ૦૬ થી ચાલુ

પ્રાર્થના સાથે ટીમ યુવાસંઘ ફરીથી એક વાર સમાજના સર્વ જ્ઞાતિજનો દિપાવલી પર્વ અને નુતન વર્ષની શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવે છે.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ
પ્રમુખ -શ્રી રવિ ધોળુ, મહામંત્રી-શ્રી મોહન ધોળુ

નોંધ : SUV નોલેજ કાર્નિવલ માટે તેમજ અન્ય ચર્ચાઓ માટે ૨૨ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ સુરત ખાતે યુવાસંઘની પંચમ કારોબારીનું આયોજન કરવામાં આવેલ છે. સેન્ટ્રલ હોદ્દેદારો, રિજયન હોદ્દેદારો, સલાહકાર સભ્યો સહિત દરેક કારોબારી મિત્રો અચુક હાજરી આપશો.



વિગોડીમાં ભગવાન લક્ષ્મીનારાયણ તેમજ રામદરબારનો ૪૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

વિગોડી તા.નખત્રાણા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન તેમજ રામ દરબારનો ૪૬ મો વાર્ષિક પાટોત્સવની ઉજવણીમાં સ્થાનીક સમાજ તેમજ બહાર વસ્તા ભાઇ બહેનોએ માદરે વતનમાં ઉપસ્થિતી રહી ઉત્સ-ાહ ભેર ભાગ લીધો હતો.

પ્રથમ દિવસે તા.૩.૮.૨૦૧૭ના દિવસે સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઇ મનજીભાઇ ભાવાણીના અદ્યક્ષતામાં સમાજની કારોબારી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નવ નિર્માણ અપના ઘર ભવન એવમ નુતન વાડીનું ઉદઘાટન (લોકાર્પણ સમારોહ)નો સમય વૈશાખ મહિનામાં વિદ્યાર્થીઓના વેકેશન દરમ્યાન આયોજીત કરવો અને તારીખ સામાન્ય સભામાં ફાયનલ કરવી એવું નક્કી કરવામાં આવ્યું.

બીજા દિવસે તા.૪.૮.૨૦૧૭ ના રોજે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના પ્રાંગણમાં કિરણ મહારાજ દ્વારા ગઢવીની સંગીતની ટીમ દ્વારા સંગીતમય સત્યનારાયણ મહા પુજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું એમાં શ્રોતાજનો મંત્ર મુગ્ધ રસ તરબોળ બન્યા હતા. બપોર પછીના સત્રમાં ચડાવાની મીટીંગનું આયોજન રાખેલ હતું. રાત્રીના સમયે ગ્રામસભાનું આયોજન રાખેલ હતું તેમાં બહાર વસતા ભાઈઓના પ્રશ્નોના નિવારણ કરવામાં આવેલ.

૩જા દિવસે તા.૫.૮.૨૦૧૭ના સવારનાં આપણા ઈષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન તેમજ રામ દરબારનો મહોત્સવમાં પ્રથમ પાલખીની જલ યાત્રા સમીરસર તળાવે વાજતે ગાજતે લઇ જવામાં આવેલ હતી. ત્યારબાદ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના પ્રથમ દ્વિતીય અને તૃતીય પગલાં આપી નગર ભ્રમણ કરી અને પછી મંદિરે પહોંચેલ હતા.

બીજા સત્રમાં બપોરના ૩ કલાકે સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઇ ભાવાણીની અદ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં નવ નિર્મીત અપના ઘર ભવન એવમ્ નુતન વાડીનું ઉદ્ઘાટન સમારોહનો સમય સર્વાનુમતે તા.૬-૫/૭-૫/૮-૫-૨૦૧૮ વૈશાખ મહિનામાં ધામધૂમથી ઉજવાનો એવું નક્કી કરવામાં આવ્યું તેમજ ચાલુ કાર્યકારણીની મુદત ૩ વર્ષની પુરો થયેલ છે. એવી જાહેરાત મહામંત્રી શ્રી કિશોરભાઇ સોમજીભાઇ કાલરીયા, ખામગાંવ દ્વારા કરવામાં આવેલ.

ત્યારબાદ સામાન્ય સભાએ ચાલુ કાર્યકારણીને આગામી ૩ વર્ષ માટે કન્ટ્યુનેટ કરવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમની કાર્યવાહીનું સંચાલન સમાજના મહામંત્રી શ્રી કિશોરભાઇ સોમજીભાઇ કાલરીયા, ખામગાંવ દ્વારા કરવામાં આવ્યું.

।। સનાતન પરમો ધર્મ ।।

શ્રી આણંદ જીલ્લા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ

‘ઉમા ભવન’ શ્રી ક.ક.પા.સમાજવાડી, આણંદ-સોજીત્રા રોડ,નવી પાણીની ટાંકી સામે,
મુ.પો. આણંદ,પીન કોડ-૩૮૮૦૦૧, ફોન નં૦૨૬૯૨-૨૬૨૦૮૦

શ્રી આણંદ જીલ્લા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ભારતભરેમાં વસતા જ્ઞાતીજનોને નવા વર્ષના સાલમુબારક પાઠવે છે. સંવત ૨૦૭૪ થી શરુ થતુ નવું વર્ષ સર્વે જ્ઞાતીના પરિવારજનો ને દિર્ધાયુષ્ય બક્ષે તેમજ જીવન,સુખમય,સમુધ્ધમય,તંદુરસ્ત સ્વાસ્થ્યસભર સાથે ઉત્તરોત્તર આર્થીક પ્રગતીશીલ બને તેવી પ્રભુ પાસે પ્રાથના. .. ..

શુભ દિપાવલી સાથે નવા વર્ષના સાલ મુબારક


પ્રમુખશ્રી
તેજાભાઇ નાકરાણી-આણંદ


મહામંત્રીશ્રી
અમૃતભાઇ માકાણી-બોરસદ


ખજાનચીશ્રી
મોહનભાઇ ભાદાણી-આણંદ


ઉપ પ્રમુખશ્રી
હરીભાઇ ધોળુ-પેટલાદ


ઉપ પ્રમુખશ્રી
જયંતીભાઇ પોકાર-પણસોરા


ઉપ પ્રમુખશ્રી
રામજીભાઇ ચૌહાણ-બોરસદ


ઉપ પ્રમુખશ્રી
લખમશીભાઇ લીંબાણી-ચીખોદરા


ઉપ પ્રમુખશ્રી
રાવજીભાઇ ચૌહાણ-ઊમરેઠ


સહમંત્રીશ્રી
મહેન્દ્રભાઇ પોકાર-આણંદ


સહમંત્રીશ્રી
ચંદુભાઇ ભાદાણી-આણંદ


સહમંત્રીશ્રી
જેઠાભાઇ લીંબાણી
આણંદ ગ્રામિણ સમાજ


સહમંત્રીશ્રી
નારણભાઇ નાકરાણી -પેટલાદ


સહ ખજાનચીશ્રી
ગોવિંદભાઇ લીંબાણી- વાસદ


સહ ખજાનચીશ્રી
ભવનભાઇ ભાદાણી-આણંદ


ઓડીટરશ્રી
હિંમતભાઇ વાઘડીયા
(CA) - આણંદ


સહ ઓડીટરશ્રી
કિરીટભાઇ લીંબાણી
(CA) - આણંદ

- શ્રી આણંદ જીલ્લા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ એ આણંદ જીલ્લાની૧૩ સમાજોના જુમખારૂપી એક સમાજ છે જેના ધ્વારા આણંદ મધ્યે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ થકી આપણી જ્ઞાતી અને તેમાં પણ આણંદ જીલ્લામાં વસતા તમામ જ્ઞાતી જનોની એકતાના દર્શન કરાવતો મિલનરૂપી કાર્યક્રમ છે.
- આ કાર્યક્રમ થકી જીલ્લા લેવેલ જ્ઞાતીનું સમુહમિલન, સમુહભોજન અને સમુહલગ્ન રૂપી ત્રીવેણી કાર્યક્રમ હોય તેવી પ્રતીતી લાગી રહી છે.
- આગામી સાતમા સમુહ લગ્નનું આયોજન સવંત ૨૦૭૪ને કારતક સુદ ૧૧ને તા. ૩૧-૧૦-૧૭ ને મંગળવારના રોજ નિર્ધારિલ છે જેમાં ૧૪ નવ યુગલો પ્રભુતામાં પગલા માંડશે. આ સમગ્ર કાર્યક્રમ આપણી જ્ઞાતીના વડીલોની છત્રછાયામાં,માતૃશક્તીના આશીર્વાદ,યુવાનોની કાર્યશક્તીની સાથે આ મંગલમયવિધિ શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉજવવામાં આવશે.
- આણંદ જીલ્લા સમાજે આજસુધી પ્રથમ સમુહલગ્નમાં- ૧૩,દ્વીતીય સમુહલગ્નમાં ૨૭, તૃતીય સમુહલગ્નમાં ૧૮, ચતુર્થ સમુહલગ્નમાં ૨૯ , પંચમ સમુહલગ્નમાં ૩૫, છઠ્ઠા સમુહ લગ્નમાં ૧૭ એમ કુલ ૧૩૯ નવયુગલોને લગ્ન જીવનના બંધનમાં બાંધી વર-કન્યાને પાણીગ્રહણની વિધિ માતા- પિતારૂપી સમાજના પ્રાંગણમાં કરવામાં આવી.

ઘટક સમાજ	પ્રમુખશ્રીનું નામ
આણંદ	તેજાભાઇ નાકરાણી
આણંદ ગ્રામિણ	વાલજીભાઇ પોકાર
ચિખોદરા	નારણભાઇ માકાણી
પેટલાદ	પ્રેમજીભાઇ ભાવાણી

ઘટક સમાજ	પ્રમુખશ્રીનું નામ
બોરસદ	ખીમજીભાઈ ચૌહાણ
બોરસદ તાલુકા	નવિનચંદ્ર માકાણી
ખંભાત	ડાહયાભાઇ ભગત
તારાપુર	જીવરાજભાઇ જાદવાણી
સોજીત્રા	તુલસીદાસ નાકરાણી

ઘટક સમાજ	પ્રમુખશ્રીનું નામ
ઊમરેઠ	ગંગારામ વાસાણી
પણસોરા	કેશવલાલ ભગત
સારસા	દિનેશભાઇ ભગત
વાસદ	શીવદાસભાઇ જાદવાણી

ટીમ યુવાસંઘ-ટર્મ ૨૦૧૬/૧૮-મધ્યાંતર

જયલક્ષ્મીનારાયણ, વંદે માતરમ

યુવાસંઘના ૨૦૧૬-૧૮ વર્ષની ટર્મને જોત જોતામાં એક વર્ષપુર્ણથયુ છે. એક વર્ષપુર્ણથાય એટલે વિતેલા વર્ષના લેખા-જોખા જોઇ લેવાની ભારતીય પરંપરા છે. તો આવો આપણે જોઈએ ૨૦૧૬/૧૮ની ટર્મના પ્રથમ વર્ષમાં થયેલ કાર્યોને ઉડતી નજરે.

વિતેલુ એક વર્ષ એટલે કે મિશન ૨૦૨૦ ના અંતિમ ચરણો તરફનું એક કદમ. આ વિતેલા વર્ષ દરમ્યાન મિશન ૨૦૨૦ અંતર્ગત લક્ષીત થયેલા ઘણાકાર્યક્રમોને સિધ્ધ કરવાનો યુવાસંઘના સુત્ર ``જ્ઞાન-શીલ-એકતા`` તથા ``ચૈતન્ય-સ્ફુર્તિ-ઉત્સાહ`` વડે પુરજોશથી પ્રયાસકરવામાંઆવેલ છે.

ટર્મ ૨૦૧૬/૧૮ ની શરૂઆત થી જ જોઇએ તો.......

૨૦/૨૧ ઓગષ્ટ, ૨૦૧૬ના રોજ શ્રી અ.ભા.ક.ક.પા. સમાજના આધ્યાત્મિક કેન્દ્રસ્થાન એવા શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થાન-દેશલપરના આંગણે ભગવાન લક્ષ્મીનારાયણના સાનિંધ્યમાં તથા કચ્છ રીજીયનની યજમાનીમાં વર્તમાન ટીમનું ગઠન થયું. યુવાસંઘના વડા તરીકે યુવાસંઘમાં વર્ષોથી સેવા આપી રહેલા DMG રીજીયનના શ્રી રવિભાઇ ધોળુની વરણી થઇ. યુવાસંઘની તમામ કમિટીઓના સુપ્રિમ ચેરમેન તરીકે એટલે કે ટીમ યુવાસંઘના ઉપ-પ્રમુખપદે સનાતની વિચાર વડે રંગાયેલા સાબર રીજીયનના શ્રી વસંતભાઇ ધોળુને નિમવામાંઆવ્યા.

ટીમ યુવાસંઘના સંચાલન માટે મહામંત્રી પદ સરદાર પટેલ રીજીયનના શ્રી મોહનભાઇ ધોળુને એટલે કે મને સોંપવામાં આવ્યું જેને નિષ્ઠાપુર્વક નિભાવવા માટે હું સદાય કાર્યરત રહીશ. ત્યાર બાદ વર્તમાન ટીમ માટેના ચાવીરૂપ હોદ્દેદારોની તથા વિવિધ સમિતીઓના કન્વીનરોની વરણી કરવામાં આવી.

વરણી પામેલા દરેક કાર્યકરો આમ તો ઘણા સમયથી સેવાને વરેલા જ છે છતાંય તેમની સેવાને કુશળતાનો પાશ ચડાવા માટે તારીખ ૧૬/૧૭/૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ દેવભુમિ નાસિક ખાતે MMR રીજીયનની યજમાનીમાં અને ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં પંચમ કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ. તેજ સ્થળે વર્તમાન ટર્મની પ્રથમ કારોબારી સભા પણ મળેલ.

૭/૮ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ MGR રીજીયનની યજમાની માંનરોડા મુકામે દ્રિતિય કારોબારી સભા મળેલ. તેની સાથે સાથે YSK ચિંતન બેઠક પણ તેમાં નવા સુધારા-વધારા કરવા માટે યોજવામાં આવેલ.

૨૮ મે, ૨૦૧૭ ના રોજ SVR રીજીયનની યજમાની માં આસનસોલ-રાણીગંજ મુકામે હોટલ મિડવેના ભવ્ય બેંક્વેટ હોલમાં તૃતિય કારોબારી સભા મળેલ. કારોબારી સભાની સમાપ્તિ બાદ કાર્યકરો આ-ગામી મિશન માટે એનજી મેળવી શકે તથા તેમના પરિવાર પણ એકમેક સાથે એકરૂપ થાય તે હેતુથી SVR રીજીયન અને NCR રીજીયન દ્વારા ગંગટોક-દાજીલિંગના પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું.

૨/૩ સપ્ટેમ્બર, ૨૦૧૭ ના રોજ CGR રીજીયનની યજમાનીમાં રાયપુર મુકામે ચતુર્થ કારોબારી અને AGM નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ.

યુવાસંઘના ઈતિહાસમાં અભુતપુર્વ ભવ્યતામાં આ AGM નું આયોજન કરવામાં આવેલ જે બદલ મારી સાથે તમામ ટીમ યુવા સંઘ CGR રીજીયન અને રાયપુર સમાજ તથા રાયપુર યુવક મંડળનો ખુબ ખુબ આભાર માને છે તેમજ સમાજ માટે ઘસાવામાં તેઓ એ જે તત્પરતા બતાવી છે તે બદલ બિરદાવીએ છીએ.

વિતેલા વર્ષ દરમ્યાન લેવામાં આવેલ નિર્ણયો અને પ્રોજેક્ટો જોઈએ તો સૌ પ્રથમ YSK અંગે મોટો નિર્ણય લેવામાં આવેલ. પહેલા (કોઈ પણ રીતે) મૃત્યુ વખતે જ ૮ લાખ રૂપિયા આપવામાં આવતા હતા જે હવેથી મૃત્યુજો અકસ્માતમાં થાય તો તાત્કાલિક ૧૬ લાખ રૂપિયા દિવગંત નિધી આપવામાં આવશે. તેમજ અકસ્માતમાં સંપુર્ણ અંપગતા આવે તો ૮ લાખ સહાય નિધી અકસ્માત વખતે તથા ૮ લાખ દિવગંત નિધી મૃત્યુ વખતે એમ કુલ ૧૬ લાખ આપવામાં આવશે તથા જો અકસ્માતમાં આંશિક અપંગતા આવે તો ૪ લાખ સહાય નિધી અકસ્માત વખતે આપવામાં આવશે.

ત્યાર બાદ સમાજજનો ને ખરીદીમાં આર્થિક લાભ થાય તે માટે યુનિટી કાર્ડનો પ્રોજેક્ટ શરૂકરવામાં આવેલ છે. YSK ની જેમ જ યુનિટી કાર્ડ યુવા સંઘનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સંગઠન સે સમૃધ્ધિ કી ઔર સુત્રદ્વારા યુનિટી કાર્ડવડે માત્ર આપણા સમાજના પરિવારજનો ની આર્થિક બચત થાય તેવો જ હેતુ નથી પરંતુ આપણી સમાજની સંગઠન શક્તિને બહોળા વ્યાપમાં પ્રખ્યાત કરવાનો પણ હેતુ છે.

આ ઉપરાંત ગ્રીન ઈન્ડીયા, પંચામૃત શિબિર, ગૃહિણી તાલીમ, યુવા ઉત્કર્ષ, કોચિંગ કેમ્પ, રમત મહોત્સવ વગેરે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.

થોડી નજર આગામી આયોજનો તરફ.

આ ટર્મની સમાપ્તિ સુધીમાં YSK વડે ૨૭૦૦૦ સભ્યોને આવરી લેવામાં આવશે. તથા શ્રી સમાજના સંપુર્ણ પરિવારોને વેબકોમ વડે કોમ્પ્યુટરાઈઝડ કરી લેવામાંઆવશે.

આગામી ૨૩/૨૪/૨૫ ડિસેમ્બર, ૨૦૧૭ નારોજ વલથાણ-સુરત મુકામે SUV સ્કુલનો દશાબ્દી મહોત્સવ એટલે કે SUV નોલેજ કાર્નિવલ ઉજવાશે. તે પહેલા ૨૨ ડિસેમ્બરના રોજ પંચમ કારોબારી યોજાશે. (SUV નોલેજ કાર્નિવલના આયોજન અંગે જરૂર જણાય તો ૨૨ ડિસેમ્બર પહેલા પણ કારોબારી સભા મળશે)

એપ્રિલ અથવા મે, ૨૦૧૮ના રોજ છઠ્ઠી કારોબારી સભાના આયોજન અંગે વિચારણા ચાલુ છે. જેના સમય અને સ્થળ નક્કી થયે જણાવવામાં આવશે.

આ ઉપરાંત ઘણા બધા આયોજનો વિતેલા વર્ષ માં થયેલ છે તથા આગામી વર્ષમાં થનાર છે. તે બધાની માહિતી જો આપવા રહીએ તો તે આત્મશ્લાઘા ગણાશે.

તેથી સ્વંય પ્રશંસાના કરતા આટલે થી જ અટકીએ અને વિતેલા વર્ષ દરમ્યાન ટર્મ ૨૦૧૬/૧૮ના સલાહકાર સભ્યો, સિનીયર સભ્યો, સેન્ટ્રલ ટીમ મેમ્બરો, થીમ લિડરો, રીજીયન હોદ્દેદારો, યુવામંડળો દ્વારા તન-મન-ધનથી જે સાથ સહકાર મળતો રહ્યો છે તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર માનું છું અને અપેક્ષા રાખુ છું કે આવો જ સાથ સહકાર આગામી વર્ષમાં મળતો રહેશે.

સુંદર કાર્યો સચોટ રીતે સમયસર પુરા કરતા રહીને મિશન ૨૦૨૦ને વર્તમાન ટર્મમાં જ સિધ્ધ કરવાનો પ્રયત્નકરતા રહીએ.

યુવાસંઘના કોઈપણ હોદ્દેદાર દ્વારા સમાજના હિતમાં ક્યારેક કડવા બનીને કોઇને મનદુઃખ થાય એવું કહેવાઇ ગયું હોય કે એવું વર્તન થયું હોય તો યુવાસંઘની વર્તમાન ટીમ એવા દરેક સભ્યોની માફી માંગે છે.

અસ્તુ.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ
પ્રમુખશ્રી- શ્રી રવિ ધોળુ
મહામંત્રીશ્રી- શ્રી મોહન ધોળુ

શ્રી ઉમિયા દ્વારેથી

હપ્તો-૧૯૪

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા આપ સૌને જય માતાજી પાઠવે છે. મા ઉમિયાના આશિષથી આપ સૌ સુખી સમૃદ્ધ અને આબાદ રહો તેવી શુભેચ્છા.

શ્રાવણ માસની કથા પૂર્ણાહૂતિ

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા દરવર્ષે યોજાતી શ્રાવણ માસની કથાની પૂર્ણાહૂતિ તા.૨૧.૦૮.૨૦૧૭ના રોજ સત્સંગ હૉલમાં યોજાઇ. સતત એક માસ સુધીની ભાગવત કથા થઇ. જેમાં રામાયણ, મહાભારત, ગીતા પુરાણ, શક્તિ પૂજા, શિવપૂજા, જ્યોર્તિલિંગ, સમગ્ર સનાતન ધર્મ ઉપર સુંદર, ભાવભક્તિપૂર્ણ સત્સંગ સાથે વિદૂષી સ્વામીની પ્રતિમાનંદ સરસ્વતી, ચિન્મય સંસ્કૃતિ આશ્રમ-સુરેન્દ્રનગર વાળાએ વ્યાસપીઠ ઉપરથી ધર્મ અને સંસ્કૃતિની જાળવ-ણી ઉપર ભાર મૂક્યો. આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના માનદ્‌મંત્રીશ્રી દિલીપભાઇ નેતાજીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું. તેમણે કથાના સુંદર આયોજન બદલ શ્રી ઈશ્વરભાઇ પટેલ, અમૃતભાઇ પટેલ તથા બાબુભાઇ પટેલને ધન્યવાદ પાઠવ્યા. આ કથાના ઉપદેશનું મનન ચિંતન કરીએ, જીવનને ઉન્નત બનાવીએ એવી ભાવના સાથે કથાકાર માતાજીને ખૂબ ખૂબ વંદન.

ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાની જનરલ સભા

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાની જનરલ સભા તા.૨૭.૦૮.૨૦૧૭ના રોજ બપોરે ૨.૦૦ કલાકે માતાજીના ચાચર ચોકમાં સંસ્થાના પ્રમુખ શ્રી નાર-ાયણભાઇ લલ્લુદાસ પટેલના પ્રમુખસ્થાને મળી. સભાની શરુ-આતમાં સંસ્થાના માનદમંત્રીશ્રી દિલીપભાઇ નેતાજીએ સહુનું સ્વાગત કર્યું. વાર્ષિક અહેવાલ, ઓડિટ રિપોર્ટ, અંદાજીત બજેટ મંજૂર કરવામાં આવ્યું. એજન્ડા મુજબના તમામ કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. જનરલ સભામાં સભાસદો તરફથી સંસ્થાના વિકાસ માટેના સૂચનો સૂચવાયા. તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબો પ્રમુખશ્રી/મંત્રીશ્રી તરફથી અપાયા.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંદર્ભે સી.કે. પટેલે સભાને વિસ્તૃત માહિતી આપી. જેમાં આશરે ૧૦૦૦ કરોડના ખર્ચે, ૧૦૦ વીઘા જમીનમાં ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ, આરોગ્ય કેન્દ્ર, કન્યા-કુમાર છાત્રાલય,પાટીદારોનો ઈતિહાસ રજૂ કરતો પ્રોજેક્ટ,કેરિયર ડેવલપમેન્ટ, સમગ્ર દષ્ટિકોણથી આર્થિક, સામાજિક,શૈક્ષણીક વિકાસ ઉત્થાનની પ્રવૃત્તિઓની ઝાંખી કરાવવામાં આવી, સંસ્થાના સહમંત્રીશ્રી પ્રહલાદભાઇ બેન્કરની આભાર વિધિથી સભા પૂર્ણ થઇ.

નવરાત્રિ શક્તિપર્વનો મહોત્સવ

તહેવારોએ ભારતીય સંસ્કૃતિની વિરાસત છે. ધર્મ આધારિત તહેવારોએ માનવીય મૂલ્યોની જાળવણી કરી જીવન જીવવાનો રાહ બતાવ્યો છે. નવરાત્રિ એટલે નવ દિવસનો ઉત્સવ, શક્તિ, ભક્તિ, સાધના અને ઉપાસનાનું પર્વ, માતાજીમાં ઉજવાતા તહેવારોમાં નવરાત્રિ શ્રેષ્ઠ પર્વ છે.

મા ઉમિયાનો નવરાત્રિ મહોત્સવ શ્રી ઉમિયા માતાજી-ઊંઝાના ચાચર ચોકમાં આસો સુદ-૧ તા.૨૧.૦૯.૨૦૧૭ થી આસો સુદ-૯ તા.૨૯.૦૯.૨૦૧૭ સુધી ભવ્યાતિભવ્ય ઉજવાયો. આ ઉત્સવ માટે આરતી, પ્રસાદ, નવચંડી હવન, ફૂલોની આંગી, માતાજીની સાડી વગેરેની ઉછામણી થઇ, જેમાં નગરજનોનો અભૂતપૂર્વ ઉત્સાહ, માતાજી પ્રત્યેનો ભક્તિભાવ જોવા મળ્યો.

ઉછામણીમાં ભાગ લેનાર તમામ દાતાશ્રીઓનો સંસ્થા હૃદયપૂર્વક આભાર માને છે. માતાજીના મંદિરમાં કોટ ફરતે, માતાજીની માંડવી, દરેક જગ્યાએ હેલોઝોન, L.E.D. લાઇટ રંગબેરંગી સીરીઝથી ભવ્ય રોશની કરવામાં આવી, ઓફિસ, માનસરોવર, ભોજનાલય, વિશ્રાતિગૃહ વગેરેમાં આ નવ દિવસનો નજારો અભૂતપૂર્વક લાગતો હતો.

આસો સુદ આઠમના દિવસે નવચંડી હવન તેમજ તે દિવસે ૯૦૧ દિવડાની મહાઆરતી કરવામાં આવી. આ મહાઆરતીનો નજારો અદભૂત, અવર્ણનીય, આહલાદક રહ્યો. ચાચર ચોક માનવ મહેરામણથી જાણે ઉભરાયો. શક્તિ-ભક્તિ-ઉપાસનાના આ પર્વમાં ભા-ઈઓ, યુવાનો, બહેનોને ગરબા સાથે શિસ્તબદ્ધ ઘૂમતા જોવાનો અવર્ણનીય લાહવો સહુએ માણ્યો.

વિખ્યાત ગાયકવૃંદે નવે દિવસ આસ્થાપૂર્વક ગરબા ગવડાવ્યા. આ મહોત્સવને સફળ બનાવવા શ્રી ઉમા માઇ મંડળ-ઊંઝાના પ્રમુખ શ્રી એસ.કે.પટેલ, મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ ભારે જહેમત ઉઠાવી. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ.

ઉચ્ચ શિક્ષણ સહાયનિધિ

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા તરફથી જરુરીયાતમંદ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા ભાઇબહેનોને વગર વ્યાજની લોન અપાય છે. જેના ફોર્મનું વિતરણ ચાલુ કરેલ છે. સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ ભરી મોકલી આપવાની છેલ્લી તા.૩૧.૧૨.૨૦૧૭ છે. ધોરણ-૧૨ કે છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા કે તેથી વધુ મેળવેલ હોય તેમને માર્કશીટની ઝેરોક્ષ પાછળ નામ-સરનામું-ટેલીફોન નંબર લખી ફોર્મ મંગાવી લેવા વિનંતી છે. જૂના વિદ્યાર્થિઓએ ફોર્મ ભરી મોકલી આપવાની છેલ્લી તા.૧૫.૧૨.૨૦૧૭ છે. વધુ વિગતોની જાણકારી માટે સંસ્થાના ફોન:૦૨૭૬૭-૨૪૫૯૭૨ ઉપર પૂછપરછ કરી શકાશે.

આપ સૌના ઉપર મા ઉમાના
આશીર્વાદ સદૈવ ઉતરતા રહે એ જ
પ્રાર્થના.
આપ સર્વનો સહકાર એ જ
અભિલાષા સહ ।। જયશ્રી ઉમિયા ।।

સામાન્ય માનવી ની વાચા

મેરે મનકી ગંગા ... તેરે મનકી જમુના બોલ રાધા બોલ સંગમ હોગા કે નહી... અરે બોલ રાધા બોલ સંગમ હોગા કે નહિ.

ખુલમ ખુલ્લા પ્યાર કરેંગે હુમ દોનો અરે ઈસસ દુનિયા સે નહિ ડરેગે હુમ દોનો...

અગર તુમ મિલ જાઓ જમાના છોડ દેગે હુમ, તુંમેહ પાકર જમાના ભરશે રિસ્તા તોડ દેગે હુમ...

મારાં યુવા (યુવતી અને યુવાન) મિત્રો રૂપેરી પરદા પર ગવાયેલ આ ફિલ્મી ગીતો તમોને ક્ષણીક જરૂર આનંદ આપશે. પરંતુ આ આનંદ રણમાં દેખાતા ઝાઝવાના જળ જેવો હશે.

આ ગીતો સંવાદોને આપણી રીયલ લાઈફ બનાવવા અને અપનાવવા જેવા નથી. આવા ગીતો સંવાદો ને અક્ષર સહ સાચા માનવાને બદલે પ્રતીકાતમક સવરૂપ માજ સમજવા જોઈએ.

રૂપેરી પરદા પર ભજવતા દશયો માં હિરો હિરોઈન તેમની રીયલ લાઈફ માં કદીએ પતિ પત્ની નથી હોતા. તેમજ વિલન પિસ્તોલની ગોળી કે રામ પુરી ચાકુથી કદીએ મરતો નથી. તે આવનારી બીજી ફિલ્મ માં જીવતો રહીને રોલ ભજવે છે તે આપ સૌ ભલી ભાતી જાણો જ છો.

વિદ્યાર્થી કાળમાં યુવા મિત્રો કોલેજમાં અભ્યાસ કરવા જાય છે. આ બહુજ સારી વાત છે. અતયારનો સમય જ્ઞાન લેવાનો અને સ્વ વિકાસ કરવાનો છે.

કોલેજ માં લેવાતાં વર્ગ દરમિયાન તમારા અણગમતા વિષયો હોઈ ત્યારે કેટલાક યુવા મિત્રો કલાસમાંથી બહાર નીકળી જઈને બગીચા કે અન્ય ગમતા સ્થળે ફરવા નીકળી જાય છે. અને મનગમતા પાત્રો સાથે બેસી રહિને હલે મલે છે. અને આવા મિલાનોમાં અભ્યાસની ચર્ચા હોઈ તો બહુજ સારી વાત છે. પરંતુ ગણે ભાગે હાલમાં ચાલતા રૂપેરી પરદાના ગીત અને સવાંદો નીજ વાતો હોઈ છે.

આવા મિલનો તમારા સંબંધમાં વધારો કરે છે. તમોએ પસંદ કરેલ પાત્ર તમારાં સવ્ભાવ વર્તન અને વ્યવાર ને અનુકુળ હશે? કદાચ અનુકુળ આવશે તો તમારું ભવિષ્ય તેની સાથે બંધાવાનું છે. તેથી મિત્રો યાદ રાખશો કે, તમારાં વધુ પડતા મિલનો ને કારણે મિત્રતા ઘનિષ્ટ ને મજબૂત બનશે, ત્યારે તમો ફિલ્મી અંદાઝમાં એક બીજાને જનમ જનમ માં સાથ રહેવાના કોલ પણ આપસો. અને તમોએ પસંદ કરેલ તમારુ પ્રિય પાત્ર તમારી પોતાની સમાજ કે જ્ઞાતિનું હોઈ તો બહુજ સારી વાત છે. પરંતુ આ પાત્ર અન્ય જ્ઞાતિ કે સમાજનું હોઈતો તમ-ારો પરિવાર કે સમાજ તેને અપનાવશે? તમ-ારી પસંદગીનું પાત્ર આપણી સમાજના નીતિ નિયમો નું પાલન કરશે?

અને તમો કદાચ વિચારતા હો કે પરિવાર અને સમાજ તમોને સ્વીકારશે નહિ તો તમો અલગ થઈને તમારી પોતાની દુનિયા વસાવસો. આમ બનશે તો ભવિષ્યમાં તમારાં સુખ દુઃખ માં તમોને સાથ દેવા માટે તમારી પડખે કોણ ઉભું રહેશે? અને વખત વીતતા તમારાં બાળકો થશે તો તેનું ભવિષ્ય કોણ કંડારસે? તેને સંસ્કાર કોણ આપશે? તમારાં સંતાનો કાકા, મામા, માસા, ફાઈ, દાદી અને દાદા કોને કહેશે? આ ઉપરાંત તમારો ઘરસંસાર ચલવવા માટે તમોને નાણા કાપ અને આર્થિક બાબતે મદદ કરવા કોણ આવશે?

તમો પરિવાર અને સમાજ થી વિખુટા પડી જસો. અને આવા હજુ ઘણા બધા પ્રશ્નો તમારા જીવનમાં ડગલે ને પગલે તમારી સામે આવીને ઉભા રહેશે.

માણસ આદિકાલથી હમેશા સમુહ અને સમાજમાં રહેતો, શીખતો અને વહેવાર કરતો આવ્યો છે. આપણો દેશ સમાજવાદી દેશ છે. ભારતમાં વસતી દરેક જ્ઞાતિઓ ની તેની પોતાની સમાજ રચના કરેલી હોઈ છે. તેના નીતી અને નિયમો પણ બનાવેલ હોઈ છે, તેમજ તેના પોતાના આગવા વહેવારો પણ ચાલતા હોઈ છે. હવે તમે જે તમારી પોતાની નવી દુનિયા વસાવવા જતા હો ત્યારે એટલું વિચારજો કે તમારી પોતાની સમાજ નહિ હોઈ તો તમારા ભવિષ્યના વહેવારો કેવા અને કોની સાથે કરશો? તેથી તમોને કહેવાનું છે કે મારા વહાલા મિત્રો આવા ભાગેડું લગ્નોથી આપણી સમાજને તો નુકસાન થાઈજ છે પણ તેની સાથે તમારા માવિત્રો અને પરિવારજનોની પણ નાલેશી થશે અને તેઓ સગા વહાલા કે સમાજમાં ક્યાંય મોઢું બતાવવા લાયક નહિ રહે.

તમારા ભાગેડું લગ્નથી વર્ણશંકર પ્રજાને પ્રોસ્તાહન આપવા જેવું બનશે. આવા લગ્ન કર્યા બાદ થોડા વર્ષ તમોને અનુકુળ પ્રતિકુળતા માં વિતશે. અને થોડાક વર્ષો પછી તમારા સંતાનો પણ થાય. ત્યાર પછી તમોને કદાચ પસ્તાઓ પણ થશે કારણ કે હમેશા તમારી સાથે રહેવાવાળા તમારો પરિવાર સમાજ, સગા વહલા અને મિત્ર વર્ગ વર્તુળથી તમો બહુજ પાછળ રહી ગયા હશો. અને સમય રૂપી પાણી તમારા માથા થી ઉપર આવી ગયુ હશે. આવી બાબતે જેણે આપણી સમાજથી હટીને ભાગેડું લગ્ન કરેલા છે તેમના બહુજ કડવા અને ખરાબ અનુભવો દેખાઈ રહ્યા છે. તેઓની ત્રિશંકુ જેવી પરિસ્થીતી થઈ છે. આપણા સમાજે તેને અપનાવેલ નથી.

મિત્રો એટલેજ સમય વર્તે સાવધાન થઈને તમોએ લીધેલ ખોટો નીરનય ને તમો ફરી ઠંડા મગજ થી આગળ પાછળનો વિચાર કરીને પગલું ભરસો તમો જોશ માં હોશ ગુમાંવશો નહિ. એમાંજ તમારું પોતાનું હિત હશે.

અને આવી બાબતે વડીલો એ પણ ખુબજ મહત્વની ભુમીકા ભજવવાની હોઈ છે. આપણા સંતાનો ઉમર લાઇક બન્યા પછી સંતાનો ની સાથે મિત્રવત બેસી તેના મિત્ર બની ને તેના મિત્રોનું લીસ્ટ બનાવવું જોઈએ તેની દિન ચર્યા અને મોબઈલના વાર્તાલાપો જોઈ સાંભળીને તેની સાથે રહીને સાચી અને વ્યહવારિક સમજ આપવી જોઈએ. તેમની સાથે શક થાઈ તેવું વર્તન કદીયે ન કરવું પરંતુ મિત્રવત વાતાવ-રણ બનાવવું જોઈએ. તેના સવ્ભાવ પ્રમાણે સંસ્કારીક વાતો અને વાતાવરણ બનાવવું જોઈએ અને પરિવાર સમાંજ હિતમાં ની વાતો કરવી જોઈએ. તેની સાથે બેસીને તેને લીધેલા ખોટા પગલાંથી પાછા વાળવા માટેના ભરપૂર પ્રયત્નો કરવા જોઈએ.

બની શકેતો સગા વહાલા નો સાથ સહકાર પણ લેવો જોઈએ. આવા યુવા મિત્રોને એકાંતમાં, ઉદાસીનતા માં કે રીસવામાં જવા ન દેવા જોઈએ. તેનું મન આનંદિત અને પ્રફુલિત થાય તેવા પ્રયત્નો કરવા. અને આપના ઘરનું વાતાવરણ હમેશા આનંદમય અને ગમ્મત ભર્યું હોવું જોઈએ. ઘરમાં આ યુવાન ભાઈ બહેન કે ભોજાઈ હોઈ તો તેની સાથે તંદુરસ્ત અને નિખાલસ નોક ઝોક કે ગમ્મત પણ થવી જોઈએ. તદુપરાંત આપની પાસે જો સગવડ હોઈ તો વર્ષમાં એકાદ વખત આપ સોની સાથે રહીને પુરા પરિવાર સાથે કોઈ સારા સ્થળે હરવા ફરવા જવાનો પ્રોગ્રામ પણ બનાવવો જોઈએ. તેથી આપના પરિવારના નાના મોટા દરેક સભ્યો એક બીજા સાથે રહીને નીકટતા અને ઘનિષ્ઠતા માં વધારો થશે. તદુપરાંત આપના યુવામિત્રોને સમાજની દરેક પ્રવૃતીમાં ભાગ લેવા માટે પ્રેરણા અને પ્રોસ્તાહન આપવું જોઈએ. આપનાં સંતાનો ને સગા સબંધીઓ અને સમાજ જનો ના પરિવારો સાથે હળવા મળવા દેવા જોઈએ. વડીલોએ પરિવારના દરેક સભ્યોને એકતાના સૂત્રમાં બાંધવા માટે સારી મહેનત કરવી જોઈએ સાથે સાથે વડીલોએ નીરવ્યસની તેમજ સંસ્કારમાંય બનીને સમય સુચકતા વાપરી ને ઘરનું વાતાવરણ સંપ શાંતિમાય બનાવવું જોઈએ આપનાં સંતાનો હમેશા આપનું અનુકરણ કરે છે. તેથી આપણું વર્તન એવું ન હોવું જોઈએ કે તેઓની ભાવના ચેતના ને ઠેસ પહોચે.

સમાજના સર્વે જનોએ આવા ઠેસ પહોચેલ યુવાનની સાથે રહીને સૌ હાર્દ ભર્યું વાતાવરણ બનાવવું જોઈએ. એક કહેવત છે કે સવારનો ભૂલ્યો સાંજે ઘરે પાછો ફરે તો તેને ભૂલ્યો ન કહેવાય તેમ આ યુવા સમાજના વહેતા પ્રવ-ાહમાં ભળી જાય તેવી અભ્યથરના.

સર્વે ત્ર સુખીનઃ સંતુ, સર્વે સંતુ નીરા મયાઃ
સર્વે ભદ્રાની પશ્યન્તુ મા કસ્તીત દુઃખ માંન્યાતું

शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥

May millions of lamps illuminate ur life
with endless joy,prosperity,health & wealth forever
Wishing YOU and YOUR family a very

"HAPPY DIWALI & NEW YEAR"

VIRANI GROUP
BANGLORE,KARNATAKA
web: viranigroup.in

WESTERN GROUP
ABU DHABI , U.A.E

BIKANER RESTAURANT
KHARGHAR,NAVIMUMBAI

- GOVIND PATEL - +919448820236
- KANTILAL PATEL - +919448273789
- NAVIN PATEL - +919820008029
- RAJU CHHABHAIYA - +971543478186
- PIYUSH PATEL - +919324575054
- YASHESH RAMANI - +971507001539
- TUSHAR SENGHANI - +919845486699
- SMIT SENGHANI - +971505014545

શ્રી ઘડુલી પાટીદાર સમાજની સામાન્ય સભાનો અહેવાલ

શ્રી ઘડુલી પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા, રવિવાર તા.૧૩.૮.૨૦૧૭ના રોજ, પ્રમુખ શ્રી કાન્તીલાલ લખમશી લીંબાણીના પ્રમુખસ્થાને મંદિરના સભા હોલમાં મળેલ.

પ્રાર્થના બાદ સભાની શરુ-આત કરવામાં આવેલ. મહામંત્રીશ્રી અમૃતભાઇ માંકાણી એ સભાની કાર્યવાહી આગળ વધારેલ.

ઉપપ્રમુખ શ્રી રતિલાલ વેલજીભાઇ નાકરાણીએ સભામાં પધારેલ સભ્યોનું શબ્દોથી સ્વાગત કરેલ.

સમાજના નામી અનામી સભ્યોના થયેલ અવસાન બદ્દલ ઉભા થઇ બે મીનીટનું મૌનપાળી શ્રદ્ધાંજલી આપવામાં આવેલ.

ગત વાર્ષિક સામાન્ય સભાની મીનીટ બુકનું વાચન મંત્રીશ્રી વસંતભાઇ સામજીભાઇ સાંખલાએ કરેલ જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ.

ગત વર્ષ ૨૦૧૬-૨૦૧૭ના વાર્ષિક હિસાબોની રજુઆત ઓડિટર શ્રી પ્રેમજીભાઇ લખુભાઇ માવાણીએ કરેલ જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા.

ગતવર્ષના વિવિધ દાતાશ્રીઓ જેવા કે ભોજનદાતાઓ, ટાવર ખર્ચના દાતાશ્રીઓ, ભગવાનના વસ્ત્ર અલંકારના દાતાશ્રીઓ તથા અન્ય વિવિધ દાતાશ્રીઓના પ્રમુખશ્રી તથા વડિલોના હસ્તે શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવેલ.

ત્યારબાદ ચાલુ વર્ષના વિવિધ દાતાશ્રીઓના નામો લખવામાં આવ્યા જેમાં ૧) પાંચમના ભોજન દાતાશ્રી સ્વ. અરવિંદભાઇ પ્રેમજીભાઇ લીંબાણી (થાણા), ૨) રાંધણછઠ્ઠના ભોજન દાતા શ્રી દેવશીભાઇ શીવજીભાઇ મૈચાત (વડનગર), ૩) શીતળાસાતમના ભોજન દાતા સ્વ.રાજાભાઇ પચાણભાઇ વાઘડીયા (ઘડુલી), ૪) જન્માષ્ટમીના ભોજન દાતા સ્વ.લાલજીભાઇ દેવજીભાઇ ચૌધરી (ચાણસ્મા), ૫) નંદ મહોત્સવના ભોજન દાતા સ્વ.દેવજીભાઇ નારાણભાઇ સાંખલા (ઘડુલી), ૬) કૃષ્ણજન્મ મહાઆરતીના દાતા સ્વ. રતનબેન સામજીભાઇ સાંખલા (નાડીઆદ), ૭) રાંધણછઠ્ઠ ચા-નાસ્તાના દાતા શ્રી દેવશીભાઇ, શિવજીભાઇ મૈચાત (વડનગર), ૮) શીતળા સાતમ -ચા-નાસ્તાના દાતા સ્વ. રસીકલાલ કરમશીભાઇ કાલરીયા (રસાયણી), ૯) જન્માષ્ટમીના ચા-નાસ્તાના દાતા સ્વ.લધારામ દામજીભાઇ સાંખલા (આણંદ), ૧૦) નંદ મહોત્સવ-ચા-નાસ્તાના દાતા શ્રી રતનશીભાઇ લાલજીભાઇ સેંઘાણી (નડીઆદ), ૧૧) પક્ષી ચણના દાતા (૧૨ માસના) સ્વ.નારાણભાઇ માવજીભાઇ સાંખલા પરિવાર (થાણા-રાજકોટ), ૧૨) મંદિર પ્રસાદના દાતા (૧૨ માસના) શ્રી હંસરાજભાઇ પ્રેમજીભાઇ સાંખલા (કલોલ), ૧૩) પાટોત્સવના દાતા સ્વ. નાગજીભાઇ વાલજીભાઇ હળપાણી પરિવાર (બેચરાજી,કળે), ૧૪) મીનરલ વોટરના દાતા શ્રી ખીમજીભાઇ દેવજીભાઇ સાંખલા -(નંદાસણ), ૧૫) સરસ્વતી સન્માનના દાતા શ્રી ચંદુભાઇ કાનજીભાઇ સાંખલા -પેટલાદ-રંગાઇપુરા, ૧૬) સહ-ાયક ભોજનદાતા માટે કુલ્લ ૬૦ દાતાશ્રીઓએ સ્વૈચ્છિક નામો નોંધાવેલ.

ત્યારબાદ સમાજે લીધેલ ફકુબાપાના મકાન વિશેની માહિ-તી આપવામાં આવેલ. બાંધકામ સમિતિએ બનાવેલ પ્લાન રજુ કરવામાં આવેલ અને અંદાજીત ખર્ચની માહિતી આપવામાં આવેલ. દિવાળી પછી કામ શરુ કરવાનું નક્કી કરવામાં આવેલ. ઉપરોક્ત રજુઆતોને બહાલી આપવામાં આવેલ.

સમાજ વિકાસ તથા શિક્ષણ વિકાસ અંગે વિચારો લેવામાં આવેલ. ઉપસ્થિત ઘણા સભ્યોએ પોતાના વિચારો આપેલ.

સમાજની વર્તમાન કારોબારી તથા ટ્રસ્ટીઓની મુદત પૂર્ણ થતાં આગામી ત્રણ વર્ષ માટે (૨૦૧૭-૧૮ થી ૨૦૧૯-૨૦) નવિન કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. નવિન કારોબારી માટે ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ. ચૂંટણી પંચે સૂચવેલ કારોબારી માટેના તથા ટ્રસ્ટીપદ માટેના નામોને મંજુરી આપવામાં આવેલ. ત્યારબાદ નીચે મુજબ હોદેદારોની વરણી કરવામાં આવેલ.

ટ્રસ્ટી શ્રી કાન્તીલાલ લખમશી લીંબાણી -થાણા

શ્રી રતિલાલ વેલજીભાઇ નાકરાણી -પનવેલ

શ્રી દેવજીભાઇ રામજીભાઇ લીંબાણી -નરોડા

અનુસંધાન પાનુ નં ૨૦

શ્રી અ.ભા.ક.ક.પા. યુવાસંઘની ટર્મ ૨૦૧૬/૧૮ની રાયપુર (છત્તીસગઢ રિજીયન) ખાતેની ચતુર્થ કારોબારી સભા અને પ્રથમ વાર્ષિક સામાન્ય સભાનો અહેવાલ



ફોરેસ્ટ કાઉન્સિલના છત્તીસગઢ રિજીયનની યજમાનીમાં અને શ્રી ક.ક.પા.યુવક મંડળ, રાયપુરના સાથ સહકારથી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘની વર્તમાન ટર્મની ચતુર્થ કારોબારી સભા તારીખ ૦૨/૦૯/૨૦૧૭, શનિવારના રોજ પાટીદાર ભવન, ફાફાડીહ, રાયપુર ખાતે સફળતાપુર્વક સંપન્ન થઇ હતી. અને ૦૩/૦૯/૨૦૧૭, રવિવારના રોજ જ્ઞાનોદય ભવન, ગુજરાતી સ્કુલ, રાયપુર ખાતે **AGM** યોજાઇ હતી. તથા ૦૪/૦૯/૨૦૧૭ના રોજ પિકનીકની સાથેસાથે ઉધ્ધોગ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ડિજીટલ ઈન્ડીયા-ડિજીટલ યુવાસંઘ-ડિજીટલ રાયપુરના સુત્ર પ્રમાણે કારોબારી સભા અને **AGM** માં પધારનાર સૌ સભ્યોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન પહેલેથી જ કરવામાં આવ્યું હતું. ઓનલાઇન માહિતી પ્રમાણે જે તે સમયે જે તે સાધનમાં આવનાર સભ્યોને ફાફાડીહ સમાજવાડીમાં સંપુર્ણ વાતાનુકુલિત રૂમમાં ઉતારો આપવામાં આવ્યો. તેમની માહિતી ઓનલાઇન ચેક કર્યા બાદ કોઈપણ સભ્યને પોતાની બેગ માત્ર કપડા કાઢવા માટે જ ખોલવી પડે તેવા સાધનો વડે ભરચક સ્વાગત કમ ઉતારા કિટ આપવામાં આવેલ.

બીજા દિવસે એટલે કે ૦૨/૦૯/૨૦૧૭ના રોજ કારોબારી સભા માટે પધારેલ સર્વ સભ્યોનું સર્વપ્રથમ છત્તીસગઢ રિજીયન અને રાયપુર યુવકમંડળ દ્વારા ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું.

સેન્ટ્રલ પ્રેસિડેન્ટ શ્રી રવિભાઇ ધોળુ (ગોવા)ની અધ્યક્ષતામાં યોજાયેલ કારોબારી સભામાં પ્રથમ મહાનુભાવોની સ્થાનવરણી છત્તીસગઢ રિજીયન સેક્રેટરી શ્રી શંભુભાઇ છાભૈયા(રાયપુર) દ્વારા થઇ હતી. ત્યાર બાદ એજન્ડા મુજબ ચર્ચા યુવાસંઘ જનરલ સેક્રેટરી શ્રી મોહનભાઇ ધોળુ(પેટલાદ) દ્વારા હાથ ધરવામાં આવેલ. અંતે આભારવિધી નર્મદા કાઉન્સિલ પ્રેસિડેન્ટ શ્રી કાંતિભાઇ સાંખલા (સિન્નર) દ્વારા સંપન્ન થઇ હતી. કારોબારી સભાની સમાપ્તિ બાદ રાત્રે ૯ થી ૧૧ કલાક દરમ્યાન રાયપુર સમાજની ત્રણેય પાંખ સાથે શ્રી સમાજની ત્રણેય પાંખોએ વિચાર ગોષ્ઠિ કરેલ જેમાં સમાજ ઉપયોગી વિચાર નવનીત પ્રાપ્ત થયેલ.

ત્રીજા દિવસે એટલે કે ૦૩/૦૯/૨૦૧૭ના રોજ શ્રી સમાજની કોઇ પણ ઘટક સંસ્થા કે સમાજે જોયુના હોય તેવા માહોલમાં **AGM** માટે પધારનાર સભ્યોની રેલી ઉતારાની જગ્યા (ફાફાડીહ સમાજવાડી) થી **AGM** સભા સ્થળ (જ્ઞાનોદય ભવન) યોજાઇ હતી.

રાયપુર શહેરના મેયર શ્રી પ્રમોદ દુબેજી દર મહિનાની ત્રીજી તારીખ રાયપુર શહેરમાંનો વિહીકલ ડે તરીકે ઉજવે છે. આપણી સમાજના ચુસ્ત સમયપાલનની છાપને લીધે તેઓશ્રી સવારમાં ૭:૩૦ કલાકે ફાફાડીહ સમાજવાડીમાં તેમના અન્ય સાથીદારો સાથે ઉપસ્થિત રહી, પ્રસંગોચિત ઉદ્દ્બોધન કરી(કે જેમાં કચ્છ કડવા પાટીદારોના ભારોભાર વખાણ હતા) મિટીંગ રેલીને સાયકલો તથા પગપાળા દ્વારા પ્રસ્થાન કરાવાઇ હતી. આ રેલીમાંરાયપુર મેયર સહિતના રાજકારણીઓ, શ્રી સમાજના પ્રમુખ શ્રીઅબજીભાઇ કાનાણી(મુંબઇ), ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઇ ભાવાણી (કોલ્હાપુર), મહામંત્રી શ્રી પુરુષોત્તમભાઇ ભગત(અંકલેશ્વર), કેન્દ્રિય મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી યશોદાબેન નાકરાણી(ગોવા), છત્તીસગઢ ઝોન સમાજ પ્રમુખ તથા સાથીદારો, રાયપુર સમાજ પ્રમુખ તથા સાથીદારો, ટીમ યુવાસંઘના પ્રેસિડેન્ટ શ્રી રવિભાઇ ધોળુ અને તેમની ત્રિ-સ્તરીય ટીમ તથા આબાલ-વૃધ્ધ-મહિલા સહિત સૌ સભ્યો હાજર હતા. દોઢ થી બે કિલોમિટર દુર આવેલ **AGM** સ્થળ જ્ઞાનોદય ભવન, ગુજરાતી સ્કુલ, રાયપુર સુધી સૌએ સાઇકલ કે પગપાળા દ્વારા અંતર કાપ્યું હતું.

સભાસ્થળે પંહોચ્યા બાદ અને સમુહમાં ગોઠવાયા બાદ સૌ સભ્યાને જ્ઞાનોદય સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રમ્પેટ/બ્યુગલ/ડ્રમ વગાડીને આવકારવામાં આવેલ. સ્કાઉટ ટુકડી સૌને વૃક્ષારોપણના સ્થળ સુધી લઇ ગઇ હતી. ત્યાં સર્વ મહાનુભાવોના હસ્તે વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવણીનું બીજું ઉત્તમ(પ્રથમ=સાયકલ રેલી) કાર્ય થયું હતું.

ઓડીટોરિયમ હોલમાં પ્રવેશતા જ સભ્યોને રાયપુર સમાજની કુમારિકાઓ દ્વારા કુમકુમ-તિલક-પુષ્પોથી સત્કારવામાં આવ્યા હતા.

ત્યારબાદપ્રથમ વાર્ષિક સાધારણ સભા યુવાસંઘ સેન્ટ્રલ પ્રેસિડેન્ટ શ્રી રવિભાઇ ધોળુ(ગોવા)ના અધ્યક્ષસ્થાને સવારમાં ૯:૩૦ કલાકે છત્તીસગઢ રિજીયનની ટીમ (મહામંત્રી શ્રી શંભુભાઇ છાભૈયા(રાયપુર)) દ્વારા સ્થાનગ્રહણ કરાવીને શરૂ થઇ હતી. દરેક કાર્યની શરૂઆત પ્રભુ પ્રાર્થનાથી થવી જોઇએ એવી પરંપરાને જાળવી રાખતાયુવાસંઘના પુર્વ સોશ્યલ એન્ડ સ્પિરીચ્યુઅલ કન્વીનર શ્રી વિઠ્ઠલભાઇ નાયાણી(રાયપુર)એ અધ્યાત્મકતામાં તરબોળ પ્રાર્થના કરાવી હતી, જેમાં બાળકોએ વૈદિક પધ્ધતિ પ્રમાણે આસનમાં બેસીને સાથ આપ્યો હતો. ત્યાર બાદ વર્ષ દરમ્યાન દિવંગત થયેલ આત્માઓની શાંતિ અર્થે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ.

ત્યારબાદ યજમાન રિજીયનના ચેરમેન શ્રી અશોકભાઇ વાલાણી(રાયપુર) દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ સભાનું સંચાલન યુવાસંઘ જનરલ સેક્રેટરી શ્રી મોહનભાઇ ધોળુ(પેટલાદ)ને સોંપવામાં આવેલ.

શ્રી મોહનભાઇ ધોળુ એ સૌપ્રથમ ફોરેસ્ટ કાઉન્સિલ-છત્તીસગઢ રિજીયનની યજમાનીમાં અને રાયપુર યુવક મંડળના સાથ સહકારથી યોજાતી કારોબારી સભામાં ઉપસ્થિત સૌ સભ્યોનું સ્વાગત કરીને એજન્ડા મુજબ મિટીંગની કાર્યવાહી આગળ વધારેલ. પ્રથમ એજન્ડા મુજબ ગત **AGM** ની મિનીટ્સનું વાંચન મંત્રી શ્રી ઉમેશ રંગાણી(નાગપુર) દ્વારા કરવામાં આવેલ. જેને સભાએ સર્વાનુમતે બહાલી આપેલ. દ્રિતિય એજન્ડા મુજબ હિસાબોની રજુઆત સહખજાનચી શ્રી બાબુભાઇ ભાવાણી(બારડોલી)એ કરેલ. સાથોસાથ **YSK** ના હિસાબોની રજુઆત **YSK CEO** શ્રી અમૃતભાઇ નાકરાણી(અંકલેશ્વર) દ્વારા થયેલ. જેને સર્વાનુમતે બહાલી મળેલ. તૃતિય એજન્ડા મુજબ દરેક કાઉન્સિલના પ્રમુખશ્રી અને મંત્રીશ્રીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં આવતા રિજીયનોના હોદ્દેદારશ્રીઓને આમંત્રિત કરી રિજીયનમાં થયેલ કાર્યક્રમો અને રિજીયનો દ્વારા આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવેલ અને સંપન્ન થયેલ કાર્યોનો અહેવાલ આપવામાં આવેલ. આગામી એજન્ડા મુજબ મિશન ચેરમેન શ્રી વંસતભાઇ ધોળુ(તલોદ) દ્વારા દરેક મિશનના લીડરોને મંચ પર બોલાવી જે તે થીમના કાર્યો અંગે ચર્ચા કરી અત્યાર સુધી થયેલ કાર્યોનો અહેવાલ આપવામાં જણાવેલ તે મુજબ મિશન લીડર્સ દ્વારા થયેલ કાર્યો અને આગામી આયોજનોનો અહેવાલ આપવામાં આવેલ.

આ ચર્ચા દરમ્યાન બપોરના ભોજનનો સમય થતા એજન્ડા અટકાવીને વાર્ષિક સાધારણ સભાના પ્રથમ સત્રની સમાપ્તિ કરવામાં આવેલ. ભોજન બાદ દ્રિતિય સત્રની શરૂઆત છત્તીસગઢ રિજીયનની બાળાઓ દ્વારા લોકલ સાંસ્કૃતિક કૃતિ રજુ કરીને કરવામાં આવેલ. ત્યાર બાદ પ્રથમ સત્રમાંમિશન ચેરમેનશ્રીની અધુરી રહેલ ચર્ચા હાથ ધરવામાં આવેલ.

આગળના એજન્ડા મુજબ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ - શ્રી ઉમા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વલથાણ-સુરત ખાતે આવેલ **SUV** ઈન્ટરનેશનલ સ્કુલને દસ વર્ષ પુર્ણ થતા હોઇ આ

યુવાસંઘની વાર્ષિક સામાન્ય સભાનો અહેવાલ

ગામી ૨૩,૨૪,૨૫ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ દશાબ્દી મહોત્સવ ઉજવવાનો છે તે હેતુથી નોલેજ કાર્નિવલ (જ્ઞાનોત્સવ) નું આયોજન કરવામાં આવેલ છે તે અંગેની વિસ્તૃત માહિતી યુવા ઉત્કર્ષ સમિતિ અને શિક્ષણ-પ્રતિભા શોધ સમિતિ વતી શ્રી નટવરભાઇ સામાણી(નાગપુર), શ્રી પરેશભાઇ માવાણી(મુંબઇ), શ્રી અંજુબેન ધોળુ(મુંબઇ), શ્રી સંગીતાબેન નાકરાણી (પનવેલ) તથા SUV નોલેજ કાર્નિવલ ચેરમેન શ્રી દામોદરભાઇ ભાવાણી, વાઇસ-ચેરમેન શ્રી પ્રેમજીભાઇ કેશરાણી(મુંબઇ), કન્વીનર શ્રી ગૌરાંગભાઇ ધનાણી(કડોદરા), કાર્યાલય મંત્રી શ્રી હરેશભાઇ રામાણી(બારડોલી), દ.ગુ. ઝોન સમાજ મહામંત્રી શ્રી રમેશભાઇ પારસિયા(સુરત), દ.ગુ. રીજીયન ચેરમેન શ્રી ભવનભાઇ જાદવાણી(કામરેજ) અને DGR ટીમ દ્વારા ઓડિયો/વિડીયો/પાવરપોંઇટ રૂપે સંપુર્ણ માહિતી આપવામાં આવેલ. ત્યાર બાદ SUV અને શ્રી સમાજની ટીમ છત્તીસગઢના મુખ્ય મંત્રી શ્રી રમણસિંહની શુભેચ્છા મુલાકાતે જવા નીકળેલ.

સ્પેશિયલ એજન્ડા મુજબ છત્તીસગઢ રિજીયન, રાયપુર સમાજ અને રાયપુર યુવામંડળ દ્વારા વિશીષ્ઠ પ્રતિભાઓ અને રાજકીય હોદ્દેદારોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલ.

આ એજન્ડામાં સંપર્ક યાત્રાને પણ સાંકળી લેવામાં આવેલ.વિશીષ્ટ સન્માનની પુર્વભુમિકા બાંધતા યુવાસંઘ વાઇસ-ચેરમેન શ્રી વસંતભાઇ ધોળુ(તલોદ)એ હિન્દી-ગુજરાતી-અંગ્રેજી ભાષામાં રમુજી ટોનમાં દરેક મહાનુભાવોને યુવાસંઘની કાર્ય-પધ્ધતિ અને તેર થીમો અંગે માહિતગાર કર્યા હતા. વિશીષ્ટ સન્માનમાં મુખ્યત્વે નીચેના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ના સુપુત્ર તથા રાજનંદગાંવના સંસદ સભ્ય શ્રી અભિષેક સિંહ કે જેઓ ભાજપ પક્ષના ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાના પ્રભારી પણ છે. વર્ષોથી ધરશિવા વિધાનસભાના(કે જ્યાં આપણી સમાજનો એક પણ વોટ નથી) ધારાસભ્ય પદે ચુંટાતા રહેલ આપણી જ સમાજના શ્રી દેવજીભાઇ સામાણીને સન્માન્વામાં આવ્યા હતા. તેઓશ્રી છત્તીસગઢ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ પણ છે.

આ ઉપરાંત રાજનંદગાંવ રાજગામી સંપદા ન્યાસના ચેરમેન શ્રી રમેશભાઇ દિવાણી, ક.ક.પાટીદારનું માત્ર એક જ ઘર છે એવી બલોદાબજાર નગરપાલિકાના અધ્યક્ષ શ્રી વિક્રમભાઇ પોકાર, રાયપુર જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયંતિભાઇ દિવાણી(રાયપુર), રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ-રાયપુર શાખાના શાખા પ્રચારક શ્રી જગદીશભાઇ દિવાણી (રાયપુર), અને મહિલા સંઘના નવનિયુક્ત કર્ણધારો તેમજ હાલની AGM અને ચાર દિવસ દરમ્યાન યોજાયેલ દરેક કાર્યક્રમોના દાતાશ્રીઓ અને સંપુર્ણ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરનાર કાર્યકરોને સન્માનીત કરવામાં આવ્યા હતા.

સન્માન કાર્યક્રમ દરમ્યાન શ્રી અભિષેકસિંહે જણાવેલ કે આપણો સમાજ સમયની સાથે નહિ, પણ સમય આપણી સમાજ સાથે ચાલી રહ્યો છે. યુવાસંઘની જે ૧૩ થીમો દ્વારા કાર્ય થઇ રહ્યું છે, તેમાંથી ખુદ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રેરણા લીધેલ હશે એવું અમને લાગી રહેલ છે. આ ઉપરાંત અન્ય રાજકીય આગેવાનોએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ.

મહાનુભાવોની વિદાય બાદ સ્પેશિયલ એજન્ડાની સમાપ્તિ થઇ.

આગામી એજન્ડા યુવાસંઘ યુનિટી કાર્ડ અંગેનો હતો. આ વિશે વિશદ ચર્ચા ફોરેસ્ટ કાઉન્સિલ પ્રેસિડેન્ટ શ્રી રજનીભાઇ નાકરાણી(ઇન્દોર) કે જેઓ આ પ્રોજક્ટના ચેરમેન પણ છે તેમના દ્વારા કરવામાં આવેલ. આ વિષય પર તેઓશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે આ કાર્ડ અંતર્ગત આપણી સમાજના સભ્યોને મુસાફરી(કેબ-બસ-ટ્રેન-વિમાન), શોપિંગ(માર્કેટ-ઓનલાઇન), સેવા(રેસ્ટોરન્ટ-ઇન્સ્યોરન્સ-હોસ્પિટલ-મેડિકલ સ્ટોર-બ્યુટિ પાર્લર વગેરે) માં ફાયદો મળે તે રીતે અલગ-અલગ ક્ષેત્રની વિવિધ કંપનીઓ સાથે ટાઇ-અપ કરવામાં આવશે.

ટીમ યુવાસંઘ દ્વારા ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણાવાઇ રહેલો યુવાસંઘ યુનિટી કાર્ડના પ્રોજેક્ટને કાર્ડની વેબસાઇટ (http://yuva-2016.appspot.com/vst) ને સર્વર પર અપલોડ કરી લોંચ કરવામાં આવેલ. પ્રથમ યુનિટી કાર્ડ હોલ્ડરનું માન યુવાસંઘ પ્રેસિડેન્ટ શ્રી રવિભાઇ ધોળુને એનાયત કરવામાં આવ્યું. સભામાં ઉપસ્થિત દરેક સમાજજનોએ આ પ્રોજેક્ટને વખાણ સાથે આર્શીવાદ આપેલ.

આગામી એજન્ડામાં કારોબારીમાં નક્કી કરેલ ઠરાવ મુજબ વેબ-કોમમાં ચોઇસ નંબરની ફાળવણી દ્વારા થતી આવકને હવે પછીથી જો ફાળવણી રિજીયન દ્વારા થઇ હશે તો રિજીયનને આવકના ૫૦% મળશે તેવા ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ અને છત્તીસગઢ રિજીયન અને રાયપુર યુવામંડળ દ્વારા ૪ થી ૫ ચોઇસ નંબરની ફાળવણી કરીને શુભ શરુઆત કરી દેવામાં આવેલ. તેવી જ રીતે આગામી સમયમાં બિઝનેશ સેલ કન્વીનર શ્રી પરસોત્તમભાઇ છાભૈયા અને તેમની ટીમ દ્વારા ચલો પેજીસનું આયોજન હાથ ધરવ-ામાં આવશે. જેમાં જાહેરાતથી જે આવક થશે તેને પણ ઉપરના નિયમ અને રેશિયો મુજબ વંહેચવામાં આવશે.

ત્યાર બાદ અમુક મિત્રોના સમાજ ઉપયોગી સુચનો સાથે ઓપન મંચનો એજન્ડા સંપન્ન થયો. ત્યાર બાદ કેન્દ્રિય મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી યશોદાબેન નાકરાણીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ જેમાં તેમણે આશા રાખેલ કે યુવાસંઘ એક દીકરાની જેમ જ મહિલા સંઘને સાથ આપશે. તેમના બાદ શ્રી સમાજના મહામંત્રી શ્રી પરસોત્તમભાઇ ભગતએ આર્શી વચન સાથે સનાતન ધર્મ પત્રિકાની માહિતી આપેલ. તેમના બાદ શ્રી સમાજના પ્રમુખ શ્રી અબજીભાઇ કાનાણીએ આર્શીવાદ આપતા કહેલ કે હવેથી મહિલા સંઘને અને યુવાસંઘને સમાજ સાથે કદમ મિલાવી ચાલવામાં તેમની ટીમ મદદરૂપ થશે. અને ત્રણેય પાંખો ભેગા મળી સમાજને વિકાસ તરફ અગ્રેસર લઇ જઇશું..

ત્યારબાદ અધ્યક્ષ સ્થાનેથી રજુઆત થઇ હતી જેમાં પ્રેસિડેન્ટ શ્રી રવિ-ભાઇ ધોળુ(ગોવા)નું કહેવાનું તાત્પર્ય હતું કે સૌના સાથથી જ સમાજ સંર્વાગી વિકાસ તરફ અગ્રેસર થશે. મહિલા સંઘને જ્યારે પણ યુવાસંઘની જરૂર પડશે ત્યારે યુવાસંઘ સદૈવ તેમને સાથ આપશે. તેમજ આગામી સમ-યમાં આવી રહેલ મેગા ઈવેન્ટ SUV નોલેજ કાર્નિવલ માં સર્વ જ્ઞાતિજનો તન-મન-ધનથી જોડાઇને કાર્યક્રમને સાથે મળી સફળતા તરફ દોરી જઇએ તેવી અપીલ કરેલ. આગામી વર્ષમાં બાકી રહેલા લક્ષ્યને સમયસર પુર્ણ કરી મિશન ૨૦૨૦ને લક્ષીત કરવા ત્રિ-સ્તરીય માળખાને અનુરોધ કરેલ.

મંડળ પ્રમુખ શ્રી દિપકભાઇ નાકરાણી તથા રાયપુર યુવામંડળની ટીમ દ્વારા જે સફળતાથી ચતુ-દિવસીય સમ્રગ મિટીંગનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું. તથા પ્રથમ દિવસે સભ્યોને પિક-અપ કરવા, બીજા દિવસે કારોબારી સભાનું આયોજન, ત્રીજા દિવસે સાયકલ રેલી અને AGM નું આયોજન, છેલ્લા દિવસે પિકનીક અને ઉધોગ-દર્શનની વ્યવસ્થા તથા આમંત્રિત સભ્યોને ડ્રોપ-ઓફ કરવા સુધીની વ્યવસ્થા માટે રાયપુર યુવામંડળ દ્વારા જે ટીમો બનાવવામાં આવેલ તે દરેક ટીમોના સભ્યોને મંચ પરબોલાવી યુવાસંઘના સેક્રેટરી શ્રી મોહનભાઇ ધોળુ દ્વારા ભાવવિભોર કંઠે આભાર માનવામાં આવેલ.

આ ઉપરાંત ફોરેસ્ટ કાઉન્સિલ-છત્તીસગઢ રિજીયનએ જે ઉલ્હાસથી આ આયોજનમાંસાથ આપ્યો તે માટે ટીમ યુવાસંઘ દ્વારા કાઉન્સિલ પ્રેસિડેન્ટ શ્રી રજનીભાઇ નાકરાણી(ઇન્દોર), કાઉન્સિલ સેક્રેટરી શ્રી ભરતભાઇ છાભૈયા(પુના), રિજીયન ચેરમેન શ્રી અશોકભાઇ વાલાણી(રાયપુર), આઇ.પી.સી. શ્રી જયંતિભાઇ નાકરાણી, વાઇસ-ચેરમેન શ્રી કિશોરભાઇ નાકરાણી(રાયપુર), ચીફ સેક્રેટરી શ્રી શંભુભાઇ છાભૈયા(રાયપુર) તેમજ રિજીયનના કર્ણધારો સહિત ટીમ છત્તીસગઢને મંચ પર બોલાવી બિરદાવવામાં આવેલ.

તેની સાથે સાથે રાયપુર સમાજ, રાયપુર મહિલા મંડળ, રાયપુર યુવામંડળ, છત્તીસગઢ ઝોન સમાજ, સર્વ દાતાશ્રીઓ, કાર્યકરો, આબાલ-વૃધ્ધો, સહિત સમગ્ર આયોજનમાંનામી-અનામી તેમજ પ્રત્યક્ષ-પરોક્ષ સેવા આપનારાઓનો મોહનભાઇ દ્વારા આભાર માનવામાં આવેલ.

ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરીને મિટીંગને સમાપ્ત જાહેર કરવામાં આવી.મિટીંગની સત્તાવાર સમાપ્તિ બાદ સૌ મિત્રોએ સાથે ભોજન લીધેલ.

સમગ્ર સભાનું સંચાલન યુવાસંઘ સેક્રેટરી શ્રી મોહનભાઇ ધોળુએ કરેલ. તેમને છત્તીસગઢ રિજીયનના સેક્રેટરી શ્રી શંભુભાઇ છાભૈયા તેમજ ડિવીઝનલ ચેરમેન શ્રી પવન દિવાણી(રાજનંદગાંવ)એ તેમને સહકાર આપેલ.

યુવાસંઘની ચતુર્થ કારોબારી સભા અને વાર્ષિક સાધારણ સભાના ભવ્ય આયોજન માટે તથા પિકનીક અનેઉધ્યોગદર્શન હેતુથી સુંદર વ્યવસ્થા પુરી પાડવા માટે અને સમ્રગ આયોજનમાં ખડેપગે રહી બધા કાર્યક્રમોને સફળ બનાવવા માટે ટીમ યુવાસંઘ છત્તીસગઢ રિજીયન અને રાયપુર યુવામંડળનો હ્રદયપુર્વક આભાર માને છે. શ્રી સમાજના પુર્વ પ્રમુખ શ્રી રામજીભાઇ કરમશીભાઇ નાકરાણી(રાયપુર) તથા શ્રી સમાજના પુર્વ ટ્રસ્ટી શ્રી પન્નાલ-ાલભાઇ કરશનભાઇ નાયાણી(રાયપુર) કે જેઓ એ કાર્યક્રમ દરમ્યાન હાજર રહી યુવ-ાઓને પ્રેરણા આપી હતી. તે બદલ તેમનો પણ ખુબ ખુબ આભાર.

રાયપુરના શ્રી તુલસીભાઇ દિવાણી(ગંગાસાગર કાઉન્સિલ પ્રેસિડેન્ટ) અને શ્રી પરસોત્તમભાઇ છાભૈયા (સેન્ટ્રલ યુવાસંઘ-બિઝનેસ સેલ કન્વીનર) અને સેન્ટ્રલ યુવાસંઘના સિનીયર સભ્યોએ પણ આયોજનમાં સાથ આપ્યો એ બદલ ધન્યવાદ સાથે ટીમ યુવાસંઘ સૌનો આભાર માને છે.

જય મિશન.......જય યુવાસંઘ

Work Best In Your Nest

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ-મહામંત્રીશ્રી શ્રી મોહન ધોળુ (પેટલાદ)

નુતન વર્ષાભિનંદન

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ – સૌરાષ્ટ્ર ઝોન


પ્રમુખ શ્રી
નાનજીભાઈ વાડિયા


મહામંત્રીશ્રી
કરમશીભાઇ વાસાણી


ઉપપ્રમુખશ્રી
લીલાધરભાઇ પજવાણી


ઉપપ્રમુખશ્રી
રતનશીભાઈ સુરાણી


ખજાનચીશ્રી
મનસુખભાઇ વાડિયા


સહમંત્રીશ્રી
કનુભાઈ વાગડીયા


સહમંત્રીશ્રી
હીરાલાલ પોકાર


સહખજાનચીશ્રી
મણિલાલ વાડિયા


સલાહકારશ્રી
ચંદ્રકાન્તભાઈ સેંઘાણી


સલાહકારશ્રી
બાબુભાઇ વાસાણી

કારોબારી સભ્યો:
* યોગેશભાઈ આર. ભગત – ચિતલ
* વિઠ્ઠલભાઈ વિ. પોકાર – ભાવનગર
* ડો.જયેશ કે. ભગત – રાજકોટ (વે)
* પ્રવીણભાઈ આર. રાજાણી – મોરબી
* કિશોરભાઈ જી. વાસાણી – ધ્રાંગધ્રા
* ભગવાનભાઇ એમ. માવાણી – હળવદ
* રવીલાલ વી. ચોપડા – હળવદ
* ચંદુભાઈ પી. છાભૈયા – જોરાવરનગર
* જસવંતભાઈ એ. લીંબાણી - રાજકોટ
* ડાહ્યાભાઈ ડી. પોકાર – ગોંડલ
* હરિભાઈ એ. પોકાર – રાણપુર
* કેશવલાલ પી. સેંઘાણી – વિંછીયા
* મોહનભાઇ કે. વાસાણી - માંગરોળ
* મણિલાલ એ. લીંબાણી – જેતપુર

યુવા કારોબારી સભ્યો:
* નવીનભાઈ એ. પોકાર – જોરાવરનગર
* ધર્મેન્દ્રભાઈ ડી. પોકાર – જામનગર
* ઉદય એચ. પારસીયા – રાજકોટ (વે)
* પ્રકાશ એમ. ભગત – મોરબી
* કલ્પેશ વી. સેંઘાણી – વાંકાનેર
* ડાહ્યાભાઈ આર. નાકરાણી - આટકોટ
* કિશોરભાઈ એસ. પોકાર – ગોંડલ
* ધર્મેન્દ્ર એમ. રામાણી – ઢસા
* ઈશ્વરભાઈ કે. સુરાણી – બોટાદ
* જીતેન્દ્ર વી. નાકરાણી – હળવદ
* અનિલભાઈ જે. સુરાણી – ધ્રાંગધ્રા
* ગોવિંદભાઇ વી. છાભૈયા – લીંબડી
* જેન્તીલાલ એલ. સેંધાણી – થાનગઢ
* શાંતિલાલ એમ. પજવાણી - વેરાવળ
* લલિતભાઈ એસ. લીંબાણી – ઉના

સૌરાષ્ટ્ર ઝોન ઘટક સમાજ:

	પ્રમુખ	મહામંત્રી		પ્રમુખ	મહામંત્રી
* રાજકોટ	પ્રેમજીભાઈ એમ. જાદવાણી	* ઈશ્વરભાઈ ડી. દીવાણી	* મોરબી	હરિભાઈ કે. ભગત	* કાંતિભાઈ એસ. ડાયાણી
* જોરાવરનગર	બાબુભાઇ એલ. વાસાણી	* નરેશભાઈ એન. છાભૈયા	* લીંબડી	હીરાલાલ કે. પજવાણી	* હરિલાલ એ. પોકાર
* જામનગર	સુધીરભાઈ ડી. પોકાર	* શંકરલાલ જી. પોકાર	* ધ્રાંગધ્રા	કિશોરભાઈ જી. વાસાણી	* અનિલ જે. ભગત
* રાજકોટ (વે)	મહેન્દ્રભાઈ એન. ભગત	* પ્રદીપભાઈ એન. ભગત	* અમરેલી	મુળજીભાઈ વી. પોકાર	* મગનભાઈ એન. પોકાર
* બોટાદ	હરિભાઈ એન. હળપાણી	* ચુનીભાઈ એમ. પટેલ	* ગોંડલ	અમૃતભાઈ ડી. પોકાર	* બાબુભાઇ એમ. પોકાર
* હળવદ	ચંદુભાઈ એન. પોકાર	* હસમુખભાઈ ડી. ચોપડા	* વાંકાનેર	મનસુખભાઇ કે. વાડિયા	* સુરેશભાઈ આઈ. છાભૈયા
* વેરાવળ	લીલાધરભાઇ પી. પજવાણી	* પ્રવીણભાઈ પજવાણી	* ભાવનગર	ગોપાલભાઈ કે. રવાણી	* વિઠ્ઠલભાઈ વી. પોકાર
* ઉના	રમેશભાઈ એસ. વાઘડિયા	* જગદીશભાઈ એન. નાકરાણી	* કોંઢ	અંબાલાલ વી. સામાણી	* ભરતભાઈ એમ. વાસાણી
* જસદણ	દામજીભાઇ બી. સેંગાણી	* વિનોદભાઈ આર. પોકાર	* ચોટીલા	લાલજીભાઈ કે. સેંધાણી	* નરશીભાઈ પી. સેંધાણી
* અમરેલી(ગ્રામ્ય)	યોગેશભાઈ આર. ભગત	* દિનેશભાઇ એ. કાલરીયા			

"આગામી નવું વર્ષ આપ સૌને લાભદાયી રહે એવી શુભકામના"

શ્રી ઘડુલી પાટીદાર સમાજની સામાન્ય સભાનો અહેવાલ

પાનુ નં ૧૫ થી ચાલુ

: કારોબારી મંડળ :

પ્રમુખ શ્રી પ્રેમજીભાઇ લાલજીભાઇ સેંગાણી -નડીયાદ, ઉપપ્રમુખ શ્રી માનણભાઇ મનજીભાઇ જાદવાણી -ઘડુલી, શ્રી રતિલાલ મનજીભાઇ સાંખલા -સાંગલી, મહામંત્રી શ્રી અમૃતલાલ લખુભાઇ માકાણી -બોરસદ, મંત્રી શ્રી વસંતભાઇ સામજીભાઇ સાંખલા-નડીયાદ, ભવનભાઇ મનજીભાઇ લીંબાણી-અમદાવાદ, ખજાનચી - વિજયભાઇ ખીમજીભાઇ નાકરાણી-ખોપોલી, સહખજાનચી- નિતીનભાઇ સુરેશભાઇ રુડાણી-ઘડુલી, કા.સભ્ય- ખેતાભાઇ જેઠાભાઇ સાંખલા -થાણા, પરબતભાઇ ધનજીભાઇ ભાવાણી-વાપી, કરસનભાઇ મુળજીભાઇ સાંખલા -હાલોલ, મોહનલાલ હરજીભાઇ રુડાણી -થાણા, જીવરાજભાઇ શીવજીભાઇ જાદવાણી -તારાપુર, ધનજીભાઇ દામજીભાઇ સાંખલા -નડીયાદ, રવજીભાઇ પ્રેમજીભાઇ જાદવાણી -ઘડુલી, દેવજીભાઇ પ્રેમજીભાઇ લીંબાણી -વિરા, ડાહ્યાલાલ વાલજીભાઇ ભાદાણી -આંબલીયાસણ, વિરજીભાઇ ભીમજીભાઇ લીંબાણી -રાધનપુર, નરસીંહભાઇ પરબતભાઇ ભાવાણી -ઘડુલી

હસમુખભાઇ પેથાભાઇ હળપાણી -નાગપુર, હંસરાજભાઇ વાલજીભાઇ સાંખલા -ઘડુલી, પ્રેમજીભાઇ લખુભાઇ માવાણી -ગોંડલ, રમણીકલાલ વિરજીભાઇ ભાદાણી -માલાડ

: આમંત્રિત સભ્યશ્રીઓ :

દેવશીભાઇ નારાણભાઇ સાંખલા -થાણા, રતનશીભાઇ નાનજીભાઇ શેઠીયા -થાણા, ગંગારામ કરસનભાઇ પોકર -ઘડુલી, કાન્તીલાલ કેશરાભાઇ માંકાણી -ઘડુલી, મણીલાલ માવજીભાઇ પોકાર -વડોદરા

વાલજીભાઇ દેવજીભાઇ રામાણી -ઔરંગાબાદ, અરવિંદભાઇ ગોવિંદભાઇ રુડાણી -સુરત, હિરાલાલ દેવજીભાઇ ચૌધરી -ચાણસ્મા, મણીલાલ દેવજીભાઇ સાંખલા -ઘડુલી, હરેશભાઇ ખીમજીભાઇ સાંખલા -નંદાસણ, રતનશીભાઇ કરસનભાઇ સેંઘાણી -પ્રાંતિજ, લક્ષ્મણભાઇ મનજીભાઇ ધોળુ -દહેગામ

મોહનલાલ ખેતાભાઇ હળપાણી -કળે, વસંતભાઇ અરજણભાઇ પોકાર -કટોસણ, કિશોરભાઇ દેવજીભાઇ પોકાર -મદુરાઇ, રમેશભાઇ વાલજીભાઇ સેંગાણી -મહેસાણા, હરેશભાઇ અબજીભાઇ સેંગાણી -ઘડુલી, દિનેશભાઇ ભીમજીભાઇ ગોગારી -ઘડુલી

: સલાહકાર સમિતિ :

વાલજીભાઇ જેઠાભાઇ સાંખલા -થાણા, જસવંતભાઇ દેવજીભાઇ સાંખલા -ઘડુલી, વિશ્રામભાઇ સોમજીભાઇ માંકાણી -અમદાવાદ, વિરજીભાઇ કરસનભાઇ પાંચાણી -મહેસાણા

ઉપસ્થિત સભ્યોએ નવી કારોબારીના નામોને તાળીઓના ગડગડાથી વધાવી લીધેલ.

વિદાય લેતા પ્રમુખશ્રી કાન્તીભાઇ લીંબાણી એ જણાવેલ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે સમાજમાં ઘણા ભાઇઓ સમાજ માટે સેવા આપવા થનગની રહ્યા છે તેમને મોકો આપવો જોઇએ. ઝાડનાં જૂનાં પાંદડા ખરે છે અને નવાં પાન આવે છે. સમાજસેવાએ કાંટાળો તાજ છે. તેમાં તમો યશની અપેક્ષા રાખશો નહી, મારા પ્રમુખ પદના કાર્યકાળ દરમ્યાન મારા સાથીદાર કારોબારી સભ્યો તથા આપના તરફથી ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો છે નવી આવેલ કારોબારીને પણ વિકાસના કાર્યોમાં આપણે સાથ સહકાર આપવો પડશે. દાન દાતાશ્રીઓ હંમેશા જ્યારે જ્યારે સમાજને જરુર પડી છે ત્યારે ત્યારે આગળ આવ્યા છે દાન દાતાશ્રીઓને હું પ્રણામ કરું છું. સમાજના મૂકસેવકો પોતાની ફરજ સમજીને કાર્ય કરી રહ્યા છે તેઓની સેવાને બિરદાવું છું.

નવનિયુક્ત પ્રમુખશ્રી પ્રેમજીભાઇ લાલજીભાઇ સેંગાણીએ જણાવેલ કે સમાજે મારા ઉપર વિશ્વાસ મૂકી પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપી છે. તે જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડવાની હું ખાત્રી આપું છું. મારા સાથી કાર્યકરો પણ સમાજવિકાસનાં કાર્ય કરવા ઉત્સુક છે આપ સૌના સાથ સહકારથી આપણે સમાજને ઉન્નતિના શિખરે લઇ જશું.

આભારવિધિ કર્યા બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવેલ અને સભાની સમાપ્તિ કરવામાં આવેલ.

સરસ્વતી સન્માન સમારોહ

શ્રી ઘડુલી પાટીદાર સમાજ દ્વારા તા.૧૫.૮.૨૦૧૭, મંગળવારના રોજ રાત્રે પ્રમુખ શ્રી પ્રેમજીભાઇ લાલજીભાઇ સેંગાણીના અધ્યક્ષ સ્થાને, લક્ષ્મીનારાયણ ચોકમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ.

પ્રમુખ શ્રી, ટ્રસ્ટીશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, હોદ્દેદારો તથા સરસ્વતી સન્માનના દાતા સ્વ. રતનબેન સામજીભાઇ સાંખલા પરિવારના સભ્યોને સ્થાન ગ્રહણ કરાવવામાં આવેલ.

પ્રમુખશ્રીના હસ્તે દિપ પ્રાગટ્ય બાદ બાલિકાઓ દ્વારા સ્વાગતગીત રજુ કરવામાં આવેલ.

કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઇ ભટ્ટ, ઘડુલી ગ્રામ પંચાયતના નવ નિયુક્ત યુવાન પ્રમુખ શ્રી નિતીનભાઇ રુડાણી, યુવક મંડળના પ્રમુખશ્રીની વિશેષ ઉપસ્થિતી હતી.

આ પ્રસંગે અ.ભા.ક.ક.પા. સમાજ-મહિલા સંઘના ઉપપ્રમુખ શ્રીમતી કમળાબેન લીંબાણી ઉપસ્થિત રહ્યા હતા.

મહામંત્રીશ્રી અમૃતભાઇ માંકાણી એ સભાની શરુઆત કરતાં જણાવેલ કે સમાજ દ્વારા વર્ષોથી ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા છે જેમાં ખર્ચના દાતાઓ મળી રહ્યા છે

ગયા વર્ષના ટ્યુશન ક્લાસ તથા સરસ્વતી સન્માનના ખર્ચના દાતા સ્વ.રતનબેન સામજીભાઇ સાંખલા નડીઆદ હતા. જેઓના હસ્તે બાળકોને ઈનામો આપવામાં આવશે.

ત્યારબાદ ટ્રસ્ટીશ્રી રતિલાલ વેલજીભાઇ નાકરાણી એ સ્વાગત પ્રવચન કરેલ. સ્થાનિક સમાજનાં તેજસ્વી વિદ્યાર્થી બાળકોને સરસ્વતી સન્માનના દાતા પરિવાર, પ્રમુખશ્રી,ટ્રસ્ટીશ્રીઓ તથા વડિલોના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

તાલુકા વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઇ ભટ્ટ, વડિલ શ્રી જસવંતભાઇ સાંખલા, ટ્રસ્ટીશ્રી કાન્તીલાલ લખમશી લીંબાણી, પ્રમુખ શ્રી પ્રેમજીભાઇ લાલજીભાઇ સેંગાણીએ પ્રસંગોચિત વિચારો આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રીશ્રી અમૃતભાઇ માંકાણી તથા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ.

આભારવિધિ બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવેલ અને રાત્રે ૧૨.૦૦ કલાકે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ.

હાલોલ મહિલા માર્ગદર્શન શિબીર

તા.૨૪.૦૮.૨૦૧૭ને ગુરુવારના બપોરના ૩ કલાકે શ્રી ક.ક.પા. હાલોલ ખાતે મહિલા મંડળના પ્રમુખ શ્રી લીલાબેન સાંખલાના અધ્યક્ષ સ્થાને મહિલા માર્ગદર્શન શિબીરનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને અખીલ ભારતીય યુવા સંઘના યુવા ઉત્કર્ષ કમીટીના પૂર્વ કન્વિનર અને હાલમાં ઉમિયા પરીવાર ઉંઝા મહિલા પરીષદના મંત્રી એવા શ્રી નર્મદાબેન સેંગાણી (સુરત) ના આગમન સાથે સમાજની તમામ બહેનો એ મહેમાન શ્રી નું તાલીઓના ગડગડાટ સાથે સ્વાગત કરેલ હતું.

ત્યારબાદ મહિલા મંડળના મંત્રીશ્રી હેમલતાબેન સાંખલા એ સમસ્ત મહિલા મંડળનું અને આવેલ મહેમાન શ્રી નર્મદાબેન સેંગાણી તેમજ તેમની સાથે પધારેલ લક્ષ્મીબેન ભાવાણીનું શાબ્દીક રીતે સ્વાગત કર્યું હતું અને મહેમાનોના હાથે માઁ ઉમિયાના દિપનું પ્રાગટ્ય કરાવ્યું હતું ત્યારબાદ અંકિતાબેન પારસિયાએ ભગવાનની પ્રાર્થના ગાઈને સભાને ભક્તિમય બનાવેલ હતી.

તેમજ હાલોલ મહિલા મંડળ દ્વારા ભુતકાળ અને વર્તમાન કાળમાં મંડળ શું કાર્ય કરી રહ્યું છે જેની જાણકારી આપવામાં આવેલ.

ત્યારબાદ નર્મદાબેન સેંગાણીએ પોતાના વિચારો જણાવેલ હતા. તેમાં તેને એક સ્ત્રી શું છે અને તેમનું શું મહત્વ છે અને એક સ્ત્રી શું કાર્ય કરી શકે છે. તેના વિશે સમજણ આપેલ હતી.

દૂધમાં સાકર ભળે તેમ દિકરીને સાસરીયામાં ભળી જઈને સૌનું ધ્યાન રાખીને પરિવારમાં ભળી જવું જોઈએ તેમાં દિકરી એ સાસુ પ્રત્યે કેવું વર્તન કરવું જોઈએ અને પોતાની જવાબદારી કેવી રીતે સંભાળવી જોઈએ. તેમજ દિકરીને સાસરે મોકલાવ્યા પછી માતાઓએ ખુબજ મર્યાદામાં દિકરીને ફોન કરવા જોઈએ. કારણ કે જેમ દહીને દૂધ સાથે ભળવામાં સમય લાગે છે. તેમ દિકરીને પણ ત્યાં ભળવાનો સમય આપવો જોઈએ.

રોજે-રોજ ફોન કરીને ડિસ્ટર્બ ના કરવી જોઈએ. અને માતા તરફથી જેટલી શીખામણ આપવામાં આવે તે બધી દિકરીના હિતમાં અને સાસરીયા ના હિતમાં રાખીને આપવી જોઈએ. તેમ જણાવેલ હતું દિકરી બાપને ખુબ વ્હાલી હોય છે. દિકરી બાપની આન-બાન અને શાન હોય છે. તેના વિશે પણ ખુબ લંબાણ પૂર્વક ચર્ચા કરી હતી. તેના શિવાય આપણા વડિલોના સાત્વિક જીવન અને સાત્વિક વિચારો કેવા હતા તેના વિષે દિકરી અને દિકરાનું કઈ રીતે ઘડતર કરવું જોઈએ વગેરે ઘણા બધા અલગ અલગ વિષયો ઉપર વિસ્તારથી ચર્ચા કરી હતી.

ત્યારબાદ ખુલ્લા મંચમાં બહેનોમાં પ્રશ્નોત્તરી કરેલ હતી અને તેના જવાબોનું નિરાકરણ નર્મદાબેન પાસેથી મેળવેલ હતું.

શિબીરના અંતમાં પ્રમુખ શ્રી લીલાબેન સાંખલા એ પણ પોતાના વિચારો જણાવ્યા હતા. અંતમાં મહિલા મંડળ તરફથી નર્મદાબેન ને સ્મૃતિ ચિહન આપી સન્માનિત કર્યા હતા. અને મંત્રીશ્રી તરફથી આવનાર મહેમાન અને સમસ્ત મહિલા મંડળનો આભાર માનેલ હતો અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ હતો.

પ્રતિનિધિ શ્રી હરેશભાઇ વાગડીયા, હાલોલ.

શ્રી કડવા પાટીદાર સત્યનારાયણ સમાજ અને યુવામંડળ દયાપર કચ્છ ની નવાજુની

શ્રી કડવા પાટીદાર સત્યનારાયણ યુવામંડળ દયાપર દ્વારા આ વર્ષે જન્માષ્ટમી પર્વ દરમિયાન કચ્છ દર્શન, ગલી ક્રિકેટ નાટક તથા વાર્ષિક સાધારણ સભા* નું આયોજન માદરે વતન દયાપર ખાતે કરવામાં આવેલ હતું. જેના અનુસંધાને તા. ૯ ઓગસ્ટ ના સાંજ સુધીમાં ભારતભર માંથી દયાપરવાસીઓ નું માદરે વતન ખાતે આગમન થઇ ચૂક્યું હતું.

કચ્છદર્શન

તા. ૧૦ અને ૧૧ ઓગસ્ટ ના બે દિવસ દરમિયાન *યુવામંડળ દ્વારા કચ્છ દર્શન ના ફેમિલી સાથે પ્રવાસ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કાળો ડુંગર, ભુજ મધ્યે સ્વામિનારાયણ મંદિર, મ્યુઝિયમ, પ્રાગમહેલ, આયના મહેલ, ભુજોડી ખાતે વંદેમાત્રમ તીર્થ, અંબેધામ ગોધરા, માંડવી ખાતે વિજય વિલાસ પેલેસ, માંડવી બીચ, શ્યામકૃષ્ણ વર્મા સ્મારક નસ્ત્રક્રાંતિ તીર્થસ્ત્રસ્ત્ર જેવા સ્થળો ની મુલાકાત ૩૦૦ થી વધુ ભાઈ બહેનોએ ફેમિલી સહીત લીધેલ હતી અને આનંદમાણેલહતો..

યુવામંડળ વાર્ષિક સાધારણ સભા

તા. ૧૨ ઓગસ્ટ ના યુવામંડળ ની વાર્ષિક સાધારણ સભા નું આયોજન સવારે ૯: ૦૦ કલાકે શ્રી લખપત તાલુકા વાડી ના સભાગૃહ માં મંડળ પ્રમુખ શ્રી જેન્તીલાલ પારસિયા સુરત ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતું જેમાં અતિથિવિષેસ તરીકે શ્રી લખપત તાલુકા સમાજ પ્રમુખ અને સત્યનારાયણ સમાજ પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ દિવાણી સુરેન્દ્રનગર ખાસ ઉપસ્થિત રહેલ. સૌ પ્રથમ હોદેદારો અને અતિથિવિષેસ શ્રીઓ ના સ્થાનગ્રહણ બાદ દીપપ્રગટ્ય થી સભાની શુભ સરૂઆત કરવામાં આવી.

એજેન્ડા મુજબની કાર્યવાહી માં સ્વાગત પ્રવચન અને પ્રસ્તાવના મંત્રીશ્રી ગૌતમ હળપાણી બોરસદ દ્વારા, ગત જનરલ મીટીંગ ની મિનિટ્સનું વાંચન મંત્રીશ્રી ભરત પારસિયા કલોલ દ્વારા, આવક જાવક ના હિસાબોની રજુઆત ખજાનચી શ્રી મહેશ વાગડીયા સુરત દ્વારા તથા સમગ્ર વર્ષ દરમિયાન થયેલ કામગીરી નો અહેવાલ મહામંત્રી શ્રી નરેશ પારસિયા સુરત દ્વારા રજુ કરવામાં આવ્યા...

આગામી તા. ૨૩, ૨૪, ૨૫ ડિસેમ્બર ૨૦૧૭ ના યોજનાર શ્રી અ.ભ.ક. ક.પા. સમાજ દ્વારા પ્રેરિત અને ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ યુવાસંઘ દ્વારા આયોજિત "SUV KNOWLEDGE KARNIVAL 2017" અંગેની વિસ્તૃત માહીતી અને છણાવટ યુવાસંઘ પ્રવક્તા અને મંડળના મંત્રી ગૌતમ હળપાણી બોરસદ દ્વારા આપવામાં આવી.

વિશેષ પ્રતિભા સન્માનમાં દયાપર ના વતની અને બહાર કે સ્થાનિક લેવલે જેમણે રાજકીય, સામાજિક, શૈક્ષણિક, રમતગમત કે અન્ય ક્ષેત્રે વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરેલ હોય તેવી પ્રતિભાઓ નું યુવામંડળ વતીથી બહુમાન કરવામાં આવ્યું. સભામાં ઉપસ્થિત અતિથિવિષેસ શ્રી પ્રેમજીભાઈ દિવાણી, વડીલ શ્રી વાલજીભાઈ વાડિયા જામનગર, મણીલાલપારસિયા સુરત, રજનીભાઇ વાગડીયા સુરત વિ. મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન આપેલ. મુક્ત મંતવ્યો ના દૌર માં ડો. રાજેશ મૈયાત પલુશ., શિતલબેન સાંખલા દયાપર , હેમલતાબેન લીંબાણી દયાપર, હિતેશ પોકાર દયાપર, જયાબેન પોકાર મહેસાણા, વિ. પોતાના



પ્રમુખશ્રી : મણિલાલ પારસિયા, સુરત



મહામંત્રીશ્રી : મણિલાલ પોકાર, મલાડ



યુવામંડળ પ્રમુખશ્રી : ચંદુલાલ વાડિયા, નડિયાદ



યુવામંડળ મહામંત્રીશ્રી : ગૌતમભાઈ હળપાણી બોરસદ

અમુલ્ય સુચનો આપેલ હતા.

પ્રમુખસ્થાને થી જેન્તીભાઈ પારસિયા એ જણાવેલ કે આપણે સૌ ભારતભરમાં જુદાજુદા સ્થળે વસવાટ કરતા હોવા છતાં એકબીજાના સંકલન માં રહીને આવા સમાજ ઉપયોગી અને વિકાસલક્ષી કાર્યો કરી શક્યાં તે બદલ સમગ્ર કારોબારી અને સમાજ્ઞો ને અભિનંદન સાથે આભાર માનેલ. અને ખીચોખીચ ભરેલો સભાગૃહ જોઈને યુવામંડળ સ્થાપવાનો હેતુ સાર્થક થતો હું જોઈ રહયો છું તેવી લાગણી વ્યકત કરેલ, અને આ કારોબારી ની મુદત પૂરી થતી હોઈ તેને બરખાસ્ત કરવાની જાહેરાત કરેલ અને સલાહકાર વડીલો ને નવી કારોબારી ની રચના માટે જવાબદારી સોંપીવામાં આવી. આની સાથે સાથે ભારતભર ના જુદાં જુદાં વિસ્તારમાંથી આવેલ કારોબારી સભ્યોના નોમીનેસન નામની જાહેરાત કરવામાં આવી અને આ સભ્યો ની મીટીંગ માં સર્વાનુમતે નીચે મુજબ ટર્મ ૨૦૧૭-૨૦ માટે હોદ્ધેદારો ની નિમણુંક કરવામાં આવી.

સત્યનારાયણ યુવા મંડળ દયાપર નવી કારોબારી ટર્મ ૨૦૧૭-૨૦

પ્રમુખઃ ચંદુલાલ દેવજી વાડિયા-નડિયાદ

IPP: જેન્તીલાલ દેવજી પારસિયા સુરત

ઉપ પ્રમુખઃ નવીન હીરાલાલ બાથાણી દયાપર

ઉપ પ્રમુખ; નવીન વિરજી લીંબાણી નડિયાદ

ઉપ પ્રમુખઃ નરેશ મણીલાલ પારસિયા સૂરત

મહામંત્રીઃ ગૌતમ લખમસી હળપાણી બોરસદ

મંત્રીઃ ભરત કાંતિભાઈ પારસિયા કલોલ

મંત્રીઃ જગદીશ શિવદાસ હળપાણી દયાપર

મંત્રીઃ ભાવેશ કાંતિભાઈ પારસિયા મહેસાણા

ખજાનચીઃ નવીન ભાણજી પારસિયા સુરત

સહ ખજાનચીઃ હરેશ શિવજી પારસિયા હાલોલ

સહ ખજાનચીઃ રાજેષ નારણ વાડિયા રાજકોટ.

નવનિયુક્ત પ્રમુખ ચંદુલાલ વાડિયા એ આ મહત્વપૂર્ણ જવાબદારી માટે તેમને લાયક ગણ્યા તે બદલ સભા નો આભાર માન્યો અને મંડળ ને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઇ જવા માટે સર્વે યુવાનો નો સાથ સહકાર ની માંગણી કરેલ.

અંતમાં આભાર દર્શન નવનિયુક્ત મંત્રીશ્રી જગદીશ હળપાણી એ કરેલ અને સમગ્ર સભાનું સફળ સંચાલન મહામંત્રી નરેશ પારસિયા સુરત કરેલ હતું..

ઐતિહાસિક નાટક નસ્ત્રજય ચિતોડસ્ત્રસ્ત્ર નું આયોજન

૧૨ ઓગસ્ટ ૨૦૧૭ ના રાત્રે ૯:૦૦ કલાકે સત્યનારાયણ યુવામંડળ દ્વારા આયોજિત અને સ્થાનિક દયાપર ના યુવાનો દ્વારા અભિનીત અને ગૌસેવા ના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક વાડીના પટાંગણ મા નસ્ત્રજય ચિતોડસ્ત્રસ્ત્ર નું આયોજન તાલુકાવાડી ના પટાંગણ માં કરવામાંઆવેલ હતું જેમાં સમસ્ત તાલુકા માંથી ૩૦૦૦થી પણ વધુ લોકોની નોંધપાત્ર ઉપસ્થિત હતી.....

ગલી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન

તા ૧૩ ઓગષ્ટ ના યુવામંડળ દ્વારા ગલી ક્રિકેટ ની આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર દેશમાંથી આવેલ યુવાનો ને ભેગા કરીને સંયુક્ત રીતે આઠ ટિમો બનાવવામાં આવેલ હતી જેનાથી કચ્છમાં વસતો યુવાન બહાર વસતા યુવાન સાથે ની મિત્રતા વધે, ભાઈચારા ની ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી સંયુક્ત રીતે આઠ ટિમો બનાવવામાં આવી હતી. જેમાં આખા દીવસ દરમિયાન યુવાનોએ ખુબજ આનંદ માણેલ હતો. યુવાનોનો ઉત્સાહ વધારવા વડીલો,માતાઓ, બહેનો,અને બાળકોની સવારથીજ ગ્રોઉન્ડપર નોંધપાત્ર હાજરી હતી. આ ટુર્નામેન્ટ દરમિયાન કચ્છી ભાષામાં કોમેન્ટ્રી બોલીને કિશોર ભગત અને જનક રંગાણી એ ઉપસ્થિત સેર્વે નું અનોખું મનોરંજન પુરું પાડેલ હતું.સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન અને સંચાલન સુરતના દિવ્યેશ પારસિયા, જીગ્નેશ પારસિયા દયાપર ના કીર્તિ ભગત , સંજય મૈયાત દ્વારા કરવામાં આવેલ હતું.

સત્યનારાયણ સમાજ વાર્ષિક સાધારણ સભા.

તા. ૧૫ ઓગષ્ટ ના સવારમાંસ્વતંત્ર દિવસ નિમિત્તે ૯:૦૦ કલાકે ધ્વજવંદન બાદ સત્યનારાયણ સમાજવાડી ના નારણ રૈયા ચોકમાં વાર્ષિક સાધારણ સભા નું આયોજન પ્રમુખ પ્રેમજીભાઈ દિવાણી ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ જેમાં સ્થાન ગ્રહણ અને દિપ પ્રાગટય બાદ આવકાર પ્રવચન મંત્રીશ્રી મનસુખભાઇ પારસિયા નડિયાદ દ્વારા, ગત જનરલ મીટીંગ ની મિનિટ્સનું વાંચન મંત્રીશ્રી નવીન બાથાણી દયાપર દ્વારા અને આવક જાવક ના હિસાબોની રજુઆત ખજાનચી શ્રી રજનીભાઇ વાગડીયા સુરત દ્વારા કરવામાં આવી.જન્માષ્ટમી પર્વ અને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ચડવા લઈને કે અન્ય રીતે આર્થિક સહયોગ આપનાર ભમશાઓ નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યાતથા આગામી વર્ષ માટે ના દાતાઓના ચડાવા મહામંત્રી શ્રી રમેશભાઇ પારસિયા સુરત દ્વારા લેવામાં આવ્યા અને સભા દ્વારા તાળીઓના ગડગડાટથી તેમને વધાવવામાં આવ્યા.

મુક્ત મંતવ્ય ના દૌર માં ઉપસ્થિત સમાજ જનો માંથી ઘણા બહેનો અને યુવામીત્રોએ સમાજ ઉપયોગી અમુલ્ય સૂચનો કરેલઅને ઉપસ્થિત વડીલો શ્રી વાલજીભાઈ વાડિયા

ઔરંગાબાદ સમાજના તેજસ્વી તારલાઓ



ચી. સાગર શેંઘાણી

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): અત્રેના શ્રી શિવરામ કન્સ્ટ્રકશનવાળા કચ્છમાં કોટડા-ચકારનાં શ્રી શિવરામ-ભાઈ દેવરામભાઈ શેંઘાણીનો પૌત્ર અને ભરતભાઈ વ રેખાબેન માકાણીના પુત્ર ૧૨માં ૮૨% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા માકાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૯૮૨૩૦૫૭૪૩૯



ચી. મેહુલ સાંખલા

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): અત્રેના શ્રી મહાદેવ સૌ મિલ વાળા કચ્છમાં ઉગેડીનાં શ્રી ડાયાભાઈ ધરમસીભાઈ સાંખલાનો પૌત્ર અને દેવીન્દ્રભાઈ વ પ્રિયાબેન સાંખલાનો પુત્ર ૧૨માં ૭૯% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા સાંખલા પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૯૮૯૦૮૬૩૩૦૫



કુ. ભક્તિ ચૌહાણ

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): અત્રેના શ્રી અમર પ્લાય એન્ડ ટાઇલ્સવાળા કચ્છમાં ખોંભડીના શ્રી માનણભાઈ કરમસીભાઈ ચૌહાણની પૌત્રી અને મહેન્દ્રભાઈ વ લક્ષ્મીબેન ચૌહાણની પુત્રી ૧૨માં ૭૮% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા ચૌહાણ પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૯૮૯૦૯૨૪૮૧૪



ચી. હિમાંશુ દિવાણી

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): અત્રેના શ્રી વિષ્ણુ સૌ મિલ વાળા કચ્છમાં દેશલપર(ગું)ના શ્રી વાલજીભાઈ નાનજીભાઈ દિવાણીનો પોત્રો અને શંકરભાઈ વ ભારતીબેન દિવાણીના પુત્ર ૧૨માં કોમર્સમાં ૭૬% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા દીવાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૯૪૨૩૪૫૬૧૧૨



ચી. પરીત ભાવાણી

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): અત્રેના શ્રી કન્હૈયા સો મિલ વાળા કચ્છમાં અઈયરનાં શ્રી રામજીભાઈ જેઠાભાઈ ભાવાણીનો પૌત્ર અને ગોવિંદભાઈ વ રમીલાબેન ભાવાણીનો પુત્ર ૧૦માં ૮૪% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા ભાવ-ાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૯૦૧૧૦૧૫૦૦૩



ચી. યશ રામાણી

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): અત્રેના શ્રી રામ પ્લાય એન્ડ ટિમ્બરવાળા કચ્છમાં ગડુલીનાં શ્રી વિશ્રામભાઈ દેવજીભાઈ રામાણીનો પૌત્ર અને નરસીભાઈ વ સાધનાબેન રામાણીનો પુત્ર ૧૦માં ૮૪% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા રામાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૯૪૨૧૬૮૪૦૪૧



ચી. પ્રતિક નાકરાણી

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): અત્રેના શ્રી કૃષ્ણ ટિમ્બર ઇન્ડસ્ટ્રીવાળા કચ્છમાં રતડીયાનાં શ્રી ખીમજીભાઈ રતનસી નાકરાણીનો પૌત્ર અને કાંતીભાઈ વ નિતાબેન નાકરાણીનો પુત્ર ૧૦માં ૮૧% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા નાકરાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૯૩૭૦૨૨૮૮૭૦



ચી. તેજસ ચૌહાણ

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): અત્રેના શ્રી અમર પ્લાય એન્ડ ટાઇલ્સવાળા કચ્છમાં ખોંભડીના શ્રી માનણભાઈ કરમસીભાઈ ચૌહાણના પૌત્ર અને મહેન્દ્રભાઈ વ લક્ષ્મીબેન ચૌહાણનો પુત્ર ૧૦માં ૮૦% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા ચૌહાણ પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૯૮૯૦૯૨૪૮૧૪



ચી. ધ્રુવ દિવાણી

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): અત્રેના શ્રી સુર્યા માર્બલવાળા કચ્છમાં દેશલપર(ગું)ના શ્રી મણીલાલભાઈ અરજણભાઈ દિવાણીનો પૌત્ર અને શ્રી નગીનભાઈ વ જોશનાબેન દિવાણીનો પુત્ર ૧૦માં ૮૦% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા દિવાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૮૬૦૦૧૧૧૧૧૧



ચી. નિત રામાણી

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): અત્રેના શ્રી રામ પ્લાય એન્ડ ટિમ્બરવાળા કચ્છમાં ગડુલીનાં શ્રી વિશ્રામભાઈ દેવજીભાઈ રામાણીનો પૌત્ર અને હંસરાજભાઈ વ દીપાબેન રામાણીનો પુત્ર ૧૦માં ૮૦% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા રામાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૯૮૨૩૨૬૧૬૨૦



ચી. હેમંત રામાણી

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): અત્રેના શ્રી જલારામ ટ્રેડર્સ વાળા કચ્છમાં ગડુલીનાં શ્રી રતનસીભાઈ દેવજીભાઈ રામાણીનો પૌત્ર અને મહેશભાઈ વ જયાબેન રામાણીનો પુત્ર ૧૦માં ૭૫% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા રામાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૯૪૨૨૨૧૧૩૯૯



ચી. આકાશ વાસાણી

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) અત્રેના શ્રી લક્ષ્મી વિજય સૌ મિલ વાળા કચ્છમાં રવાપર-નવાવાસના શ્રી ગંગદાસભાઈ પચાણ વાસાણીનો પૌત્ર અને કુમુદકંતભાઈ વ સંગીતાબેન વાસાણીનો પુત્ર ૧૦માં ૭૨% માર્ક સાથે ઉતીર્ણ થઈ આપણી સમાજ તથા વાસ-ાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. મો. ૯૦૧૧૪૮૨૧૨૧.

શ્રી કડવા પાટીદાર સત્યનારાયણ સમાજ અને યુવામંડળ દયાપર કચ્છ ની નવાજુની

જામનગર, શ્રી ડાયાભાઈ મૈયાત, પરષોત્તમભાઈ વાડિયા, ભવનભાઈ લખાણી, સરપંચશ્રી ભવનભાઈ લીંબાણી દયાપર, નાનજીભાઈ વાડિયા જામનગર વિ. મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન આપેલ.

પ્રમુખસ્થાનેથી શ્રી પ્રેમજીભાઈ દિવાણી એ તેમની કાવ્યમય વાણીમાં સભાને સંબોધિત કરેલ અને સમાજ વિકાસના આ કાર્યોમાં સમાજ્ઞનો ના સહયોગ બદલ આભાર માનેલ અને યુવામંડળ ના યુવાનો ને ગૌસેવા ના લાભાર્થે યોજેલ નાટક, ગલી ક્રિકેટ ટુર્નામેન્ટ, કચ્છ દર્શન પ્રવાસ જેવા કાર્યો ના આયોજનો બદલ બીરદાવેલઅને જણાવેલ કે નસ્ત્રવડીલોની આંખ અને યુવાનો ની પાંખસ્ત્રસ્ત્ર બન્ને સાથે મળીને કાર્યો કરશું તો દુનિયાનું એકેય કામ અશક્ય નથી તેવી અમૂલ્ય શીખ યુવાનો ને આપેલ અને આ કારોબારી ની મુદત પૂર્ણ થતી હોઈ સૌના આભાર સહ તેને બરખાસ્ત કરવાની જાહેરાત કરેલ અને નવી ટર્મ ના ગઠન માટે ટ્રુસ્ટીશ્રીઓ ને જવાબદારી સોંપેલ. આ સાથે વિવિધ વિસ્તારમાંથી આવેલ કારોબારી સભ્યો ના નામ ની જાહેરાત કરવામાં આવી. આ કરોબારી સભ્યો અને ટ્રુસ્ટીશ્રીઓ સાથે દશ મિનિટની અલાયદી મિટિંગમાં વિચારવિમર્શ ના અંતે સર્વાનુમતે ટર્મ ૨૦૧૭-૨૦ માટે આ મુજબ હોદ્દેદારો ની વરણી કરવામાં આવી.

શ્રી કડવા પાટીદાર સત્યનારાયણ સમાજ દયાપરના કર્ણધારો ૨૦૧૭-૨૦૨૦

*પ્રમુખઃ મણિલાલ વાલજીભાઈ પારસિયા- સૂરત

ઉપપ્રમુખઃ નાનજીભાઈ શિવજીભાઈ વાડિયા- જામનગર

ઉપપ્રમુખઃ વિનોદભાઈ નારણભાઈ મૈયાત- દયાપર

*મહામંત્રીઃ મણિલાલ રામજીભાઈ પોકાર - મુંબઇ

મંત્રીઃ નવીનભાઈ હીરાલાલ બાથાણી- દયાપર

મંત્રીઃ મનસુખભાઈ કાનજીભાઈ પારસિયા- નડિયાદ

ખજાનચીઃ રજનીભાઈ દેવસીભાઈ વાગડીયા - સુરત

એસહખજાનચીઃ ગંગારામભાઈ નથુભાઈ મૈયાત- દયાપર

અંતમાં સભાની આ-ભારવિધિ મંત્રીશ્રી મનસુખભાઈ પારસિયા દ્વારા અને સમગ્ર સભાનું સફળ સંચાલન મહામંત્રી શ્રી રમેશભાઈ પારસિયા દ્વારા કરવામાં આવ્યુ અને અંતે રાષ્ટ્રગીતના ગાન બાદ સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી.

આ સાથે દરવર્ષની જેમ પરંપરાગત જન્માષ્ટમી ના તહેવારમાં છઠઠ, સાતમ, આઠમ ના સમસ્ત ગામવાસી ઓ બેન્જો અને ઢોલ ના તાલે દાંડિયા રસ ની રમઝટ ની સાથે સાથે કૃષ્ણ જન્મોત્સવ, મટકીફોડ, જેવા કાર્યક્રમો નુ પણ ઉત્સાહભેર આયોજન કરવામાં આવેલ હતું.

શ્રી સનાતન પાટીદાર સમાજ, ઉડુપી સામાન્ય સભાનો અહેવાલ

ગત તા. ૧૦-૯-૨૦૧૭ ને રવિવારના બપોર પછી ૩:૦૦ કલાકે પ્રમુખ શ્રી સોમજીભાઈ નાથાણીના અધ્યક્ષપદે ગૌશાળાના પ્રાંગણમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગૌશાળાના નામે સારી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી હતી. પ્રથમ સ્થાન ગ્રહણ બાદ પ્રમુખશ્રી દ્વારા આવેલ તમામ સભ્યોનું સ્વાગત કરવામાં આવેલ. ત્યાર પછી મંત્રી શ્રી રતિલાલ નાથાણી દ્વારા ગત મિનિટ્સ બુકનું વાંચન કરવામાં આવ્યું હતું તેમજ મંત્રીશ્રી દ્વારા આવેલ પત્રોનું વાંચન કરવામાં આવેલ. ત્યાર બાદ વસંતભાઈ ગોરાણી દ્વારા કેન્દ્રીય સમાજ તેમજ દક્ષિણ કર્ણાટક સમાજની ગતિવિધીઓનો અહેવાલ આપવામાં આવ્યો હતો. તેમાં આવતી તા. ૮-૧૦-૨૦૧૭ ના શ્રી દક્ષિણ કર્ણાટક કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સામાન્ય સભા તથા સરસ્વતી સન્માન કાર્યક્રમ બાબતની જાણકારી આપવામાં આવી હતી.. તેમાં ઉડુપી સમાજમાંથી એસ.એસ.એલ.સી. ઉપર ૧૪ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ટકાવારી પ્રમાણે યોગ્યતા ધરાવે છે. જે ઉડુપી સમાજ માટે ગૌરવની વાત છે. અને આ વિદ્યાર્થી તથા તેમના માતા-પિતા તથા સમાજમાંથી સારી સંખ્યામાં લોકોએ આ સામાન્ય સભા તથા સરસ્વતી સન્માન સમારોહમાં ભાગ લેવા માટે આગ્રહ કરેલો હતો.

ત્યાર બાદ આપણાં આવતાં સામાજીક તહેવારો નવરાત્રી, દશેરા, શરદ પૂનમ તથા સમૂહ મિલન બાબતની તૈયારી માટે ચર્ચાઓ કરવામાં આવી તથા આની તૈયારી યુવા મંડળના પ્રમુખ મનસુખભાઈ નાથાણીને સોપવામાં આવી. અને આ જવાબદારી પ્રમુખ મનસુખભાઈ નાથાણીએ સ્વીકારી હતી. ત્યાર બાદ નવરાત્રીમાં આ સમાજના હાલમાં ૩૭ ફર્મ છે. તો દરેક નોરતામાં ચાર ફર્મવાળા સાથે માતાજીની આરતી ઉતારશે. તેની નામાવલીની પણ જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ સમાજવાડી માટે સમાજે જે પ્લોટ લીધો છે તેમાં થોડી ઘણી અડચણો છે તેના માટે નિમેલી કમીટીમાં પુરૂષોત્તમ નાથાણી દ્વારા તેની ગતિવિધીનો અહેવાલ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ખુલ્લા મંચમાં સમાજના દરેક સભ્યોએ પોતાના સુઝાવો મુક્યા હતાં. તેમાં યોગ્ય સુઝાવોને સર્વાનુમતે માન આપવામાં આવ્યું હતું તથા આ ચાલુ સભામાં ગૌશાળાના મહંત તથા ઉડુપી કૃષ્ણા મંદિરના હાલના ગાદીપતિ એવા સ્વામી પણ આપણી વચ્ચે આવી પહોંચ્યા હતાં અને આ સમાજને આશીર્વાદ આપ્યાં હતાં. આ એક અહોભાગ્ય હતું. ત્યાર બાદ પ્રમુખશ્રીએ જણાવેલ કે આપણે બધાં એક ભાવનાથી તથા સંગઠીત થઈને સારા વિચારોથી આ સમાજને પ્રગતિના પંથે લઈ જઈએ તેવી મારી આપ સર્વે સમાજજનોને નમ્ર વિનંતી છે. સાથે સાથે નવ નિર્મિત મહિલા મંડળને પણ વિનંતી કરશું કે સમાજ વિકાસમાં આપ પણ જોડાવ અને સારાં કાર્યક્રમો કરો એવી આશા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ માતાજી તથા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જય ઘોષ સાથે આ સભાને પૂર્ણ જાહેર કરેલ હતી.

ત્યાર બાદ આ જ સ્થળે ઉડુપી સનાતન પાટીદાર યુવક મંડળની પણ સામાન્ય સભાનું આયોજન હતું. તેમાં ખાસ સમાજના તહેવારોની ઉજવણી તથા સુરત ખાતે એસ.યુ.વી. નોલેજ કાર્નિવલ બાબતમાં ચર્ચા હતી તથા તૈયારી માટે મંડળના સભ્યોને યોગ્યતા મુજબ કામની જવાબદારી સોપવામાં આવી હતી.

ત્યાર બાદ આ ગૌશાળામાં ઘણી બધી બહેનો ગાયો માટે ખાવાનું લઈ આવી હતી તે ગાયોને ખવરાવીને સંતોષ માણ્યો હતો તેમજ ખુલ્લામાં દરેક ભાઈ-બહેનો તથા છોકરાઓને મજા પડી ગઈ હતી તથા સ્વેચ્છાએ ગૌદાનના ફાળામાં રૂપિયા છવ્વીસ હજાર ગૌદાનમાં ભેગા થયા હતાં તે સંસ્થાને આપવામાં આવ્યા હતાં. ત્યાર બાદ રાત્રીનું ભોજન લઈને સૌ છુટા પડ્યા હતાં.

પ્રતિનિધિ વસંતલાલ કેશવલાલ ગોરાણી

આણંદ મધ્યે તુલસી વિવાહ પાનુ નં ૫૭ થી ચાલુ

સાતમા સમૂહ લગ્નમાં મળેલ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરેલ અને ભવિષ્યમાં પણ મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરેલ. હજી પણ સહાયક ભોજન દાતામાં રહી ગયેલા માટે પત્રિકા છપાય ત્યાં સુધી લખાવી શકે છે. આઠમા સમુહલગ્નના મુખ્ય ભોજન દાતાનું નામ મળી ગયેલ છે. વાસાણી ટીમ્બર માર્ટ-આણંદ, શ્રી લક્ષ્મીનારાયણ ટીમ્બર માર્ટ-આણંદ

મયુર વુડ ઈન્ડસ્ટ્રીઝ -આણંદ, મહાદેવ પ્લાય-વુડ- આણંદ જેને સર્વે સભ્યોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ. સહમંત્રીશ્રી ચંદુભાઈ ભાદાણી એ આજની આ સભામાં ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનો, મુખ્ય ભોજનના દાતા-લક્ષ્મી ગ્રુપ યુવક મંડળ અને મંડપના દાતા-માધવજીબાપા પરિવાર અને અન્યરુપે મળેલ તમામ દાતાઓ, આણંદ સમાજ કે જેનું ભવન આપણે વાપરીએ છીએ તેનો, તમામ સમિતિઓ તથા નામી-અનામી વ્યક્તિઓ કે સંસ્થાઓ કે જે સમાજને ઉપયોગી બની છે તે તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ અને રાષ્ટ્રગીતના ગાન બાદ સર્વે સભ્યોને સમુહભોજન લઈ છૂટા પડવા જણાવેલ.

પ્રચાર પ્રસાર સમિતિના પ્રતિક (Logo) અંગેની માહિતી.......

(સ્વસ્તિક સિમ્બોલનો અર્થ)

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ના નેજા હેઠળ તા. ૧૪-૧૨-૨૦૧૪ ના રોજ સમાજની ગતિવિધિ નો પ્રચાર પ્રસાર કરવા માટે "**સનાતન પત્રિકા**" મુખપત્ર ને માધ્યમ બનાવ્યું અને તેને બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું,જે આજરોજ "**સનાતન ધર્મ પત્રિકા**" ના નામથી પ્રકાશિત કરવામાં આવે છે. આ મુખપત્રને સુચારૂ રીતે બહાર પાડવાની જવાબદારી "**પ્રચાર પ્રસાર સમિત**" ને સોપવામાં આવી આ રીતે પ્રચાર પ્રસાર સમિતિનો ઉદભવ થયો......

પ્રચાર પ્રસાર સમિતિએ જવાબદારી સ્વિકારી અને તેની શરૂઆત પોતાનું પ્રતિક ચિન્હ સ્વરૂપે સ્વસ્તિકને સિમ્બોલ તરીકે સ્વીકાર કર્યો. સ્વસ્તિક શબ્દ "**સુ**" અને "**અસ્તિ**" આ બંને શબ્દોથી મળીને બનેલો છે. "**સુ**" નો અર્થ શુભ અને "**અસ્તિ**" નો અર્થ થવું. એટલે જેનાથી શુભ કલ્યાણ થાય તે સ્વસ્તિક છે.

આપણા હિંદુ ધર્મમાં માંગલિક કાર્યો, ધાર્મિક કાર્યો, પુજા, ઉપાસના જેવા કોઈપણ કાર્યની શરૂઆત "**સ્વસ્તિક**" બનાવીને કરવામાં આવે છે. સ્વસ્તિક દેવી શક્તિઓનું શુભ અને મંગલકારી ભાવનાનું પ્રતિક માનવામાં આવે છે. તે ઉપરાંત ચારે દિશાઓ અને જીવન ચક્રનું પ્રતિક છે. ચારે બાજુથી સુખ-સમુદ્ધીને આવકારવા (WEL-COME) કરવા સ્વસ્તિક નો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. "**સ્વસ્તિક**" ગણેશ નું સ્વરૂપ છે.સનાતન સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્ય ગણેશની સ્થાપના બાદ પૂજા અર્ચના થી કરવામાં આવે છે. તેથી શ્રી અ. ભા. ક. ક. પાટીદાર સમાજ નિયુક્ત પ્રચાર પ્રસાર સમિતિ એ પોતાના શુભ કાર્ય માટે સનાતની સંસ્કૃતિને આધીન સ્વસ્તિક સ્વરૂપ પ્રતિકને પોતાનો લોગો બનાવી શુભારંભ કરેલ છે.

"**સ્વસ્તિક**" ને નીરખીને જોશું તો ખ્યાલ આવશે કે તેમાં પ્રચાર પ્રસાર સમિતિનું શુભ નામ સમાયેલું છે. "**સ્વસ્તિક**" ના ચાર ભાગને અલગ અલગ રીતે જોશું તો "**પ્રચાર પ્રસાર**" નો "પ"જ દેખાશે.... કહેવાનો અર્થ એ છે કે ચારે દિશામાં પ્રચાર પ્રસાર કરવાનો છે. વૈશ્વિક સ્તર પર શ્રી અ. ભા. ક. ક. પાટીદાર સમાજનો પ્રચાર પ્રસાર કરવાનો છે. અને "**સનાતન ધર્મ પત્રિકા**" ના કાર્યને વેગ આપવાનો છે.

"પ" વચ્ચે જે ટપકું છે તે "**સ્પિકર**" નું પ્રતિક છે. Speaker થી નીકળતો અવાજ લાંબા દુરી સુધી સંભળાય, સ્પષ્ટ સંભળાય અને તેમાંથી આવતી વાત મગજમાં તેમજ મનમાં ઉતરી જાય. તે ખુબીઓનું પ્રતિક "પ" ની અંદર તેમજ સ્વસ્તિકના અંદરનું ટપકું છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે શુભ સ્વસ્તિક થકી તંગદલી જરૂરથી દુર થાય છે. પુરાણોમાં સ્વસ્તિક ને ધનની દેવી લક્ષ્મી અને બુદ્ધિના દેવતા ગણેશજી નું પ્રતિક માનવામાં આવે છે. આપણે સૌ એ શુભકાર્ય કે મંગલકાર્ય ની શરૂઆત કરાવતા બાહ્મણ દેવતાઓ ના મુખારવિંદ થી આ શ્લોક સાંભળ્યા હશેજ....

સ્વસ્તિ ન: ઇન્દ્ર વૃધ્શ્રવા: સ્વસ્તિ ન: પૂષા વિશ્વવેદા:,

સ્વસ્તિ નસ્તાક્ષ્યો અ, રષ્ટનેમિ સ્વસ્તિ નો બ્રહસ્પતિદધાતુ:

અર્થાત: હે મહાન કીર્તિવાળા ઇન્દ્ર અમારૂં કલ્યાણ કરો, વિશ્વના જ્ઞાન સ્વરૂપ દેવ અમારૂં કલ્યાણ સાધો. જેમનું હથિયાર અમોધ છે, એવા ગરૂડ ભગવાન (નારાયણ) અમારૂં મંગલ કરો.

સારા અવસરે ઘણીવાર અનેક વિધ્નો નડતા હોય છે એવી આપણી માન્યતા હોય છે. તેથી એને નિવારવા માટે કોઈપણ કાર્ય નિવિધ્ન પુરૂ કરવાની મંગલ ભાવના સાથે "**સ્વસ્તિક**" નું પ્રતિક સંકળાયેલું છે. ભૌતિક રીતે જોતા રાષ્ટ્રધ્વજ એ રંગીન કપડાનો ટુકડો જ છે ને ? પરંતુ તેમાં સાંસ્કૃતિક ભાવના વણાયેલી છે તેની સાથે આપણું મન જોડાયેલું છે, એને આપણે કાપડના ટુકડા તરીકે નથી જોતા, આપણા દેશના પ્રતિક તરીકે ગૌરવથી સન્માન આપીએ છીએ. એજ રીતે આપણી પ્રચાર પ્રસાર સમિતિના પ્રતિકમાં પણ આપણી સનાતન સંસ્કૃતિની ભાવના વણાયેલી છે, એની સાથે આપણા સૌ સનાતનીઓનું મન જોડાયેલું છે માટેજ, પ્રચાર પ્રસાર ના પ્રતિક સન્માનની નજરે જોશું.

વર્ષો જુની સનાતની પરંપરા મુજબ કોઈપણ કાર્યો નિર્વિધ્ન પાર પાડવા માટે તેની શરૂઆત મંગલાચરણ થી કરીએ છીએ જે આપણા ઋષિઓ દ્વારા સ્થાપિત થયેલ છે. પ્રાચીન સમયમાં ઋષિમુનીઓ કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા અનુષ્ઠાન સાથે જોડાયેલા શ્લોકની રચના કરી મંગલાચરણ લખતા હતા. આપણા જેવા સામાન્ય મનુષ્યોને આવી રચના કરવી એ મુશ્કેલ છે પરિણામે ઋષિમુનીઓએ "સ્વસ્તિક" ચિન્હનું નિર્માણ કર્યું છે. પ્રચાર પ્રસાર સમિતિએ પોતાનું પ્રતિક"સ્વસ્તિક" બનાવી એવી ભાવના વ્યક્ત કરી છે કે અમારા સત સંકલ્પો વિના અડચણે પુરા થાય.

શ્રી પુના પાટીદાર સનાતન મહિલા મંડળ અને યુવતી મંડળ પિંપરી – ચિંચવડ વિભાગની વાર્ષિક સામાન્ય સભા



મહિલા મંડળ પ્રમુખ
શ્રીમતી દમયંતીબેન લિંબાણી



મહિલા મંડળ મંત્રી
શ્રીમતી વિમળાબેન લિંબાણી

શ્રી પાટીદાર સનાતન મહિલા મંડળ અને યુવતી મંડળની વાર્ષિક સામાન્ય સભા નિગડી મુકામે પાટીદાર ભવનમાં પ્રમુખ શ્રીમતી રેખાબેન રવાણીના નેજા હેઠળ યોજાઈ ગયેલ હતી. જેમાં ૩૦૦ જેટલી મહિલાઓ અને યુવતીઓએ હાજરી આપેલ હતી.

સૌ પ્રથમ મંત્રી શ્રીમતી મણીબહેન લિંબાણી એ ઉપસ્થિતસર્વેનું શાબ્દિક સ્વાગત કરેલ અને સૌ પ્રથમ પદ્દાધીકારીઓને સ્થાન ગ્રહણ કરાવેલ. ત્યારબાદ ગત સભાની મિનીટનું વાંચન કરવામાં આવેલ જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી. હતી. ખજાનચી શ્રીમતી હેમલતાબેન પોકાર દ્વારા વર્ષ દરમ્યાનનો હિસાબ રજુ કરેલ જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ. તદ્દઉપરાંત મંત્રી દ્વારા ગત ત્રણ વર્ષ દરમિયાન કરેલ કાર્યની જાણકારી આપવામાં આવેલ. આવેલ મંતવ્યો પર ચર્ચા વિચારણા કરવામાં આવેલ. ત્યારબાદ પ્રમુખ શ્રીમતી રેખાબેન રવાણી એ જણાવ્યું કે ગત ત્રણ વર્ષના કાર્યકાળ દરમ્યાન આપ સૌનો જે અમોને સાથ સહકાર મળેલ તે બદ્દલ હું આપ સૌનો હૃદય પૂર્વક આભાર માનું છું. અને હવે આ કારોબારીનો કાર્યકાળ પૂરો થતો હોઈ આગામી ત્રણ વર્ષ માટે નવી કારોબારીની રચના કરવામાં આવે તેવું જાહેર કરું છું.

નવી કારોબારીની રચના માટે પંચ તરીકે શ્રીમતી રેખાબેન, શ્રીમતી લીલાબેન અને શ્રીમતી મણીબેન ની વરણી કરવામાં આવી. જેમાં શ્રીમતી રેખાબેન દ્વારા આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ પદે શ્રીમતી દમયંતીબેન લિંબાણી નું નામ જાહેર કરવામાં આવેલ જેને સર્વાનુમતે વધાવી લેવામાં આવેલ. સર્વે ઉપસ્થિત સભ્યોના આગ્રહવશ ના કારણે પ્રમુખ પદનો સ્વિકાર કરેલ. તેમના નેજા હેઠળ આગામી ત્રણ વર્ષ માટે નવી કારોબારીની રચના કરવામાં આવેલ.

મહિલા મંડળઃ-
પ્રમુખ :- શ્રીમતી દમયંતીબેન જયંતીલાલ લિંબાણી, ઉપ પ્રમુખ :- શ્રીમતી હિરબેન વિશ્રામભાઈ પોકાર, મંત્રી :- શ્રીમતી વિમળાબેન વિનોદભાઈ લિંબાણી, સહમંત્રી :- શ્રીમતી શારદાબેન નાનજીભાઈ ગોગારી, ખજાનચી :- શ્રીમતી રૂક્ષ્મણીબેન હસમુખભાઈ પોકાર, સહખજાનચીઃ- શ્રીમતી વિમળાબેન મુળજીભાઈ પોકાર, સલાહકાર :- શ્રીમતી મણીબેન પચાણભાઈ લિંબાણી, શ્રીમતી ગીતાબેન તુલસીભાઈ ધોળું, શ્રીમતી રમીલાબેનશાંતિલાલ જબવાણી, શ્રીમતી વાલબેહન હંસરાજભાઈ પોકાર, શ્રીમતી નર્મદાબેન જેઠાલાલ સાંખલા, શ્રીમતી પ્રેમિલાબેન મનજીભાઈ ભાવાણી

યુવતી મંડળઃ-
પ્રમુખ :- સૌ. ચંદ્રિકાબેન દેવેન્દ્રભાઈ છાભૈયા, ઉપ પ્રમુખ :- સૌ. રીનાબેન અનિલભાઈ પોકાર, મંત્રી :- સૌ. સવિતાબેન મુળચંદભાઈ પોકાર, સહમંત્રી :- સૌ. નિરંજનાબેન વિનોદભાઈ ગોગારી, સલાહકાર :- સૌ. સંગીતાબેન જગદિશભાઈ લિંબાણી, સૌ. ભારતીબેન ભરતભાઈ લિંબાણી, સૌ. ભારતીબેન સુરેશભાઈ પોકાર, સૌ. વિમળાબેન સુરેશભાઈ છાભૈયા, સૌ. રશ્મિબેન જગદિશભાઈ રુડાણી, સૌ. કાંતાબેન વિનોદભાઈછાભૈયા, કાર્યવાહક :- સૌ. સ્નેહાબેન મોહનભાઈ છાભૈયા, સૌ. પુજાબેન સુરેશભાઈ પોકાર



યુવતી મંડળ પ્રમુખ
સૌ. ચંદ્રીકાબેન છાભૈયા



મહિલા મંડળ મંત્રી
સૌ. સવિતાબેન પોકાર

નવી ચૂંટાયેલ કારોબારી સભ્યોને પુષ્પ વડે સન્માનિત કરવામાં આવેલ. ત્યારબાદ મંત્રી શ્રીમતી વિમળાબેન લિંબાણીએ સભામાં ઉપસ્થિત સર્વેનો નવી કારોબારી વતી આભાર પ્રગટ કરેલ અને અંતે કોઈ કામકાજ ન રહેતા પ્રમુખશ્રીની પરવાનગીથી સભા પૂર્ણ થઈ તેમ જાહેર કરવામાં આવ્યું.

પ્રતિનિધિ :- અમૃત જયંતીલાલ લિંબાણી ચિંચવડ

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ગુજરાત યુવક મંડળ, ધનસુરા આયોજિત ૨૦ મો સમુહલગ્નોત્સવ

તા.૨૨/૧/૨૦૧૮ ને સોમવાર ના વસંત પંચમીના રોજ ઉજવાશે

શ્રી ક.ક.પા. સનાતન સમાજ ગુજરાત, ધનસુરા પ્રેરિત અને યુવક મંડળ તથા મહિલા મંડળ આયોજિત ૨૦ મો સમુહલગ્નોત્સવ ઈષ્ટદેવ ભગવાનશ્રી લક્ષ્મીનારાયણ તથા કુળદેવીશ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી તા. ૨૨/૧/૨૦૧૮ ને સોમવાર ના વસંત પાંચમી ના પવિત્ર અને શુભ દિવસે સમાજના જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં તથા સમાજના યુવા સ્વયંસેવકોના સાહસ અને સહકારથી ધામધૂમથી યોજાનાર છે જે માટે યુવક મંડળની તમામ કારોબારી અત્યારથી જ સમુહલગ્નના કામે લાગી ગઈ છે અને આ બાબતે શ્રી ક.ક.પા. સનાતન સમાજ ગુજરાત, ધનસુરાની તા. ૪/૧૦/૨૦૧૭ ને બુધવારે થનાર આગામી સભામાં સમાજ ના તમામ ઉપસ્થિત જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં સમુહલગ્નના આયોજનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવનાર છે.વધુમાં ૨૦ માં સમુહલગ્નોત્સવમાં યુવક મંડળ દ્વારા લગ્ન નોંધણીની કામગીરી આરંભી દેવામાંઆવી છે જેની સમાજના તમામ જ્ઞાતિજનોએ નોંધ લેવી. સમૂહલગ્નમાં જોડાવા ઈચ્છતા સમાજના નવયુગલોના માતા પિતાએ યુવક મંડળ ના નીચેના સભ્યોનો સંપર્ક કરવા સમૂહલગ્ન કન્વીનર જગદીશ પોકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

પ્રમુખશ્રી- મહેન્દ્ર ધોળું બોરડીટીંબાકંપા- ૯૪૨૭૦૨૭૫૨૫,
મહામંત્રીશ્રી- યોગેશ રામાણી માધવકંપા-૯૪૨૮૪૮૧૩૧૮,
મંત્રીશ્રી- અલ્પેશ ચોપડા શાંતીપુરકંપા-૯૪૨૯૪૭૬૪૭૧,
સમૂહલગ્ન કન્વીનરશ્રી- જગદીશ પોકાર ટીંબાકંપા-૯૬૮૭૪૦૫૦૦૫,
સહ કન્વીનરશ્રીઓ -
(૧) હિતેન્દ્ર પોકાર હીરાપુરકંપા-૯૯૭૯૭૪૮૭૬૧,
(૨) રાહુલ દિવાણી રણજીતપુરા-૯૪૨૬૫૪૯૬૨૮
(૩) રાજેશ ભગત એદલપુરાકંપા-૯૪૨૬૮૨૧૪૧૩,
(૪) વસંત ચોપડા બાડેરાકંપા-૯૪૨૮૫૫૬૭૦૮,
(૫) તુષાર દિવાણી નવટાંકીકંપા-૯૪૨૯૨૨૧૬૯૫.

ઉપર ના મિત્રોનો સમૂહલગ્ન માટેની કોઈપણ માહિતી તેમજ લગ્ન નોંધણી માટે સંપર્ક કરી શકો છો.

ગૌરવ



ચી. પ્રેમ રવાણી

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) અત્રેના પ્રગતી ટ્રેડિંગ કં વાળા કચ્છમાં રતડીયાનાં શ્રી રામજીભાઈ મનજીભાઈ રવાણીનો પૌત્ર અને યાદવભાઈ વ સ્વાતીબેન રવાણીનો પુત્ર ૧૦માં ૭૦% માર્ક સાથે ઉર્તીણ થઈ આપણી સમાજ તથા રવાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. મો.૯૪૨૨૨૦૭૬૭૦.

શ્રી અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મધ્ય મહારાષ્ટ્ર ઝોન

દિપાવલીની શુભકામના તેમજ નૂતન વર્ષાભિનંદન

વિક્રમ સંવત ૨૦૭૪ નું નૂતન વર્ષ શ્રી અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે સુખ શાંતિ અને સમૃધ્ધી આપનારૂ બની રહે તેમજ જ્ઞાતિજનો માં સ્નેહ,સેવા અને સહકારની ભાવના સાથે સામાજીક એકતા જળવાઈ રહે એવા શુભ આશિષ સાથે દિપાવલીની શુભ કામનાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ.

મધ્ય મહારાષ્ટ્ર ઝોન હોદેદારો (વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦)



પ્રમુખ
ખેતસી લખમસી રવાણી



ઉપપ્રમુખ
શંકરલાલ રાજારામ લિંબાણી



ઉપપ્રમુખ
જેઠાલાલ રતનશી દિવાણી



ઉપપ્રમુખ
બાબુલાલ દેવજી સાંખલા



મહામંત્રી
હસમુખ કરસન છાભૈયા



ખજાનચી
દામોદર જીવરાજ સાંખલા



મંત્રી
નાનજી ધનજીભાઈ નાયાણી



મંત્રી
ભીમજી જાદવજી દિવાણી



મંત્રી
ગોપાલ વાલજી દિવાણી



સહખજાનચી
મગનલાલ મુળજીભાઈ રામાણી

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મધ્ય મહારાષ્ટ્ર ઝોન ની કારોબારી વર્ષઃ ૨૦૧૭ થી ૨૦૨૦ માટે

શ્રી મનોહર મુળજીભાઈ હળપાણી
શ્રી મોહન માવજીભાઈ પોકાર
શ્રી ભાવેસ નારણભાઈ દિવાણી
શ્રી ખીમજી રામજીભાઈ પોકાર
શ્રી પુરસોતમ કાનજીભાઈ ચીકાણી
શ્રી પ્રેમજીભાઈ કરસનભાઈ ભાવાણી
શ્રી વિશ્રામભાઈ પચાણભાઈ નાકરાણી
શ્રી ખીમજીભાઈ અરજણભાઈ પોકાર
શ્રી દામોદર માવજીભાઈ નાકરાણી
શ્રી નરસીહ મુળજીભાઈ દિવાણી

શ્રી કાંતીલાલ દેવજીભાઈ સાંખલા
શ્રી ઈશ્વરલાલ ગંગદાસ પોકાર
શ્રી જીવરાજભાઈ હંસરાજભાઈ પોકાર
શ્રી મણીલાલ અરજણભાઈ દિવાણી
શ્રી મગનલાલ કરમશીભાઈ સાંખલા
શ્રી રવજીભાઈ પ્રેમજીભાઈ વાસાણી
શ્રી ગંગારામ મેગજીભાઈ છાભૈયા
શ્રી નારણભાઈ વાલજીભાઈ જબુવાણી
શ્રી મગનલાલ અરજણભાઈ ચૌહાણ
શ્રી ચંદુલાલ વિશ્રામભાઈ રૂડાણી

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મધ્ય મહારાષ્ટ્ર ઝોન ન્યાય સમિતી વર્ષઃ ૨૦૧૭ થી ૨૦૨૦ માટે



શ્રી નારાયણ હરજીભાઈ છાભૈયા
શ્રી ચીમનલાલ લખમશીભાઈ ચૌધરી
શ્રી પુરસોત્તમ ખેતાભાઈ દિવાણી
શ્રી ગોવીંદભાઈ ભાણજીભાઈ સાંખલા
શ્રી દેવરામભાઈ વિશ્રામભાઈ રૂડાણી
શ્રી ભીમજીભાઈ વિશ્રામભાઈ દિવાણી

શ્રી હરીભાઈ માવજીભાઈ પોકાર
શ્રી જેઠાભાઈ ઝવેરભાઈ ચૌધરી
શ્રી શરદભાઈ શાંતિલાલ માવાણી
સૌ. જસવંતીબેન જેન્તીલાલ રવાણી
સૌ. રમીલાબેન ભીમજીભાઈ દિવાણી
સૌ. લક્ષ્મીબેન શંકરલાલ લીબાણી
સૌ. રમીલાબેન ખેતશીભાઈ રવાણી



પ્રમુખ : શ્રી રામજીભાઈ દેવશીભાઈ ચવ્હાણ

મંત્રી : શ્રી જીવરાજભાઈ કરમશીભાઈ દિવાણી

સાબરકાંઠા ઝોન મીટીંગ અહેવાલ

તા.૨૫.૭.૨૦૧૭ના રોજ શ્રી અખિલ ભા.ક. ક.પા.સ. સાબરકાંઠા ઝોનની સાધારણ સભા શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજવાડી, હિંમતનગર મુકામે ઝોનના પ્રમુખ શ્રી શાંતિલાલ કે. નાકરાણીના અધ્યક્ષ સ્થાને મળેલ. તેમાં ત્રણ વર્ષ માટે નવી કારોબારીની વરણી કરવામાં આવેલ તેમજ તા.૩૧.૮.૨૦૧૭ ના રોજ નવી કારોબારીની મીટીંગ હિંમતનગર ખાતે મળેલ. તેમાં ઝોનના ત્રણ વર્ષ માટેના નવા હોદેદારોની નીચે મુજબની વરણી કરવામાં આવેલ.

પ્રમુખ : શ્રી શાંતિલાલ કરશનભાઈ નાકરાણી - તલોદ (બદામકંપા), ઉપ-પ્રમુખ : શ્રી રસિકલાલ દેવજીભાઈ છાભૈયા-હિંમતનગર (છાપરીયાકંપા), શ્રી જેઠાભાઈ રામજીભાઈ હળપાણી-નવાનગરકંપા (હિંમતનગર), શ્રી યશવંતભાઈ વસ્તાભાઈ ભગત-જામરેલાકંપા (વડાલી), શ્રી જશવંતભાઈ પુનમભાઈ નાકરાણી-અમીરગઢ (ઉમીયા ફાર્મ), શ્રી ભોગીલાલ નાનજીભાઈ ધોળુ-સવાસલાકંપા (વડાલી), મંત્રી : શ્રી કાંતિભાઈ રાજાભાઈ પોકાર-બાવસારકંપા (હિંમતનગર), સહમંત્રી : શ્રી ધનજીભાઈ સવજીભાઈ પોકાર-નીકોડાકંપા (હિંમતનગર), શ્રી સતિષભાઈ નારણભાઈ રામાણી-ખેડબ્રહ્મા, ખજાનચી : શ્રી રેવાભાઈ પ્રેમજીભાઈ ભોજાણી-પીપળીકંપા (હિંમતનગર), સહખજાનચી : શ્રી હીરાલાલ દેવસીભાઈ ધોળુ-તલોદ, આંતરિક ઓડીટર : શ્રી રવજીભાઈ પરબતભાઈ ભગત ખેડબ્રહ્મા, કેન્દ્રીય સમાજના પ્રભારી : શ્રી રતિભાઈ લધ્ધાભાઈ છાભૈયા તલોદ (મહિયલ), સલાહકાર : શ્રી નરસિંહભાઈ ધનજીભાઈ રામાણી-ચોટાસણકંપા (ઇડર), શ્રી અંબાલાલભાઈ સવઘણભાઈ લીંબાણી-અમીરગઢ (પંચવટીફાર્મ), શ્રી જયંતિલાલ મણીલાલ પોકાર-રામપુરાકંપા (તલોદ), શ્રી ડૉ.અમૃતભાઈ મેઘજીભાઈ ધોળુ-હિંમતનગર, સમૂહલગ્ન કન્વીનર : શ્રી મહેન્દ્રભાઈ કાનજીભાઈ લીંબાણી-બીલપણકંપા (હિંમતનગર), સમૂહલગ્ન ઇન્ચાર્જ : શ્રી છગનભાઈ નારણભાઈ ભાવાણી-રામપુરા (તલોદ), સમૂહલગ્ન સહઇન્ચાર્જ : શ્રી બાબુભાઈ નારણભાઈ ઠાકરાણી- ચામુકંપા (ઇડર), સમૂહલગ્ન સહકન્વીનર : શ્રી અરવિંદભાઈ કેશવલાલ વેલાણી- તારંગા (ઉમિયા ફાર્મ), શ્રી દેવસીભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ - ગાંધીપુરા (હિંમતનગર), શ્રી ગોરધનભાઈ મણીલાલ સેંઘાણી - ઇડર (ઉમિયા ફાર્મ), શ્રી ગંગારામભાઈ વાલજીભાઈ છાભૈયા વાઘેલા દેરોલ (ખેડબ્રહ્મા)

અંતમાં પ્રમુખ સ્થાનેથી બોલતાં શાન્તિલાલ કે. નાકરાણીએ જણાવેલ કે સાબરકાંઠા ઝોને છેલ્લા ત્રણ વર્ષમાં ખૂબજ સારી પ્રવૃત્તિ કરી સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરેલ છે. બે સમૂહલગ્નના સફળ આયોજન બાદ હવે તૃતીય સમૂહલગ્ન કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્યારસુધીમાં ૧૯ જોડા નોંધાઈ ચૂક્યા છે. નામ નોંધાવવાની છેલ્લી તા.૫.૯.૨૦૧૭ રાખવામાં આવેલ છે. તૃતીય સમૂહલગ્ન તા.૨.૧૧.૨૦૧૭ કારતક સુદ ૧૩ (તુલસી વિવાહ) ગુરુવારના રોજ જેતપુર કડવા પાટીદાર સમાજવાડી, વડાલી ખાતે આયોજન કરવામાં આવેલ છે. સમૂહલગ્ન અંગે કોઈપણ માહિતી જોઈતી હોય તો નીચેના મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરવા જણાવેલ. સમૂહલગ્નનું કાર્યાલય :- શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજવાડી, હિંમતનગર. ખાતે છે.

સંપર્ક :- જેઠાભાઈ આર. હળપાણીઃ- મો.૯૪૨૭૪૫૫૯૩. કાન્તિભાઈ આર. પોકાર, મો.૯૪૨૮૮૧૬૪૧૬.

ધનસુરા સમાજની નવાજુની




તા. ૩/૯/૨૦૧૭ ને રવિવાર ના રોજ શ્રી કરછ કડવા પાટીદાર સનાતન સમાજ ગુજરાત ની સામાન્ય સભા ધનસુરા ખાતે સમાજના પ્રમુખ શ્રી જગદીશભાઈ શામજીભાઈ વાસાણી ના અધ્યક્ષ સ્થાને મળી જેમાં મોટી સંખ્યા માં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા જેને શબ્દો થી સમાજના મંત્રી ભરતભાઈ વેલાણી એ આવકાર્યા હતા. સભામાં સમાજની વિવિધ સંસ્થા ના હિસાબો વાંચણમાં લેવામાં આવ્યા જેને સર્વાનુ મતે મંજુર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સમાજ દ્વારા સંચાલિત ઓધવ વિદ્યામંદિર ના નિર્માણ થઈ રહેલ નવીન સંકુલ ના ઉછામણી દ્વારા મળેલ દાનના દાતાશ્રીઓ નો સમાજના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ સભાનું વિશેષ મહત્વ યુવક મંડળ અને મહિલા મંડળની નવીન કરોબારી અને હોદ્દેદારો ની નિમણુંક કરવાનું હતું, જેની પસંદગી માટે સમાજના હોદેદારોની મહત્વની બેઠક થઈ જેમાં યુવક મંડળ અને મહિલા મંડળ ના હોદેદારો ના નામની જાહેરાત સમાજ ના મંત્રી શ્રી ભરતભાઈ વેલાણી દ્વારા કરવામાં આવી હતી જે નીચે મુજબ છે.

યુવક મંડળ હોદ્દેદારોઃ-

પ્રમુખશ્રી- મહેન્દ્રભાઈ લાલજીભાઈ ધોળું બોરડીટીંબા, ઉપપ્રમુખશ્રી (૧)જીતેન્દ્રભાઈ ખેતાભાઈ લીંબાણી દોલપુરકંપા (૨) ચંપકલાલ કાંતિભાઈ ભાવાણી મોતેસરી (૩) ધર્મેન્દ્રભાઈ રવજીભાઈ પોકાર એદલપુરા (૪)અશિષભાઈ હિમ્મતભાઈ લીંબાણી વિષ્ણુપુરા (૫) અનિલભાઈ રઘુભાઈ વેલાણી સોનિકંપા, મહામંત્રીશ્રી- યોગેશ જયંતીભાઈ રામાણી માધવકંપા, મંત્રીશ્રી- અલ્પેશ બાબુભાઈ ચોપડા શાંતીપુરા, ખજાનચિશ્રી - સતીષ હસમુખભાઈ ચોપડા વડાગામ, સહખજાનચિશ્રી- જીજ્ઞેશભાઈ ભીમાણી ઉમાફાર્મ, આંતરીક ઓડિટરશ્રી - શિરીશ નરશીભાઈ ચોપડા ધનસુરા, સમૂહલગ્ન કન્વીનરશ્રી- જગદીશ નારણભાઈ પોકાર ટીંબાકંપા, સહકન્વીનરશ્રી- (૧) હિતેન્દ્ર હરિભાઈ પોકાર હીરાપુરકંપા (૨) રાહુલ અશોકભાઈ દિવાણી રણજીતપુરા (૩) રાજેશ ભાણજીભાઈ ભગત એદલપુરા (૪) વસંત ગંગદાસભાઈ ચોપડા બાડેરાકંપા (૫) તુષાર જગદીશભાઈ દિવાણી નવટાંકીકંપા, સહમંત્રી- (૧)ધર્મેન્દ્ર વસંતભાઈ વાસાણી રામપુરાકંપા (૨) ચીરાગ મોહનભાઈ છાભૈયા બોરડીટીંબા (૩) અમિત નવનીતલાલ સુરાણી શરડીકંપા (૪) કિરણ તુલશીભાઈ માવાણી લક્ષ્મણપુરાકંપા (૫) ભદ્રેશ શામજીભાઈ છાભૈયા તખતગઢકંપા, સલાહકારશ્રી- (૧) બકુલ ચીમનભાઈ નાકરાણી બોરડીટીંબાકંપા (૨) અવિનાશ તુલશીભાઈ લીંબાણી વિષ્ણુપુરા, સંગઠનમંત્રીશ્રી- (૧)પ્રમોદભાઈ બી. માવાણી હીરાપુરકંપા (૨) અનિલ સી. પોકાર દોલપુરકંપા (૩) ચંદ્રાહશ ડી. લીંબાણી દોલપુરકંપા, સાંસ્કૃતિકમંત્રી- (૧)મનીષ વેલાણી બાડેરાકંપા (૨) યોગેશ ચોપડા હીરાપુરકંપા (૩) જયેશ મણિલાલ સુરાણી વડાગામ, રમતગમતમંત્રીશ્રી (૧) પ્રિયંક રતીલાલભાઈ પોકાર ટીંબાકંપા (૨) હિરેન અર્જણભાઈ ચૌહાણ રામશીકંપા (૩) મેહુલ રામાણી ધનપુરાકંપા(તલોદ), પ્રવાસમંત્રીશ્રી- (૧) શિવરામ દિવાણી નવટાંકીકંપા (૨) કૃણાલ ચૌધરી રામાપીરકંપા.




મહિલા મંડળ ના હોદ્દેદારોઃ-


પ્રમુખશ્રી- તારાબેન હીરાભાઈ પોકાર અદલપુરા, ઉપપ્રમુખશ્રી (૧) રાધાબેન પ્રવિણભાઈ લીંબાણી ધનસુરા, (૨) રંજનબેન હિતેશભાઈ માવાણી હીરાપુરકંપા, (૩) વિમળાબેન ઈશ્વરભાઈ માકાણી હીરાખડીકંપા, મંત્રીશ્રી- મંગળાબેન હસમુખભાઈ ચોપડા વડાગામ, સહમંત્રી- (૧) નિરુબેન ચંદ્રકાંતભાઈ બદામકંપા (૨) ભાવનાબેન ઈશ્વરભાઈ સુરાણી ટીંબાકંપા, ખજાનચિશ્રી- ઇન્દુબેન ચંપકલાલ ભાવાણી મોતેસરી, સહખજાનચિશ્રી- મણીબેન ભાઈલાલભાઈ સુરાણી વડાગામ, સલાહકારશ્રી- (૧) કાંતાબેન ઈશ્વરભાઈ નાકરાણી બદામકંપા (૨) નર્મદાબેન ડાહ્યાભાઈ નાકરાણી બદામકંપા....

ઉપર મુજબ ની યુવક મંડળ અને મહિલા મંડળ ના હોદ્દેદારોની નિમણુંક ને ઉપસ્થીત સૌ સમાજજનો એ વધાવી હતી અને અંતે સભામાં આવેલ સૌ સમાજના વડીલ, ભાઈ અને બહેનો નો હૃદય પૂર્વક આભાર સમાજ ના સહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ કે રામાણી એ વ્યક્ત કર્યો હતો ને સભાને પૂર્ણ જાહેર કરી હતી.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

મહાકૌશલ ઝોન મ.પ્ર.

(કાર્યાલય : પાટીદાર ભવન જબલપુર)



મહામંત્રી
શ્રી સંતોષભાઇ દાનાભાઇ સામાણી
જબલપુર



પ્રમુખ
શ્રી શાંતિલાલ ગંગારામભાઇ નાકરાણી
જબલપુર



ખજાંચી
શ્રી દયારામભાઇ મણીભાઇ પોકાર
જબલપુર



ઉપપ્રમુખ
શ્રી દલસુખભાઇ દિવાણી
સાગર



ઉપપ્રમુખ
શ્રી ઇશ્વરભાઇ ખીમાણી
બાલાઘાટ



મંત્રીશ્રી
શ્રી કાંતિભાઇ સાંખલા
અલ્હાબાદ



મંત્રીશ્રી
શ્રી કાંતિભાઇ નાકરાણી
મૈહર



મંત્રીશ્રી
શ્રી વિવેકભાઇ ધોળુ
બૈતુલ



મંત્રીશ્રી
શ્રી જયંતિભાઇ રંગાણી
પરસોના



મંત્રીશ્રી
શ્રી નવીનભાઇ લિંબાણી
સાગર

દિવાળી અને નવવર્ષ ની હાર્દિક શુભેચ્છા અને અભિનંદન

****

:-: કારોબારી સદસ્ય :-:

શ્રી મગનભાઇ પારસિયા - જબલપુર
શ્રી હરિભાઇ લીંબાણી - જબલપુર
શ્રી મોહનભાઇ ચોપડા - જબલપુર
શ્રી હિમ્મતભાઇ સાંખલા - બૈતુલ
શ્રી તેજાભાઇ ચૌહાણ - સાગર
શ્રી હંસરાજભાઇ રવાણી - સાગર
શ્રી પ્રવીણભાઇ સાંખલા - સાગર
શ્રીમતી નિર્મલાબેન છાભૈયા - જબલપુર
શ્રીમતી હંસાબેન પોકાર - જબલપુર
શ્રીમતી ઉર્મિલાબેન સાંખલા - સાગર
શ્રીમતી માયાબેન રવાણી - સાગર

:-: ઘટક સમાજો :-:

જબલપુર - સંતોષભાઇ સામાણી
સાગર - દલસુખભાઇ દિવાણી
સતના - ભીમજીભાઇ નાકરાણી
મૈહર - કાંતિભાઇ નાકરાણી
કટની - જીવરાજભાઇ પોકાર
અલ્હાબાદ - વિરેન્દ્રભાઇ સાંખલા
બનારસ - બાબૂભાઇ રવાણી
બાલાઘાટ - ઇશ્વરભાઇ ખીમાણી
બૈતૂલ - વિવેકભાઇ ધોળૂ
સિંગરૌલી - જયંતીભાઇ રંગાણી



ઉપપ્રમુખ
શ્રી જયંતીભાઇ ભાદાણી
સતના



સહખજાંચી
શ્રી સુરેન્દ્રભાઇ દિવાણી
જબલપુર



મંત્રીશ્રી
શ્રી બાબુભાઇ રવાણી
બનારસ



મંત્રીશ્રી
શ્રી નરેન્દ્ર કુમાર પોકાર
કટની



પ્રમુખ (ન્યાય સમિતિ)
શ્રી લખમશીભાઇ પોકાર
સાગર



મંત્રી (ન્યાય સમિતિ)
શ્રી વિરેન્દ્રભાઇ નાકરાણી
જબલપુર

:-: ઝોન ના કાર્યો :-:

ઘટક સમાજ ના ૯,૧૦,૧૧ અને ૧૨ ધોરણ ના તેજસ્વી વિદ્યાર્થિઓનું સન્માન. ઘટક સમાજ ના C.A. અને M.B.B.S. ડૉક્ટરો નું સન્માન, કેસરા પરમેશ્વરા અને નારાયણ બાપા ની જન્મ જયંતી ની ધૂમધામ થી ઉજવણી અને ગર્ભાશય ના કેંસર પ્રોટેક્શન ની વેકસીન કુંવારી કન્યાઓને આપવા માં આવશે. ઘટક સમાજ ના શુભેચ્છા બૈઠકો નું આયોજન. નિયમિત છ માસિક કારોબારી બૈઠકો નું આયોજન. અ.ભા.ક.ક. પાટીદાર સમાજ ના ધારાધોરણનું પાલન કરવું

DMG રીજીયન યુવા સંઘ સામાન્ય સભા સાંગલી

શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા રિજીયનની સામાન્ય સભા સાંગલી મુકામે તા.૨૨.૮.૧૭ના રોજ ડીએમજી પ્રમુખશ્રી પ્રવિણભાઇ વેલાણીના આપશ્રી સ્થાને મળેલ હતી. જેમાં ઓશીયન કાઉસીલ પ્રેસીડેંટ જગદીશભાઇ નાકરાણી, ઓશીયન સેક્રેટરી દિનેશભાઇ નાકરાણી, સેંટ્રલના એજ્યુકેશન પીડીઓ સંગીતાબેન નાકરાણી-મુંબઇ, સેંટ્રલ હેલ્થ પીડીઓ ગીતાબેન નાકરાણી-સાતારા, તેમજ ડીએમજી સમાજ પ્રમુખ રતીલલભાઇ સાંખલા સાંગલી સમાજના પ્રમુખ શ્રી દેવજીભાઇ તેમજ ડીએમજી ના સર્વે હોદેદારો અને કારોબારી સભ્યો તેમજ સાંગલી જીલ્લા યુવા મંડળોના સર્વે સદસ્યો ઉપસ્થિત રહેલ હતા.

આજની સભાની શરુઆત મા ઉમિયાના દિપપ્રાગટ્ય કરીને લક્ષ્મીનારાયણના જયઘોષ સાથે કરવામાં આવેલ. ત્યારબાદ સ્વર્ગવાસી થયેલ સર્વેને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. ઉપસ્થિત સર્વનું ડીએમજી ચેરમેન દ્વારા શાબ્દીક સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ ગત મિનીટબુકનું વાંચન મંત્રીશ્રી રમણભાઇ ઠાકરાણી એ કરેલ હતું તેમજ આવક જાવકના હિસાબો ખજાનચી શ્રી ધીરજભાઇ પોકારે રજુ કરેલ હતા. જેને બહાલી આપવામાં આવેલ.

ત્યારબાદ ડીએમજી મિશન ચેરમેન દિનેશભાઇ રુડાણી દ્વારા ગત સમયમાં નક્કી કરેલ થીમ આધારિત થયેલ કાર્યોની માહિતી પ્રોજેક્ટર દ્વારા આપવામાં આવેલ હતી. આગામી સમયમાં કરવાના કાર્યો બાબતે ચર્ચા કરવામાં આવેલ અને આગામી ત્રણ મહિનાના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ જેમાં ડીએમજી ૧૦૦/- y.s.k. બનાવવું. ઉડાન હમારી નો કાર્યક્રમનું આયોજન SUV ની તૈયારી કરીને ટેલેન્ટ છોકરાઓનું મૂકવામાં ડીએમજીમાં ઘરોઘર સનાતન ધર્મ પત્રિકા પહોંચાડવું, વેબકોમમાં દરેકના ફેમીલી અપડેટ કરવામાં આવા દરેક કાર્ય આગામી સમયમાં પુરા કરવાનું નક્કી કરવામાં આવેલ હતું.

ત્યારબાદ આજની જનરલ સભામાં મહેમાન તરીકે ઉપસ્થિત સંગીતાબેન નાકરાણીએ જણાવેલ કે આગામી ૨૩-૨૪-૨૫/૧૨/૨૦૧૭ના SUV નો દશાબ્દિક કાર્યક્રમમાં ૧૩ ઇવેન્ટ નક્કી કરવામાં આવેલ છે જેમાં under-16 અને under-25 ના ગ્રુપ બનાવેલ છે.

જેમાં દરેક ઇવેન્ટમાં ટેલેન્ટ છોકરાઓનું ઝોન લેવલે સિલેકશન કરીને ત્યાં મૂકવાનાં છે તે ડીએમજી લેવલે વધારેમાં વધારે છોકરાઓ ભાગ લે તેવું જણાવેલ હતું. ત્યારબાદ ગીતાબેન નાકરાણી SUV માં જે ૧૩ ઇવેન્ટ છે તેની વિસ્તારથી માહિતી આપેલ અને SUV માં ભાગ લેવા ઇચ્છતા પ્લેયરની ફાઇનલ યાદી ૧૫-૧૧-૧૭ સુધી બહાર પાડવાની હોઇ આપ સમયસર આપના ઝોનની યાદી મોકલી આપવા જણાવેલ હતું. ત્યારબાદ ડીએમજી સમાજના પ્રમુખ શ્રી રતીલાલભાઇ સાંખલા એ જણાવેલ કે યુવા સંઘના કાર્યો જોતાં લાગે છે કે સમાજના દરેક કાર્યો યુવા સંઘ કરી રહેલ છે અને દરેક થીમ આધારીત થતા કાર્યો પ્રસંશનીય છે અને તેમાંય y.s.k. યોજનાનો તો આપણી સમાજને બહુ જ લાભ થઇ રહેલ છે. આવાજ કાર્યો કરતા રહો સમાજ આપની સાથે તન-મન-ધનથી સહયોગ આપવા તૈયાર છે.

ત્યારબાદ ડીએમજી આયપીપી અને ઓશીયન પ્રેસીડેન્ટ જગદીશભાઇ જણાવેલ કે યુવા સંઘની y.s.k. યોજના શિખરો સર કરી રહેલ છે સમાજના દરેક સભ્યને તેમાં સામિલ કરીને દરેક પરિવારને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક છે. યુનિટી કાર્ડ દ્વારા સમાજને દરેક અંગે લાભ થાય તેના ઉદેશથી દરેકને સાંકળી લેવાનો પ્રયાસ છે. વેલનટાઇન ડેના બદલે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ લાવીને આપણી પરિવારની વ્યવસ્થા મજબૂત કરવા જઇ રહ્યા છીએ. ઘરોઘર સંધ્યાપાઠ થાય તેના પ્રયત્નો સફળ થઇ રહ્યા છે. વ્યસનમુક્તિ અને ભાવિ પેઢીને સંસ્કારનું સિંચન દ્વારા સમાજને સક્ષમ બનાવવાનું યુવા સંઘનું મિશન છે જેમાં દરેક નો સારુ એવું કાર્ય કરી રહેલ છે ત્યારબાદ ઓશિયન સેક્રેટરી દિનેશભાઇ એ જણાવેલ કે ડીએમજી રિજીયન ગત સમયમાં નક્કી કરેલ ગોલ કરતાં વિશેષ કાર્ય કરવા બદલ અભિનંદન. SUV માં ડીએમજીનો ડંકો વાગશે તેવી અપેક્ષા રાખેલ.

DMG ચેરમેન પ્રવિણભાઇ વેલાણી એ જણાવેલ કે સેટ્રલમાંથી આવેલ મેમ્બર દ્વારા ડીએમજીને કાર્યોની પાંચ મળેલ છે. આગામી સમયમાં નક્કી કરેલા કાર્યો સમયસર પુરા કરીશું. SUVમાં વધારેમાં વધારે છોકરાઓ ભાગ લેશે તેવા પ્રયાસો કરીશું અને ડીએમજીનો ડંકો વગાડીશું. આપ સર્વના સાથ સહકારની અપેક્ષા.

છેલ્લે આભાર વિધિ મુકેશભાઇ નાકરાણી એ કરેલ અને આજની આ જનરલ સભા પુરી થયેલ જાહેર કરેલ હતી.

સ્ટ્રેસ (તણાવ) મેનેજમેન્ટ-કે.કે.પી. સમાજની દ્રષ્ટિએ...

ડૉ. વિઠ્ઠલ ભાવાણી (સામાજીક અને આધ્યાત્મિક સમિતિ યુવાસંઘ)



"ચિંતા અને તણાવથી સંપુર્ણ મુક્ત થવાનો એક માત્ર ઉપાય અદ્યાત્મ જ છે."

૨૧મી સદિ ની વિપુલ ભૌતિક સગવળોની એક સાઇડ ઇફેક્ટ એટલે સ્ટ્રેસ. જેને નાના શબ્દમાં ચિંતા પણ કહી શકાય. ભલભલા ચમરબંધીઓ પણ આમાથી બાકાદ ન રહી શકાય. વધતા ઘટતા અંશે સ્ટ્રેસ દરેકમાં જોવા મળે જ. કે.કે.પી. સમાજની દ્દષ્ટિએ જોઇએ તો છેલ્લા દાયકાઓમાં લક્ષ્મીની મહેરબાની ઉતરી છે તે સાથે સ્પર્ધા, ઈર્ષ્યો,અદેખાઇ અને મહિલા વર્ગમાં ભૌતિક વસ્તુઓની મહત્વાકાંક્ષા વગેરે એ પણ બાય પ્રોડક્ટ તરીકે પ્રવેશ કર્યો છે. પહેલા એકજ ધંધામાં (બેનસામાં) ઘણા બધા ભાગીદાર રહેતા જેથી કામનો ભાર વહેંચાઇ જતો. હવે ધંધાનું ભારણ અને એ પણ સ્પર્ધાત્મક રીતે એકજ વ્યક્તિ પર આવ્યું છે અને જેના સ્વરુપે સ્ટ્રેસ પહેલાંના દાયકાઓની સરખામણીમાં વધવા માંડ્યુ છે. તણાવ અને તેનાથી થતા રોગો જેવા કે ડાયાબીટીસ,બ્લડપ્રેશર ,હાર્ટએટેકનું પણ પ્રમાણ વધવા માંડ્યું છે. આ રોગો ને તણાવ કે ચિંતા સાથે સીધો જ સંબંધ છે. આપણા સમાજમાં આર્થિક અને જીવન શૈલીમાં ખુબજ ઝડપી પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે. જેની સાથે દરેક સમય કદમ મીલાવવો એ પણ તણાવનું એક કારણ છે.

<u>સ્ટ્રેસ મેનેજમેન્ટ</u>

દરેક વ્યક્તિ માટે તણાવના જુદા જુદા કારણો હોઇ શકે છે. આપણે આપણા તણાવના કારણોની તપાસ કરીએ તો ચોક્કસ તેનો ઇલાજ શક્ય છે.

<u>ટાઇમ મેનેજમેન્ટ</u>

દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં ટાઇમ મેનેજમેન્ટ શીખવવું જ રહ્યું.પોતાના ભરચક સીડ્યુલમાંથી થોડી હળવી પળો પોતાના માથે તથા પરિવાર માટે કાઢવી જ પડશે.

<u>પોઝીટીવ એટીટ્યુટ</u>

ગ્લાસને અડધો ભરેલો હોય તો તેને ભરેલા તરીકે જોવો પડશે. પુરો ભરેલો ગ્લાસ જીંદગીમાં કોઇને પણ મળતો નથી. પોતાના ભાગે આવેલો અડધો ભરેલો ગ્લાસ ભરેલા ગ્લાસ તરીકે જોવો પડશે નહિ કે અડધા ખાલી ગ્લાસ તરીકે.

<u>પુરતી ઉંઘ</u>

ઓછી ઉંઘ એ તણાવનું બહુ મોટું કારણ છે જેથી બીનજરુરી ઉજાગરા ઘટાડીને પુરતી ઉંઘ લેવી જ (૭ થી ૮ કલાક).

<u>મન ના વિચારોને જોવા</u>

આખી જીંદગી મનમાં સારા કે નરવા વિચારો તો અવિરત આવ્યા જ કરવાના જે આપણા કંન્ટ્રોલની બહાર છે. તેને જોવાની પ્રેકટીસ કરવી પડશે. મનના વિચારોમાં ભળ્યા વગર તેને જોવા પડશે.

<u>લોગ ક્યા કહેંગે!</u>

એક સારો મેસેજ હતો કે આખી જીંદગી ડરી ડરીને જીવ્યા કે લોગ ક્યા કહેંગે. અંતમાં લોગ કહેતે હે રામ રામ સત્ય હે.

જીવનમાં હાસ્ય, ઉલ્લાસ, નાની નાની વાતોમાં આનંદ ને સ્થાન આપો.

અતિશય નફરત, અતિશય કામનો ભાર, ઈર્ષો, નાની નાની વાતોને મોટું સ્વરુપ આપવાને ડીલીટ કરો.

: છેલ્લે લાસ્ટ બટ નોટ લીસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. :

ચિંતા કે તણાવનો સંપુર્ણ ઇલાજ તો માત્ર અધાત્મમાં જ છે ભગવાન શ્રીકૃષ્ણ એ ભગવતગીતામાં કહ્યું છે કર્મ એવ ધીકારસ્તે મા ફલેશું કલાચન. કર્મ કરવું એ તારો અધીકાર છે. સારા માં સારું કર્મ કરવું પણ કર્મનું ફળ કે રીઝલ્ટ જે આવે તેનો હસ્તા મુખે (પરમઆનંદ)થી સ્વીકારવું જેમાં હરખ કે શોખ ન કરવો. પછી તણાવ કે ચિંતા જેવી ચિઝ તારી જીંદગીમાં રહે તો મને જણાવજે...

ડૉ. વિઠ્ઠલ ભાવાણી, બાબુ કાલરીયા અને ટીમ સામાજીક અને આધ્યાત્મિક યુવા સંઘ સનાતન ધર્મ પત્રીકાના દિપોત્સવી અંક નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવે છે.



with best compliment....

શ્રી કડવા પાટીદાર સમાજ, ઔરંગાબાદ

"પાટીદાર ભવન" , જાલના રોડ ,
ઔરંગાબાદ – ૪૩૧૦૦૫ ફોન.નં. ૦૨૪૦–૨૩૨૨૨૧૬

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું મુખપત્ર " **સનાતન ધર્મ પત્રિકા** "ના દિવાળી અંકના દ્વિતિય સંસ્કરણ પ્રસંગે..**શ્રી કડવા પાટીદાર સમાજ, ઔરંગાબાદ** શુભેચ્છા આપે છે.
આપણી જ્ઞાતીનાં સર્વે બાંધવોને દિપાવલી તેમજ નવવર્ષની હાર્દિક શુભેચ્છાઓ.

યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા વર્ષ દરમિયાન લેવાતા ઉપક્રમો


MLC ચંદુભાઈ રૂડાણીને શુભેચ્છા...


Cancer Awarness Programe...


GST Guidness Programe...


Tree Plantation Progr. with Gayatri Pariwar


Blood Donation Camp


Pictionary


One Day Picnic....


Ongoing Yoga..

વર્ષ દરમિયાન સમાજ અંતર્ગત લેવામાં આવતા પ્રસંગો

▶ સ્નેહ મિલન ▶ ગણપતી ઉત્સવ ▶ જન્માષ્ટમી ઉત્સવ ▶ નવરાત્રી ઉત્સવ ▶ સરસ્વતી સન્માન

પ્રમુખ
શ્રી બાબુભાઈ દેવજીભાઈ સાંખલા

મહામંત્રી
શ્રી ગોપાલભાઈ વાલજીભાઈ દિવાણી

શુભ દિપાવલી અને નવવર્ષની શુભેચ્છાઓ.

સંવત ૨૦૭૩ દિવાળી પર્વ તેમજ સંવત ૨૦૭૪ નૂતન વર્ષના અભિનંદન

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણા - કચ્છ

વિદર્ભ ઝોન

C/o. શ્રી કચ્છ પાટીદાર સમાજ,
પાટીદાર ભવન, લકડગંજ, નાગપુર - ૪૪૦ ૦૦૮.





પ્રમુખશ્રી	ઉપપ્રમુખશ્રી	ઉપપ્રમુખશ્રી	મહામંત્રીશ્રી	સહમંત્રીશ્રી	સહમંત્રીશ્રી	સહમંત્રીશ્રી	ખજાનચીશ્રી	સહખજાનચીશ્રી
ધીરજલાલ દેવજી	વાલજીભાઈ નથુભાઈ	રતનશી અખેરાજ	ભીમજીભાઈ લાલજી	વાલજીભાઈ શિવગણ	પ્રકાશભાઈ ગોવિંદ	અમૃતલાલ ભીમજી	ખેમચંદ જેઠાભાઈ	નારણભાઈ લખમશી
ભાવાણી	દિવાણી	માનાણી	સેંગાણી	દિવાણી	છાભૈયા	સાંખલા	છાભૈયા	છાભૈયા
અમરાવતી	અકોલા	ઘાટરોડ, નાગપુર	નાગપુર	વરૂડ	બલ્લારપુર	ભંડારા	લકડગંજ, નાગપુર	કળમેશ્વર

ન્યાય સમિતી :– ખેતાલાલ કાનજી પોકાર (ઉમરેડ), ત્રિભુવનદાસ મેઘજી રૂડાણી (નાગપુર), મોહનલાલ ધનજી છાભૈયા (ઘાટરોડ), દાના માવજી સાંખલા (કન્હાન), અમૃત વાલજી કાલરીયા (અમરાવતી).

કારોબારી સભ્ય :– રસિક ચોપડા, વિનોદ લિંબાણી (નાગપુર), ખુશાલ ભાવાણી(અમરાવતી), જયંતીભાઈ ભાવાણી (અકોલા), હરિભાઈ ધોળુ (બલ્લારપુર), પ્રવિણ પોકાર (ભંડારા) ગોવિંદ પોકાર, ભગવાનદાસ ભિમાણી(ગોંદિયા), પુરૂષોત્તમ સાંખલા (કોરાડી), ભવાનભાઈ ભાદાણી (વરૂડ), જયંતીભાઈ પોકાર (ચંદ્રપુર), દિલીપ માકાણી (ચિખલી), રામજીભાઈ પોકાર (કારંજા લાડ), નવીન સાંખલા (વાશીમ), શંકરભાઈ લિંબાણી (ખામગાંવ), ખેતશી નાકરાણી (મલકાપુર), તરૂણ સાંખલા (વણી), ખીમજીભાઈ ભગત (વર્ધા), પ્રવિણ ભાદાણી (યવતમાલ), મણીલાલ પોકાર (છિંદવાડા), શાંતીલાલ છાભૈયા (મુલતાઈ), હિમ્મતભાઈ રામાણી (પાંઢુર્ણા), વિરેન્દ્ર નાકરાણી (સિંદી), જયંતીલાલ ભાવાણી (દેવરી), દેવશી દિવાણી (આકોટ), જેઠાભાઈ ભાવાણી (બારસી ટાકલી), વિનોદ ભાદાણી (તિવસા), નાનજીભાઈ પોકાર (અંજનગાંવ), વાલજીભાઈ ભાવાણી (શેગાંવ).

શ્રી અખીલ ભારતીય ઠાકરાણી પરિવાર જોગ ભડલી

શ્રી અખિલ ભારતીય ઠાકરાણી પરિવારનું વાર્ષિક મિલન તા.૨૭/૮/૧૭ ના રોજે ભડલી મુકામે પરિવારના સુડધન શ્રી ચક્ષબૌતેર તેમજ રુપાંસતી માતાજીના વાર્ષિક તીથી નિમિત્તે મળેલ હતું. જેમાં ભારત ભરમાં રહેતા ઠાકરાણી પરિવાર તા.૨૭/૮/૧૭ ના રોજે ભડલી મુકામે આવી પહોંચ્યા હતા.

શ્રી અખિલ ભારતીય ઠાકરાણી પરિવારની જનરલ સભા તા.૨૭/૮/૧૭ના રોજે બપોરેના ૩.૦૦ કલાકે પ્રમુખ શ્રી ખીમજીભાઇ ડાયાભાઇ ઠાકરાણીના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.

જેમાં પરિવારના વસ્તી પુસ્તકનું અને પરિવારના પેઢી નામાનું વિતરણ કરવામાં આવેલ હતું. પરિવારની આજની મિટીંગ રાબેતા મુજબની હોઇ બંને સ્થાનકોના વિકાસ બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવેલ. હાલમાં થઇ રહેલ બાગબગીચાના કાર્યો બાબતે તેમજ ભવિષ્યમાં બંને ધામોને રમણીય સ્થળ બનાવવા સર્વેનો સુર રહ્યો હતો.

ઠાકરાણી પરિવાર નાનો હોઇ ભારતભરમાં વસવાટ કરે છે પરિવારના દરેક સભ્યોમાં નજીકતા આવે અને એકબીજાના સુખ-દુઃખના સાથી બની રહીને સૌનો સાથ પરિવારનો વિકાસના સુત્ર સાથે સર્વ ઉપસ્થિત સભ્યોએ સુર મેળવ્યો હતો.

શ્રી અખિલ ભારતીય ઠાકરાણી પરિવારની કારોબારી મંડળની મુદત પુરી થતાં આગામી ત્રણ વરસ માટેની નવી કારોબારીની નિમણુક કરવા બાબતે ચર્ચા થતા સર્વાનુમતે નવી કારોબારીની નીચે પ્રમાણે નિમણુક કરવામાં આવેલ હતી.

પ્રમુખ શ્રી : કાંતીલાલ રવજીભાઇ ઠાકરાણી-વિજયદુર્ગ, ઉપપ્રમુખ શ્રી : વિઠ્ઠલભાઇ માવજીભાઇ ઠાકરાણી - ખારઘર, બેચરભાઇ ભીમજીભાઇ ઠાકરાણી - ભડલી, મહામંત્રીશ્રી : શાંતિલાલ કરસનભાઇ ઠાકરાણી - મુંબઇ, મંત્રીશ્રી : ઝવેરભાઇ ડાયાભાઇ ઠાકરાણી - ભાલેજ, સહમંત્રીશ્રી : પ્રદિપભાઇ કાંતિલાલ ઠાકરાણી - ભુજ, ખજાનચી : લીલાધરભાઇ ભીમજીભાઇ ઠાકરાણી - ભુજ, સહખજાનચી : તુલસીદાસ પેથાભાઇ ઠાકરાણી - શક્તિગડ, રમણીકલાલ રવજીભાઇ ઠાકરાણી - પડેલ, વિઠ્ઠલભાઇ કરસનભાઇ ઠાકરાણી - તળેબજાર, ઑડિટર : કાંતિલાલ મનજીભાઇ ઠાકરાણી - જલગાંવ પ્રતિનિધિ : રમણીકલાલ ઠાકરાણી -દેવગડ

હૈદ્રાબાદ મુકામે કોટડા (જ.) પાટીદાર યુવક મંડળ દ્વારા આગામી ૩,૪,૫,૬ મેં ૨૦૧૮માં ઉજાવનાર ત્રિવેણી મહોત્સવની આયોજન સમિતિની મીટીંગ



તા.૧૭.૯.૧૭ ના રોજ હૈદ્રાબાદ મુકામે કોટડા (જ.) પાટીદાર યુવક મંડળ દ્વારા આગામી ૩,૪,૫,૬ મેં ૨૦૧૮માં ઉજાવનાર ત્રિવેણી મહોત્સવની આયોજન સમિતિની મીટીંગ હૈદ્રાબાદ સિંકન્દ્રાબાદ કોટડા વાસી સમાજના યજમાન પદે યોજવામાં આવેલ.

ભારત ખૂણે ખૂણેથી વધારે આયોજન સમિતિના સભ્યો તથા કોટડા વાસીઓનું દુપટ્ટા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું.

સવારના સેસનમાં મીટીંગમાં સંપૂર્ણ કાર્યક્રમની ગોઠવણી તથા રુપરેખા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

વિવિધ સમિતિઓ ના કન્વીનરો પાસે કાર્યના અહેવાલ તથા પ્લાનીંગ વિશે ચર્ચા કરવામાં આવી.

બપોર પછીના સેસનમાં હૈદ્રાબાદ સિંકન્દ્રાબાદ કોટડા દ્વારા સમાજનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભારતના ખૂણે ખૂણેથી પધારેલ કોટડા વાસીઓને સામેલ કરવામાં આવ્યા.

આયોજન સમિતિ દ્વારા ત્રિવેણી મહોત્સવ સંપૂર્ણ માહિતી આપવામાં આવે.

સાંજેનું પ્રીતી ભોજન કરી સ્નેહમિલનનું સમાપન કરવામાં આવ્યું.

મિટીંગનું આયોજન કરવા બદલ મહોત્સવના પ્રમુખ શ્રી અરવિંદભાઇ રુડાણી સૂચન થી મહામંત્રી શ્રી હરેશ વેલાણી એ આભાર માનેલ.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મધ્ય મહારાષ્ટ્ર ઝોન દિપાવલીની મંગલ કામના અને નૂતન વર્ષાભિનંદન

દિપોત્સવીના દિવડાઓ માત્ર આપનાઘરના આંગણે જ નહી પણ આપના પારિવારીક જીવનને પણ પ્રકાશથી ભરી દે અને નૂતન વર્ષનું નવલું પ્રભાત આપના માટે આશાનું નવું કિરણ લઈને પ્રગટે અને આપના જીવનમાં નવો ઉન્મેષ અને ઉલ્લાસ ભરી દે એવી શુભકામના.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મધ્ય મહારાષ્ટ્ર ઝોનની ચાલીસગાંવ પાટીદાર ભવન ખાતે તા.૧૬.૭.૨૦૧૭ રવિવારના રોજ ત્રિવાર્ષિક સામાન્ય સભા મળેલ જેમાં આપણા ઝોનના ભવ્ય ભૂતકાળને નજરમાં રાખીને આધુનિક વર્તમાન સમય સાથે કદમ મીલાવી સમાજ વિકાસના કાર્યમાં તન મન ધનથી સેવા આપે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેવા હેતુ અને અપેક્ષા સાથે નવી કારોબારીની નિમણુક કરવામાં આવી.

ભૂતકાળમાં પણ કેન્દ્રીય સમાજ દ્વારા જે કાર્યો કે આદેશ કરવામાં આવેલ તેનું સંપૂર્ણ પણે પાલન ઝોન દ્વારા કરવામાં આવેલ હાલમાં જે કેન્દ્રીય સમાજના નવા કર્મધારો નિમણુક થયેલ છે તેઓ દ્વારા જે કાર્ય સોંપવામાં આવશે તેને પૂર્ણ કરવાનો મારો પ્રયત્ન રહેશે.

ઝોનના માધ્યમથી નાસિક, અહેમદનગર, મરાઠવાડા,ખાન્દેશ, વિભાગમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. જેમાં વિશેષ ફાળો યુવા સંઘ તથા મહિલા સંઘ ના કાર્યકર્તા નો હોય છે હાલમાં જ કચ્છ રીજીયનથી કૃષિ મીત્રો મધ્ય મહારાષ્ટ્ર ઝોનમાં આવેલ ખેતી વિકાસ કેન્દ્રો જલગાંવ, ઔરંગાબાદ, રાહુરી નાસિકની મુલાકાતે આવેલ અને આધુનિક ખેતી પદ્ધતિની જાણકારી મેળવી. શ્રી ઉમા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી સતરાવાલા ઉમા વિદ્યાપીઠ વલથાન, સુરત ખાતે તા.૨૩,૨૪,૨૫ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ શ્રી સમાજના સામાજીક અને શૈક્ષણીક પાસાઓને સાંકળી લેતી ઈવેન્ટો એસ.યુ.વી નોલેજ કાર્નિવલનું આયોજન થવા જઈ રહ્યું છે તેમાં મ.મહાઝોન સમાજમાંથી ઘણા યુવક, યુવતીઓ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવવા આતુર છે. તેમજ આપણી સમાજમાં જે સગપણની સમસ્યા છે તેના નિરાકરણ માટે મધ્ય મહારાષ્ટ્ર ઝોન, મધ્ય મહારાષ્ટ્ર રિજીયન અને નાસિક જીલ્લા સમુહ લગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે દ્વારા ૧૫ વર્ષથી ઉપરના યુવક યુવતીના બાયોડેટા સાથે પરિચયથી પરીણય પુસ્તીકા રુપે પ્રકાશીત કરવા જઈ રહ્યા છીએ તે આપણી સમાજ માટે ઉપયોગી સાબિત થશે સર્વ ક્ષેત્રમાં સફળતા આપની સહચારી બની રહે અને આપ યશસ્વી અને તેજસ્વી બનો એવી માઁ ઉમિયા શક્તી પ્રદાન કરે એવી પ્રાર્થના સહ ફરી એક વખત નવા વર્ષની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન..

શ્રી અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મધ્ય મહારાષ્ટ્ર ઝોન
પ્રમુખ : ખેતશી લખમશીભાઇ રવાણી
મહામંત્રી : શ્રી હસમુખ કરસનભાઇ છાભૈયા
એવં સમસ્ત હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ ઝોનની ઘટક સમાજો.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પુના ઝોન

દિપાવલીની શુભકામના એવમ નૂતનવર્ષ ના હાર્દિક અભિનંદન

વિક્રમ સવંત ૨૦૭૪ નું નુતન વર્ષ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સર્વે જ્ઞાતિજનો માટે સુખદાયી, લાભદાયી, અને મંગલદાયી બની રહે અને જ્ઞાતિજનોમાં સ્નેહ, સેવા અને સહકારની ભાવના સાથે સામાજીક એકતા જળવાઈ રહે એવા શુભ આશિષ સાથે દિપાવલી અભિષ્ટચિંતન એવમ શુભકામનાઓ સહ નવાવર્ષના હાર્દિક અભિનંદન મોકલાવીએ છીએ, તેમજ નવ નિર્વાચિત શ્રી અ. ભા. ક. ક. પા. સમાજ નખત્રાણા ની કારોબારી સમિતિ ને ભવિષ્યની યોજનાઓ માટે શુભેચ્છા.

પુના ઝોન હોદ્દેદારશ્રીઓ (વર્ષ ૨૦૧૭-૨૦૨૦)


પ્રમુખ
શ્રી પુરુષોત્તમ પોકાર


ઉપ પ્રમુખ
શ્રી સોમજી દિવાણી


મહામંત્રી
પ્રો. ડો. પુરુષોત્તમ પોકાર


મંત્રી
શ્રી હંસરાજ પોકાર


ખજાનચી
શ્રી દેવશી પોકાર


સહ ખજાનચી
શ્રી ડાહ્યાલાલ સેંઘાણી


પુના ઝોન અંતર્ગત સમાજો

પુના સમાજ


પ્રમુખ
શ્રી ખીમજી દડ્ગા
પ્રમુખ-ન્યાય સમિતિ,પુનાઝોન


મંત્રી
શ્રી ચતુરલાલ લિંબાણી

પિંપરી-ચિંચવડ સમાજ


પ્રમુખ
શ્રી જયંતીલાલ લિંબાણી


મંત્રી
શ્રી મોહનલાલ છાભૈયા

કોંઢવા સમાજ


પ્રમુખ
શ્રી લખમસી સેંઘાણી
ઉપપ્રમુખ-ન્યાય સમિતિ,પુના ઝોન


મંત્રી
શ્રી ડાહ્યાલાલ સેંઘાણી

બારામતી સમાજ


પ્રમુખ
શ્રી ડાહ્યાલાલ સાંખલા


મંત્રી
શ્રી મણીલાલ પજવાણી

અકલુજ-પંઢરપુર સમાજ


પ્રમુખ
શ્રી સોમજી ચૌહાણ


મંત્રી
શ્રી માવજીભાઈ ચૌહાણ

સોલાપુર સમાજ


પ્રમુખ
શ્રી રતનશી ભાવાણી


મંત્રી
શ્રી છગનલાલ ચૌધરી


દૌંડ-ચૌફુલા સમાજ


પ્રમુખ
શ્રી રામજી પોકાર


મંત્રી
શ્રી રમણીકલાલ પોકાર

ભીમાશંકર પાટીદાર સમાજ


પ્રમુખ
શ્રી રતનશીભાઈ ચૌધરી


મંત્રી
શ્રી ડાહ્યાભાઈ સાંખલા

નારાયણગાંવ-આળેફાટા સમાજ


પ્રમુખ
શ્રી નાનજીભાઈ ગોરાણી


મંત્રી
શ્રી તેજાભાઈ દિવાણી

પુના મુકામે શ્રી પાટીદાર સમાજ દ્વારા મહા. રાજ્ય વિધાનસભા વિધાયક શ્રી ચંદુભાઈ રૂડાણી નો સન્માન સમારોહ યોજાયો

પુણ્ય નગરી પુના મુકામે શ્રી પાટીદાર સમાજ પુના દ્વારા દર વર્ષે યોજાતો સરસ્વતી સન્માન સમારોહ આ વર્ષે ૨૭ ઑગસ્ટના રોજ પાટીદાર ભવન પુના મુકામે યોજાઈ ગયેલ જેમાં આપણી જ્ઞાતિના જલગામના સભાસદ એવા ભાઈ શ્રી ચંદુલાલ વિશ્રામભાઈ રૂડાણી જેઓ હાલ ભારતીય જનતા પાર્ટી તરફથી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભાસદ છે તેમનું સન્માન પાટીદાર સમાજ પુના તરફથી કરવામાં આવેલ.



સવારના શરુ થયેલ સરસ્વતી સન્માન સમારોહની દરમ્યાન બપોરના ૧૧-૩૦ કલાકે વિધાયાકશ્રી, ચંદુભાઈ રૂડાણી નું જલગામ (મહા.) બાય રોડ થી સીધું આગમન પાટીદાર ભવનમાં થતાંજ તેમનુ તેમજ તેમના સહકારીઓનું તાલીઓના ગડગડાટથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને ડાયસ પર સ્થાન આપવામાં આવ્યું.

સમાજના મંત્રીશ્રી ચતુરલાલ રતનશીભાઈ લિંબાણીએ પુના સમાજના જ્ઞાતિજનોને શ્રીમાન ચંદુભાઈનો પરિચય આપતા કહ્યુંકે તેઓ શ્રી કચ્છ માં દેવપર-યક્ષ ના વતની છે. તેમના પિતાશ્રી ૧૯૬૫માં ધંધાર્થે જલગામ (મહા.) સ્થાયી થયેલ. તેમના પિતાજીના સમયથી વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલ હોવાના કારણે ભારતીય જનતા પક્ષ સાથે રાજકીય રીતે જોડાયેલ છે. તેમજ તેમના મોટાભાઈશ્રી યશવંતભાઈ જલગામ નગરપાલિકામાં બે વખત નગર સેવક તરીકે ચૂંટાઈને સફળતાપૂર્વક સેવાઓ આપેલ છે. આજે પણ તેમનો સમગ્ર રૂડાણી પરિવાર સ્થાનિક તેમજ કેન્દ્રીય લેવલે અનેક દિગ્ગજ રાજકીય હસ્તીઓ સાથે અંગત નિકટતા ધરાવે છે. જે સમાજના માટે એક ગૌરવની વાત છે. વખત પડ્યે સંકટ સમયે આપણા ભાઈઓને વિના સંકોચે અવિલંબ મદદ માટે તેમનો પરિવાર હંમેશા તત્પર હોય છે.

શ્રી ચંદુભાઈનો અભ્યાસ હાયર સેકેન્ડરી સુધીજ થયેલ છે પરંતુ ભાજપમાં શરૂઆતથી જોડાયેલ હોવાથી અને મૃદ્ભાષી હોવાના કારણે તેમજ તેની રાજકીય સુજબુજ ઉચ્કોટીની હોવાના કારણે નવેમ્બર ૨૦૧૬માં જલગામ વિધાન પરિષદની બેઠક પર ભારે બહુમતથી ચુંટાઈ આવેલ છે. ગુજરાત (કચ્છ) ના વતની પરપ્રાંતમાં વિધાન સભ્યનો ઉચ્ચ હોદા પરની વરણી ને લીધે આપણી કેન્દ્રીય સમાજનું ગૌરવ વધારેલ છે, જે આપણી જ્ઞાતિજનો માટે ઘણાજ ગૌરવની વાત છે. સ્થાનિક પાટીદાર સમાજ, ગુજરાતી સમાજ, અન્ય સંસ્થાઓ તેમજ વિવિધ બેન્કોમાં ચેરમેન તરીકેની સેવાઓ આપી રહેલ છે. કેન્દ્રીય યુવાસંઘના મિસન ૨૦૨૦ ને રાજકીય ક્ષેત્રે આપના જેવા મહાનુભાવો સાર્થક કરશે તેમજ રાજકીય ક્ષેત્રે પદાપર્ણ કરવા થનગનતા આપણી સમાજના અન્ય અનેક યુવતીઓ-યુવાનો માટે આપ પ્રેરણા અને આદર્શ મૂર્તિ બની રહેશો. તેમનો નાનો સુપુત્ર રોહિત ક્રિકેટ ક્ષેત્રે રાષ્ટ્રીય લેવલે સારી નામના મેળવેલ છે અને હાલ તેનું સિલેકશન રણજી ટ્રોફી ક્રિકેટ એસોસિએશન, મુંબઈ ખાતે થયેલ છે. જલગામ ખાતે તેમનો પરિવાર વિવિધ વ્યવસાયોથી જોડાયેલ છે.

આવા બહુઆયામી પ્રતિભા ધરાવ-તા શ્રી ચંદુભાઈ રૂડાણી આજે આપણી પુના સમાજના આમંત્રણને માન આપી આ સમારોહમાં પધારેલ છે. જે આપણા સૌ માટે અતિ આનંદ અને ગર્વની વાત છે. ત્યારબાદ સમાજના પ્રમુખશ્રી, ખીમજીભાઈ દડ્ગા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, કરસનભાઈ છાભૈયા તેમજ પુના ઝોનના પ્રમુખશ્રી, પુરૂષોત્તમભાઈ પોકારના વરદ હસ્તે શાલ ઓઢાડી, શ્રીફળ, મોમેન્ટો અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શ્રી ચંદુભાઈએ પોતાના પ્રાસ્ત-વિક ભાષણમાં કહ્યુ કે પુના સમાજ દ્વારા યોજાયેલ પ્રથમ વખત આવા સરસ્વતી સમારોહમાં મને બોલાવી મારું જે સન્માન કર્યુ તે બદ્દલ હું આપ સૌનો ઋણી છું. મારી અત્યાર સુધીની કારદીકીમાં પ્રથમ વખત સરસ્વતી સમારોહમાં મને સન્માનિત કરવામાં આવ્યો છે જે મારા માટે ગૌરવની વાત છે. મે પોતે હાયર સેકેન્ડરી સુધી અભ્યાસ કરેલ હોવાના કારણે શિક્ષણનું મહત્વ કેટલું જરૂરી છે તે સમજાય છે મારી વિદ્યાર્થી ભાઈ-બહેનોને વિનંતી છે કે શિક્ષણમાં હંમેશા ધ્યેય ઊંચું રાખજો જેથી જગતના કોઈપણ સ્થાન પર પહોંચી શકશો. માતાઓને મારી નમ્ર વિનંતી કે પોતાના સંતાનો ને અમુકજ ટકા લાવો તેવું ન કહેતા જે લાવે તેનામાં ખુશ રહેજો અને તેને જે સેક્ટરમાં રૂચી હોય તેમાં પ્રોત્સાહન આપશો જેથી તે પોતાના પરિવારનું તેમજ સમાજનું નામ રોશન કરે. મારા જેવું કોઈપણ કામ હોય તો અડધી રાત્રે પણ નીઃસંકોચ ફોન દ્વારા જણાવશો હું જરૂરથી મદદરૂપ થઈશ જે મારા માટે ગૌરવની વાત હશે.

ત્યારબાદ પાટીદાર ભવનમાં આવેલ મંદિરમાં શ્રી ચંદુભાઈ તેમજ તેમના સાથી મિત્રોના વરદ હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરવામાં આવી તેમજ પ્રસાદ ગ્રહણ કરેલ. પુના પાટીદાર સમાજ દ્વારા રાખવામાં આવેલ સ્વરૂચી ભોજનનો આસ્વાદ સૌ કોઈએ માનેલ ત્યારબાદ પ્રતિષ્ઠિત સભાસદો સાથે મુક્ત પણે ચર્ચા-વિચારના પણ કરેલ.

પ્રતિનિધિ :- શ્રી કૃષ્ણકુમાર રવજીભાઈ વાગડીયા પુણે

॥સનાતન પરમોધર્મ ॥

॥ स्वस्थ माता स्वस्थ भारत ॥

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા અનુમોદિત સ્વાસ્થય જાગૃતિ અભિયાન

'Prevention is Better Then Cure'

જય લક્ષ્મીનારાયણ સહ જણાવવાનું કે

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા અનુમોદિત ॥ स्वस्थ माता स्वस्थ समाज ॥ સ્વાસ્થય જાગૃતિ અભિયાન ના માધ્યમથી ભારતભરમાં ફેલાયેલ આપણી KKP સમાજોમાં જઈ મહિલાઓમાં થતાં જાનલેવા ગર્ભાશય કેન્સર બાબત સાચી સમજણ, વેક્સીનેસન અને શિક્ષણ થી રોકથામ કરી સ્વસ્થ માતા થી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ સમાજથી સ્વસ્થ ભારત બનાવવાની દિશામાં એક નવતર રચનાત્મક પગલાં પાડી પહેલ કરેલ છે. આ ॥ स्वस्थ माता स्वस्थ समाज ॥ અભિયાન દ્વારા અમોએ સ્વેછીક રીતે સેવા ભાવનાથી વિવિધ સમાજોમાં જઈ જાગૃતિ લાવવાનું નક્કી કરેલ છે. શ્રી કચ્છ પાટીદાર સમાજ નાગપુરથી શરૂઆત થયેલ આ અભિયાન મધ્ય ભારતમાં સફળતાપૂર્વક લાગુ કરાવ્યા બાદ હવે આપણી કેન્દ્રીય સમાજ દ્વારા અનુમોદન અને સમર્થન મળેવી તેના બેનર હેઠળ આ કાર્ય કરી રહ્યા છીએ.

અત્યાર સુધી મધ્ય ભારતના ઝોનમાં વિવિધ સમાજોમાં ॥ स्वस्थ माता स्वस्थ समाज ॥ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં પ્રત્યક્ષ રીતે ૧૧૦૦ કરતાં વધારે કુંવારી દીકરીઓ અને મહિલાઓને ગર્ભાશય કેન્સર થી બચાવ ના વેક્સીન અપાવેલ છે. અને પરોક્ષ રીતે આ અભિયાન દ્વારા અન્ય સમાજોમાં પણ આ જાનલેવા મહારોગથી બચાવવાના વેક્સીન અપાયેલ છે. અમો સામાજિક રીતે સેવાભાવથી આ કાર્ય હાથ ધરવા પહેલાં કલકત્તાના 'તારા કેન્સર ફાઉન્ડેશન'ના ભગવાનભાઈ ધોળુ, તેમના સહયોગી ડૉ. અંશુમનકુમાર, નાગપુરના કેન્સર વિશેષજ્ઞ ડૉ. સુશીલ માનધનિયા, આપણા ડૉ. રમેશ ભગત, ડૉ. વિપુલ છાભૈયા રાજકોટની સલાહ સૂચન અને માર્ગદર્શન મેળવી આ વિષય સમજી, તેનો યથા શક્ય અભ્યાસ કરી આ જાનલેવા કેન્સરથી આપણી જ્ઞાતિમાં મહિલાઓને બચાવવાનો નમ્ર પ્રયાસ શરુ કરેલ છે. અમારા અત્યાર સુધીના જાત અનુભવ અને આ રોગ બાબત મેડીકલ રીપોર્ટ અને ઈન્ટરનેટ થી મેળવેલ માહિતીઓનું સંકલન કરી તેના આધારે તૈયાર કરેલ પોગ્રામને વિવિધ સમાજોમાં પ્રોજેક્ટર દ્વારા VDO Clip બતાવી, કેન્સર થી બચાવ માટે સ્વચ્છતા, પરીક્ષણ અને શિક્ષણથી બચાવ તકેદારી અને વેક્સીનેસન થી કાયમી સુરક્ષા બાબત જાણકારી આપી Cervical Cancer વિષે જાગરૂકતા લાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ વિષયે પશ્ર્નોત્તરી થી યથા સંભવ શંકાઓનું સમાધાન કરી, સામાજિક રીતે સમૂહમાં આયોજન દ્વારા આર્થિક રીતે પ્રતિ દીકરી-મહિલા ના ખર્ચમાં ૩૦ ટકા જેટલી બચત કરાવી શકાય તેવું આયોજન થઇ શકે તેની સવિસ્તાર માહિતી આપી આ સ્વાસ્થય જાગૃતિ અભિયાનને યશસ્વી બનાવવા પ્રયત્નશીલ છીએ. આ સ્વાસ્થય જાગૃતિ અભિયાન માટે અમોએ ભારતના દક્ષિણપૂર્વની સમાજોના જવાબદારો સાથે પૂર્વ નિયોજિત આયોજન કરી નીચે પ્રમાણેની સભાઓનું આયોજન કરેલ હતું તેનો અહેવાલ અહીં પ્રસ્તુત છે.

1. તા.૧૩.૯.૨૦૧૭ના નાગપુર થી નીકળી તા ૧૪.૯.૨૦૧૭ના નિશ્ચિત સમયથી ૬ કલાક મોડે બપોરે ૧ વાગે ભુવનેશ્વર પહોચ્યા હતા. પછાડના ૪ વાગે બાજુના ટ્વિન સીટી અને બન્ને તરફ મહાનદીથી ઘેરાયેલ કટક શહેરમાં શ્રી કાંતિભાઈ ડાયાણી ના ઘરે પૂર્વ નિર્ધારિત આયોજન મુજબ કટક સમાજની બધી દીકરીઓ અને મોટી બહેનો હાજર રહી હતી. અમારા આ પ્રથમ પ્રયાસમાં મહિલાઓમાં જીજ્ઞાસા, ઉત્સુકતા અને સભાના અંતે સમાધાન જોઈ અમારો ઉત્સાહ વધ્યો હતો. સ્થાનિક સમાજ પ્રમુખશ્રી કાંતિભાઈ ડાયાણી, મંત્રીશ્રી ચંદુભાઈ ખેતાણી, મહીલામંડળ પ્રમુખશ્રીમતી લીલાબહેન ડાયાણી, મંત્રી શ્રીમતી ચંચળબહેન દીવાણી, યુવકમંડળ પ્રમુખશ્રી દિનેશભાઈ ડાયાણી, મંત્રીશ્રી શાંતિલાલ છાભૈયા એ સભાના આયોજન માટે તૈયારી તેમજ સહયોગ કરયો હતો.
2. તા.૧૪.૯.૨૦૧૭ની રાત્રે ઓડીશાની રાજધાની ભુવનેશ્વર સમાજની સભા હિમત્તભાઈ ખેતાણીના નિવાસ સ્થાને મળેલ હતી આ સભા આયોજનમાં સ્થાનિક સમાજ પ્રમુખશ્રી કાંતિભાઈ લીંબાણી, મંત્રીશ્રી હિમત્તભાઈ ખેતાણી, ઓડીસા ઝોન પ્રમુખશ્રી પુરષોત્તમ ભાઈ લીંબાણી, ઝોન મંત્રીશ્રી ઈશ્વરભાઈ રૂડાણી, મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી લીલાબહેન લીંબાણી, મંત્રી શ્રીમતી જયાબહેન ભાવાણી, યુવકમંડળ પ્રમુખશ્રી હિંમતલાલ ધોળુ, મંત્રીશ્રી લલીતભાઈ લીંબાણી તેમજ અહી પ્રેકટીસ કરતા ડૉ. દેવરામભાઈ છાભૈયાનો વિશેષ સહયોગ મળ્યો હતો. બીજા દિવસે અમો વિશ્વપ્રસિદ્ધ સૂર્યમંદિર કોણાર્ક, પુરી માં જગન્નાથ મંદિરના દર્શન અને બીચનો આનંદ માણ્યો હતો. ભુવનેશ્વર-કટક યાત્રા દરમ્યાન સ્ટેશને ઉતરાવી, રહેઠાણ, ફરાવવા અને પરત ગાડીમાં બેસાડવામાં સમાજના પ્રમુખ કાંતિભાઈ લીંબાણીએ પોતાના અતિ વ્યસ્ત સમયમાંથી બે દિવસ અમારા માટે ફાળવ્યા હતા.
3. તા.૧૬.૯.૨૦૧૭ના સવારે ભુવનેશ્વરથી નીકળી રેલ્વે દ્વારા બપોરે ૩ વાગે આંધ્રપ્રદેશના મુખ્ય અને સ્વચ્છ શહેર વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા. સવારે વિશાખાપટ્ટનમ દર્શન કર્યા બાદ રવિવાર ૧૭.૯.૨૦૧૭ના પછાડ ૪ વાગે પાટીદાર ભવનમાં સભા રાખવામાં આવેલ હતી. અમારી આ યાત્રા દરમ્યાન સૌથી વિશાળ સંખ્યા ધરાવતી સમાજમાં હાજરી પણ તેના પ્રમાણમાં બહોળી સંખ્યામાં રહી હતી. સભાના અયોજન વ્યવસ્થા સ્થાનિક સમાજ પ્રમુખ શ્રી ગંગારામભાઈ વાડિયા, મંત્રીશ્રી જયંતીભાઈ સેંઘાણી, મહિલામંડળ પ્રમુખ શ્રીમતી કાન્તાબહેન રૂડાણી, મંત્રી શ્રીમતી પ્રેમીલાબેન સાંખલા, યુવક મંડળ પ્રમુખશ્રી તુલસીભાઈ રામાણી, મંત્રીશ્રી જયંતીભાઈ દીવાણી તેમજ બેચરભાઈ પોકાર, ચંદુભાઈ પોકાર, ઝવેરભાઈ ભગત, હંસરાજભાઈ દીવાણી, અને મનસુખભાઈ પોકારનો વિશેષ સહયોગ મળ્યો

હતો. વિશાખાપટ્ટનમમાં સ્ટેશને ઉતરાવી રહેઠાણ, ફરાવવા અને પરત ગાડીમાં બેસાડવાની તમામ વ્યવસ્થા શ્રી કમલેશ બેચરભાઈ પોકારે કરી હતી.

4. તા.૧૯.૯.૨૦૧૭ના સવારે વિશાખાપટ્ટનમ થી રેલ્વે દ્વારા નયનરમ્ય આરકુ વેલી થી પસાર થઇ અમો સાંજે જગદલપુર પહોંચ્યા હતા. અહિ સમાજ પ્રમુખશ્રી વાલજીભાઈ રૂડાણી, મહિલામંડળ પ્રમુખ શ્રીમતી કાન્તાબહેન નાયાણી અને યુવકમંડળ પ્રમુખશ્રી અશોકભાઈ નાયાણી સાથે મુલાકાત કરી આ અભિયાનની સંપૂર્ણ માહિતી આપી હતી. પાછલા વર્ષે છત્તીસગઢ ઝોનમાં થયેલ વેક્સીનેસન કાર્યક્રમમાં જગદલપુર સમાજમાં આ બાબતે પહેલાં થી માહિતી હતીજ. બીજા દિવસે અહીના પ્રસિદ્ધ તીર્થગઢ અને ચિત્રકોટ વોટરફોલના અદ્ભુત દ્રશ્યને માણ્યું હતું. જગદલપુર યાત્રા દરમ્યાન સ્ટેશને ઉતરાવી રહેઠાણ ફરાવવા અને પરત ગાડીમાં બેસાડવાની વ્યવસ્થા સ્થાનિક પાટીદાર અને સમસ્ત ગુજરાતી સમાજના પ્રમુખશ્રી વાલજીભાઈ રૂડાણીએ કરી હતી.

5. રાત્રે ૮ વાગે છત્તીસગઢ રાજ્યના જગદલપુર-બસ્તરના નક્સલવાદ પ્રભાવિત વિસ્તારમાંથી રોમાંચિત બસયાત્રા કરી તા. ૨૦.૯.૨૦૧૭ના સવારે તેલંગાણાના ખમ્મામ પહોચ્યા હતા. અહીં બપોરબાદ ૪ વાગે શ્રી ડાહ્યાભાઈ છાભૈયાના નિવાસ સ્થાને સભાનું આયોજન કર્યું હતું. ભણતર અને સંગઠનની દ્રષ્ટીએ વિશેષ સ્થાન ધરાવતી આ સમાજમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. સ્થાનિક સમાજ પ્રમુખશ્રી સુરેશભાઈ ધોળુ, મંત્રીશ્રી કેશવલાલ ધોળુ, તેલંગાણા આંધ્રપ્રદેશ ઝોન પ્રમુખશ્રી છગનભાઈ ધોળુ, મંત્રીશ્રી વસંતભાઈ ડાયાણી, મહિલામંડળ પ્રમુખ શ્રીમતી વિમળાબહેન રુડાણી, મંત્રી શ્રીમતી ગંગાબહેન પોકાર, યુવકમંડળ પ્રમુખશ્રી વિનોદ પોકાર, મંત્રીશ્રી જયંતીલાલ ધોળુ તેમજ શ્રીડાહ્યાભાઈ છાભૈયા અને પબ્લિક પ્રોસ્યુકેટર એડવોકેટ શ્રી દિનેશભાઈ રૂડાણીનો વિશેષ સહયોગ મળ્યો હતો. આ અમારી સ્વાસ્થય જાગૃતી અભિયાનનું પાંચમું અને અંતિમ ઠેકાણું હતું.

અમારી આ અખિલ ભારતીય કક્ષાની પ્રથમ સ્વાસ્થય જાગૃતિ યાત્રા દરમ્યાન અમે ઓડીસા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા ૪ રાજ્યની પાંચ સમાજોની મુલાકાત પહેલાં અમોએ પહેલાથી Cervical Cancer Awareness Protection & Prevention ગર્ભાશય કેન્સરની જાગૃતિ, બચાવ અને તકેદારી માટેના Vaccine બાબત WHO વિશ્વ સ્વાસ્થય સંસ્થા નો મેડીકલ રીપોર્ટ, અમારા અત્યાર સુધીના વેક્સીનેસનના અહેવાલ પહેલાંથી સમાજના જવાબદારોને મોકલાવી દીધા હતા. આ બાબતે સ્થાનિક મહિલારોગ અને કેન્સરરોગ વિશેષજ્ઞ ડોક્ટરની સલાહ લઇ આ વેક્સીનેસન કરાવવાની ભલામણ કરેલ હતી. આ વિસ્તારમાં આ વિષયે તારા કેન્સર ફાઉન્ડેશનથી મળેલ જાણકારી અને સ્થાનિક ડોક્ટરની સલાહ સૂચન મુજબ આ વેક્સીનેશન લાગવવાની કેવળ સલાહ નહિ પણ તે જરૂરી છે તેવી મહિલારોગ વિશેષજ્ઞની ભલામણ મળેલ હતી એટલે અમારું કાર્ય સરળ થયું હતું. વેક્સીનેસન આવનાર દિવસોમાં 3 ડોઝના સમયનું આયોજન કરી લગાવવાના છે. આ સ્વાસ્થ જાગૃતિ અભિયાન સાથે સમય મળતા સમાજિક સમસ્યા, તેના સમાધાન અને વિચારોની આપ લે પણ થઇ હતી. તે દિશામાં યોગ્ય પરિણામ માટે વૈચારિક જાગરૂકતા પણ અનિવાર્ય છે. અમારા આ પ્રથમ પ્રયાસમાં મહિલાઓમાં જીજ્ઞાસા, ઉત્સુકતા અને અંતે સમાધાન જોઈ અમારો ઉત્સાહ બેવડાયો છે.

અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આ અભિયાન સ્વાસ્થ સાથે સંકળાયેલ છે, અમો કોઈ આ વિષયના નિષ્ણાંત કે ડોક્ટર નથી માટે આ વેક્સીનેસન બાબતે સ્થાનિક મહિલારોગ અને કેન્સરરોગ વિશેષજ્ઞ ડોક્ટરની સલાહ સુચન લઇ આ વેક્સીનેસન કરાવવાની ભલામણ કરીએ છીએ. સ્વાસ્થય જાગૃતિ અભિયાન દરમ્યાન બહેનોએ સ્વાસ્થય બાબત જીજ્ઞાસા વ્યક્ત કરી હતી કે આપણી જ્ઞાતિની મહિલાઓના ખૂનમાં હિમોગ્લોબીન ની કમી કેમ જણાય છે? અને તેના જેવા અન્ય સામાન્ય સ્વાસ્થય બાબત પ્રશ્નો પૂછ્યા હતા તેમના પ્રશ્નોના અમે અમારા સામાન્ય જ્ઞાન દ્વારા આંશિક સમાધાન કર્યું હતું પણ અમને એમ લાગે છે કે આજે સામાન્યતઃ ડોક્ટરોની વ્યવસાયિક મેડીકલ પ્રેક્ટીસ માં Prevention & Protection કરતાં Cure કરવાની ભાવના જ મુખ્યતઃ દેખાય છે. Prevention કે Protection વિષે કાંઇ કહેવાતું જ નથી. જયારે Health માટે એમ કહેવાય છે કે Prevention is Better Then Cure માટે જો સમાજમાં સ્વાસ્થય બાબતે Prevention ની જાગરૂકતા લાવવામાં આવે તો પાછળથી Cure કરવાના અતિ ખર્ચાળ ઉપચારમાં ઘટાડો કરી સમાજમાં રચનાત્મક કાર્ય કરી શકાય તેવું અમને લાગે છે. આ બાબતે આપણી સમાજના ડોક્ટર મિત્રોનો સાથ સહકાર અને માર્ગદર્શન અપેક્ષિત છે. અમે નામના ની કામના વગર કેવળ અને કેવળ સેવાભાવથી પ્રેરાઈ આ વ્રત લીધું છે. માનવતાના આ કાર્ય માટે અમારી અપેક્ષા છે કે આ સ્વાસ્થય જાગૃતિ અભિયાન ઝોન માધ્યમથી દરેક ઘટક સમાજોમાં થાય તેમાટે ઝોનના જવાબદાર ભાઈઓએ પહેલ કરવી જોઈએ. આપણાં ગોત્ર પરિવારમાં નીયાણી ભેટ તરીકે સ્વાસ્થય સુરક્ષાનું આ નવતર ઘરેણું પહેરાવી સ્વસ્થ માતા થી સ્વસ્થ સમાજ બનવવાનું રચનાત્મક કાર્ય કરી શકાય. આ કાર્ય અમે એકલાજ કરી લેશું તેવું પણ નથી આ સતત ચાલુ રાખવાનું સહિયારું કાર્ય છે. સેવાભાવી ભાઈઓ આમાં સહભાગી બને તે અપેક્ષિત અને આવકાર્ય છે.

ટીમ

॥ स्वस्थ माता स्वस्थ समाज ॥

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

સંપર્ક: Ramesh Limbani : 94228 01695, 86691 80846 rspngp@yahoo.com
Valjibhai Diwani : 94228 01438 vavaghani@gmail.com
Jiwarajbhai Ramani : 97666 32421 pateljiwaraj@gmail.com

वेबपेज Swasth Mata Swasth Bharat: https://www.facebook.com/healthysamaj/
वेबग्रूप ॥ स्वस्थ माता स्वस्थ भारत ॥

Shri Kutch Kadva Patidar Samaj

Mapusa - Goa

વર્તમાન કારોબારી સમિતી



પ્રમુખશ્રીઃ શ્રી શાંતિભાઇ ગોપાલભાઇ નાકરાણી, ઉપપ્રમુખશ્રીઃ શ્રી વિઠ્ઠલભાઇ જેઠાભાઇ પોકાર, મહામંત્રીશ્રીઃ શ્રી જયંતીલાલ હરીભાઇ પોકાર, સહમંત્રી : શ્રી દામોદરભાઇ જીવરાજ ભાવાણી, સહમંત્રીઃ શ્રી જગદીશ પ્રેમજીભાઇ નાકરાણી, ખજાનચીઃ શ્રી અમૃતલાલ શિવજીભાઇ રામાણી, સહખજાનચીઃ ધનજીભાઇ દાનાભાઇ પોકાર, સભ્યશ્રીઓઃ શ્રી મનજીભાઇ દાનાભાઇ પોકાર, શ્રી સામજીભાઇ જીવરાજભાઇ ભાવાણી, શ્રી જીવરાજભાઇ મોહનભાઇ માકાણી, શ્રી પુરુષોતમભાઇ મુળજીભાઇ દિવાણી, શ્રી પ્રકાશભાઇ રમેશભાઇ નાકરાણી, શ્રી વાલજીભાઇ નારાયણભાઇ વાસાણી, શ્રી પુરષોત્તમભાઇ પુંજાભાઇ કેશરાણી, શ્રી હરસુખભાઇ જીવરાજભાઇ છાભૈયા.

મહિલા મંડળ (માપ્સા-ગોવા) કારોબારી સમિતિ



પ્રમુખ : શ્રીમતી જસોદાબેન શાંતિભાઇ નાકરાણી, ઉપપ્રમુખ : શ્રીમતી ગીતાબેન મનજીભાઇ પોકાર, મહામંત્રી : શ્રીમતી દમયંતીબેન નવિનચંદ્ર માકાણી, સહમંત્રી : શ્રીમતી રસીલાબેન હરસુખભાઇ છાભૈયા, ખજાનચી : શ્રીમતી વિજયાબેન અશોકભાઇ નાકરાણી, સહખજાનચી : શ્રીમતી વર્ષાબેન પ્રવિણભાઇ ધોળુ, કા.સભ્યો : શ્રીમતી શાંતાબેન અમૃતભાઇ રામાણી, શ્રીમતી જયાબેન જયંતિભાઇ પોકાર, શ્રીમતી મણીબેન વાલજીભાઇ વાસાણી, શ્રીમતી જયાબેન પરસોત્તમભાઇ કેશરાણી, શ્રીમતી ચંપાબેન ઝવેરભાઇ ગોરાણી, શ્રીમતી કસ્તુરબેન શંકરલાલ દિવાણી, શ્રીમતી કાંતાબેન કેશવલાલ નાકરાણી, શ્રીમતી જયાબેન ધનજીભાઇ પોકાર, શ્રીમતી સવિતાબેન છગનભાઇ લીંબાણી

કચ્છ ક.પા. યુવા મંડળ માપ્સા કારોબારી સમિતિ



પ્રમુખશ્રી : જગદીશભાઇ પ્રેમજીભાઇ નાકરાણી, ઉપપ્રમુખશ્રી : પુરુષોત્તમભાઇ જીવરાજભાઇ માકાણી, મહામંત્રીશ્રી : દિપકકુમાર કરસનભાઇ લીંબાણી, સહમંત્રીશ્રી : મનોજકુમાર અમૃતલાલ રામાણી, ખજાનચીશ્રી : પ્રવિણભાઇ નથ્થુભાઇ ધોળુ, સ્પોર્ટસ મંત્રીશ્રી : દિલીપભાઇ માવજીભાઇ ચૌહાણ, પર્યટનમંત્રીશ્રી : ડાયાભાઇ રવજીભાઇ ભાવાણી, શૈક્ષણીક મંત્રીશ્રી : મુકેશકુમાર મનજીભાઇ પોકાર, કૉ.ઓડીનેટરશ્રી : વિસનજીભાઇ નારણભાઇ વાસાણી, સાંસ્કૃતિકમંત્રીશ્રીઓ : ભૂપેન્દ્રકુમાર પરસોત્તમભાઇ દિવાણી, શ્રી સુરેશકુમાર નાથાલાલ પોકાર

યુવતી મંડળ કારોબારી



પ્રમુખશ્રી : શ્રીમતી ભગવતીબેન છગનભાઇ માધાણી, ઉપપ્રમુખશ્રી : શ્રીમતી જયાબેન રાજેશભાઇ ભગત, મહામંત્રીશ્રી : શ્રીમતી સેજલબેન તુષાર ભાવાણી, સહમંત્રીશ્રી : શ્રીમતી લક્ષ્મીબેન ડાયાલાલ ભાવાણી, ખજાનચીશ્રી : શ્રીમતી જ્યોત્સના દિપકકુમાર પોકાર, સહખજાનચીશ્રી : શ્રીમતી રેખાબેન ભુપેન્દ્ર દિવાણી, કા.સભ્યો : દિક્ષાબેન કિશોરકુમાર માકાણી, સરલાબેન સુરેશકુમાર નાથાણી, તારાબેન જગદીશ પોકાર, રેખાબેન નરેન્દ્રભાઇ પોકાર

શ્રી રે.રોડ પાટીદાર સનાતન સમાજ દ્વારા ઉજવાયો દશેરાનો ઉત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ



સરસ્વતી સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ આયોજન

ઘાટકોપર (મુંબઇ): ભારત વર્ષની સૌથી પહેલી રચાયેલ સમાજ એટલે કે "શ્રી રે.રોડ પાટીદાર સનાતન સમાજ" દ્વારા ઘાટકોપર પાટીદાર વાડી મધ્યે તા.૩૦.૯.૨૦૧૭ શનિવારના રોજ સવારના ૯.૦૦ કલાક થી રાત્રીના ૯.૦૦ કલાક સુધી વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવેલ હતું.

પ્રથમ સત્રમાં સવારના ૯.૦૦ કલાકે રે.રોડ સમાજના વિદ્યાર્થી ભાઇ બહેનોને દરવર્ષની જેમ ઇનામો તેમજ મોમેન્ટો અર્પણ કરીને સરસ્વતી સન્માન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમનું આયોજન સમાજના પ્રમુખ શ્રી પરસોતમ નાનજી સેંઘાણીના અધ્યક્ષપદે તથા તેમનું સંચાલન રે.રોડ યુવક મંડળના પ્રમુખ શ્રી અશોકભાઇ હીરાલાલ લિંબ-ાણી તથા તેના સાથી કાર્યકરો દ્વારા સુંદર રીતે પાર પાડવામાં આવ્યું.

ત્યારબાદ ઘાટકોપર વાડી (ટ્રસ્ટ ફંડ) ના નવા નીમાયેલ હોદેદારોને માનપૂર્વક આમંત્રણ આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું. જેમાં શ્રી અરુણભાઇ નાકરાણી, શ્રી ચંદુભાઇ માકાણી, શ્રી કેશવભાઇ લિં-બાણી, શ્રી પ્રવિણભાઇ ધોળુ તથા નવયુવાન ટ્રસ્ટીઓ શ્રી મહેન્દ્રભાઇ સેંઘાણી અને પ્રકાશભાઇ માવાણી સામેલ હતા.

શ્રી ચંદ્રકાંતભાઇ કાંતીલાલ છાભૈયા જેઓ અ.ભા.ક.ક. સમાજ દ્વારા પ્રકાશિત થતા મુખ પત્ર સનાતન પત્રિકાના કન્વીનર પદે સેવા આપી છે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

બપોરના ભોજન બાદ ૨:૩૦ કલાકે રે.રોડ સમાજના નાના ભૂલકાઓથી પાંસઠ વર્ષના ભાઇ-બહેનો દ્વારા ખુબજ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.

આ કાર્યક્રમનું સંચાલનમાં યુવક મંડળ તથા મહિલા મંડળે ખુબજ મહેનત કરેલ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી જયશ્રીબેન નરોતમ સાંખલા તથા શ્રીમતી પુજાબેન નિલેષભાઇ સાંખલા દ્વારા કરવામાં આવેલ હતું.

સાંજના ૭:૩૦ વાગે ભોજન લીધા બાદ દોઢેક કલાક સંગીતના તાલે બહેનોએ રાસ ગરબાની જબરદસ્ત રમઝટ બોલાવેલ હતી અને તેનો ભરપુર આનંદ માણ્યો હતો.

અંતમાં રાત્રે ૯:૩૦ કલાકે આખા દિવસમાં માણેલ વિવિધ કાર્યક્રમોની યાદોને વગોળતા સૌ કોઇ છૂટા પડ્યા હતા.

ખરેખર આ દિવસ યાદગાર રહ્યો હતો.



TEJ KARAM GROUP OF INDUSTRIES

Windson Chemical Pvt.Ltd.

Manufacturers of Formaldehye and Resins
Block.No:1834/P1 & P2, Chikhli Vansda Road, At & Po. Alipore - 396409, Chikhli. Dist : Navsari
Board Line : +91 99740 05824 / 25 Mo.no:- +91 81282 26322
Visit us : www.windsonchem.com | Email : info@windsonchem.com

Windson Chem Industries

Block.No:186/P, Chikhli Vansda Road,
Next to Gaurang Plastic,
At & P0. Manekpur
Ta: Chikhli. Dist : Navsari

Noble Industries

Block.No:1834/P1 & P2, Chikhli Vansda Road,
At & Po. Alipore - 396409,
Chikhli. Dist : Navsari
Board Line : +91 99740 05824 / 25

Aditya Timpack Private Limited

61/ P1, Gandevi Road,Valoti,
Ta.Chikhli, Pin: 396380, Dist.Navsari,
Tele.No. 02634 – 263570
Ph: 9909963436
Email: adityatimbers@yahoo.com

Aditya Timbers

Gandevi Road,
Devsar – 396380
Ta: Gandevi, Dist: Navsari
Visit Us: www.adityapallets.com

Aditya Industries

Manufacturer of Flush doors & Door Frame,
Molded Doors , Block Board , Plywood
Block No: 1834/1, Chikhli Vansda Road,
Opp. Hans Metal ,At. Po: Alipore,
Tal: Chikhli, Dist-Navsari
Ph: 9909963436
Email: adityaindustries@ymail.com
Website: www.adityadoors.com

Aditya Corporation

Manufacturer of Membrane Doors ,
PVC Doors , Flush Doors,
Block No:1820, Chikhli Vansda Road,
At.Po: Alipore, Tal: Chikhli, Dist-Navsari
Ph: 7069388863
Email: adityacorporation@gmail.com

Autocraft Ply & Doors

Manufacturer of Film Face Plywood ,
Veneer Plywood & Flexo Ply
Block No:430, Bamanvel village Road,
At.Po: Khundh, Tal: Chikhli, Dist-Navsari
Ph: 9824910044
Email: autocraftdoors@gmail.com
Website: www.autocraftdoors.com

મહાકૌશલ ઝોન (મ.પ્ર.)ના આગામી ૩ વર્ષ માટે ચુનાવ સંપન્ન




પ્રમુખ : શાંતિલાલ નાકરાણી

જબલપુર પાટીદાર ભવનમાં તા.૧૬.૭.૨૦૧૭ ના રોજ ઝોનના વર્તમાન પ્રમુખ શાંન્તિલાલ ગંગારામ નાકરાણીના પ્રમુખે સ્થાને ઝોનની મીટીંગ સંપન્ન થઇ વર્તમાન મહામંત્રી શીવગણભાઇ છાભૈયાએ બધા પદાધિકારીઓને શબ્દોથી સ્વાગત સાથે મંચસ્થ કરાવ્યા. માઁ ઉમિયાના માલ્યાર્પણ અને દિપપ્રાગટ્ય સાથે મીટીંગ શરુ કરી. કોષાધ્યક્ષ સંતોષભાઇ સામાણીએ પાછળના ત્રણ વર્ષના હિસાબ રજુ કર્યા. સભાએ બહાલી આપી.મંત્રી શીવગણભાઇએ ત્રણ વર્ષના કાર્યોની જાણકારી આપી ઝોનમાં આવતા બધી જ સમાજોના પ્રતિનિધિઓએ પોતાના વિચારો અને સુજાવો રજૂ કર્યા. મહિલા સદસ્યોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા મીટીંગમાં સભાપતિ અને પ્રમુખ શાંતિલાલ નાકરાણીએ બધાના વિચારો સાંભળ્યા પછી બધાને સંતોષ જનક જવાબો આપ્યા અને બધાને ગત ત્રણ વર્ષ માટે આપેલ સહયોગ માટે ધન્યવાદ આપ્યા. અંત વર્તમાન ઝોન કારોબારીનું વિસર્જન કર્યુ અને નવી કારોબારીની ચૂંટણી માટે સમય આપ્યો. પછી બધી સમાજના સદસ્યો દ્વારા નવી કારોબારીની ઘોષણા કરી નવી કારોબારીને મંચસ્થ કરાવવામાં આવી. નવી કારોબારીમાં નીચે પ્રમાણે સદસ્યો ચુટવામા આવ્યા.

પ્રમુખ : શ્રી શાન્તિલાલ ગંગારામ નાકરાણી-જબલપુર, મહામંત્રી સંતોષભાઇ દાનાભાઇ સામાણી, કોષાધ્યક્ષ : દયારામભાઇ મણીભાઇ પોકાર, ઉપપ્રમુખ : દલસુખભાઇ વાલજીભાઇ દિવાણી, સાગર-ઇશ્વરભાઇ લાલજીભાઇ ખીમાણી-બાલાઘાટ જયંતીભાઇ કાંતિભાઇ ભાદાણી- સતના, મંત્રીશ્રી : કાંતિભાઇ ખેતાભાઇ સાંખલા-અલ્હાબાદ,કાંતિભાઇ લખમશીભાઇ નાકરાણી-મૈહર, બાબુભાઇ પેથાભાઇ રવાણી બનારસ, નરેન્દ્રકુમાર નારાયણભાઇ પોકાર-કરની, વિવેકભાઇ હરિભાઇ ધોળુ-બૈતુલ, જયંતિભાઇ ખેતાભાઇ રંગાણી પરસોના, નવીનભાઇ દેવજીભાઇ લીંબાણી-સાગર. સહ ખજાનચી : સુરેન્દ્રભાઇ નાનજીભાઇ દીવાણી-સાગર. કારોબારી સદસ્યો : મગનભાઇ રામજીભાઇ પારસીયા, વિરેન્દ્રભાઇ માવજીભાઇ નાકરાણી, હરિભાઇ શીવદાસ નાકરાણી, મોહનભાઇ લખમશીભાઇ ચોપડા,હિંમતભાઇ ડાહ્યાભાઇ સાંખલા, તેજાભાઇ રામજીભાઇ ચૌહાણ, હંસરાજભાઇ ભાણજીભાઇ રવાણી, લખમશીભાઇ તેજાભાઇ પોકાર, પ્રવીણભાઇ કાંતિભાઇ સાંખલા, શ્રીમતી નિર્મળાબેન રવિલાલ છાભૈયા, શ્રીમતી હંસાબેન દિનેશભાઇ પોકાર , શ્રીમતી ઉર્મિલાબેન કેશવભાઇ સાંખલા, શ્રીમતી માયાબેન કાન્તિભાઇ રવાણી.

નવી કારોબારીના મંચસ્થ કર્યા બાદ નવા મહામંત્રી સંતોષભાઇ સામાણી એ શબ્દોથી બધાને આવકાર્યો અને નવા ત્રણ વર્ષના કાર્યો માટે વિચારો આમંત્રિત કર્યા હતા. ત્યારબાદ શ્રી દલસુખભાઇ સાગર, વિવેકભાઇ બૈતુલ, લખમશીભાઇ સાગર લખમશીભાઇ સતના તેમજ શ્રીમતી નિર્મલાબેન, શ્રીમતી મીનાબેન શ્રીમતી કસ્તુરબેન અને શંકરભાઇ કરની વાળાએ પણ પોતાના વિચારો અને સુચન આપ્યા હતા.

કાર્યક્રમમાં ઝોનના સ્થાપના પ્રમુખ રામજીભાઇ સામાણી એ વિશેષ રુપથી ઉપસ્થિતી આપી હતી.



પ્રમુખ : શાંતિલાલ નાકરાણી

આ કાર્યક્રમમાં પાટીદાર સમાજ-જબલપુર યુવક મંડળ જબલપુર અને મહિલા મંડળ જબલપુરે વિશેષ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ઝોન પ્રમુખે બધાને ધન્યવાદ આપતા આગામી ત્રણ વર્ષ માટે સહયોગની અપેક્ષા રાખી હતી. કાર્યક્રમ બાદ ભોજન લઇ બધા છુટા પડ્યા હતા.

શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ-મુંબઈ, વાર્ષિક સામાન્ય સભાનો અહેવાલ

સમાજના પ્રમુખ શ્રી ધનજીભાઈ શીવગણ રુડાણીના અધ્યક્ષ સ્થાને મળેલ આજની વાર્ષિક સામાન્ય સભામાં અખિલ ભારતીય ક.ક.પા.સમાજ નખત્રાણાના નવનિર્વાચીત પ્રમુખ શ્રી અબજીભાઇ વિશ્રામ કાનાણી તેમજ શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ સંસ્કારધામ દેશલપરના વડીલ પ્રમુખશ્રી જેઠાભાઇ લાલજી ચોપડા તથા શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઇના નવનિર્વાચીત ચેરમેન શ્રી છગનભાઇ નાનજી રામજીયાણી (કુરબાઇ/ઘાટકોપર) કે જેઓ કેન્દ્રીય સમાજના પણ ટ્રસ્ટી છે વિશિષ્ટ ઉપસ્થિતી રહેલ.

સહમંત્રી શ્રી ગૌતમ કેશરાણી દ્વારા સર્વે વડીલો તેમજ હોદેદાર શ્રીઓના સ્થાન ગ્રહણ બાદ દિપપ્રાગટ્ય સાથે ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ અને કુળદેવી માઁ ઉમિયાજીની આરતી કરવામાં આવેલ.

મહામંત્રી શ્રી કેવશલાલ દામજી લિંબાણી એ ગત સામાન્ય સભાની મિનીટસનું વાંચન કરેલ જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ. સમાજના ખજાનચી શ્રી ચંદુભાઇ શીવગણ ધોળુ એ વાર્ષિક હિસાબો રજુ કરેલ. સમાજના ઉ.પ્રમુખ તેમજ નિર્માણ સમિતિના પ્રમુખ શ્રી અરુણભાઇ હંસરાજ નાકરાણીએ હિસાબોની વિગતવાર છણાવટ કર્યા બાદ સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ.

ત્યારબાદ કેન્દ્રીય સમાજના નવા વરાયેલા પ્રમુખ શ્રીઅબજીભાઇકાનાણીતેમજ શ્રી અ.ભા.લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખશ્રી જેઠાભાઇ ચોપડા અને મુંબઇ ટ્રસ્ટ ફંડના ચેરમેન તેમજ કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી શ્રી છગનભાઇ નાનજી રામજીયાણીનું સમાજ વતીથી સન્માન કરવામાં આવેલ. કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી પદે વરાયેલ મુંબઇ વિભાગના શ્રી દિનેશભાઇ મનજી સાંખલાની પણ નોંધ લેવાયેલ જેઓ આજે પહોંચી નહોતા શક્યા. ઉપરાંત શ્રી ભવાનભાઇ હરિભાઇ લિંબાણી(અંધેરી), શ્રી ઉમેશભાઇ નાથાણી (ઘાટકોપર), શ્રી મહેન્દ્ર જીવરાજ સેંઘાણી (ઘાટકોપર), શ્રી ચંદ્રકાંત છાભૈયા (વિક્રોલી), શ્રી રતનસી લાલજી દિવાણી (થાણા), શ્રી હિરાલાલ પારસીયા (મલાડ), શ્રી રામજીભાઇ માવજી બાથાણી (ભિવંડી) અને શ્રી પ્રેમજીભાઇ કેશરાણી આ સર્વે ભાઇઓ કેન્દ્રીય કારોબારીમાં સ્થાન પામ્યા છે તેઓનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ.

શ્રી ક.ક.પા. જ્ઞાતિ ટ્રસ્ટ ફંડની (૨૦૧૭-૨૦) મુદત માટે વરાયેલ નવા ટ્રસ્ટીઓનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ જેમાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઇ નાકરાણી, વાઇસ ચેરમેન શ્રી રતિભાઇ ઉકાણી, વાઇસ ચેરમેન શ્રી હિરાલાલ ભાવાણી (બોરીવલી),સહ મેં.ટ્રસ્ટી શ્રી ચંદુભાઇ માકાણી (ઘાટકોપર)સહ મેં ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર સેંઘાણી (ઘાટકોપર) ખજાનચી શ્રી શાંતિલાલ ભગત (ડોંબિવલી), ટ્રસ્ટી શ્રી કેશવલાલ લિંબાણી (મુલુંડ), શ્રી કાંતિભાઇ લખમશી લિંબાણી (થાણા), શ્રી પુરુષોત્તમભાઇ પોકાર (વિરાર), શ્રી શાંતિલાલ ભીમાણી (ડોંબિવલી), શ્રી



હીરાલાલ માવજી રામજીયાણી (બોરીવલી) તેમજ કૉ. ઓપ્ટ ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઇ વીરજી ધોળુ (ઘાટકોપર) અને શ્રી પ્રકાશ હરજી માવાણી (ઘાટકોપર) કેન્દ્રીય સમાજે અને મુંબઇ ટ્રસ્ટ ફંડના નવા વરાયેલ કર્ણધારોને જ્ઞાતિજનોએ તાળીઓના ગડગડાટથી વધાવેલ.

ત્યારબાદ નિર્માણ સમિતિ પ્રમુખ શ્રી અરુણભાઇ એ અહેવાલ આપતાં જણાવેલ કે જમીન સંપાદનમાં સમિતિએ સારો એવો પંથ કાપ્યો છે જે સર્વે દાતાશ્રીઓને આભારી છે મુંબઇલક્ષ્મીનારાયણસમાજને કારણે અખિલ ભારતીય સ્તરે તેમજ મુંબઇમાં પણ સામાજીક માહોલમાં ઘણો સકારાત્મક બદલાવ આવ્યો છે નિર્માણ સમિતતીના મહામંત્રીશ્રી ઉમેશભાઇ નાથાણી જણાવેલ કે અત્યાર સુધી ૭૪ ગુંઠા જમીન સંપાદીત થઇ ગયેલ છે અને બીજી ૧૦ ગુંઠા જમીનની વાત ચાલુ છે ટુંક સમયમાં તેની પણ ખરીદી થઇ જશે. ત્યારે ટોટલ ૮૪ ગુંઠા જમીન થશે. જ્ઞાતિ ગંગાનો આવોજ સહયોગ હશે તો ૧૦૦ ગુંઠાનો આકડો જલ્દી પાર થઇ જશે. અ.ભા. લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, સંસ્કાર ધામના પ્રમુખ શ્રી જેઠાભાઇ ચોપડાએ પોતાના વ્યક્તવ્યમાં જ્ઞાતિગંગાને ભૂમિદાનમાં પોતાના નામ નોંધાવવા અપિલ કરેલ. ધર્મની ખેતીમાં વાવેતર કરશો તો લક્ષ્મીનારાયણ ભગવાનની કૃપા રહેશે.ઉપરાંત વડીલશ્રીએ સંસ્કારધામની શિક્ષણ તેમજ રમતગમત સંકુલ અંગે માહિતી આપેલ. પરિવાર પ્રાર્થના કુટુંબમાં કરવી જરુરી છે નવી પેટીમાં સંસ્કારોનું સિંચન થશે.

ત્યારબાદ અ.ભા. ક.ક.પા. સમાજના પ્રમુખ શ્રી અબજીભાઇ કાનાણીએ સમાજ દ્વારા કરવામાં આવેલ સન્માન બદલ આભાર વ્યક્ત કરેલ. મુંબઇ ખાતે સમાજનો ટુકો ઇતિહાસ જણાવતા કહેલ કે આઝાદી, પહેલા વડીલ શ્રી રતનશી ખીમજી ખેતાણીના અધ્યક્ષ સ્થાને સમાજ સ્થાપના થયેલ હતી. જ્ઞાતિના ઉદ્ધારક અને સાચા રાહબર એવા પૂજ્ય સંતશ્રી ઓધવરામ મહારાજનું અમુલ્ય યોગદાન રહ્યું છે. ત્યારબાદ જણાવેલ કે SUV સ્કૂલ (સુરત)નો દશાબ્દી ઉત્સવ તા.૨૩.૨૪.૨૫ ડીસેમ્બર ૧૭ના ઉજવવાનો છે તો આપ સૌ ઉજવણીનો લાભ અવશ્ય લેશોજી. સનાતન ધર્મ પત્રીકાના આજીવન સભ્યો વધુમાં વધુ બને તેવા સહીયારા પ્રયત્નો કરીએ.પત્રિકામાં જાહેરાતો આપી આર્થીક યોગદાન આપવા અપીલ કરેલ. નખત્રાણા બોર્ડીંગ ખાતે Export Import ના ૪ દિવસના નિવાસી કોર્સ ચાલુ કરેલ. બે સત્ર સફળતા પૂર્વક પુરા થઇ ગયેલ છે ખેતી ઉદ્યોગને લગતા ટૂંકા કોર્સનું આયોજન વિચારાધીન છે. દિવાળી વાણી અચુક આપવા અપીલ કરેલ. આપ સૌના સાથ સહકારથી નવી જવાબદારી સુપેરે પાર પાડશુ એવો આત્મવિશ્વાસ છે.

ત્યારબાદ આજની વાર્ષિક સામાન્ય સભા સાથે અસાધારણ સભાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

મુખ્ય એજન્ડા : સમાજના કારોબારી સભ્યો અને હોદેદારોની નિયુક્તી અંગે નિયમમાં ફેરફાર કરવા બાબત. તા.૨.૮.૨૦૧૭ના આવેલ પત્રને અનુસંધાને તા.૯.૯.૨૦૧૭ની કારોબારી સભામાં આ વિષય લેવામાં આવેલ અને તે અંગે ચર્ચા વિચારણાને અંતે નિર્ણય લેવામાં આવેલ તે ૧) હાલના બંધારણ મુજબ ૩ વર્ષ બાદ કારોબારી સભ્ય બની શકશે. એટલે કે સમાજના સભ્ય બન્યા બાદ ૩ વર્ષ પછી કારોબારી સભ્ય બની શકશે. (કોઇ ફેરફાર નહી). ૨) હાલના બંધારણ હોદેદાર બનવા માટે કોઇ મુદત નક્કી કરવામાં આવેલ નથી. જે હવેથી નવા બનનાર સભ્યોને હોદેદાર બનવા માટે સભ્ય બન્યા બાદ ૭ વર્ષ પછી હોદેદાર બની શકશે.૩) ઉપરોક્ત નિયમ તા.૧.૧૧.૨૦૧૭ નવા બનનાર સભ્યોને લાગુ પડશે. ૪) હોદેદાર બનવા માટે હાલના બંધારણમાં ઉંમરની કોઇ જોગવાઇ નથી જે હવેથી હોદેદાર બનવા માટે ઉંમર ૩૫ વર્ષ પુર્ણ ઓછામાં ઓછી હોવી જોઇએ.

ઉપરોક્ત મુદ્દા ઉપર સવિસ્તર ચર્ચાઓ થયેલ. અંતમાં એક એક મુદ્દા પર મત લેવામાં આવતાં સર્વાનુમતે સર્વે મુદાને અસાધારણ સભાએ મંજૂર કરેલ. પ્રમુખશ્રી ધનજીબાપા એ જણાવેલ કે આજની સભામાં શ્રી જેઠાભાઇ તેમજ શ્રી અબજીભાઇ હાજર છે જે આનંદની વાત છે વાર્ષિક સભા તેમજ અસાધારણ સભામાં સર્વે એ ચર્ચામાં ભાગ લઇ અંતે સર્વાનુમતે નિર્ણય લીધા તે સમાજ માટે ગર્વની વાત છે. કેન્દ્રીય સમાજના નવા વરાયેલા પ્રમુખ શ્રી અબજીભાઇને અભિનંદન સાથે શુભેચ્છા આપેલ. આભાર વિધી બાદ સભા પુર્ણ જાહેર મહાપ્રસાદ લઇ સૌ છુટા પડ્યા.

2017-10-11 -Unjha Judgement in SDP Newspaper (932)

જ્ઞાતિ જોગ સંદેશ

આદરણીય જ્ઞાતિજનો..........

સતપંથ અંગે જ્ઞાતિમાં ચાલતા વિવાદ અંગેનો કેસ આપણી જ કડવા પાટીદારોની સર્વોચ્ચ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- ઊંઝા ખાતે માતાજીના ધામમાં ચાલી રહ્યો હતો. જેનો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા ગત તા. ૦૮-૧૦- ૨૦૧૭ ના રોજ બંને પક્ષકારોના પ્રતિનિધીઓની હાજરીમાં ઐતિહાસિક ચુકાદો આપેલ છે, તેને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ આવકારે છે. તેમજ સૌ જ્ઞાતિજનોને વિનંતી કરે છે કે આ ચુકાદાને આપણે માન આપીએ, તેનો આદર કરીએ. તે ઉપરાંત કોઈ પણ જાતના સાચા-ખોટા અને વિવાદિત નિવેદનો ટાળીએ અને માતાજી સંસ્થાનના આદેશને આદર આપી તેનું સૌ પાલન કરીએ તેવી આપ સૌને અરજ છે.

પ્રમુખશ્રી : અબજીભાઈ વિશ્રામ કાનાણી
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha



અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના

સનાતન અને સતપંથના વિવાદ અંગે

નિમાયેલ લવાદનો નિર્ણય

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાએ વિશ્વના કડવા પાટીદારોની સર્વોચ્ચ અને અંગત માલિકીની એકમાત્ર ધાર્મિક સંસ્થા છે તેથી પાટીદાર સમાજના હિતોનું રક્ષણ કરવાનું, સમાજમાં સંપ-સહકાર-સંગઠન-ભાવાત્મક એકતા-ભાઈચારો અને મા ઉમિયા પ્રત્યેનો ભક્તિભાવ વધે તે માટેના પ્રયાસો કરે છે. આ સંસ્થા દ્વારા સમાજમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે. આ સંસ્થાનો પારદર્શક અને વિકાસલક્ષી અભિગમ હોવાથી આ સંસ્થાનું સમાજમાં આગવું સ્થાન છે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા-૩૮૪૧૭૦ (ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com ● Email : umiyamatajiunjha@gmail.com ● / www.facebook.com/umiyamatajiunjha

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha

૨

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં વર્ષોથી ચાલતા સનાતન અને સતપંથ ના જે વિવાદ ચાલે છે તે માટે આ બન્ને સંસ્થાઓએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાને લવાદગીરી સોંપી છે જે બન્ને પક્ષોએ લવાદગીરી સ્વીકારી છે. બન્ને સંસ્થાઓ સનાતન સમાજે **તા. ૧૫-૦૯-૨૦૧૫** અને સતપંથ સમાજે **તા. ૨૮-૦૯-૨૦૧૫** ના રોજ પોતાની સંસ્થાના લેટર પેડ ઉપર લખી સંસ્થાઓના જવાબદાર **૧૧-૧૧** પ્રતિનિધિઓના નામ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝામાં રજુ કર્યા હતા. તે અંતર્ગત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાની વાર્ષિક જનરલ સભા તેમજ કારોબારી સભામાં અવાર-નવાર તેમના વિવાદો અંગે રજુઆતો કરવામાં આવેલ તેમજ બન્ને પક્ષના આગેવાનોએ રૂબરૂ અને ટેલીફોન દ્વારા આ વિવાદના ઉકેલ માટે રજુઆતો કરેલ તે અનુસંધાને આ બન્ને સંસ્થાના પ્રતિનિધિઓને અનેકવાર માતાજી સંસ્થાનમાં શાંતિથી સાંભળ્યા. બન્ને પક્ષ તરફથી ખુલાસા-પ્રતિ ખુલાસાઓ કરવામાં આવ્યા બન્ને પક્ષ સાથે અવાર-નવાર મિટીંગો કરીને સાંભળવામાં આવ્યા. આમ ખૂબ જ ઊંડાણ પૂર્વક બન્ને પક્ષોને સમજવાનો પ્રયત્ન કર્યો છે. મા ઉમિયાએ અમને જે સુઝાડયુ તેવી સુઝબુઝથી નીચેના નિર્ણય આપીએ છીએ. જે બન્ને પક્ષોએ અમલ કરવાનો રહેશે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા-૩૮૪૧૭૦ (ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com ● Email : umiyamatajiunjha@gmail.com ● / www.facebook.com/umiyamatajiunjha

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana   PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા
Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha



૩

(૧) સતપંથ અને સનાતન પંથ શબ્દોને કારણે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ વિભાજીત સ્થિતિમાં છે જેને કારણે સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થયેલ છે. જેથી સનાતન અને સતપંથ ને સમરસ કરવાની અત્યંત જરૂરીયાત છે. કચ્છ સમાજના સનાતન અને સતપંથના ભાઈ-બહેનો મા ઉમિયાના સંતાનો હોવાથી હવે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ તરીકે ઓળખવાનો છે. હવેથી સતપંથ અને સનાતન પંથ શબ્દોનો પ્રયોગ કરવાનો રહેશે નહિ અને તે પ્રમાણે સમગ્ર સમાજે સામાજિક વ્યવહાર કરવાનો છે.

(૨) ઈમામશાહ શબ્દ મુસ્લીમ (ઈસ્લામધર્મ) સાથે જોડાયેલો છે જેથી મુસ્લીમ (ઈસ્લામધર્મ) ના કોઈપણ ક્રિયાકર્મો-વિધિ વિધાન સતપંથ સમાજે કરવી યોગ્ય નથી. કચ્છ કડવા પાટીદાર સમાજના સતપંથમાં માનવાવાળાઓએ સંપૂર્ણ પણે હિન્દુ ધર્મના ઈશ્વર તથા ઈશ્વરના અવતારો તથા દેવી-દેવતાઓ વગેરેનું પૂજન કરવું તથા હિન્દુ ધર્મના શાસ્ત્રોનું વાંચન તેમજ તેના પ્રવચનોમાં ભાગ લેવો જોઈએ. જેથી સતપંથ અને સનાતન સંપ્રદાયે સમરસ થઈ સાથે મળીને હિન્દુ ધર્મની ઓળખ ઊભી કરવાની છે. તેથી સમગ્ર સમાજ હિન્દુ કડવા પાટીદાર તરીકે ઓળખતો કરવાનો છે.

(૩) પીરાણાપંથની જે સંસ્થા છે તે સંસ્થામાં કચ્છ કડવા પાટીદાર સમાજના સતપંથમાં માનનારા વર્ષોથી પોતાની આવકના ૧૦ % ફાળો આપે છે જેથી આ સંસ્થાનો સંપૂર્ણ વહીવટ હિન્દુ સનાતન ધર્મ મુજબ આપણા સમાજ પાસે એટલે કે કચ્છ કડવા પાટીદાર સમાજ પાસે રહે તે ખાસ જરૂરી છે. જેથી આ ફંડ આપણા સમાજના વિકાસ માટે વાપરી શકાય.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન
ઊંઝા-૩૮૪૧૭૦.
(ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com ● Email : umiyamatajiunjha@gmail.com ● / www.facebook.com/umiyamatajiunjha

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha

<u>૪</u>

(૪) ઘણા સમયથી બન્ને પક્ષે વ્યક્તિગત સામાજિક કે અન્ય સંસ્થાઓમાં એકબીજા સામે કોર્ટ કચેરીમાં જે કેસો કરવામાં આવ્યા છે તે આજ તારીખથી ૯૦ દિવસ સુધીમાં કેસો સંપૂર્ણપણે પાછા ખેંચી લેવા જેથી બન્ને પક્ષે સદભાવ અને પ્રેમ જળવાઈ રહેશે.

(૫) કચ્છ કડવા પાટીદાર સમાજમાં બહેન દિકરીઓ અને સગા વ્હાલાઓ એકબીજાના ઘરે જાય નહિ તેવા જુદા-જુદા ઠરાવો થયેલ છે તે રદ કરવા અને બહેન દિકરીઓ, ભાઈઓ અને સગા વ્હાલાઓમાં બહિષ્કારનું વાતાવરણ ઉભુ થયેલ છે તે નાબુદ કરી સમાજમાં ભાઈચારા અને પ્રેમનું વાતાવરણ ઊભુ કરવું. જેથી કરીને સામાજિક સંગઠનોને સમરસ કરી શકાય.

(૬) અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં આપણા પૂર્વજોએ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓની સ્થાપના કરેલી તે વખતે બન્ને સંપ્રદાયોની સંયુક્ત મિલકતો અને સામાજિક સંબંધો હતા. તેમાં એમની સમજ એવી હતી કે સાથે રહેવાથી ધીરે ધીરે સતપંથમાં માનનારા સનાતન હિન્દુ ધર્મના પ્રવાહમાં ભળી જશે અને તેના પરિણામો પણ આવ્યા છે. હજુ પણ કેટલાક પ્રસંગો સાથે ઉજવવામાં આવે છે. તેથી સતપંથમાં માનનારા ભાઈ-બહેનો સમજપૂર્વક મોટા પ્રવાહમાં ભળી જાય તેવી મા ઉમિયાની ઈચ્છા છે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા-૩૮૪૧૭૦. (ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com ● Email : umiyamatajiunjha@gmail.com ● / www.facebook.com/umiyamatajiunjha

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha

<u>૫</u>

(૭) પિરાણા પંથ વિષ્ણુ ભગવાનના દસ અવતારોમાં દસમા અવતાર તરીકે નિષ્કલંકી નારાયણમાં માને છે. જે હિન્દુ ધર્મની માન્યતા વિરૂધ્ધ છે તેના બદલે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ વિષ્ણુ ભગવાનના દસમા અવતારમાં કલકી નારાયણ તરીકે અવતરવાના છે તે મુજબ તેની આરતી/પૂજા કરવી

આપણા હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અધ્યાય ૩ માં ૩૫ મા શ્લોકમાં નીચે પ્રમાણે કહ્યું છે.

श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् ।
स्वधर्मे निधन श्रेयः परधर्मो भयावहः ॥ ३५ ॥

સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે. પોતાના ધર્મમાં મરવું પણ કલ્યાણકારી છે અને અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. ॥ ૩૫ ॥

ઉપર મુજબના લવાદોના નિર્ણયની અમલવારી બન્ને પક્ષ સાથે મળી ભાઈચારાની ભાવનાથી સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજે કરવી, જયારે મિટીંગો, સંમેલનો કરવાની જરૂર પડે ત્યારે સમાજમાં પ્રેમ અને ભાઈચારાનું વાતાવરણ ઊભુ કરવા ઝુંબેશ ચલાવવાની છે જેમાં શ્રી ઉમિયા માતાજી સસ્થાન-ઊંઝા હંમેશા કચ્છ કડવા પાટીદાર સમાજની સાથે છે અને રહેશે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા-૩૮૪૧૭૦. (ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha

<u>૬</u>

આ ચુકાદાના અમલીકરણ માટે સમાજમાં વધુમાં વધુ પ્રચાર થાય તે માટે સમાજની મિટીંગોમાં અને સમાજની માસિક પત્રિકાઓમાં છાપી પ્રચાર કરવો.

ઉપરોક્ત નિર્ણય નીચે જણાવેલ લવાદ કમિટીએ સર્વાનુમતે કરેલ છે.

<u>શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાની લવાદ કમિટી</u>

૧. શ્રી નારાયણભાઈ લલ્લુદાસ પટેલ - ઊંઝા	પ્રમુખશ્રી
૨. શ્રી મણીભાઈ ઈશ્વરલાલ પટેલ - ઊંઝા	કન્વીનરશ્રી
૩. શ્રી દિલીપભાઈ મણીલાલ પટેલ - ઊંઝા	માનદમંત્રીશ્રી
૪. શ્રી વિક્રમભાઈ ધનજીદાસ પટેલ - ઊંઝા	સભ્યશ્રી
૫. શ્રી પ્રહલાદભાઈ જોઈતારામ પટેલ - મહેસાણા	સભ્યશ્રી
૬. શ્રી વસંતભાઈ નારાયણદાસ પટેલ - ઊંઝા	સભ્યશ્રી
૭. શ્રી બાબુભાઈ એચ. ઘોડાસરા - રાજકોટ	સભ્યશ્રી
૮. શ્રી જયરામભાઈ ગોવિંદભાઈ વાંસજાળીયા - જામનગર	સભ્યશ્રી
૯. શ્રી જયંતિભાઈ કાલરીયા - રાજકોટ	સભ્યશ્રી
૧૦. શ્રી ગણેશભાઈ દ્વારકાદાસ પટેલ - સુરત	સભ્યશ્રી

સ્થળ :- ઊંઝા

તારીખ :- ૦૮-૧૦-૨૦૧૭

(નારાયણભાઈ એલ. પટેલ)
પ્રમુખ
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

"સનાતન ધર્મ પત્રિકા" ના માધ્યમે અમારા જ્ઞાતિજનોને "નૂતન વર્ષાભિનંદન"

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ રચિત

શ્રી દક્ષિણ – મહારાષ્ટ્ર ગોવા ઝોન

નવા વરસે નવલા રે થઈએ, એકબીજાને આનંદથી મળીએ,
બધે હસી-ખુશી વહેંચતા ફરીએ, અજ્ઞાન દૂર કરી જ્ઞાનની જ્યોત પ્રગટાવીએ.
દુર્ગુણો દૂર કરી સદ્‌ગુણો અપનાવીએ, નિરાશા ખંખેરી આશાનો દીપ જલાવીએ.
નવા વર્ષે નવલા બની નવેસરથી, નવું વર્ષ હળીમળી પ્રેમથી ઉજવીએ.

દક્ષિણ મહારાષ્ટ્ર – ગોવા ઝોન સમાજના ગૌરવવંતા ઉચ્ચ પદાધિકારીઓ

અ.ભા. સમાજ ઉપપ્રમુખ



શ્રી ગોપાલભાઈ ભાવાણી

યુવા સંઘ પ્રમુખ



શ્રી રવિભાઈ ધોળુ

મહિલા સંઘ પ્રમુખ



સૌ. જશોદાબેન નાકરાણી

સ્થાપક પ્રમુખ



શ્રી જેઠાભાઈ પોકાર

પ્રમુખ



શ્રી રતિભાઈ સાંખલા

IPP



શ્રી મનુભાઈ નાકરાણી

ઉપ પ્રમુખ



શ્રી રતનશીભાઈ લિંબાણી

ઉપ પ્રમુખ



શ્રી લધાભાઈ ધોળુ

મહા મંત્રી



શ્રી પરસોત્તમભાઈ રૂડાણી

મંત્રી



શ્રી દેવજીભાઈ પોકાર

મંત્રી



શ્રી કાંતિભાઈ ઠાકરાણી

મંત્રી



શ્રી શાંતિભાઈ નાકરાણી

ખજાનચી



શ્રી વિશ્રામભાઈ જબુવાણી

સહ ખજાનચી



શ્રી રવજીભાઈ દિવાણી

ઝોન અંતર્ગત આવતી સમાજો

૧. શ્રી કોલ્હાપૂર જીલ્લા પાટીદાર સમાજ, કોલ્હાપૂર.
૨. સાંગલી જીલ્લા પાટીદાર સમાજ, સાંગલી.
૩. સાતારા જીલ્લા પાટીદાર સમાજ, સાતારા.
૪. રત્નાગિરી-સિંધુદુર્ગ જીલ્લા પાટીદાર સમાજ, ચિપલૂણ
૫. ઈચલકરંજી કચ્છ કડવા પાટીદાર સમાજ, ઈચલકરંજી.
૬. સાવંતવાડી પાટીદાર સમાજ, સાવંતવાડી.
૭. મહાડ કચ્છ કડવા પાટીદાર સમાજ, મહાડ.
૮. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, મડગાંવ ગોવા.
૯. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, ફોંડા-ગોવા.
૧૦. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, મ્હાપુસા-ગોવા
૧૧. શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ, ઈસ્લામપુર

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ સુરતની વાર્ષિક સામાન્ય સભા

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ સુરતની વાર્ષિક સામાન્ય સભા તા.૨૩.૯.૨૦૧૭ની સમાજવાડી ઉમાભવન ખાતે પ્રમુખ શ્રી પ્રેમજીભાઇ ભાવાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. સૌપ્રથમ સમાજના હોદેદારો અને કમીટીના સભ્યોને સ્થાન ગ્રહણ કરાવવામાં આવ્યું. વર્ષ દરમ્યાન દીવંગત આત્માને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

ગતમીટીંગની મીનીટસનું વાંચનઝવેરભાઇરામાણી(મહામંત્રી) એ કર્યું વાર્ષિક હિસાબોનું વાંચન સુરેશભાઇ કેસરાણી (સહમંત્રી) એ કર્યું હતું.

suv સ્કુલના દશાબ્દી મહોત્સવના ચેરમેન દામોદરભાઇ ભાવાણી ૨૦૧૭માં સ્કુલનું ઓપનીંગ થયુ આજે દશ વર્ષ પુરા થાય છે તા.૨૩.૨૪.૨૫ ડીસેમ્બરમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા જઇ રહ્યા છીએ. વડીલોનું સ્વપ્નું હતું કે આપણી સ્કુલ હોવી જોઇએ. NRI ઝોનનો કાર્યક્રમમાં વધારો થયો છે. ૨૦,૦૦૦ માણસો ભેગા થવાના છે. ૩૫૦૦ થી ૪૦૦૦ માણસો બહારથી આવશે.૧૯૬૫થી અમેરિકામાં આપણા ભાઇઓ રહે છે દશ વર્ષ પછી તેઓએ સમાજની સ્થાપના કરી છે. અમેરિકા, દુબઇ, લંડન, આફ્રીકા અમે જઇ આવ્યા છીએ. તેઓ આ કાર્યક્રમમાં આવશે. આ કાર્યક્રમ કેમ સારો થાય તે જવાબદારી આપણી છે.

રમેશભાઇ પારસીયા : (મહામંત્રી શ્રી દ.ગુ. સમાજ) ૨૩ વર્ષથી સમૂહલગ્ન કરીએ છીએ. દ.ગુ. સમાજ લેવલે ૨૨ દિકરીઓના નામ આવ્યા છે છેલ્લી તારીખ ૩૦.૯ છે છેલ્લા ૨ વર્ષથી સુવર્ણ દાન આપીએ છીએ. આ વર્ષે ૧૧ ગ્રામ નોંધાયુ છે ૧૬ થી ૧૭ લાખનો ખર્ચ છે. ysk વિશેની વિસ્તારથી માહિતી આપી. કેન્દ્રીય સમાજની માહિતી આપી. કેન્દ્રમાં ટ્રસ્ટી તરીકે શ્રી કરશનભાઇ સેંઘાણીની નીમણુંક કરવામાં આવી છે. દ.ગુ. સમુહલગ્નમાં દાતા શ્રી જીવણભાઇ રંગાણી (જહાંગીરપુરા) તરફથી પ્રત્યેક દિકરીને ૧૦૦ ગ્રામ ચાંદીની બીસ્કીટ આપવામાં આવશે. સ્કુલના દશાબ્દી મહોત્સવની વાત કરી. સંસ્થા પગભર થાય એવી આપણી ભાવના છે. દાતાઓ વગર કાર્યક્રમ થતા નથી.

પરસોતમભાઇ સાંખલા :- છેલ્લી તારીખ સુધી સમુહલગ્નમાં આવકારશું ફક્ત પત્રીકામાં નામ નહી આવે. બને પક્ષને ૫૦,૫૦ ભોજન પાસ આપવામાં આવશે. આર્થિક સહયોગ વગર કોઇ કાર્ય શક્ય નથી. ૨૦૦ કિ.મી. ઉપરનાને આગલા દિવસે એન્ટ્રી મળશે. પત્રીકામાં ૧૧૦૦૦, ૧૫૦૦૦નું નામ આવશે. સન્માન ૨૧૦૦૦ ઉપરનાં દાતાઓનું થશે. સમુહલગ્નમાં ભાગ લેનાર દ.ગુ. સમાજના પણ સભ્ય બનવું પડશે.

પ્રેમજીભાઇ ભાવાણી - પ્રમુખ શ્રી કિરણ હોસ્પિટલ માટે ૧ કરોડનું દાન ભેગુ થયું છે.આપણે, સમાજના વિકાસ માટે કોઇક કરીએ. વડીલો દ્વારા સમાજના ત્રણે ઝોનમાં વાડી કરવી એવું નક્કી થયું છે ઉઘના થઇ ગઇ છે. હવે ઉત્તરઝોનમાં બાકી છે. તેના માટે કાંઇક કરીએ.

સમાજના વિકાસ માટે શું કરવું જોઇએ તેના માટે ઓપન મંચમાં વિરજીભાઇ માંકાણી, કાન્તીભાઇ સાંખલા,લધાભાઇ ભાવાણી, ભાણજીભાઇ ખેતા માંકાણી, મયુરભાઇ રંગાણી, રમેશભાઇ પારસીયા, લાલજીભાઇ ભાવાણી, પચાણભાઇ ભાવાણી, રમણભાઇ, હરિભાઇ પોકાર, પુષ્પાબેન લીંબાણી, કેશવલાલ ભાવાણી, સામજીભાઇ ગોરાણી જયંતીભાઇ પોકાર, મણીલાલભાઇ પારસીયા, દામોદરભાઇ ભાવાણી, વિશ્રામભાઇ છાભૈયાએ પોતાનાં સુચનો સુચનો આપ્યાં હતાં. પ્રેમજીભાઇ ભાવાણી (પ્રમુખ શ્રી) માથાંદીઠ ૫૦ રુ. દર ત્રણ મહીને ઉઘરાવાળા દશમા મહીનાથી શરુ કરશું. છેલ્લી જાન્યુઆરીની ૫ તારીખ સુધી ફંડ આવી જવું જોઇએ. જીવ દીઠ ઉઘરાવાના છે.

ત્યારબાદ સર્વાનુમતે કમીટીની નવી નિમણુક કરવામાં આવી. ચુંટણી કમિશનર તરીકે દામોદરભાઇ ભાવાણી અને વિરજીભાઇ માંકાણી રહ્યા હતા. નવા વરાયેલા પ્રમુખ શ્રી પ્રેમજીભાઇ ભાવાણી :- તમે અમારા પર વિશ્વાસ મુક્યો છે તમારો સાથ અને સહકાર મળશે. તેવી હું આશા રાખું છું.

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ-સુરત વર્ષ ૨૦૧૭-૧૮ કારોબારી

ટ્રસ્ટીશ્રીઓ શંકરભાઇ વાસાણી, નાનજીભાઇ વાલાણી, કાન્તિભાઇ સાંખલા, રમેશભાઇ પારસીયા, લાલજીભાઇ ભાવાણી, કરશનભાઇ સેંગાણી,

હોદેદારશ્રીઓ પ્રમુખશ્રી - પ્રેમજીભાઇ ભાવાણી, ઉપપ્રમુખશ્રી - પરસોતમભાઇ સાંખલા, મંત્રીશ્રી - ઝવેરભાઇ રામાણી , સહમંત્રીશ્રી- સુરેશભાઇ કેસરાણી, ખજાનચીશ્રી- રામજીભાઇ ભાવાણી,

કારોબારી સભ્યો દામોદરભાઇ મનજી ભાવાણી, કિશોરભાઇ કેસરાણી,સામજીભાઇ ગોરાણી, કાન્તિભાઇ પોકાર, ધનાભાઇ ડાયાણી, રમણીકભાઇ છાભૈયા, રમેશભાઇ લીંબાણી, શિવગણભાઇ ભાવાણી, જયંતીભાઇ લિંબાણી, હરિભાઇ ચૌધરી

ઓડીટર શ્રી અમૃતભાઇ લાલજી સાંખલા, જયંતિભાઇ નાનજી પોકાર, મુકેશભાઇ કિશોરભાઇ માંકાણી, જગદીશભાઇ હરિભાઇ કાલરીયા.

કૉપ્ટ સભ્ય શ્રી વિરજીભાઇ માંકાણી, હરિભાઇ માંકાણી, શામજીભાઇ કાલરીયા, કાન્તિભાઇ ભાવાણી, મોહનભાઇ નાકરાણી, ડાહ્યાભાઇ સાંખલા, રજનીકાંતભાઇ વાગડીયા, પ્રેમજીભાઇ સેંઘાણી, રમણભાઇ પોકાર, હિંમતભાઇ માંકાણી

કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રીશ્રી ઝવેરભાઇ રામાણીએ કર્યું હતું. આભારવિધી : મંત્રીશ્રી ઝવેરભાઇ રામાણીએ કરી હતી અને સૌ અલ્પહાર લઇ છુટા પડ્યાં.

શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા ઝોન સમાજનું ગૌરવ

૧) કેન્દ્રીય યુવા સંઘના પ્રમુખ શ્રી રવિભાઇ દેવસી ધોળું મડગાંવ-ગોવા

૨) કેન્દ્રીય મહિલામંડળના પ્રમુખ શ્રીમતી યશોદાબેન શાંતિભાઇ નાયાણી-મ્હાપુષા-ગોવા

૩) કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઇ વાલજી ભાવાણી-કોલ્હાપુર

ઝોન દ્વારા થયેલ કાર્યોનો અહેવાલ

૧) શૈક્ષણીક :- ઘટક સમાજોમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિક કરવા સરસ્વતી સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

અલગ અલગ ઝોનમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થિઓનું વિશેષ સન્માન કરવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ કરિયર ગાઇડના શિબીરનું આયોજન કરવામાં આવે છે.

૨) વસ્તી ગણતરી-યુવા સંઘની મદદથી ૧૦૦% કામગીરી પૂર્ણ થયેલ છે.

૩) બિજનેશ સેલ-ઘટક સમાજોમાં બિજનેસ માર્ગદર્શન શિબિરોનાં આયોજન કરવામાં આવેલ છે. તેમજ જીએસટી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

૪) સામાજિક : સાંગલી જીલ્લા પાટીદાર સમાજમાં સમુહલગ્નનું દરવર્ષે આયોજન કોલ્હાપુર જીલ્લા સમાજમાં સુવર્ણજયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી તેમજ ટ્યુસ યુવા સંઘ ને ૨૫ વર્ષ પુરા થતાં વિવિધ કાર્યક્રમોનું આયોજન રત્નાગીરી સિન્ધુદુર્ગ ઝોન યુવક મંડળ ૧૦ વર્ષ પુરા થતા ઘટક સમાજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.

૫) આધ્યાત્મીક : ઘટક સમાજોમાં વિદ્વાનો તથા સંતો મહાપુરુષોનાં પ્રવચનનું આયોજન તેમજ પરિવારોમાં નિયમિત પરિવાર પ્રાર્થના તથા પરિવાર સમૂહ ભોજનનો ઝોન દ્વારા આગ્રહ કરવામાં આવે છે આદ્ય સમાજ સુધારકોની જન્મજયંતિ તથા સંતોની પુણ્યતિથિ તથા પારંપારિક ઉત્સવો સમગ્ર ઝોન ગટક સમાજોમાં ઉજવવામાં આવે છે.

તેમજ ઝોનની સંપૂર્ણ ઘટક સમાજો સનાતન ધર્મને અનુસરીએ છીએ.

૬) આરોગ્ય ઘટક સમાજોમાં રોગ નિદાન કેમ્પના આયોજન તેમજ નારાયણજી બાપાની જન્મજયંતિ નિમિત્તે મહા રક્તદાન પ્રક્રિયા કાર્યક્રમમાં ૧૨૦૧ બોટલ રકમ એકત્રિત શ્રી ૨૯ ઝોનમાં મોખરે રહેલ હતા. તેમજ ysk માં નોંધપાત્ર કામગીરી કરીએ છીએ.

૭) રાજકીય તથા નેતૃત્વ : ઘટક સમાજોમાં સ્થાનિક ક્ષેત્રે રાજકીય પક્ષમાં સભ્યો કાર્યરત છે. ઘટક સમાજોના કાર્યક્રમમાં રાજકીય કાર્યકર્તાઓને બોલાવીએ છીએ.

૮) પ્રચારને પ્રસાદ : ઝોનના હોદેદારોની ઝોન અંતર્ગત સમાજમાં સંપર્ક યાત્રાનો ઉપક્રમ ચાલુ છે. ઝોનના વિકાસ માટે કેન્દ્રીય સમાજે નિયુક્ત કરેલ ઝોન પ્રભારીને ઝોનની મિટીંગોમાં બોલાવી એમનું માર્ગદર્શન લઇએ છીએ. તેમજ કેન્દ્રીય સમાજે ૨૯ ઝોનની જવાબદારી આપેલ શ્રી ગોપાલભાઇ ભાવાણી-કોલ્હાપુર તેમજ શ્રી શંકરભાઇ રવાણી જયપુર વાળાનું માર્ગદર્શન લઇએ છીએ.

૯) ફંડ આયોજન કેન્દ્રીય સમાજને ૧૦૦% દિવાણી બોણી નિયમિત મોકલીએ છીએ તેમજ ઘટક સમાજોમાં વ્યક્તિગત સભ્યો ઉપર આવેલ નૈસર્ગિક આપત્તિમાં જીલ્લા સમાજો આર્થિક સહયોગ તથા પીઠબળ આપે છે.

૧૦) કૃષિ પર્યાવરણ ૧ થી ૭ જુલાઇ ગ્રીન ડી.એમ.જી ના નામે દરેક ઘટક સમાજોમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ. ઘટક સમાજોમાં સ્વચ્છતા અભિયાનોનું આયોજન કરવામાં આવે છે.

૧૧) યુવા સંઘ સમાજનું સંકલનઃ ઝોન સમાજ તથા યુવા સંઘનો સમન્વય બહુ જ સારો છે દરેક પ્રવૃત્તિ સાથે મળીને કરવામાં આવે છે. ઝોનની દરેક મિટિંગમાં યુવા સંઘના પ્રતિનિધિની હાજરી હોય છે. યુવા સંઘના સાથ-સહકારથી દરેક થીમના કાર્યક્રમોનું ઘટક સમાજોમાં આયોજન કરવામાં આવે છે.

૧૨) રમત ગમત : ઘટક સમાજોમાં ક્રિકેટ, વોલીબોલ જેથી અનેક રમતોના ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

દરેક ખેલાડુઓને તથા યુવામંડળોને ઝો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે ઘટક સમાજ અલગ અલગ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓના વિશેષ સન્માન કરવામાં આવે છે.

પ્રતિનિધિ : પુરુષોત્તમ રુડાણી



આવો ઓળખીએ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વને...

શાંતિભાઈ દિવાણી.....

વતન કચ્છ નખત્રાણા તાલુકાના થરાવડા (ભડલી) ગામનો નવયુવાન, હાલ કર્મભૂમિ મહારાષ્ટ્ર રાજ્યના સિંધુદુર્ગ જીલ્લાના માલવણ અંતરીયાળ ગામનો માનવ. માતા દમયંતીબેનને કુખે અવતરેલ, પિતા અબજીભાઈ અરજણભાઈ દિવાણીનો હોનહાર પુત્ર શાંતિ પટેલ. ૪૪ વર્ષનો યુવાન, ઉર્મિલાબેનનો ભરથાર, સંયુક્ત પરિવારમાં માતા-પિતા અને નાના ભાઈના પરિવાર સાથે રહેતા વ્યવસાયમાં ''શક્તિ હાર્ડવેઅર'' ના નામે છેલ્લા ૨૦ (વીસ) વર્ષથી સ્થાનિક પ્રજા સાથે હળી મળીને વ્યવસાય કરી રહ્યા છે. તેના પુરાવા સ્વરૂપે કહું તો સ્થાનિક લાયન્સ ક્લબ જેવી સંસ્થામાં સક્રિય થઈ પ્રવૃત્તિશીલ રહેવાને લઈને પ્રમુખ સુધીના હોદ્દાએ પહોંચી માલવણમાં ખુબ જ સારા કાર્ય કરી માલવણ લાયન્સ ક્લબને મોખરે રાખ્યુ છે. તેમના કાર્યોમાં કહું તો જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને આર્થિક મદદ તેમજ અભ્યાસ લક્ષી સાહિત્ય વિતરણ, તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન, દસમી-બારમીમાં અભ્યાસ કરતાં જરૂરીયાત મંદને શિષ્યવૃત્તિ, શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિ, વૃક્ષારોપણ, રમત-ગમત ક્ષેત્રે ક્રિકેટ, કબડ્ડીની સ્પર્ધાઓના આયોજન, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી રાષ્ટ્ર ભાવના જાગૃત કરાવવી, સ્થાનિક દેવબાગ સ્કૂલમાં ડિજીટલ વર્ગ શરૂ કરાવ્યા. સ્થાનિક ગણેશ વિસર્જન વ્યવસ્થામાં સુવ્યવસ્થા ગોઠવવામાં સહયોગી.

આમ સ્થાનિક ક્ષેત્રે જુદા-જુદા કાર્યો થકી એક આગવી ઓળખ. સ્થાનિક અન્ય સંસ્થાઓ જેવી કે શ્રી દત્ત મંદીર - ગણેશ ઉત્સવ મંડળમાં કારોબારી સભ્ય. ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટીમાં કારોબારી સભ્ય, સ્વરાધ્ય ફાઉન્ડેશન-માલવણમાં સલાહકાર, શ્રી સિંધુદુર્ગ જીલ્લા વ્યાપારી મહાસંઘમાં કારોબારી સભ્ય. આ વાત થઈ સ્થાનિક પ્રજા સાથે પોતાની કર્મભૂમીમાં પોતાની સેવાનો સહયોગ. એ જ રીતે માલવણ તાલુકા પાટીદાર યુવક મંડળ પ્રમુખ, શ્રી રત્નાગિરી સિંધુદુર્ગ જીલ્લા યુવા સંઘમાં રાજકીય કન્વીનર, શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર-ગોવા રીઝીયન યુવા સંઘમાં કા. સભ્ય. પોતાની સમાજ માટે પણ હરહંમેશ કંઈક કરવાની ભાવના સાથે હંમેશા તત્પર જ હોય છે.

કહેવામાં આવે છે કે સમાજના કે અન્ય સંસ્થાઓના કામ ધંધાને સંભાળીને ત્યારે જ શક્ય બને જ્યારે પરિવારનો સહયોગ સાંપડે. પરિવારમા પિતાજીની હૂંફ, મોટી બેન જશોદાના આશીર્વાદ, બનેવી જગદીશકુમાર ધંધામાં ભાગીદાર હોવાથી તેમનો પણ સહકાર, નાનાભાઈ પ્રકાશનો સહયોગે શાંતિભાઈને આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યુ છે. માતા દમયંતિબેન અને પત્ની ઉર્મિલાબેને પણ એમના કાર્યને હરહંમેશ પ્રોત્સાહન પુરૂ પાડ્યુ છે. અને તેમનો હોંસલો વધાર્યો છે. એમના શબ્દોમાં કહું તો આ બધાં કાર્ય પાછળ માતા-પિતાના આશીર્વાદ, બેન બનેવીનો પ્યાર, ભાઈના સહકાર થકી આ તબ્બકે પહોંચ્યો છું.

''સનાતન ધર્મ પત્રિકા'' આવા અનોખા વ્યક્તિત્વને બિરદાવે છે. અને મા ઉમિયા ને પ્રાર્થના કરે છે કે આવા હોનહાર યુવાનનો હોંસલો હંમેશા બુલંદી ઉપર પહોંચે, સમાજ અને રાષ્ટ્રને માટે સમર્પિત થઈ સેવા કરવા માટે દિર્ઘાયુ અર્પે એવી શુભેચ્છાઓ સાથે વિશેષ અભિનંદન.....!

સંપર્ક : શાંતિભાઈ પટેલ મો. ૯૪૨૨૮૮૮૬૬૬



ऋतु चर्या - Seasonal Lifestyle According To Ayurveda

पूर्ण वर्ष को आयुर्वेद में २ काल में विभक्त किया गया है- आदान काल और विसर्ग काल. आदान काल में पृथ्वी का उत्तरी छोर (north pole) सूर्य की तरफ झुक जाता है. पृथ्वी की इस क्रिया के कारण धरती पर सूर्य की गति उत्तर की ओर होती है. इस कारण इसे उत्तरायण (आयन अर्थात गति) भी कहा जाता है. आदान का अर्थ है 'ले लेना'. ये वह काल है जिसमें सूर्य एवं वायु अपने चरम पर आते हैं. इस काल में सूर्य पृथ्वी की सब उर्जा और ठंडक ले लेता है. अतः इस समय में शरीर में कमज़ोरी आने लगती है. दूसरा काल है विसर्ग काल जिसमे पृथ्वी का दक्षिण छोर सूर्य की ओर मुखरित होता है. इस लिए सूर्य की गति दक्षिण की ओर होती है. इसलिए ये दक्षिणायन भी कहा जाता है. इसे विसर्ग काल कहा जाता है जिसका अर्थ है 'प्रदान करना'. इस काल में सूर्य धरती को उर्जा प्रदान करता है.

विसर्ग काल में चंद्र प्रधान होता है. ऐसा प्रतीत होता है मानो यह संपूर्ण धरा पर नियंत्रण किए हुए हैं। सब वनस्पति और प्राणियों को चंद्र पोषण प्रदान करता है. धरती को मेघ, वर्षा और पवन के कारण ठंडक मिलती है. एक वर्ष में दो आयन होते हैं- उत्तरायण और दक्षिणायन एवं इनके कारण वर्ष में ६ ऋतु होती हैं और हर काल में ३ ऋतु होती है. आदान काल में- शिशिर, वसंत और ग्रीष्म जबकि विसर्ग काल में वर्षा, शरद और हेमंत. हर ऋतु दो माह की अवधि लिए हुए है.**आदान काल**शिशिरमाघ, फाल्गुन15 जनवरी-15 मार्च तक का समय ठंडी एवं ओसपूर्ण ऋतु

वसंतचैत्र, वैसाख15 मार्च- 15 मई तक का समयवसंत

ग्रीष्मज्येष्ठ, आषाढ़15 मई- 15 जुलाई तक का समयग्रीष्म/गर्मी**विसर्ग काल**

वर्षाश्रावण, भद्रपद15 जुलाई- 15 सितंबर तक का समयसावन/वर्षा

शरदआश्विन, कार्तिक15 सितंबर- 15 नवंबर तक का समयशरद / पतझड़

हेमंतमार्गशीर्ष, पौष15 नवंबर - 15 जनवरी तक का समयशीत/ सर्दी

शरद त्रतुचर्या

(15 सितंबर- 15 नवंबर तक का समय)

संयमित आहार-विहार द्वारा शरद ऋतु में कैसे अपने स्वास्थ्य की सुरक्षा की जा सकती है तथा इस ऋतु के रोग-विकारों से कैसे आसानी से मुक्ति पायी जा सकती है, इसी विषय पर प्रकाश डालता यह विशेष आलेख :-

ऋतु चर्या का अर्थ है ऋतु के अनुसार ही पथ्यापथ्य का सेवन करना अथवा ऋतु के अनुसार ही चेष्टा और जीवनचर्या का पालन करना. वर्ष में कुल ६ ऋतुएं होती हैं और इन ऋतुओं के अनुसार निर्दशित आहार-विहार को अपनाने वाला ही सदा स्वस्थ रहता है। आयुर्वेद में इन ६ ऋतुओं के लिए अलग-अलग आहार-विहार का वर्णन मिलता है, जिसे अपनाकर ही आरोग्य और आनंद की प्राप्ति सम्भव है।

आश्विन-कार्तिक मास की अवधि शरद ऋतु कहलाती है। शरद ऋतु के आहार-विहार तथा रोगोपचार की चर्चा के क्रम में आयुर्वेद में यह भी बताया गया है कि यह काल शक्ति संचय एवं रोग मुक्ति का काल है। सूर्य की गरम किरणों के प्रभाव से शरीर में संचित पित्त शरद ऋतु में प्रकुपित हो जाता है तथा रक्त भी पित्त के प्रकुपित होने से दूषित हो जाता है। जिनकी प्रकृति में पित्त की प्रधानता है या जो लोग पित्तजन्य रोगों जैसे एसिडिटी, चर्मरोग, सिर में दर्द, अत्यधिक प्यास लगना, ज्वर(बुखार), रक्तपित्त आदि से परेशान है उन्हें इस ऋतुचर्या का पालन अत्यधिक सावधानी के साथ करना चाहिए। ऐसी स्थिति में आहार-विहार सम्बन्धी नियमों का पालन आरोग्य लाभ के लिए अति आवश्यक है।

शरद ऋतु में विशेष रूप से खुलकर भूख लगने पर ही भोजन ग्रहण करना चाहिए तथा ग्रहण किया जाने वाला भोजन स्वाद में मधुर, हल्का तथा तिक्त रस से युक्त होना चाहिए। इस ऋतु में प्राय: ऐसा भोजन लेना चाहिए, जो पित्त नाशन का कार्य करता हो।

इस ऋतु में पीने के पानी पर सबसे अधिक ध्यान देना चाहिए क्योंकि नदी नालों के जल में वर्षा के पानी के साथ कई प्रकार के हानिकारक तत्व मिल जाते है। परिणामस्वरुप इन दिनों में दूषित जल के कारण होने वाले रोग अधिक होते हैं।

पथ्य (क्या करें):-

१] अनाज-

इस ऋतु में गेहूँ, ज्वार, बाजरे की गरम रोटी, गाय का दूध, मक्खन, घी, मलाई, श्रीखंड आदि आहार द्रव्यों का सेवन हितकर है।

२] सब्जी और दाल-

सब्जियों में चौलाई, लौकी,फूलगोभी, पालक, मेथी, गोभी, ककोड़ा, परवल, गिल्की, ग्वारफली, गाजर, मक्के का भुट्टा, तुरई, कद्दू, सहजन की फली, जमींकंद आदि का सेवन करना चाहिए। मूंग की दाल और सेम का सेवन भी लाभप्रद होगा।

અનુસંધાન પાનુ નં ૫૧


MADE FROM
IMPORTED
WOOD
Believe in
the Best
QUALITY PRODUCT
Pineapple™
PLY
BOARD
DOOR
IS 2202
CM/L-2887585
Part-1
IS 1659
CM/L-2887484
All Products are ISI Certified
Mfg.of Plywood, Block Board & Flush Door
OUR EXCLUSIVE PRODUCT RANGE
100% Imported New Zealand Pine Block Board
(M.R. & B.W.R. Grade)
100% Imported Pine Flush Door
(M.R. & B.W.R. Grade)
Marketed By
GLOBAL
PLYWOOD INDUSTRIES
Contact : Vasant Patel M.: 098252 88556
FAC.: GEETA WOOD PRODUCTS
Survey No. 112, Behind Gram Electronic (Videocon)
Village - Varsamedi, Tal. Anjar-Kutch.
email : geetawoodproducts@rediffmail.com
FINELINE 079 26577520

ऋतु चर्या - Seasonal Lifestyle According To Ayurveda

३] फल-

फलों में अंजीर, पके केले, जामफल, जामुन, तरबूज, अनार, अंगूर, नारियल, पका पपीता, गन्ना आदि। सूखे मेवों में अखरोट, आलू बुखारा, काजू, खजूर, चारोली, बादाम, सिंघाड़े, पिस्ता।

४] मसाले-

मसालों में जीरा, आंवला, धनिया, हल्दी, खसखस, दालचीनी, कालीमिर्च, सौंफ।

५] घी का सेवन विशेष फायदेमंद

घी का सेवन करना चाहिए। घी अग्नि को तो प्रदीप्त करता ही है साथ ही साथ पित्त का भी शमन करता है। इसके अलावा बरसात के दिनों में आ गई रुक्षता को भी दूर करता है। गन्ने का रस एवं नारियल का पानी खूब फायदेमंद है।

६] शरद ऋतु मे विशेष आहार-

शरद ऋतु में हरड़ का प्रयोग विशेष रूप से लाभप्रद है, अत: मिश्री अथवा गुड़ व धनिये के साथ हरड़ का सेवन करना चाहिए। इसके साथ ही शक्कर के साथ आंवले का सेवन करने से लाभ मिलता है।

शरद ऋतु में सुबह में हल्का, मधुर रस प्रधान और शीघ्र पचने वाला नाश्ता लेना चाहिए। १ गिलास दूध अथवा दूध से बनी खीर या फिर दलिया का सेवन किया जा सकता है। गुड़-घी के साथ गरम रोटी अथवा चना के सत्तू में घी और चीनी मिलाकर भी नाश्ते में लेना लाभप्रद है। इसके अलावा भुना हुआ मूंगफली दाना और भिगोया हुआ चना व किशमिश भी सेवन किया जा सकता है।

आयुर्वेद के अनुसार शरद ऋतु में पौष्टिक तत्व वाले स्निग्ध (चिकनाई), मधुर, अम्ल और लवण रस युक्त पदार्थों तथा मौसमी फलों का सेवन नियमित रूप से करना चाहिए, जैसे शुद्ध घी, ताजा मक्खन, दूध, मलाई, रबड़ी, दूध-चावल की बनी खीर, दूध व केला, ठंडे दूध के साथ रात में सोते समय गुनगुने दूध के साथ घी (१-२ चम्मच), गुड़, मिश्री, हलवा, मालपूआ, शुद्ध घी की जलेबी व दूध, पौष्टिक लड्डू व पाक, टमाटर, पालक व गाजर का रस या सूप, गोंद के लड्डू, भिगोये हुए देशी चने आदि।

७] शरद ऋतु मे विशेष विहार-

शरद ऋतु में गरम व मोटे कपड़े, चादर, पांव में मोजा तथा कान की बंद टोपी का उपयोग बाहर निकलते समय अवश्य करना चाहिए, इससे शरीर पर ठंड का असर नहीं होता है।

अभ्यंग(मालिश)-

इस ऋतु में सुबह की धूप में बैठकर तेल मालिश करनी चाहिए। तेल मालिस से विशेषकर हड्डियों को शक्ति मिलती है । मालिस के बाद स्नान करके गीले शरीर को पोंछकर सुखे, मौसम के अनुसार गरम व मोटे वस्त्र धारण करने से तरोताजगी की अनुभूति होती है।

८] पंचकर्म-

शरद ऋतु मे विरेचन कर्म (मल द्वारा शारीरिक दोषोंकों बाहर निकालना) करना चाहिए। विरेचन से दूषित पित्त दोष का शमन होने से पित्त के कारण होने वाले रोग नहीं हो पाते।

९] प्राणायाम-

शीतली व शीतकारी प्राणायाम लाभप्रद होते हैं। बाएं नासाछिद्र से गहरी श्वांस लें।

अपथ्य (क्या न करें) :-

चूंकि शरद ऋतु में पित्त व रक्त दूषित रहता है, अत: ऐसे खाद्य-पेय पदार्थों से परहेज बरतना चाहिए, जो पित्त को दूषित करते हैं, विशेषकर गरम, चरपरा व कड़वा पदार्थ नहीं लेना चाहिए।

अ] आहार-

१] मौसमी सब्जियों का कम सेवन करें, क्योंकि वर्षा ऋतु का नया पानी होने की वजह से वो दोषयुक्त होती हैं।

२] ओस, जवाखार जैसे क्षार, दही, खट्टी छाछ, गरम एवं मसालेदार वस्तुएं नहीं लें। खट्टे फल जैसे-नींबू, सन्तरा, मौसम्बी आदि का सेवन कम करें।

३] बाजरी, मक्का, उड़द, कुलथी, चौला, फूट, प्याज, नोनिया की भाजी, रतालू, बैंगन, इमली, पोदीना, फालसा, अनानास, कच्चे बेलफल, कच्ची कैरी, तिल, मूंगफली सरसों आदि पित्तकारक होत हैं अत: इनसे बचें।

४] मिर्च मसालों का प्रयोग कम करें। यदि किसी को मसालेदार ही खाना है तो उसके लिए अदरक का प्रयोग किया जा सकता है।

५] मद्यपान न करें।

६] इस ऋतु में मट्ठे का प्रयोग हानिकारक माना गया है तथा करेला, सौंफ, हींग, काली मिर्च, पीपल, सरसों का तेल आदि द्रव्यों का प्रयोग भी अधिक नहीं करना चाहिए। उड़द से बने गरिष्ठ पदार्थों का सेवन न करें। शरद ऋतु में खट्टे व चरपरे पदार्थों, जैसे कढ़ी आदि का सेवन कम करना चाहिए।

અનુસંધાન પાનુ નં ૫૩

2017-10-11 -Unjha Judgement in SDP Newspaper (932)

ऋतु चर्या - Seasonal Lifestyle According To Ayurveda

ब] विहार/ जीवनचर्या-

१] इस ऋतु में रात में त्यादा देर तक जगे रहना और दिन में सोना भी हानिकारक है, अत: ऐसा न करें और कड़ी धूप में ज्यादा देर तक न बैठें। ओस एवं शीतल हवा से बचें तथा वर्फ और सुराही का पानी सेवन न करें।

२] इस ऋतु में शरीर का बल मध्यम रहता है अत: अत्यधिक परिश्रम और अति व्यायाम करना हानिकारक है।

३] पुरवाई हवा से बचें क्योंकि ये हवा बंगाल की खाड़ी से उठने के कारण नमी लिए होती है। इस के कारण पुरानी बीमारियां जैसे- जोड़ों का दर्द आदि फिर से उखाड़ सकती हैं।

४] संयम से रहें और क्रोध अधिक न करें। जब भी समय मिले दोस्तों के साथ हंसी मज़ाक करते हुये समय व्यतीत करें।

५] इस ऋतु मे दिन और रात के तापमान में काफी अन्तर होता है। कई बार रात बहुत ठंडी भी हो जाती हैं इसलिए रात में सोते समय ये ध्यान रखना चाहिए कि शरीर कहीं से उघड़ा हुआ न रह जाये।

६] ऐसे लोग जो अपने कमरे **में एसी, पंखे या कूलर** का उपयोग करते हैं, उन्हें भी ध्यान रखना चाहिए कि उन का कमरा आवश्यकता से **अधिक ठंडा न हो**, ऐसा न करने पर वात कुपित होने की सम्भावना रहती है। जिसके कारण कई बार सुबह उठते वक्त पूरे शरीर में दर्द महसूस होता है।

७] चंदन के साथ उद्वर्तन, गर्म पानी से स्नान और मोती से बनी आभूषण प्रयोग करना इस ऋतु में सार्थक है.



ડો. કિશોર ભાવાણી (M.D. (AYU))
રીસર્ચ ઓફીસર ઈ'ચાર્જ સફદરજંગ હોસ્પિટલ, ન્યુ દિલ્હી
સી.સી.આર.એ.એસ. આયુષ મંત્રાલય, ભારત સરકાર મો ૭૪૦૫૪૦૩૧૦૬

શ્રી દેશલપર (ગુંતલી) યુવક મંડળ ૫ થી ૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમ્યાન કચ્છમાં ઉજવશે રોપ્ય મહોત્સવ

દેશલપર (ગુંતલી) ક. ક. પાટીદાર યુવક મંડળ સ્થાપનાને ૨૫ વર્ષ પુરા થતાં હોવાથી આગામી સ્નેહમિલન માદરે વતનમાં રોપ્ય મહોત્સવ તરીકે ભવ્યતામાં ઉજવવાનું નક્કી કરેલ છે. ઔરંગાબાદ ખાતે આઠમાં અધિવેશનમાં નક્કી કર્યા મુજબ આગામી અધિવેશન દક્ષિણ કોલ્હાપુર ઝોનને બદલે રોપ્ય મહોત્સવ હોવાથી કચ્છના ઉત્સાહી ભાઈઓના વિનંતીને ધ્યાનમાં રાખી આગામી અધિવેશન માદરે વતનમાં ભવ્યતાથી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ. તે બાબતમાં હાલમાં ૩-૯-૧૭ રોજ સુરત મુકામે કાર્યકર્તાઓની આયોજન બાબતની સભામાં વિચાર વિનિમય કરી રૂપરેખા નક્કી કરવામાં આવેલ.

શ્રી ઉમિયા માતાજી ધામ સુરત મુકામે વડીલ શ્રી માવજીભાઈ મુળજીભાઈ વેલાણીની હાજરીમાં પ્રમુખશ્રી દયારામ અરજણ ભાદાણી (કોલ્હાપુર) ના પ્રમુખપદે લેવાયેલ આ સભામાં મંત્રીશ્રી હસમુખ મનજી દિવાણી(ઈચલકરંજી) દ્વારા મિનીટ બુકનું વાંચન કરવામાં આવેલ અને ખજાનચી શ્રી દિલીપ માવજી દિવાણી (ઈચલકરંજી) દ્વારા ફંડફાળા બાબત જાણકારી આપવામાં આવેલ. ગત કારોબારીમાં નક્કી કર્યા મુજબ દરેક ઝોનની આર્થિક સહાયતાથી રોપ્ય મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ. જેના માટે આયોજન સમિતિની રચના કરવામાં આવેલ જેના પ્રમુખપદે શ્રી મનસુખ રવજીભાઈ ચૌધરી (હેદરાબાદ) સાથે વિવિધ સમિતિઓની જવાબદારીઓ ઉત્સાહી ભાઈઓને સોપવામાં આવેલ. કચ્છની ઠંડીનો ખાસ અનુભવ લેવા અને રણ મહોત્સવનો લહાવો મળે તે હેતુથી ૫ થી ૭ જાન્યુઆરી ૨૦૧૮ એમ ત્રણ દિવસીય મહોત્સવ માણવાનું નક્કી કરવામાં આવ્યું. આ મહોત્સવમાં સત્કાર અને સન્માન, રમતગમત, સાંસ્કૃતિક, પતંગ મહોત્સવ, શ્રી ગુંતલી માતાનો ધાર્મિક મહોત્સવ અને કચ્છના રણમાં મોડી રાત્રી સુધી ચાલતા રણ મહોત્સવ જેવા આનંદ ઉત્સવો સાથે રોપ્ય મહોત્સવ ને યાદગાર બનાવવા માટે સૌએ પોતાના મંતવ્યો રજુ કરેલ.

રોપ્ય મહોત્સવમાં સમય અને સુગમતા માટે આ વખતે સરસ્વતી સન્માન ફક્ત ગ્રેજુએટ અને પોસ્ટ ગ્રેજુએટસ ભાઈ-બહેનો જ પાત્ર રહેશે. શેક્ષણિક વર્ષ ૨૦૧૪-૨૦૧૫, ૨૦૧૫-૨૦૧૬, ૨૦૧૬-૨૦૧૭ ના સર્વે સન્માનપાત્ર ભાઈ-બહેનોએ તેમના સર્ટીફીકેટ (માર્કશીટ) આગળના અડ્રેસ પર તા. ૩૧-૧૦-૧૭ સુધી જમા કરાવવા વિંનતી.

મધ્ય-ઔરંગાબાદ ઝોન : શ્રી રવજીભાઈ જાદવજીભાઈ દિવાણી ૯૯૬૦૪૨૩૪૩૨ Email : patelravji67gmail.com

દક્ષિણ-કોલ્હાપુર ઝોન : શ્રી દિનેશભાઈ સામજી વાડિયા ૯૫૪૫૧૧૯૯૮૮ Email : dineshpatel9988gmail.com

પૂર્વ-ઉતર આન્ધ્ર ઝોન : શ્રી જગદીશ અંબાલાલ દિવાણી ૯૮૪૯૯૦૪૯૯૩ Email : jagdishapatel73gmail.com

કચ્છ ઝોન : શ્રી શાંતિલાલ દયાલાલ સાંખલા ૯૧૦૬૮૪૬૭૫૩

સુરતના વેલાણી પરિવારે આ સભાની સુંદર આયોજન કરેલ તે બદ્દલ તેમનો શાબ્દિક આભાર માનવામાં આવ્યો હતો.


સનાતની જ્ઞાતિજનોને દિપાવલીની શુભેચ્છા સહ..નૂતન વર્ષાભિનંદન
શ્રી રત્નાગિરી – સિંધુદુર્ગ જીલ્લા પાટીદાર સમાજ
રૂમઝુમ કરતી દિવાળી આવી, ભલે આવી, એની સાથે શું શું લાવી ?
સર્વત્ર હર્ષ અને ઉલ્લાસ લાવી, દિવડાની જ્યોતનો પ્રકાશ લાવી,
મિઠાઈઓ ખાવાની લિજ્જત લાવી, આંગણે રંગોળીની સરસ ભાત લાવી,
ફટાકડા ફોડી હરખાવાની મજા આવી, મિત્રો સગાંઓને મળવાની તક લાવી,
અંતરમાં અજવાળુ કરવાનું પર્વ લાવી......
શુભેચ્છકો
પ્રમુખ
શ્રી નરસિંહભાઈ છાભૈયા
ઉપપ્રમુખ
શ્રી છગનભાઈ ધોળુ
મહામંત્રી
શ્રી કાન્તીભાઈ ઠાકરાણી
મંત્રી
શ્રી કાન્તીભાઈ પોકાર
સહ મંત્રી
શ્રી રસિકભાઈ રંગાણી
ખજાનચી
શ્રી મોહનભાઈ લિંબાણી
ઓડીટર
શ્રી પ્રવિણભાઈ રંગાણી
શ્રી રત્નાગિરી – સિંધુદુર્ગ જીલ્લા પાટીદાર મહિલા સંઘ
સ્થાપના ના પ્રથમ વર્ષ નિમિત્તે વિશેષ શુભેચ્છા સહ...
પ્રમુખ
સૌ. હંસાબેન ધોળુ
ઉપપ્રમુખ
સૌ. રૂક્ષ્મણીબેન ભોજાણી
.....પ્રમુખ
સૌ. પ્રભાબેન લિંબાણી
મહામંત્રી
સૌ. પ્રમિલાબેન રૂડાણી
મંત્રી
સૌ. ચંપાબેન ધોળુ
સહ મંત્રી
સૌ. હર્ષાબેન ઠાકરાણી
ખજાનચી
સૌ. નીતાબેન લિંબાણી
સહ ખજાનચી
સૌ. રમિલાબેન છાભૈયા
શ્રી રત્નાગિરી – સિંધુદુર્ગ જીલ્લા પાટીદાર યુવા સંઘ
દશાબ્દી વર્ષ નિમિત્તે......વિશેષ શુભેચ્છા સહ.....
પ્રમુખ
શ્રી રમણિકલાલ ઠાકરાણી
IPP
શ્રી વિશ્રામભાઈ રૂડાણી
ઉપપ્રમુખ
શ્રી રસીકભાઈ રંગાણી
મહામંત્રી
શ્રી સંજયભાઈ છાભૈયા
મંત્રી
શ્રી ગોવિંદભાઈ છાભૈયા
સહ મંત્રી
શ્રી મોહનભાઈ ઠાકરાણી
ખજાનચી
શ્રી ધીરજભાઈ પોકાર
સહ ખજાનચી
શ્રી નરેન્દ્રભાઈ પોકાર
ઓડીટર
શ્રી યોગેશભાઈ છાભૈયા
PRO
શ્રી ગૌતમભાઈ વાલાણી
શ્રી સમાજ મહિલા સંઘ તથા યુવા સંઘમાં સમાવિષ્ટ થતાં તાલુકાઓ
૧. કુડાળ
૨. કણકવલી
૩. માલવણ
૪. દેવગડ
૫. તરલા વૈભવવાડી
૬. રાજાપુર
૭. લાંજા
૮. સંગમેશ્વર-દેવરૂખ
૯. ચિપલૂણ
૧૦. ગુહાગર
૧૧. ખેડ
૧૨. દાપોલી
૧૩. મંડણગડ
realpatidar.com

મધ્ય ગુજરાત ઝોન સામાન્ય સભા

આણંદ મધ્યે કેન્દ્રીય સમાજના મધ્ય ગુજરાત ઝોનની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

નવીન કારોબારીની રચના કરાઇ

આણંદ મધ્યે તા.૨૩ જુલાઇ ૨૦૧૭ ને રવિવારના રોજ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ-મધ્ય ગુજરાત ઝોનની સામાન્ય સભા મળી હતી.

હોદેદારશ્રીઓના સ્થાનગ્રહણ બાદ ઝોન સમાજના આમંત્રણને માન આપી પધારેલા મોટી સંખ્યામાં હાજરી અંગે મહામંત્રીશ્રી અમૃતભાઇ માકાણીએ હર્ષની લાગણી વ્યક્ત કરેલ અને મા ઉમિયા માતાજી, લક્ષ્મીનારાયણ ભગવાન અને સનાતન ધર્મના જયઘોષ સાથે આવકાર્યા હતા.

મહામંત્રીશ્રી અમૃતભાઇ માકાણીએ આજની આ સભાના અધ્યક્ષ સ્થાન માટે આણંદ સમાજના પ્રમુખશ્રી તેજાભાઇ વેલજીભાઇ નાકરાણીની વરણી કરાવ્યા બાદ અધ્યક્ષ મહોદય તેમજ મંચસ્થ હોદેદારશ્રીઓના વરદ્ હસ્તે મા ઉમાનો દિપ પ્રગટાવી દિપદેવની સાથે ગજાનન ગણપતિ મહારાજને યાદ કરી સભાની શરુઆત કરાવી હતી. પુરા થતાં વર્ષ દરમ્યાન આપણી વચ્ચેથી વિદાય લઇ પ્રભુને પ્યારા થનારા કેન્દ્રીય સમાજના પૂર્વ મહામંત્રી માવજીભાઇ ભગત સેવા ભાવી ડૉ. વી.કે.પટેલ અને સરહદ ઉપર શહીદ થનારા આપણા જવાનો તેમજ નામે અનામી વ્યક્તિઓ પ્રત્યે બે મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવે ઉપસ્થિત સર્વે સભ્યોનું શાબ્દીક સ્વાગત સહમંત્રીશ્રી નથુભાઇ પોકારે તેમની આગવી શૈલીથી કરેલ.

મહામંત્રીશ્રી અમૃતભાઇ એલ માકાણીએ જણાવેલ કે આપસૌ ખુબજ મોટી સંખ્યામાં અમારા આમંત્રણને માન આપી પધાર્યા છો તે બદલ આનંદની લાગણી અનુભવું છું ત્યારબાદ એજન્ડા મુજબની કાર્યવાહીમાં તા.૩૧.૭.૧૬ની સામાન્ય સભામાં થયેલ કાર્યવાહીની મિનિટસનું વાંચન સહમંત્રીશ્રી પ્રહલાદભાઇ પોકાર-હાલોલ એ કર્યું અને બહાલી અપવામાં આવી હતી. ઝોનના વાર્ષિક હિસાબો ખજાનચીશ્રી ખીમજીભાઇ પોકાર માત્ર દ્વારા કરવામાં આવેલ જેને સભાએ બહાલી આપી હતી. આવેલા પાઠોનું વાંચન મહામંત્રીશ્રી અમૃતભાઇ માકાણીએ કરેલ અને વર્ષ દરમ્યાન હોદેદારશ્રીઓ અને કારોબારી સભાઓમાં કરવામાં આવેલ નિર્ણયો અંગેની માહિતી મહામંત્રીશ્રી અમૃતભાઇ એલ. માકાણી એ આપી અને સભાનો બહાલી મેળવી હતી જેમાં ઝોનમાં આવતી ઘટક સમાજ માટે જ્યારે પણ પોતાની સમાજમાં નવી એન્ટ્રી માટે કોઇપણ સનાતની સભ્ય આવે ત્યારે તે સભ્ય પાસેથી તેઓ જ્યારથી આવ્યા હોય તે સમાજનું સંમતીપત્ર નોઓબજેકશન સર્ટીફીકેટ લેવું અને ત્યારબાદ જ નવી એન્ટ્રી આપવી.

એલ.એસ.ભાવાણી હોસ્ટેલ અંગેની માહિતી અને ગતીવિધિનીનો અહેવાલ વિસ્તાર પૂર્વક મહેન્દ્રભાઇ પોકારે રજૂ કરેલ. ન્યાય સમિતિનો અહેવાલ માવજીભાઇ લીંબાણી નડીયાદ એ રજુ કરેલ

કેન્દ્રીય સમાજના મધ્ય ગુજરાત ઝોન પ્રભારી શ્રી દેવજીભાઇ ભાવાણી-સુરત એ કેન્દ્રીય સમાજની ગતિવિધીથી સભાને માહિતગાર કરેલ જેમાં નખત્રાણા મુકામે શરુ કરવામાં આવેલ ટુંકા ગાળાના કોર્સ બાબતે ગાંધીધામ સમાજવાડીનો ઉદઘાટન કાર્યક્રમ અને ત્યાંની રહેવાની વ્યવસ્થા જેમાં એસી-નોન એસી રુમો સાથેની વાડીનો લાભ લેવા હાકલ કરેલ.

ચાલુ વર્ષે કેન્દ્રીય સમાજની કારોબારી સમિતિની મુદત પુરી થતી હોઇ દરેક સભ્યોએ વધુમાં વધુ સંખ્યામાં હાજર રહેવા જણાવેલ. મધ્ય ગુજરાત ઝોનની મીટીંગનું સંચાલન અને ઝોન પરીવારની ભાવના સાથે ચાલે છે તે હું જોઇ રહ્યો છું જે ધન્યવાદને પાઠવે છે.એલ.એસ.ભાવાણી હોસ્ટેલનો વહીવટ પણ સુવ્યવસ્થિત રીતે કરી રહ્યા છો તે બદલ ઝોનના સર્વે કાર્યકર્તા અને તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ.

મુક્ત મંતવ્યોમાં

નારણભાઇ માકાણી-વડોદરા. વાલજીભાઇ વી.આઇ.પી. રોડ, અમૃતભાઇ ઠાકરાણી-વડોદરા, ધનજીભાઇ-નડીયાદ, પરસોત્તમભાઇ-હરણી, વસંતભાઇ નડીયાદ,હીરાલાલ-કપડવંજ અને પ્રહલાદભાઇ પોકારે પોતાના વિચારો રજુ કરેલ.

યુવાસંઘ મહામંત્રીશ્રી મોહનભાઇ ધોળુએ યુવાસંઘની ગતી વિધીથી સભાને માહિતગાર કરેલ સાથે એસ.યુ.વી. દશાબ્દી મહોત્સવ જે વલથાણ મુકામે યોજાવાનો છે તેની માહિતી આપી હતી.

પ્રમુખશ્રી તેજાભાઇએ સૌ પ્રથમ મુક્ત મંતવ્યોમાં પોતાના વિચારો રજુ કરનારા તમામ સભ્યોનો આભાર માનેલ અને તેમના સુચનો અને પરત્વે ધ્યાન રાખવામાં આવશે તેવું જણાવેલ અને પોતાના કાર્યકાળમાં પોતાનાથી કે સમિતિ વતી કોઇ ભુલ થઇ હોય તો સૌ કોઇ તેને ભુલી માફ કરશો આપનો સહકાર અમોને ભરપુર મળ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે યુવા સંઘ સરદાર રીજીયન દ્વારા આયોજીત થનગનાટના પ્રોગ્રામ થકી થયેલ આવકમાંથી હોસ્ટેલમાં દાન કરવા બદલ યુવા સંઘ સરદાર રીજીયનનો આભાર માનેલ અને હવે જ્યારે નિયમ મુજબ અમારી સમિતિની મુદત પુરી થતી હોઇ નવી સમિતિની રચના કરવા આ સમિતિના વિસર્જનની જાહેરાત કરેલ અને આગળની કાર્યવાહી કરવા મહામંત્રીશ્રી અમૃતભાઇ માકાણીને જણાવેલ.

મહામંત્રીશ્રી અમૃતભાઇ માકાણીએ જણાવેલ કે નવી કારોબારીના ગઠન માટે ઝોનની ઘટક સમાજો પાસેથી તેમની સમાજમાંથી લેવાના થતા કારોબારી સભ્યોના નામોની યાદી અગાઉથી જ મંગાવી લીધી છે જે યાદી માટે સભા પાસે મંજુરી માગતાં સૌ હાજર તમામ સભ્યોએ હાથ ઉંચા કરી મંજુર કરેલ. હોદેદારોની નિમણુક માટે કેન્દ્રીય સમાજના મધ્ય ગુજરાત ઝોન પ્રભારી શ્રી દેવજીભાઇ ભાવાણીને ચૂંટણી અધ્યક્ષ તરિકે નિમવાના આવ્યા ત્યાર બાદ આગામી ત્રણ વર્ષ માટે હોદેદારોની નિમણુક કરેલ જેનેસૌ કોઇ સભ્યોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ.

પ્રમુખશ્રી ધનજીભાઇ દામજીભાઇ સાંખલા-નડીયાદ, ઉપપ્રમુખશ્રી હરીભાઇ પ્રેમજીભાઇ ધોળુ-પેટલાદ, ઉપપ્રમુખશ્રી નથુભાઇ કરમશીભાઇ પોકાર-કઠલાલ, ઉપપ્રમુખશ્રી નારણભાઇ પ્રેમજીભાઇ માકાણી-વડોદરા, મહામંત્રીશ્રી અમૃતભાઇ લખુભાઇ માકાણી-બોરસદ, સહમંત્રીશ્રી ચંદુભાઇ વિશ્રામભાઇ ભાદાણી-આણંદ, જયંતીભાઇ દેવજીભાઇ ભગત-કપડવંજ, ભરતભાઇ મગનભાઇ લીંબાણી-પદમલા, ખજાનચીશ્રી ખીમજીભાઇ જીવરાજભાઇ પોકાર-માતર, સહખજાનચીશ્રી જયંતીભાઇ રામજીભાઇ પોકાર-પણસોરા, નરસિંહભાઇ રતનશીભાઇ લીંબાણી-નડિયાદ, ભવાનભાઇ માવજીભાઇ વાગડીયા-વડોદરા, ન્યાય સમિતિ : ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ કાનજીભાઇ પોકાર-આણંદ, મંત્રીશ્રી ધરમશીભાઇ તેજાભાઇ પોકાર-વડોદરા, ખજાનચીશ્રી માવજીભાઇ વસ્તાભાઇ લીંબાણી-નડીયાદ

નવા નિમાયેલ પ્રમુખ શ્રી ધનજીભાઇ દામજીભાઇ સાંખલા એ પ્રથમ પ્રમુખ તરીકેનું પ્રવચન કરેલ અને આપ સૌએ તેમનામાં મુકેલ વિશ્વાસ માટે તન મન અને ધન થકી તેને પુરો કરવાનો પ્રયાસ કરીશ. મહામંત્રીશ્રી અમૃતભાઇ માકાણીએ જણાવેલ કે આપ સૌએ પુનઃ મારામાં જે વિશ્વાસ મુક્યો છે તેને આગળ ધપાવવાનો પ્રયત્ન કરીશ.

આભારવિધિ સહમંત્રીશ્રી ચંદુભાઇ ભાદાણી એ કરેલ અને રાષ્ટ્રગાન સાથે સભાને પ્રમુખશ્રીની મંજુરીથી પુર્ણ જાહેર કરેલ.

પ્રતિનિધિ : અમૃતભાઇ માકાણી

આપ સહુને દિવાળી અને નૂતન વર્ષની સુખ-સમૃદ્ધિ માટે હાર્દિક શુભેચ્છા.....

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, યલહંકા, બેંગલોર

હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ

પ્રમુખ : શ્રી વિશ્રામભાઈ લાલજીભાઈ છાભૈયા   ઉપ પ્રમુખ : શ્રી રવિલાલ લખમશીભાઈ ધનાણી

મહા મંત્રી : શ્રી ધીરજલાલ માવજીભાઈ દિવાણી   મંત્રી : શ્રી નવીનભાઈ ધનજીભાઈ સોમજીયાણી   સહ-ખજાનચી : શ્રી પુરૂષોત્તમભાઈ લખમશીભાઈ વેલાણી

મંત્રી : શ્રી નરેશભાઈ લખમશીભાઈ દિવાણી   ખજાનચી : શ્રી લખમશીભાઈ રાજાભાઈ દિવાણી   ઓડીટર : શ્રી ચંદુલાલ કરશનભાઈ દિવાણી

શ્રી ધનસુખભાઈ મુળજીભાઈ સુરાણી ● શ્રી નાનજીભાઈ લધારામભાઈ લીંબાણી ● શ્રી રમેશભાઈ હીરજીભાઈ દિવાણી ● શ્રી મણીલાલ કરશનભાઈ લીંબાણી ● શ્રી લાલજીભાઈ લધારામભાઈ ધોળુ
શ્રી પુરૂષોત્તમભાઈ શામજીભાઈ છાભૈયા ● શ્રી બેચરભાઈ શીવદાસભાઈ સુરાણી ● શ્રી પ્રવિણભાઈ વિશ્રામભાઈ છાભૈયા ● શ્રી કિશોરભાઈ રામજીભાઈ સુરાણી

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મહિલા મંડળ, યલહંકા, બેંગલોર

હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યોશ્રીઓ

પ્રમુખશ્રી : ગીતાબેન વિશ્રામભાઈ છાભૈયા   મહામંત્રીશ્રી : ભગવતીબેન ગોવિંદભાઈ દિવાણી   ખજાનચીશ્રી : હેમલતાબેન અરવિંદભાઈ સુરાણી

ઉપ પ્રમુખશ્રી : તારાબેન પુરૂષોત્તમભાઈ છાભૈયા   સહમંત્રીશ્રી : ભગવતીબેન ધીરજલાલ દિવાણી   સહ ખજાનચીશ્રી : વનીતાબેન નરેશભાઈ દિવાણી

શારદાબેન પુરૂષોત્તમભાઈ લીંબાણી ● ઉષાબેન હરેશભાઈ વેલાણી ● નિર્મલાબેન ધનસુખભાઈ સુરાણી ● ચંદ્રિકાબેન ગૌતમભાઈ પાંચાણી ● નર્મદાબેન રમેશભાઈ લીંબાણી
જયશ્રીબેન પુરૂષોત્તમભાઈ રામાણી ● ચેતનાબેન હિતેશભાઈ નાકરાણી ● અરૂણાબેન નરેન્દ્રભાઈ લીંબાણી ● ગૌરીબેન વાડીલાલ નાકરાણી

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ યુવક મંડળ, યલહંકા, બેંગલોર

હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ

પ્રમુખ : શ્રી પ્રવિણભાઈ વિશ્રામભાઈ છાભૈયા   મહામંત્રી : શ્રી કિશોરભાઈ રામજીભાઈ સુરાણી   ખજાનચી : ભરતભાઈ માવજીભાઈ ભગત

ઉપ પ્રમુખ : શ્રી રમેશભાઈ લધારામભાઈ લીંબાણી   સહમંત્રી : શ્રી મહેન્દ્રભાઈ શીવદાસભાઈ ધોળુ   સહ ખજાનચી : જગદીશભાઈ રમેશભાઈ તેજાણી

ઉપ પ્રમુખ : શ્રી ભરતભાઈ રવજીભાઈ નાયાણી   સહ મંત્રી : શ્રી જગદીશભાઈ મોહનભાઈ પાંચાણી   ઓડીટર : પંકજભાઈ પુરૂષોત્તમભાઈ છાભૈયા

નવીન લખમશીભાઈ વેલાણી ● લહેરીકાંત રવજીભાઈ ધનાણી ● ગૌતમ ગંગદાસભાઈ કેશરાણી ● હરેશ અરજણભાઈ લીંબાણી ● મનસુખ લાલજીભાઈ સુરાણી
બિપીન દેવરામભાઈ રામાણી ● ગૌતમ ખીમજીભાઈ પાંચાણી ● વિનોદ બેચરભાઈ સુરાણી ● પ્રકાશ મણીલાલ નાકરાણી ● સુરેશ વિશ્રામભાઈ નાકરાણી ● હર્ષદ ધીરજભાઈ દિવાણી ●
અમિત મણીલાલ લીંબાણી ● કિરણ અરવિંદભાઈ સુરાણી ● દીપેશ પોપટલાલ પાંચાણી ● અમિત શાંતીલાલ સુરાણી ● રાજેન્દ્ર લાલજીભાઈ ધોળુ

દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, દોડ્ડબાલાપુર, બેંગલોર

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, દોડ્ડબાલાપુર સાથે સંકળાયેલા દરેક પરિવારજનોને તથા સમગ્ર કચ્છ કડવા સનાતન પાટીદાર સમાજના પરિવારજનોને દીપાવલીની શુભ કામનાઓ સાથે સંવત ૨૦૭૪ ના મંગલમય પ્રભાતથી શરૂ થતું નૂતન વર્ષ આપ સર્વેને સુખદાયી, શુભદાયી અને લાભ કરનાર રહે એવી શુભ ભાવના સાથે નૂતન વર્ષાભિનંદન.....

-: સમાજના હોદ્દેદારશ્રીઓ :-

પ્રમુખ : શ્રી વીરજીભાઈ નારાયણભાઈ ભાવાણી
ઉપ પ્રમુખ : શ્રી પુરૂષોત્તમભાઈ રામજીભાઈ ભાવાણી
ઉપ પ્રમુખ : શ્રી શાંતીલાલ ગોવિંદભાઈ ભાવાણી
મહામંત્રી : શ્રી ગંગદાસભાઈ નારાયણભાઈ ભાવાણી
સહમંત્રી : શ્રી રતનશીભાઈ સોમજીભાઈ દિવાણી
ખજાનચી : શ્રી નરસિંહભાઈ મનજીભાઈ નાકરાણી
સહ ખજાનચી : શ્રી લાલજીભાઈ કાનજીભાઈ ચૌહાણ

-: કારોબારી સભ્યશ્રીઓ :-

શ્રી રવજીભાઈ ભીમજીભાઈ ભાવાણી   શ્રી દિનેશભાઈ રામજીભાઈ ભાવાણી
શ્રી પ્રવિણભાઈ રામજીભાઈ ભાવાણી   શ્રી નરેન્દ્રભાઈ લાલજીભાઈ ચૌહાણ

-: મહિલા મંડળના હોદ્દેદારો :-

પ્રમુખ : પાર્વતીબેન વીરજીભાઈ ભાવાણી   સહમંત્રી : કલાબેન ગંગદાસભાઈ ભાવાણી
ઉપ પ્રમુખ : જયાબેન રવજીભાઈ ભાવાણી   ખજાનચી : નર્મદાબેન પુરૂષોત્તમભાઈ ભાવાણી
મંત્રી : દમયંતીબેન શાંતીભાઈ ભાવાણી   સહ ખજાનચી : નર્મદાબેન લાલજીભાઈ ચૌહાણ

-: યુવક મંડળના હોદ્દેદારો :-

પ્રમુખ : શ્રી વિઠ્ઠલભાઈ નારાયણભાઈ ભાવાણી
ઉપ પ્રમુખ : શ્રી દિનેશભાઈ રામજીભાઈ ભાવાણી
મંત્રી : શ્રી વિનોદભાઈ રામજીભાઈ ભાવાણી
સહમંત્રી : શ્રી મનોજભાઈ વીરજીભાઈ ભાવાણી
ખજાનચી : શ્રી મણીલાલ ગોવિંદભાઈ ભાવાણી
સહ ખજાનચી : શ્રી અશોકભાઈ નરસિંહભાઈ નાકરાણી

આણંદ મધ્યે આગામી તુલસી વિવાહના દિવસે સપ્તમ સમુહલગ્નના આયોજન સંદર્ભે આણંદ જીલ્લા ક.ક.પા. સનાતન સમાજની જનરલ સભા યોજાઇ

આણંદ મધ્યે તા.૩ સપ્ટેમ્બર ૨૦૧૭ ને રવિવારના રોજ શ્રી આણંદ જીલ્લા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની જનરલ સભા સપ્તમ સમુહ લગ્નોત્સવના આયોજન સંબંધે વિશાળ જ્ઞાતિજનોની હાજરીમાં મળી હતી. હોદેદારશ્રીઓના સ્થાન ગ્રહણ બાદ જીલ્લા સમાજના આમંત્રણને માન આપી પધારેલા વિશાળ જ્ઞાતિજની હાજરી અંગે મહામંત્રીશ્રી અમૃતભાઇ માકાણીએ હર્ષની લાગણી વ્યક્ત કરેલ અને મા ઉમિયા-માતાજી, લક્ષ્મીનારાયણ ભગવાન અને સનાતન ધર્મના જયઘોષ સાથે આવકાર્યા હતા.

મહામંત્રીશ્રી અમૃતભાઇ માકાણીએ આજની આ સભાના અધ્યક્ષ સ્થાન માટે આણંદ સમાજના પ્રમુખ શ્રી તેજાભાઇ વેલજીભાઇ નાકરાણીની વરણી કરાવ્યા બાદ અધ્યક્ષ મહોદય તેમજ મંચસ્થ હોદેદારશ્રીઓના વરદ હસ્તે મા ઉમાનો દિપ પ્રગટાવી દિપદેવની સાથે ગજાનન ગણપતિ મહારાજને યાદ કરી સભાની શરુઆત કરાવી હતી.

પુરા થતા વર્ષ દરમ્યાન આપણી વચ્ચેથી વિદાય લઇ પ્રભુ ને પ્યારા થનારા સ્વજનો પ્રત્યે બે મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. ઉપસ્થિત સર્વે સભ્યોનું શાબ્દીક સ્વાગત ઉપપ્રમુખશ્રી જયંતીભાઇ પોકારે તેમની આગવી શૈલીથી કર્યું.

મહામંત્રીશ્રી અમૃતભાઇ એલ. માકાણીએ જણાવેલ કે આપસૌ ખુબજ મોટી સંખ્યામાં અમારા આમંત્રણને માન આપી પધાર્યા છો તે બદલ આનંદની લાગણી અનુભવું છું.

એજન્ડા મુજબની કાર્યવાહીમાં ગત સામાન્ય સભામાં થયેલ કાર્યવાહીની મિનિટસનું વાંચન સહમંત્રીશ્રી ચંદુભાઇ ભાદાણી-આણંદ એ કર્યું અને બહાલી આપવામા આવી હતી. બાદમાં પોતાની વ્યસ્તતા હોવા છતાં પણ સમાજ માટે સમય ફાળવી સમાજના હિસાબો તૈયાર કરનાર ઓડીટર શ્રી હિંમતભાઇ વાગડીયા (સીએ) હિસાબોનું વાંચન કરી બહાલી અપાવી હતી.

વર્ષ દરમ્યાન થયેલ કારોબારી સભાઓમાં કરવામાં આવેલ. નિર્ણયો અંગની માહિતી મહામંત્રીશ્રી અમૃતભાઇ એલ. માકાણી એ આપી અને સભાની બહાલી મેળવી હતી જેમાં છઠ્ઠા સમુહ લગ્ન બાદ બે કારોબારી સભાઓનું આયોજન કરવામાં આવેલ.

ભંડોળ બાબતે બંધારણમાં બનાવેલ ઠરાવ મુજબ બચત રહેતી રકમ લોન પેંટે ૧૨ ટકા વ્યાજે લોકલ સમાજના પ્રમુખ અને મંત્રીની સહી અને જવાબદારીથી આપવામાં આવી જે અંગે ખજાનચીશ્રી એ હીસાબોમાં વાંચનમાં લીધું.

સપ્તમ સમુહ લગ્નની તા.૩૧.૧૦.૨૦૧૭ સંવત ૨૦૭૪ ને કારતક સુદ-૧૧ નક્કી કરવામાં આવી.

લગ્ન સમિતિઓની સરાહનીય કામગીરીને ધ્યાન પર લેતાં જે તે સમિતિઓને રિપિટ કરવી એવું નક્કી કરવામાં આવેલ. જે લીસ્ટનું લાંચન કરવામાં આવ્યું.

સપ્તમ સમુહ લગ્નમાં થનારા ખર્ચ અને કન્યાદાન વસ્તુભેટ અંગેનું લીસ્ટ છઠ્ઠા સમુહ લગ્નમાં નક્કી કરવામાં આવેલ લિસ્ટમાં થોડા ફેરફારો સાથે મંજૂર કરવામાં આવ્યા.

લગ્ન નોંધણી ફીની રકમમાં ફેરફાર કરવામાં આવેલ.

કારોબારી સભામાં થયેલ કાર્યવાહી અને આપ સર્વે એ આપેલ મંજુરી બાદ મહામંત્રી શ્રી અમૃતભાઇ એલ. માકાણીએ જણાવ્યું કે હવે જ્યારે આપણી સમાજના પ્રાંગણમાં આયોજીત થનારા સાતમા સમુહલગ્નના આયોજનરુપે થનારા ખર્ચને પહોંચી વળવા દાતાઓ લેવાની કાર્યવાહી શરુ કરવા જઇ રહ્યા છીએ ત્યારે સમાજે નક્કી કરેલ પધ્ધતી જણાવી હતી જેમાં અનુદાન ખર્ચ અને કન્યાદાન વસ્તુ ભેટની આઇટમો અને તેની રકમો સાથેનું લીસ્ટ દરેક સમાજોને મોકલી આપવામાં આવેલ છે.

કોઇપણ પ્રકારે સહયોગી બનનારા દાતા માટે આપણે ચડાવા લેતા નથી પરંતુ નક્કી કરેલ ફીક્સ રકમ જ લેવામાં આવશે.

દાતા તરીકે એકજ નામ આવશે તો તેનું નામ તરત જ જાહેર કરવામાં આવશે પરંતુ એકથી વધુ નામ આવે તો ડો સિસ્ટમથી એક નામ જાહેર કરવામાં આવશે.

સમુહલગ્ન ખર્ચ દાતા પેંટે રુ.----- કે તેથી વધુની રકમ અને કન્યાદાન વસ્તુ ભેટના દાતાનું જાહેર સન્માન કરવામાં આવશે.

તમામ પ્રકારે સહયોગી બનનારા દાતાઓશ્રીઓના બેનર બનાવવામાં આવશે જે લગ્ન મંડપ પર રાખવામાં આવશે.

મુખ્ય ભોજનદાતા અને મંડપના દાતા વિશેષ બેનર બનાવવામાં આવશે જે બેનર લગ્ન મંડપ અને ભોજન મંડપ પર રાખવ-ામાં આવશે.

કન્યાદાન વસ્તુ ભેટ માટે ચોવીસ આઇટમ માટે ૨૬ દાતા લેવાના છે જે ડૉ. સિસ્ટમથી જાહેર કરવામાં આવશે.

કન્યાદાનની કુલ આઇટમ ૨૭ જેમાં પાનેતર તથા ચાંદીની ગાય ફીક્સ કરેલ છે.

પ્રમુખશ્રી તેજાભાઇ વેલજીભાઇ નાકરાણીએ જણાવેલ કે અત્યાર સુધી ૧૪ લગ્નો નોંધાઇ ગયેલ છે જે આપણી સૌની કામગીરીના ભાગ રુપે છે અગાઉની જેમ જ આપણને આ સાતમા સમુહલગ્ન માટેના મુખ્ય ભોજનના દાતા મળી ગયેલ છે લક્ષ્મી ગ્રુપ યુવક મંડળ આણંદ અને ભોજનદાતા તરીકે સ્વ.માધવજીભાઇ હીરજીભાઇ ભાવ-ાણી પરીવાર-આણંદ મળી ગયેલ છે જે જણાવતાંની સાથે જ્ઞાતિજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ. આપણે સૌ જીલ્લા સમાજના પરિવાર રુપે વર્ષમાં ફક્ત એકજ વખત મીટીંગના સ્વરુપે મળીએ છીએ. આપ સર્વે સભ્યો તન મન અને ધનથી સહકાર આપશો તેવી વિનંતી સાથે આશા વ્યક્ત કરેલ અને દાતાઓને પણ ઉદાર હાથે દાન આપી આ સમૂહલગ્ન રુપી યજ્ઞમાં સાથ આપવા પ્રોત્સાહીત કરેલ અને ભોજન દાતા અને મંડપદાતાનો વિશેષ આભાર વ્યક્ત કરેલ. લગ્ન પત્રિકામાં હવે સમાજ પણ ભાગ લઇ શકશે એવું સર્વ સંમત નક્કી કરવામાં આવ્યું. અને સાથે હવે આવતા સમુહલગ્નમાં દાતાની જાહેરાતના ભાગ રુપે જગ્યા પણ વધારે આપવાનું નક્કી કરવામાં આવ્યું.

આગળનું સંચાલન સહમંત્રી શ્રી ચંદુભાઇ ભાદાણીએ સંભાળ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે આગામી છઠ્ઠા સમુહલગ્ન માટે દાતાઓ થવા માટે વિનંતી કરતા આવેલ ચિઠ્ઠીઓમાંથી અગાઉ નક્કી કરવામાં આવેલ પદ્ધતિ મુજબ ડૉ સિસ્ટમથી દાતાઓના નામ જાહેર કરવામાં આવ્યા જેને સભાએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધેલ. નક્કી થયેલ દાતામાં ૧. મુખ્ય ભોજના દાતા શ્રી લક્ષ્મી ગ્રુપ યુવક મંડળ-આણંદ, ૨. મંડપના દાતા સ્વ.માધવજીભાઇ હીરજીભાઇ ભાવાણી-પરિવાર-આણંદ ૩. લગ્ન પત્રીકાના દાતા કુળદેવી ટીમ્બર એન્ડ પ્લાય-આણંદ, ૪.લગ્નપૂજાના દાતા સ્વ.વેલજીભાઇ પચાણભાઇ નાકરાણી-આણંદ, ૫. કુલહારના દાતા શ્રી સુર્ય ટીમ્બર માર્ટ-હરીભાઇ પ્રેમજીભાઇ ધોળુ-પેટલાદ, ૬.મીનરલ વોટરના દાતા જયશ્રી પ્લાય-આણંદ, ૭.શોભાયાત્રાના દાતા જયજલારામ સોમીલ-પણસોરા,૮. બગીના દાતા શ્રી સોમનાથ ટીમ્બર-ચીખોદરા,૯. વિડિયોગ્રાફીના દાતા લખુભાઇ ખીમજીભાઇ લીંબાણી -આણંદ, ૧૦.એલ.ઇ.ડી.ના દાતાસત્યમ મેટલ ઇન્ડસ્ટ્રીઝ -આણંદ -સામ-રખા, ૧૧. ભુદેવ દક્ષીણાના દાતા માકાણી અને છાભૈયા પરિવાર-બોરસદ.

સહાયક ભોજનદાતા લેખે કુલ ૪૩ વ્યક્તિગત અને કુલ ૭ નામો સમાજના નોંધાયા હતા. કન્યાવસ્તુ ભેટદાન માટે સમાજે નક્કી કરેલ તમામ ૨૭ આઇટમ માટે દાતાઓ નોંધાઇ ગયેલ. મહામંત્રી શ્રી અમૃતભાઇએ જણાવ્યું કે સહમંત્રી શ્રી ચંદુભાઇ-ભાદાણી એ દાતા થવા માટેની આપ સર્વની સમક્ષ મુકેલ ટહેલને આપ સૌએ જીલી લઇ સમાજને આર્થિક યોગદાન પુરુ પાડવાનું અણમોલ કાર્ય કરેલ છે જેને બીરદાવ્યું હતું. સમુહલગ્નમાં ફરજ બજાવનાર વિવિધ કમિટિ દ્વારા સેવા આપનાર તમામ સભ્યોનો સુનિયોજીત કામ કરવા બદલ આભારની સાથે અભિનંદન આપેલ અને આગામી સાતમા સમૂહ લગ્નોત્સવની સફળતા પણ આપ સૌના કામ પર આધારીત છે તેમ જણાવેલ.

આગામી સાતમા સમહલગ્નનું આયોજન અને વધુમાં વધુ ભવ્ય બને તે સંદર્ભે આપ આપનું મુક્ત સુચન-આપી શકો છો જે અંગે ખૂલ્લા મંચની હાકલ કરેલ જેમાં પરબતભાઇ આણંદ, પરસોત્તમભાઇ બોરસદ, ગંગાબેન ધોળુ પેટલાદ, જયંતીભાઇ પણસોરા એ સમાજ ઉપયોગી વિચારો રજૂ કરેલ અને સુચનો કરેલ.

અમૃતભાઇ-મહામંત્રીશ્રીએ જણાવેલ કે આપણા પૂર્વ પ્રમુખ શ્રી જયંતીભાઇનું સ્વપ્ન હતું કે આપણા આ જીલ્લાના સમુહ લગ્નમાં ભવ્યતાની સાથે સુનિયોજીત વ્યવસ્થા થકી આપણા દિકરા દિકરી છુટક લગ્નને ભુલી સમુહ લગ્નમાં જોડાય તેવું સ્વપ્ન સેવેલ તેનો હું સૌપ્રથમ સાક્ષી છું અને તેનાથી આપ સો વિદિત છો તો તેમના સ્વપ્નમાં કોઇ કચાસના રહી જાય તે જોવું આપણા સોની ફરજ છે માટે આજથી જ આગામી સાતમા સમુહ લગ્ન માટે લાગી જવાની હાકલ હતી. તેને સભા એ મંજૂરીની મહોર મારી હતી અને જણાવેલ કે કાર્યક્રમમાં સમય અનુસાર ફેરફાર કરવામાં આવે તો આપ સર્વે એ તેને મંજૂર કરેલ તેવું માનવા જણાવેલ જેને સભા એ હાથ ઉચ્ચા કરી મંજુર કરેલ.

પ્રમુખશ્રી તેજાભાઇએ દાતાઓનો મોટો આભાર માન્યો અને જણાવ્યું કે અગાઉની જેમ જ આજની આ સભામાં મોટી હાજરી જોતાં અમારાં ઉત્સાહમાં વધારો થઇ રહ્યો છે સમુહલગ્નમાં આયોજન સમિતિનું કામ કાર્યક્રમ પુર્ણ ના થાય ત્યાં સુધી કસોટી રુપ લાગે છે પરંતુ આપ સર્વેના સાથ અને સહકારથી આપણે પુર્ણ કરતા રહ્યા છીએ ને કરીશું તેવો મને ભરોસો છે જે આપણામાં રહેલ સંપ,સંગઠન અને ટીમ વર્કની જેમ કામ કરવાની પદ્ધતિને આભારી છે.

અનુસંધાન પાનુ નં ૨૨

॥શ્રી ગણેશાય નમઃ॥ ॥સનાતન પરમો ધર્મ॥ ॥શ્રી ઉમિયા માતાય નમઃ॥

દિવાળી તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ

શ્રી ઉમિયા પાટીદાર સનાતન સમાજ, ઈન્દિરાનગર, બેંગલોર

શ્રી ઉમિયા પાટીદાર સનાતન સમાજ, ઈંદિરાનગર, બેંગલોર સાથે સંકળાયેલા દરેક પરિવારજનોને તથા સમગ્ર કચ્છ કડવા સનાતન પાટીદાર સમાજના પરિવારજનોને દીપાવલીની શુભ કામનાઓ સાથે સંવત ૨૦૭૪ ના મંગલમય પ્રભાતથી શરૂ થતું નૂતન વર્ષ આપ સર્વેને સુખદાયી, શુભદાયી અને લાભ કરનાર રહે એવી શુભ ભાવના સાથે નૂતન વર્ષાભિનંદન.....

–: હોદ્દેદારો :–

પ્રમુખશ્રી : પુરૂષોત્તમભાઈ હરિભાઈ વેલાણી

ઉપ પ્રમુખશ્રી : લખમશીભાઈ મેઘજીભાઈ લીંબાણી
ઉપ પ્રમુખશ્રી : રામજીભાઈ દેવજીભાઈ ડાયાણી
મહામંત્રીશ્રી : દિનેશભાઈ કેશવલાલ લીંબાણી
મંત્રીશ્રી : કાંતિલાલ વેલજીભાઈ ભોજાણી
મંત્રીશ્રી : મગનલાલ કરશનભાઈ ડાયાણી
ખજાનચીશ્રી : મુળજીભાઈ કાનજીભાઈ પોકાર
સહ ખજાનચીશ્રી : લાલજીભાઈ કરશનભાઈ લીંબાણી
ઓડીટરશ્રી : લખમશીભાઈ કાનજીભાઈ ગોરાણી

–: કારોબારી સભ્યશ્રીઓ :–

જેઠાલાલ ભીમજીભાઈ લીંબાણી	મોહનલાલ નારાયણભાઈ વેલાણી	છગનલાલ કાનજીભાઈ પોકાર	મણીલાલ રતનશીભાઈ નાકરાણી
શંકરલાલ જેઠાભાઈ લીંબાણી	ડાહ્યાલાલ વાલજીભાઈ વેલાણી	મગનલાલ અબજીભાઈ ભગત	રામજીભાઈ વિશ્રામભાઈ ડાયાણી
પ્રવિણભાઈ કેશવલાલ લીંબાણી	છગનલાલ મેઘજીભાઈ નાયાણી	રમેશભાઈ રવિલાલ નાકરાણી	વિનોદભાઈ ભીમજીભાઈ ધનાણી

–: સલાહકારશ્રીઓ :–

કેશવલાલ માધવજીભાઈ લીંબાણી ✣ ગંગદાસભાઈ પુંજાભાઈ રવાણી ✣ પ્રેમજીભાઈ મેઘજીભાઈ લીંબાણી ✣ દેવશીભાઈ કરશનભાઈ લીંબાણી
કાંતિલાલ રતનશીભાઈ વેલાણી ✣ દેવજીભાઈ કેશવલાલ લીંબાણી ✣ દયારામભાઈ રામજીભાઈ રામાણી

શ્રી ઉમિયા પાટીદાર સનાતન મહિલા મંડળ

–: હોદ્દેદારો :–

પ્રમુખ : દમયંતીબેન લખમશીભાઈ લીંબાણી
ઉપ પ્રમુખ : નર્મદાબેન દામજીભાઈ રૂડાણી
મંત્રી : સવિતાબેન મોહનભાઈ વેલાણી
સહ મંત્રી : વિમળાબેન ખેતાલાલ દિવાણી
ખજાનચી : નર્મદાબેન કિશોરભાઈ લીંબાણી
સહ ખજાનચી : પાર્વતીબેન મનસુખભાઈ રામાણી

–: કારોબારી સભ્યો :–

મંગળાબેન મુળજીભાઈ પોકાર	હીરાબેન કાંતિલાલ વેલાણી	શાંતાબેન દિનેશભાઈ લીંબાણી
જમનાબેન ડાહ્યાલાલ ભાદાણી	વિજયાબેન જેઠાલાલ લીંબાણી	ઈન્દુબેન વિનોદભાઈ ધનાણી
દેવાબેન રામજીભાઈ ડાયાણી	ગીતાબેન કાંતિલાલ ભોજાણી	લીલાબેન દયારામભાઈ ડાયાણી

શ્રી ઈંદિરાનગર નવયુવક મંડળ

–: હોદ્દેદારો :–

પ્રમુખશ્રી : હર્ષદભાઈ બાબુલાલ વેલાણી

તત્કાલીન પ્રમુખશ્રી : પ્રવિણભાઈ કેશવલાલ લીંબાણી
ઉપ પ્રમુખશ્રી : મનસુખભાઈ મુળજીભાઈ પોકાર
ઉપ પ્રમુખશ્રી : દિનેશભાઈ ડાહ્યાલાલ વેલાણી
ઉપ પ્રમુખશ્રી : ભરતભાઈ પ્રેમજીભાઈ લીંબાણી
મહામંત્રીશ્રી : પ્રતાપભાઈ કિશોરભાઈ લીંબાણી
સહ મંત્રીશ્રી : છગનભાઈ રવિલાલ નાકરાણી
સહ મંત્રીશ્રી : કેતનભાઈ રામજીભાઈ ડાયાણી
ખજાનચીશ્રી : હરેશભાઈ ધનજીભાઈ ડાયાણી
સહ ખજાનચીશ્રી : ચમનલાલ લખમશીભાઈ લીંબાણી
પી.આર.ઓ. : સુભાષભાઈ મુળજીભાઈ પોકાર

–: કારોબારી સભ્યશ્રીઓ :–

જયંતીભાઈ હરિલાલ વેલાણી	નટવરલાલ રામજીભાઈ ડાયાણી	અશોકભાઈ લખમશીભાઈ લીંબાણી	જીતેન્દ્રભાઈ શંકરલાલ લીંબાણી
નરસિંહભાઈ વિઠ્ઠલભાઈ વેલાણી	સતીશભાઈ મગનલાલ ભગત	વિનયભાઈ ગંગદાસભાઈ રવાણી	ભાવેશભાઈ પરબતભાઈ નાકરાણી
નરેન્દ્રભાઈ દયારામભાઈ રામાણી	હિતેશભાઈ દેવશીભાઈ લીંબાણી	ધનસુખભાઈ મોહનલાલ વેલાણી	પ્રણવભાઈ મોહનલાલ વેલાણી
હિતેશભાઈ ચંદુલાલ રામાણી	વિજયભાઈ સુરેશભાઈ લીંબાણી	રમેશભાઈ પુરૂષોત્તમભાઈ વેલાણી	વિજયભાઈ ગોવિંદભાઈ પારસીયા

દ.ગુજરાત ના વિરાણીવાસી ભાઈઓ દ્વારા શ્રી સમાજના પ્રમુખશ્રી તેમજ હોદ્દેદારો નું સુરત ખાતે ભવ્ય સન્માન.

કેન્દ્રીય સમાજ ના નવા વરાયેલા પ્રમુખશ્રી અબજીભાઇ વિશ્રામભાઇ કાનાણી (હાલ ખારઘર) અને હોદ્દેદારો સમાજ ની ચારેય પાંખ ની કડોદરા ખાતે મીટીંગ માં પધારવા ના હોય તેમની સાથે સંપર્ક માં રહી મગનભાઈ નાકરાણી(સુરત) અને ઘનશ્યામભાઈ લીંબાણી (અંકલેશ્વર) એ તક ઝડપી હોટલ એમ્બેસી, સુરત ખાતે દ.ગુજરાત ના વિરાણીવાસી ભાઈઓ દ્વારા સન્માન અને પરિચય નો કાર્યક્રમ તા.૧ - ૧૦ - ૨૦૧૭ ના રોજ ગોઠવ્યો હતો વિરાણીવાસી ભાઈઓ મોટી સંખ્યામાં હાજર હતા.

આ પ્રસંગે સૌ પ્રથમ સભા ના અધયક્ષ સ્થાને શ્રી મગનભાઇ ભીમજીભાઇ નાકરાણી જાહેરાત બાદ શ્રી અબજીભાઇ કાનાણી, શ્રી પુરુષોતમ ભાઇ ભગત, શ્રી સુરેશભાઈ કાનજીયાણી (વિરાણીમોટી) - નખત્રાણા ઝોન પ્રમુખ, શ્રી વીરજીભાઇ નાકરાણી (અંકલેશ્વર),નું ડાયસ પર સ્થાન ગ્રહણ કરી લીધા પછી શ્રી મગનભાઇ નાકરાણી દ્વારા સ્વાગત પ્રવચન અને શ્રી ઘનશ્યામભાઈ લીંબાણી દ્વારા મીટીંગ નો ઉદ્ધેશ જણાવ્યો હતો. ત્યાર બાદ શ્રી સુરેશભાઈ કાનજીયાણી એ પ્રાસંગીક ઉદ્બોધન માં વિરાણીવાસી ભાઈઓ દ્વારા મારું સન્માન કર્યું તે માટે આભાર વ્યકત કર્યો હતો. શ્રી ગોપાલભાઈ ભાવાણી એ સમાજ ના પ્રથમ નાગરિક જયારે આપના જ ગામના છે અને આપના વિસ્તારમાં પધારેલ તેમનું અને તેમની સાથે પધારેલ શ્રી સમાજ ના હોદ્દેદારો તથા તથા અન્ય ના સન્માન-સ્વાગત ની તક ઝડપી તે માટે મગનભાઈ તેમજ વિરાણીવાસી મહામંત્રી શ્રી પુરુષોતમભાઇ ભગતે તેમના વકતવ્યમાં વિરાણીવાસી ભાઇઓ નો સન્માન માટે ખુબ ખુબ આભાર ભાઈઓ ને ધન્યવાદ પાઠવ્યો હતો.

પ્રમુખશ્રી કે જેઓ એ મૂક સેવા કરી છે પણ હોદ્દા નથી લીધા .હાલ પણ તેઓની ખૂબ જ દબાણ થી વરણી કરવામાં આવી છે. આગળ જણાવ્યું કે વિરાણીમોટી વિરો ની ભૂમિ છે. ૧૯૩૮ થી આજ સુધી તેઓ વિરાણીના ચોથા પ્રમુખ છે.



આગળ ના દોર માં દ.ગુજરાત નું ગૌરવ અને શ્રી સમાજ ના માન્યો હતો. ચંદ્રકાંતભાઇ છાભૈયા (કન્વીનર શ્રી, સનાતન પત્રિકા) એ સનાતન પત્રિકા અંગે ની જાણકારી આપતાં જણાવ્યું કે વિરાણીવાસી ભાઈઓ સર્વે ના ઘરે સનાતન પત્રિકા આવવું જોઈએ. લવાજમ તથા જાહેરાત વિશે ખૂબ જ વિસ્તારમાં માહિતી આપી હતી.

શ્રી સમાજ ના પ્રમુખશ્રી અબજીભાઇ વિશ્રામભાઇ કાનાણી એ સન્માન કરવા બદલ દ.ગુજરાત વિરાણીવાસી ભાઈઓ નો આભાર માન્યો હતો. તેમણે પોતાની કારકિર્દી બેંક ઓફ બરોડા થી પ્રમુખશ્રી ના હોદ્દા સુધી ની સફર ની વિગતો જણાવી હતી. સમાજ પીરાણા થી સનાતન ધર્મ સુધી કેવી રીતે અને સંતો, વડીલો, આગેવાનો એ સમાજ ને કેવી રીતે સનાતન ના માર્ગે દોર્યા જેનાથી ઘણા સભ્યો અજાણ હતા. તે વિગત ની ખૂબ સરસ માહિતી આપી વડીલો ની કરાંચી થી નખત્રાણા સુધી સફર ની જાણકારી આપી હતી. અંતમાં શ્રી મનસુખભાઈ નાકરાણી એ પ્રસંગ ને અનુરૂપ વિગતો જણાવી આભાર વિધી કરી સર્વે ભોજન નો સ્વાદ માણી છુટા પડ્યા હતા.

||શ્રી ગણેશાય નમઃ|| ||સનાતન પરમો ધર્મ|| ||શ્રી ઉમિયા માતાય નમઃ||

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ રચિત

દીપાવલી — દક્ષિણ કર્ણાટક ઝોન — શુભેચ્છાઓ

શ્રી દક્ષિણ કર્ણાટક કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, બેંગલોર

પ્રમુખશ્રી	ઉપ પ્રમુખશ્રી	મહામંત્રીશ્રી	મંત્રીશ્રી	ખજાનચીશ્રી	સહ ખજાનચીશ્રી	ઓડિટરશ્રી
						
ચિમનભાઈ નાનજીભાઈ લીંબાણી	વિશ્રામભાઈ લાલજીભાઈ છાભૈયા	વસંતલાલ કેશવલાલ ગોરાણી	પરબતભાઈ દેવજીભાઈ સાંખલા	પુરૂષોત્તમભાઈ હરિલાલ વેલાણી	હીરાલાલ વાલજીભાઈ ચૌધરી	દામોદરભાઈ પ્રેમજીભાઈ લીંબાણી

કારોબારી સભ્યો

૧. દામજી ધનજીભાઈ હળપાણી
૨. રમેશચંદ્ર મુળજીભાઈ ગોરાણી
૩. વિનોદ માવજીભાઈ વાઘડીયા
૪. રવિલાલ લખમશીભાઈ ધનાણી
૫. ભરત અબજીભાઈ રામાણી
૬. પ્રેમજી કરશનભાઈ છાભૈયા
૭. રતિલાલ લધાભાઈ ભાવાણી
૮. નારાયણ પચાણભાઈ નાકરાણી
૯. મણીલાલ ભીમજીભાઈ લીંબાણી
૧૦. રમેશ હરજીભાઈ રવાણી
૧૧. વીરજી નારાયણભાઈ ભાવાણી
૧૨. વિશ્રામ રામજીભાઈ દિવાણી
૧૩. જીતેન્દ્ર પ્રેમજીભાઈ ધોળુ
૧૪. રતિલાલ પુંજારામભાઈ નાયાણી
૧૫. જયંતીલાલ મેઘજીભાઈ રામાણી
૧૬. શંકરલાલ ગોપાલભાઈ દિવાણી
૧૭. બાબુલાલ જીવરાજભાઈ રામાણી
૧૮. મગન નારાયણભાઈ ભાદાણી
૧૯. દેવશી માધવજીભાઈ ગોરાણી
૨૦. બાબુલાલ વિશ્રામભાઈ લીંબાણી
૨૧. જયંતી હંસરાજભાઈ લીંબાણી
૨૨. ચંદુલાલ વીરજીભાઈ સાંખલા
૨૩. ગોપાલ શીવજીભાઈ સાંખલા
૨૪. જીવરાજ વાલજીભાઈ સાંખલા
૨૫. કાંતિલાલ નાનજીભાઈ પોકાર
૨૬. ખીમજી પ્રેમજીભાઈ પોકાર
૨૭. ખીમજી માનણભાઈ રવાણી
૨૮. શંકરલાલ લાલજીભાઈ હળપાણી
૨૯. દેવજી વાલજીભાઈ ચૌહાણ
૩૦. લાલજી હીરાલાલ વાસાણી
૩૧. લખમશી મેઘજીભાઈ લીંબાણી
૩૨. ડૉ. રમેશ નાનજીભાઈ લીંબાણી
૩૩. મંજુનાથ વાલજીભાઈ રૂડાણી

દક્ષિણ કર્ણાટક ઝોનની ઘટક સમાજો

શ્રી પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, દાવણગેરે
તુમકુર પાટીદાર સમાજ (રજી)તુમકુર
શ્રી કડવા પાટીદાર સમાજ (રજી), કે.આર. પુરમ
શ્રી સનાતન પાટીદાર સમાજ, ઉડુપી
શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ, નેલમંગલા
શ્રી દેવનહલ્લી પાટીદાર સનાતન સમાજ, દેવનહલ્લી
શ્રી ચિત્રદુર્ગા ડિસ્ટ્રીક્ટ પાટીદાર સમાજ, ચિત્રદુર્ગા
શ્રી બેંગલોર પાટીદાર સમાજ, પીણ્યા
લાલબાગ પાટીદાર સમાજ (રજી), લાલબાગ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, યલહંકા
શ્રી પાટીદાર પરિવાર સમાજ (રજી), મૈસુર રોડ
મલનાડ સનાતન પાટીદાર સમાજ, ચિકમગલુર
શ્રી પાટીદાર સનાતન સમાજ, હરિહર
મંડ્યા પાટીદાર સનાતન સમાજ, મંડ્યા
શ્રી ઉમિયા પાટીદાર સનાતન સમાજ, ઈન્દિરાનગર
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, દોડ્ડબાલાપુર
શ્રી પાટીદાર પરિવાર સનાતન સમાજ, મૈસુર
શ્રી તુંગભદ્રા પાટીદાર સનાતન સમાજ, શીમોગા
શ્રી કોલાર ક.ક.પા.લ સનાતન સમાજ, કોલાર

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ, દક્ષિણ કર્ણાટક રીજીયન – ૨૦૧૬–૧૮

રમેશ મનજીભાઈ રવાણી - રીજીયન ચેરમેન
નરસિંહ મગનલાલ પોકાર - તત્કાલીન પૂર્વ રીજીયન ચેરમેન
ચંદ્રકાંત વિશ્રામભાઈ બાથાણી - રીજીયન ઉપ ચેરમેન
રોમિતકુમાર મંજુનાથભાઈ રૂડાણી - તુંગભદ્રા ડિવીઝનલ ચેરમેન
કાંતિલાલ રવિલાલ પોકાર - કાવેરી ડિવીઝનલ ચેરમેન
દિનેશ નરસિંહભાઈ લીંબાણી - રીજીયન મહામંત્રી
મનોજકુમાર ખીમજીભાઈ પોકાર - રીજીયન પી.આર.ઓ.
રમેશ લધાભાઈ લીંબાણી - રીજીયન ખજાનચી
મહેશ પચાણભાઈ રવાણી - રીજીયન સહમંત્રી
કેતન રામજીભાઈ ડાયાણી - કાવેરી ડિવીઝનલ મહામંત્રી
વિનોદ રામજીભાઈ ભાવાણી - તુંગભદ્રા ડિવીઝનલ મહામંત્રી
જયેશકુમાર હસમુખભાઈ ભાવાણી - રીઝનલ સહ ખજાનચી
લલિત અર્જુનભાઈ ભાવાણી - ઓડિટર

: કેન્દ્રીય કેબિનેટ સદસ્યો :

મનસુખભાઈ જીવરાજભાઈ નાથાણી, ઉડુપી ❖ સંગીતાબેન હાર્દિકભાઈ ડાયાણી, મૈસુર રોડ, બેંગલોર ❖ હાર્દિકભાઈ મનજીભાઈ ડાયાણી, મૈસુર રોડ, બેંગલોર

સંવત ૨૦૭૪ નું આવતું વર્ષ સમગ્ર કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિજનો માટે આરોગ્યમય, સુખદાયી એવમ્ લાભદાયી રહે તેવી અમારી શ્રી દક્ષિણ કર્ણાટક કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજની ભાવના સાથે સમાજના સર્વે સભ્યોને

નૂતન વર્ષાભિનંદન. "જય સનાતન".

હરિદ્વાર મુકામે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નવનિર્મિત ઉમિયાધામ નું લોકાપર્ણ સમારોહ

!! યાદેવીસર્વભૂતેષુમાતૃ રૂપેણ સંસ્થિતા,નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ !!

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નવનિર્મિત ઉમિયાધામ નું લોકાપર્ણ સમારોહ હરિદ્વાર મુકામે ગુરૂવાર તા. ૫-૧૦-૨૦૧૭ શરદપૂનમના શુભ દિવસે સવારના ૯-૩૦ કલાકે સમારંભના પ્રમુખશ્રી, નારાયણભાઈ લલ્લુદાસ પટેલના અધ્યક્ષપદ હેઠળ,માં ઉમિયાના ભક્તો ની હાજરીમાં અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડીઓ કોન્ફરન્સ અને માં ઉમિયાના જયઘોષ સાથે કરવામાં આવેલ.

સર્વ પ્રથમ ગાયત્રી પરિવાર સંગીત મંડળી દ્વારા પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય મંગલા ચરણ સંસ્કૃત શ્લોક દ્વારા ઉતરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્ર સિંગ રાવત, સાધ્વી પ. પુ. રમા માતાજી અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ.

શ્રી દિલીપભાઈ દ્વારા સ્વાગત પ્રવચન બાદ શ્રી ઉમિયા માતાજીની માહિતી આપવામાં આવી હતી.ત્યારબાદ આમંત્રિત મહેમાનો, રાષ્ટ્રીય તથા સ્થાનિક રાજકિય નેતાઓ મા. શ્રી ત્રિવેન્દ્ર સિંગ રાવત, મુખ્યમંત્રી ઉતરાખંડ, મા. શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા રાજયકક્ષાના કૃષિમંત્રી, મા. શ્રીમતી અનુપ્રિયા પટેલ, રાજયકક્ષાના આરોગ્ય અને પરિવાર મંત્રી ભારત સરકાર, કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી શ્રી ગંગારામભાઈ સાંખલા, સંતશ્રી રમા માતાજી, ગુરૂકૃપા કુટીર હરિદ્વાર આશ્રમ, વગેરે મહાનુભાવો, સાથે સાથે દાતાશ્રીઓ, ભવનના નિર્માણ કાર્યમાં સહયોગ આપનાર તેમજ કાર્યકર્તાઓનું સન્માન ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખશ્રી નારાયણભાઈ લલ્લુદાસ પટેલના વરદ હસ્તે બુકે, શાલ અને સ્મૃતિ ચિન્હ આપીને કરવામાં આવેલ.

ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખશ્રી નારાયણભાઈ લલ્લુદાસ પટેલ નું સન્માન ઉતરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્ર સિંગ રાવત દ્વારા કરવામાં આવેલ. મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપણા આ કાર્યને બિરદાવામાં આવેલ સાથે સાથ આપણો સમાજ રાષ્ટ્રીય અભિયાનમાં દરેકે દરેક ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેલ છે તેની પણ સરાહના કરેલ. યુવા પેઢીને પણ બોધદાયક સંબોધન કરેલ.

પ્રાસંગિક સંબોધન દરમ્યાન સર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિકાસને અનુલક્ષીને સૂચનો અને વિચારો આપવામાં આવેલ. તેમાં રાજયકક્ષાના આરોગ્ય અને પરિવાર મંત્રી ભારત સરકાર મા. શ્રીમતી અનુપ્રિયા પટેલ ખાસ ઉલ્લેખ કરેલ કે હું કુર્મિ એટલે કણબી સમાજ ની દિકરી છું તમો UP માં આવી અમારી સમાજને બતાવો કે કેવી રીતે સમાજો દ્વારા સારા અને વિકસનશીલ કાર્યો એકબીજાના સહકાર્યથી થઇ શકે છે.

જેનો લાભ સમગ્ર માનવ સમાજને થઇ શકે, તેનું ઉત્તમ ઉદાહરણ એટલે ઉતરાખંડમાં નિર્મિત માં ઉમિયાનું મંદિર અને આશ્રમ.

અંતે પ્રમુખ શ્રી નારાયણભાઈ લલ્લુદાસ પટેલ દ્વારા કાર્યસફળતા નો યશ દાતાઓ, કાર્યકર્તાઓ અને ભાવિક ભક્તો પ્રત્યે વ્યક્ત કરવામાં આવેલ. આભારવિધિ મા. શ્રી આઈ. સી. પટેલ દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ.



શ્રી અ. ભા. ક. ક. પા. સ. ના સભ્યોની હાજરી વિશેષ રૂપે રહેલ, એવા સર્વ, શ્રી અ. ભા. ક. ક. પા. સ. પ્રમુખશ્રી, અબજીભાઈ વિશ્રામભાઈ કાનાણી (મુંબઈ), શ્રી અ. ભા. ક. ક. પા. સ. ટ્રસ્ટીશ્રી, ગંગારામભાઈ સાંખલા (નવી દિલ્હી), શ્રી અ. ભા. ક. ક. પા. સ. પુર્વ પ્રમુખશ્રી, રામજીબાપા (રાયપુર), ઉમિયા માતાજી સંસ્થાન પ્રમુખશ્રી, હંસરાજભાઈ ધોળું, દિલ્હી સમાજના ટ્રસ્ટીશ્રી, કરસનભાઈ વિશ્રામ પોકાર, દિલ્હી સમાજના ટ્રસ્ટીશ્રી, રવિલાલ ખીમજીભાઈ સાંખલા, દિલ્હી સમાજના પ્રમુખશ્રી, દયારામભાઈ સાંખલા, શ્રી અ. ભા. ક. ક. પા. સ. ઉત્તરભારત ઝોન પ્રમુખશ્રી, વાલજીભાઈ દેવસી માકાણી, શ્રી અ. ભા. ક. ક. પા. સ. ઉત્તરભારત ઝોન મંત્રીશ્રી, અમૃતભાઈ નારાયણ પોકાર, યુવાસંઘ સહમંત્રીશ્રી, ઉમેશભાઈ રંગાણી (નાગપુર), નર્મદા કાઉન્સિલ મંત્રીશ્રી, જગદીશ કરસન ચૌહાણ (નવી દિલ્હી), ઉત્તરભારત યુવાસંઘ રિજીયન પ્રમુખશ્રી, ઉત્તમભાઈ પ્રેમજી લિંબાણી

ઉપરોક્ત મહાનુભાવો વ્યક્તિરિક્ત નવી દિલ્હી સમાજના મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ વિશેષ હાજરી આપી હતી.

પ્રતિનિધિ : કિશોર ચોપડા, નવી દિલ્હી.

કચ્છ ના ૧૨૫ કિ. મી. ના હાયવે માત્ર ૧ કલાકમાં સ્વચ્છ કરી ને ઈતિહાસ સર્જતું યુવાસંઘ-કચ્છ રીજીયન

માતાનામઢ માં બિરાજમાન કચ્છ ધણીયાણી આઇશ્રી આશાપુરા માંના નવરાત્રી દરમ્યાન દર્શને લાખો શ્રદ્ધાળુ દેશ પરદેશથી માના દર્શન માટે આવતા હોય છે. આ પદયાત્રી ભાવિકો માટે ભુજથી માતાનામઢ અને ગઢશીશા થી મોટાયક્ષ ના માર્ગો પર કેમ્પ અને મોબાઈલ વાહનોથી આયોજકો દ્વારા સેવાના કાર્યો કરવામાં આવે છે. આના કારણે હાયવેની આજુબાજુ પ્લાસ્ટીક અને કાગળનો કચરો દુર્ગંધ મારતો પડ્યો રહે છે જેથી પર્યાવરણ ક્ષેત્રે તેની ગંભીર અસર પડતી હોય છે. એનાથી વિશેષ આવા પ્લાસ્ટિક મુંગા પશુઓના પેટમાં જતા ગંભીર અસર થાય છે.

રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીના સુત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતા ને સાર્થક કરવા આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ નવધા ભક્તિ કાર્યક્રમની કલ્પના કચ્છ રીજીયન ની કર્મયોગી કાર્યશાળા ટર્મ ૨૦૧૬-૨૦૧૮ માં રીજીયન વાઈસ ચેરમેન છગનભાઈ ધનાણી એ નવધા ભક્તિ કાર્યક્રમનો મુકેલ વિચારને યુવાસંઘ ના કાર્યકર્તાઓએ ઉપાડી લીધેલ અને તે અનુસંધાનને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

આ કાર્યને પ્લાનિંગ સાથે ૧૨૫ કિ.મી. ના દરેક ગામોના પ્રવાસ કરીને સ્થાનિક પાટીદાર સમાજ સાથે અન્ય જ્ઞાતિઓ તેમજ વહીવટ તંત્રને આ ભગીરથ કાર્યમાં જોડવાનું આયોજન કરવામાં આવેલ. આ કાર્ય માટે શ્રી વિરાણી મોટી પાટીદાર યુવક મંડળના પ્રમુખ તેમજ નખત્રાણા તાલુકાના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી ને પ્રોજેક્ટ કન્વીનરની જવાબદારી સોપવામાં આવી. આ મહા અભિયાનમાં કચ્છમિત્ર દૈનિક મીડિયા પાર્ટનર તરીકે જોડાયું. કચ્છ રીજીયનના ચેરમેન જયંતીલાલ પારસીયા, આઈ.પી.સી. શૈલેષ પોકાર, વાઈસ ચેરમેન છગનલાલ ધનાણી, મહામંત્રી શાંતિલાલ નાકરાણી અને સેન્ટ્રલ કૃષી અને પર્યાવરણ ના કન્વીનર શાંતિલાલ ભગત ના માર્ગદર્શન હેઠળ ખજાનચી કિશોર નાયાણી, ડિવીઝન પ્રમુખ લીજેશ સાંખલા, મુકેશ ઉકાણી, શાંતિલાલ નાયાણી,સેક્રેટરી નરશી પોકાર, કિશોર માવાણી, મોહન દિવાણી, રીજીયન પી.આર.ઓ. નયનાબેન પોકારના સહયોગમાં કેન્દ્રીય સમાજના હોદ્દેદારો તેમજ મહિલાસંઘ ના ઉપપ્રમુખ ગંગાબેન રામાણી, મંત્રી અનુબેન સેંઘાણી, સહખજાનચી ગંગાબેન ધોળું, ભગવતીબેન પારસીયા, ઉર્મિલાબેન ડાયાણી, ઉર્મિલાબેન ખેતાણી ટીમ દ્વારા ભુજથી માતાનામઢ અને ગઢશીશા થી મોટા યક્ષના દરેક ગામોના પ્રવાસ કરીને સ્થાનિક પાટીદાર યુવાનો, મહિલાઓ અને દરેક જ્ઞાતિના આગેવાનો સાથે મિટિંગ દ્વારા આ સફાઈ મહાઅભિયાનમાં જોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ આ સફાઈ અભિયાનનું સંપૂર્ણ આયોજન રીજીયન વાઈસ





ચેરમેન છગનલાલ ધનાણી અને ભરતભાઈ સોમજીયાણી એ નવધા ભક્તિ કાર્યક્રમ અંતર્ગત રીજીયનના દરેક હોદ્દેદાર અને કારોબારી સભ્યો સાથે સંકલનમાં રહીને કરેલ.

આ સફાઈ અભિયાનના મહાયજ્ઞમાં માત્ર ૧ કલાકમાં ૧૨૫ કિ.મી. માર્ગને સફાઈ કાર્ય માટે ૧૩ ટીમ બનાવવામાં આવી, દર ૧૦ કિ. મી. ના અંતરે કન્વીનરોની નિમણુંક કરવામાં આવી. તેમના નેજા હેઠળ ૧૦ થી ૧૨ યુવામંડળ ના ભાઈઓને મોનીટરીંગ ની જવાબદારી સોપવામાં આવી. કન્વીરો સાથે જરૂરી એવા પીવાનું પાણી, મેડિસીન તેમજ એનર્જી ફૂડ વગેરે વસ્તુઓ આપવામાં આવી. સ્વયંસેવક ને કોઈપણ પ્રકારની તકલીફ થાય તો ૧૦૮ ની સેવા ઉપલબ્ધ રાખવામાં આવેલ. આવી રીતે માઈક્રો પ્લાનિંગ દ્વારા આ ભગીરથ કાર્યને પર પાડવા ૧૪૨ યુવા મંડળ, મહિલા મંડળ તેમજ અન્ય સંસ્થાઓના ૪૦૦૦ થી વધુ સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાઈ પોતાના શ્રમ યજ્ઞ દ્વારા આ કાર્યને સફળ બનાવી એક ઈતિહાસ સર્જ્યો.

આ સફાઈ અભિયાનમાં ગુજરાત સરકારના વહીવટ તંત્રને જોડવા માટે કચ્છ રીજીયનના હોદ્દેદારોની ટીમ દ્વારા જીલ્લા કલેક્ટર રેમ્યા મોહન, એસ.પી. મકરંદ ચૌહાણ, જીલ્લા ડી.ડી. ઓ. સી.જે. પટેલ ની મુલાકાત લઈને સમગ્ર અભિયાનની માહિતી આપવામાં આવી અને આ મહા સફાઈ અભિયાનમાં જોડાવાનું આમંત્રણ આપેલ હતું. આ સફાઈ અભિયાનમાં જોડાયેલ દરેક સંસ્થાઓને સફાઈ માટે કીટમાં સાવરણા,ગમેલા,કોથળા,હાથના મોંજા, મેડીકલ કીટ સહિતની સામગ્રી મનસુખ રાજાણી, તરુણ સોમજીયાણી, શૈલેશ ડાયાણી, વસંત ભાવાણીરાજેશ ભીમાણી, ચેતન છાભૈયા, વિનોદ પોકાર, પુરુષોત્તમ ધનાણી જેવા યુવા ટીમ દ્વારા પહોંચતા કરવામાં આવેલ.

આ સફાઈ અભિયાનનું શુભારંભ રવિવાર તા. ૨૪-૦૯-૨૦૧૭ ના નખત્રાણા નવાવાસ પાટીદાર સમાજવાડી મધ્યે જીલ્લા કલેક્ટર રેમ્યા મોહન, કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, ડી. ડી. ઓ. સી. જે. પટેલ સાહેબ, પૂર્વ ધારા સભ્ય છબીલભાઈ પટેલ તેમજ અતિથી મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. આ પ્રસંગે કચ્છ જીલ્લા કલેકટર રેમ્યા મોહન એ પોતાના મનોગતમાં જણાવ્યું કે આ ભગીરથ કાર્ય રાષ્ટ્રને પ્રેરણા રૂપ છે તેવું કાર્ય પાટીદાર યુવાસંઘે કરી બતાવેલ તે બદ્દલ અભિનંદન પાઠવેલ તેમજ કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાએ જણાવેલ કે ફક્ત કચ્છમાં નહીં પરંતુ ભારતભરમાં આવું કાર્ય પ્રથમ વખત થઈ રહ્યું છે.આવું કાર્ય કચ્છના પાટીદારો જ કરી શકે તેવું કહી સમગ્ર સમાજને બિરદાવેલ અને શુભકામના આપેલ, તેમજ ડી. ડી.ઓ શ્રી સી. જે. પટેલ સાહેબે યુવાસંઘને આ ભગીરથ કાર્યનો સુવિચાર આવ્યો અને આ કાર્યને પુરા પ્લાનિંગથી અન્ય સમજો સાથે જોડી આ કાર્ય કરવા બદ્દલ ખુબજ સરાહના કરેલ. કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખશ્રી ડો. શાંતિલાલ સેંઘાણીએ આ પ્રસંગે યુવાસંઘને આશિર્વાદ સાથે જણાવેલ કે આ મહાઅભિયાનમાં આપણી સાથે બહોળી સંખ્યામાં અન્ય કાર્યકર્તાઓ જોડાયા છે ત્યારે હાયવે પર કોઈપણ પ્રકારની અફડા તફડી ન થાય તેની ખાસ કાળજી રાખશો તેમજ આ કાર્યમાં જોડાયેલ કાર્યકર્તા ભાઈ-બહેનોને ખાસ વિનંતી કે

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

બિહાર ઝારખંડ ઝોન

દિપાવલી એવમ નવવર્ષની હાર્દિક શુભેચ્છા અને અભિનંદન



પ્રમુખ : તુલસી વિરજી ગોગારી



ઉપ પ્રમુખ : રમેશ ગોપાલ છાભૈયા, રાંચી



મહામંત્રી : રામજી કાન્જી મેઘાણી



મંત્રી : બાબુલાલ શીવદાસ છાભૈયા, ધનબાદ



મંત્રી : પ્રભુલાલ ભીમજી પોકાર, રાંચી



ખાજાચી : છગન રામજી રામાણી, રાંચી



સહમંત્રી : પુરુષોત્તમ વાલજી સાંખલા, દેવઘર



સહમંત્રી : જવાહર ગોપાલ છાભૈયા, રાંચી



સહખજાચી : નરેશ હરિ પોકાર, મધુપુર



કચ્છ ના ૧૨૫ કિ. મી. ના હાયવે માત્ર ૧ કલાકમાં સ્વચ્છ

ગરમી તેમજ રજકણથી બચવા પોતાના પૂર્તિ જરૂરી પાણી, રૂમાલ જેવી જરૂરી વસ્તુ સાથે રાખવા અને જે નેક કામ માટે આપણે સૌ આવ્યા



છીએ ત્યારે મોબાઇલ દ્વારા બિન જરૂરી સેલ્ફી અથવા ફોટોગ્રાફી નહિ કરવા અનુરોધ કરેલ.

રીજીયન ચેરમેન જયંતિલાલ પારસીયા ના અધ્યક્ષ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય સમાજના ખજાનચી શ્રી છગનભાઈ રૈયાણી, ગ્રીનલેન્ડ કાઉન્સિલ મંત્રી અંબાલાલ પોકાર, નવાવાસ સમાજના પ્રમુખશ્રી નરેશભાઈ ડોસાણી, મહામંત્રીશ્રી બાબુભાઈ ધનાણી, મધ્ય વિભાગના પ્રમુખશ્રી ચંદુભાઈ વાલાણી, પશ્ચિમ સમાજના પ્રમુખશ્રી રવજીભાઈ લિંબાણી, કચ્છ કે.ડી.સી.સી. બેન્કના વાઈસ ચેરમેનશ્રી જયસુખભાઈ ડાયાણી, ટી.ડી.ઓ. શ્રી રાઠોડ સાહેબ, ડી. વાય.એસ.પી. હિમકરસિંહ સાહેબ, નખત્રાણા મામલતદાર શ્રી તેમજ સરકારી વહીવટ તંત્ર તેમજ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન રીજીયન મહામંત્રી શાંતિલાલ નાકરાણી એ કરેલ. આભાર દર્શન પ્રોજેક્ટ કન્વીનર ભરતભાઈ સોમજીયાણી એ કરેલ.

નવધા ભક્તિ સફળ કાર્યક્રમની ફલશ્રુતિ અન્વયે યુવાસંઘ કચ્છ રીજીયનના વાઈસ ચેરમેન છગનલાલ ધનાણી એ જણાવેલ કે રવિવાર તા. ૨૪-૯-૧૭ નવરાત્રી દરમ્યાન આ સમયે વાહન દ્વારા હજારો દર્શનાથીઓ એ આ કાર્યને નિહાળ્યું હતું તેમજ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલ તમામ સ્વયંસેવકોને જણાવેલ કે કયારે પણ જાહેરમાં કચરો (ગંદકી) નહિ કરે તેવી આશા વ્યક્ત કરેલ.

આ મહાઅભિયાનમાં યુવાસંઘના વાય.એસ.કે. પી.ડી. ઓ. શ્રી બાબુલાલ કેશરાણી, અશોક ઠાકરાણી, દિનેશ રામાણી, નરેશ ચૌહાણ, ધર્મેશ ધોળું, ચંદ્રકાંત ભાવાણી હસમુખ નાકરાણી ની ટીમના સહકારમાં ગુજરાત પોલીસના ૨૦૦ જવાનો, સુજલોન કું., ભુજ સમસ્ત મહિલા મંડળ, આર્ટ ઓફ લિવિંગ મહિલા મંડળ, મુસ્લિમ સમાજ, ક્ષત્રિય સમાજ, હરિજન સમાજ તેમજ મહાજન સમાજ જેવાએ આ ભગીરથ કાર્યમાં ઉત્સાહભેર જોડાઈ આ કાર્યને સફળ બનાવેલ.


આ નવધા ભક્તિ કાર્યક્રમની સફળતાને વધાવતા ટેલીફોન દ્વારા યુવાસંઘના પ્રમુખશ્રી રવિભાઈ ધોળું (ગોવા) આ કાર્યથી યુવાસંઘની સંગઠન શક્તિમાં અનેક વધારી થયો છે. તે બદ્દલ ખુબખુબ ધન્યવાદ પાઠવેલ.મહામંત્રીશ્રી મોહનભાઈ ધોળું (પેટલાદ) આ કાર્યક્રમ દરમ્યાન સતત સંપર્કમાં રહી યુવાસંઘના કાર્યકર્તાઓ ને માર્ગદર્શન પુરૂ પાડી વંદન અભિનંદન આપેલ. મિશન ચેરમેન વસંતભાઈ ધોળું (તલોદ) આ સફાઈ અભિયાન કાર્યની પ્રશંશા કરતા કચ્છ રીજીયનને આ નવધા ભક્તિ કાર્ય દ્વારા યુવાસંઘ મિશન ૨૦-૨૦ અંતર્ગત ૧૩ થીમ પૈકી ૪ થીમનું કામ કરેલ છે. જેમાં (૧) આધ્યાત્મિક અને સામાજીક સમિતિ, કન્વીનર જવેર કેશરાણી (૨) કૃષિ અને પર્યાવરણ સમિતિ, કન્વીનર રમણીક લિંબાણી (૩) રાજકીય સમિતિ, કન્વીનર ઈશ્વર વાસાણી (૪) પ્રચાર પ્રસાર સમિતિ,પી.આર.ઓ. નયનાબેન પોકાર તેમજ સર્વે કાર્યકર્તાઓને અભિનંદન આપેલ.

આ નવધા ભક્તિ કાર્યક્રમની સફળતા બદ્દલ કચ્છ રીજીયનને દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઇ રહી છે, ત્યારે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજે પત્ર દ્વારા આ કાર્યને બિરદાવીને સમગ્ર કાર્યકરોને અભિનંદન પાઠવેલ.

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, રાયપુર (છ.ગ.)

શ્રી પાટીદાર ભવન, ફાફાડીહ-૦૭૭૧-૨૧૦૩૫૪૩, ભનપુરી-૦૭૭૧-૨૧૦૨૭૩૬

આપ સર્વે જ્ઞાતિજનોને નુતન વર્ષાભિનંદન પાઠવે છે


પ્રમુખ : હંસરાજભાઈ હરજી પોકાર


ઉપપ્રમુખ : વિશ્રામભાઈ કરમશી છાભૈયા


ઉપપ્રમુખ : મુળજીભાઈ નારાયણ નાકરાણી


મહામંત્રી : મોહનભાઈ રતનશી છાભૈયા


મંત્રી : ચંદુભાઈ કરશન ભગત


મંત્રી : હરસુખભાઈ શામજી છાભૈયા


ખજાનચી : જયંતીભાઈ રતનશી છાભૈયા


સહખજાનચી : જશરાજભાઈ ગંગદાસ સામાણી

શ્રી પાટીદાર યુવા મંડળ-રાયપુર

પ્રમુખ : દિપકભાઈ મગનભાઈ નાકરાણી, ઉપપ્રમુખ : હરસુખભાઈ તુલસીભાઈ રુડાણી, ઉપપ્રમુખ : ગીરીશભાઈ ભાણજીભાઈ નાકરાણી, મહામંત્રી : શંભુલાલ ભીમજીભાઈ છાભૈયા, મંત્રી : જેઠાલાલ પુંજાભાઈ પોકાર, મંત્રી : શાંતિલાલ રતનશીભાઈ વેલાણી, ખજાનચી : મહેશભાઈ મોહનભાઈ વેલાણી, સહખજાનચી : હરસુખભાઈ ગંગારામ નાથાણી


શ્રી પાટીદાર મહિલા મંડળ-રાયપુર

પ્રમુખ : શાંતાબેન મગનભાઈ નાકરાણી, ઉપપ્રમુખ : રાધાબેન માવજીભાઈ લીંબાણી, ઉપપ્રમુખ : શાંતાબેન રવજીભાઈ રામાણી, મહામંત્રી : પ્રભાબેન કિરીટભાઈ નાકરાણી, મંત્રી : કલાબેન શાંતિભાઈ ભોજાણી, મંત્રી : મીનાબેન વિનોદભાઈ રુડાણી, ખજાનચી : વસંતીબેન ચંદુભાઈ નાકરાણી, સહખજાનચી : ચંપાબેન ભગવાનભાઈ નાયાણી

શ્રી રે.રોડ પાટીદાર સનાતન સમાજ રે.રોડ (મુંબઈ)

દિપાવલી પર્વ નિમિત્તે
હાર્દિક શુભકામના
એવમ નૂતનવર્ષાભિનંદન

Happy Diwali


પ્રમુખશ્રી : પરસોતમ નાનજી સેંઘાણી

પ્રમુખ : શ્રી પરસોતમ નાનજી સેંઘાણી, **ઉપપ્રમુખ :** શ્રી શીવજી ગોપાલ પોકાર,
મહામંત્રી : શ્રી વિનોદભાઈ ભીમજી દિવાણી, **સહમંત્રી :** શ્રી મનસુખ રણમલ સાંખલા,
ખજાનચી : શ્રી શીવજી મેઘજી દિવાણી , **સહખજાનચી :** શ્રી રવજી સામજી દ્વિવાણી

કારોબારી સભ્યો

શ્રી બાબુભાઈ નારણ સેંઘાણી | શ્રી પ્રવિણભાઈ વીરજી ધોળુ | શ્રી ગંગદાસ પ્રેમજી સાંખલા | શ્રી લાલજી રામજી પોકાર | શ્રી દિનેશ મનજી સાંખલા
શ્રી ગોવિંદ મેઘજી ભગત | શ્રી કનુભાઈ વીરજી મેઘાણીથ | શ્રી ગોવિંદ કાનજી ધોળુ | શ્રી બાબુલાલ રણમલ સાંખલા | શ્રી અનીલ રતીલાલ રામાણી

ઓડીટર : શ્રી યોગેશ મણીભાઈ રામાણી

નિરાધારોનો આધાર બનતી પાટીદાર સેવા સમિતિ હિંમતનગર

હોસ્પિટલમાં દર્દીઓને રાહત દરે ખાટલે બેઠાં સાત્વિક ભોજન ટીફીનપોહોંચાડતીએક માત્ર માનવ સેવા સંસ્થા હિંમતનગર

ડો. ચીમનભાઈ પટેલ



પ્રમુખશ્રી
ડૉ. ચીમનભાઈ એચ. પટેલ

છેલ્લા૧૮ વર્ષથી અત્રે માનવ સેવાનું પ્રશંસનીય કાર્ય કરતી પાટીદાર સેવા સમિતિ દ્વારા દર્દી ટીફીન વિતરણ વ્યવસ્થા, નિરાધાર ગરીબ લાભાર્થીઓને આખા વર્ષનું કરિયાણું, વિનામુલ્યે તબીબી સેવા વગેરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતના ગામડા અને શહેરોને ખુંદી વળી નિસ્વાર્થ લાભે માનવ સેવા કરતી આ સંસ્થાને આગાઉના વર્ષોમાં સાબરકાંઠા જીલ્લામાં શ્રેષ્ઠ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા તરીકે રોટરી ક્લબ(હિંમતનગર) દ્વારા જીલ્લા કલેક્ટરશ્રી ના હસ્તે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

પાટીદાર સેવા સમિતિ (હિંમતનગર)ના નવા વરાયેલા પ્રમુખશ્રી ડો ચીમનભાઈ એચ. પટેલ(ગાંભોઈ) તેમજ ઉપપ્રમુખશ્રી આર.એસ.પટેલ (સાબરડેરી, હિમતનગર) સંસ્થા વિષે માહિતી આપતાં જણાવે છે કે આ સંસ્થા છેલ્લા ૧૮ વર્ષથી ચલ-ાવવામાં આવે છે. સંસ્થા હાલ પોતાના અદ્યતન નવીન સંકુલમાં કાર્યરત છે. હિંમતનગર શહરની ૮૦ થી ૧૦૦ હોસ્પિટલોમાંગુજરાતના જીલ્લાના ગામડામાંથી તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ કચ્છ-ભુજથી તબી-બી સારવાર લેવા આવતા દર્દીઓને અનુરૂપ રસોઈ બનાવી સંસ્થાના ટીફીનમાં ભરી ભોજનના બન્ને ટાઈમ હિંમતનગરની તમામ હોસ્પિટલોમાંદર્દીઓના ખાટલે બેઠા અંદાજે ૨૫૦ થી ૩૦૦ જેટલા દરરોજ સવાર સાંજ, કોઈ પણ ભેદભાવ વિના ટીફીન પોહોંચાડવામાં આવે છે. અત્યાર સુધીમાં સંસ્થાએ ૧૮ વર્ષ દરમ્યાન ૧૫ લાખ ઉપરાંત દર્દીઓને જમાડ્યા છે. આ સેવાકાર્ય દરમ્યાન છતીસગઢ -રાયપુર, મુંબઈ-મહારાષ્ટ્ર, કચ્છ, કર્નાટક, કલકત્તા વગેરે શહેરો અને રાજ્યોમાં વિવિધ સ્થળેથી સમાજના દાનવીર દાતાઓનો આ સેવાકીય કાર્યમાં મોટો સહયોગ પણ મળી રહ્યો છે.

સંસ્થાના અન્ય સહયોગી એવા મંત્રી શ્રી ભાણજીભાઈ ડી પટેલ તેમજ સહમંત્રી શ્રી ચુનીભાઈ આર. પટેલે વધુમાં જણાવેલ છે કે હિંમત નગર સિવિલના દર્દી ઓને વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા શિયાળાની કાતિલ ઠંડીમાં જીલ્લાની તમામ સિવિલ હોસ્પિટલો તેમજ જીલ્લાનાગામડા અને શહેરોમાં વસતા નિરાધાર ગરીબ ૯૦૦ઉપરાંત લાભાર્થી ઓને ગરમ ધાબડા ઓઢાઢી હૂંફ આપેલ છે.

ગામડાં અને **શહેરોમાંજેનુંભગવાનશિવાય કોઈ નથી તેવા ઉમર લાયક ગરીબ નિરાધાર લાભાર્થી ઓને આખું વર્ષ ચાલે તેટલી ખાદ્ય કરિયાણાની સામગ્રીની રાશન કીટ આપવામાં આવે** છે. ગુજરાતના છેવાડાના અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ખુંદી વળી ગરીબોના ઘર સુંધી પોહંચી અનેક બીમારીઓથી ઘેરાયેલા નિરાધારોને મફત તબીબી સેવા આપી ગરીબોનો હાથ પકડી આરોગ્યની વિના મૂલ્યે સેવા આપી નવું જીવન આપવાનું ભગીરથ કાર્ય કરતી આ સંસ્થા તરફથી આંખના મોતિયાના ઓપરેશન કરી લેન્સ બેસાડવા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરી હજારો દર્દીઓને સંસ્થા તરફથી મોફતદવાઓ આપી દર્દીઓને નવું જીવન આપ્યું છે. સંસ્થાના પ્રમણ સમા કાયમી આ સેવા કાર્યમાં રસોડામાં તેમજ વહીવટી કામગીરીમાં રોજેરોજ હાજર રહીઆ સંસ્થાના સેવાકીય કાર્યને સતત ધબકતું રાખનાર સહયોગી સર્વશ્રી રામજીભાઈ ડી. પટેલ(રૂપાલકમ્પા), હરિભાઈ એચ. પટેલ(કાશીપુરાકમ્પા), ચંદુભાઈ જી. પટેલ(તળાવટીંબા), શાંતિભાઈ પટેલ (હિંમતનગર), ભાઈલ-ાલભાઈ આર. પટેલ(મોતીપુરા હિંમતનગર), અમૃતભાઈ પટેલ (પલ્લાચર), નટવરભાઈ પટેલ (મોયદ), ડાયાભાઈ પટેલ (રસુલપુર) વગેરેની કાયમી પ્રશંસનીય સેવાથી સંસ્થા આ માનવ સેવા કાર્યમાં સતત આગળ વધી રહી છે. ત્યારે અન્નદાન એજ મહાદાન, જન સેવા એજ પ્રભુ સેવા ના સંકલ્પ સાથે નિરંતર આગળ વધતી આ સંસ્થાને દાનવીર ભામાશાઓ આર્થીક સહયોગ આપી પુણ્ય કમાય એ પણ એટલુંજ જરૂરી છે.

સંસ્થા સંપર્કઃ
પાટીદાર સેવા સમિતિ (હિંમતનગર) માનવ સેવા સંસ્થા દર્દી ટીફીન વિતરણ વ્યવસ્થા, ગુરુકૃપા કોમ્પ્લેક્ષ, મહેતા પેટ્રોલ પંપની બાજુમાં, ગિરધરનગર, હિંમતનગર, જી. સાબરકાંઠા, ગુજરાત

બેંક એકાઉન્ટઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
છાપરીયા શાખા
ખાતા ક્રમ : 56367002744
RTGS / IFSC: SBIN0060367
PAN: AAATP4942N
મો : ભાણજી ભાઈ 9925168374 / ઓફીસ : 02772-241153

પાટીદાર સેવા સમિતિ (હિંમતનગર) ના નવા



મંત્રી
શ્રી ભાણજીભાઈ ડી. પટેલ

વરાયેલા હોદ્દેદારો

અત્રેની પાટીદાર સેવા સમિતિ માનવ સેવા સંસ્થાની તાજેતરમાં મળેલ બેઠકમાં આગામી વર્ષ માટે સંસ્થાનાહોદેદારોનીસર્વાનુમતે વર્ણી કરતાં સંસ્થાના પ્રમુખ -ડો ચીમનભાઈ એચ. પટેલ(આનંદ હોસ્પિટલ), ઉપપ્રમુખ ડૉ. આર. એસ. પટેલ(ડે. જનરલ મેનેજર, સાબરડેરી, હિંમતનગર), મંત્રીશ્રી ભાણજીભાઈ ડી પટેલ(મોતીપુરા, હિંમતનગર) અને સહમંત્રી શ્રી ચુનીભાઈ આર. પટેલ(હિંમતનગર) ની વર્ણી કરવામાં આવેલ. જયારે સંસ્થાના ટ્રસ્ટીઓ તરીકે સર્વશ્રી નાથાભાઈ ડી. પટેલ (માજી ધારાસભ્ય), શ્રી હંસરાજભાઈ વ.સાંખલા (મહેતાપુરા, હિંમતનગર), ડો દેવસીભાઈ પી. પટેલ(નવજીવન હોસ્પિટલ, હિંમતનગર), કેશવલાલ એમ પારસીયા (તાજપુર કુઈ), ડો પ્રવીણભાઈ એચ પટેલ (રાયગઢ), સુરેશકુમાર ડી. પટેલ(કૃષ્ણપુરા કમ્પા), મુળજીભાઈકે પટેલ (શંકરપુરા કમ્પા) વગેરેની સર્વાનુમતે વર્ણીકરવામાં આવી હતી.

પ્રચાર પ્રસાર સમિતિઃ

પાટીદાર સેવા સમિતિ (હિંમતનગર) ના નામ સાથે મળતું જુળતું પણ ભ્રામક નામ વાળી બીજીસંસ્થાઓ છે, જેનાથી છેત્રાશો નહિ. દાનઅને સહયોગઆપતાંપહેલાંઉપરજણાવેલસંપર્કઅનેબેંકએકાઉનટનીમાહિતી દ્વારાજાતેખાતરી કરી લેવા કેન્દ્રીય સમાજ દ્વારા રચિત, સનાતન પત્રિકાનું સંચાલન કરનાર,પ્રચાર પ્રસાર સમિતિ ખાસ ભલામણ કરે છે

આપના વિચારો આપના જ શબ્દોમાં...

- આવેલ પત્ર અંગે ......

જાગૃત સમાજ ના જાગૃત સનાતની તરીકે ગણતરી કરવી પડે તેવા ઉમદા અને વિચા-રવા લાયક વિચારોરજૂ કરવા માટે મોહનભાઈ હીરજીભાઈ દીવાણી - ઈચંલકરજી ને શત્ શત્ વંદન ...

આપના પત્ર માં સમાજ ની ભાવના અને સમાજેકઇક હટકે કરવું જોઈએ, તમોએ તમારી કલમ દ્વારા નસ્ત્ર સનાતન ધર્મ પત્રિકા નસ્ત્ર ના કન્વીનીર શ્રી ચંદ્રકાંતભાઈ ના સંબોધન સાથે તમારી પોતાની વાચા ને લેખન દ્વારા વાચા આપી છે તે સારું કદમ ઉપાડેલ છે -

આપના વિચારો આપના જ શબ્દોમાં ....

૧ - આપણા સમાજ ના સભ્ય ની Unique Identify હોવી જરૂરી છે જેમ કે અન્ય સંસ્થાઓ પોતાના Club Member ની આગવી ઓળખ માટે એક Logo હોય છે, આ Logo દ્વારા તેની એક ઓળખ ઊભી થાય છે.આંમ પરીચય થવાથી જરૂરીયાતમંદ ને મદદરૂપ થવામાં કે અન્ય સહાય માટે આગળ આવવાની પ્રેરણા મળેછે તો આ રીતે આપણા માં પણ આવું કઇક હોવું જોઈએ.

૨ - આપનો બીજો સુઝાવ છે કે દરેક Zone સમાજ માંઅલગ અલગ કામ માટે યોગ્ય માણસો ની નિમણુંકકરવી, જેથી એક Zone માંથી ગયેલ સભ્ય ને અન્ય Zone માં પોતાની જરૂરીયાત મુજબ ના કામ માટે Perticularમાણસ થી Contact કરી માર્ગદર્શન મેળવી શકાય .

૩ - ત્રીજો સુઝાવ છે કે સમાજ ની જટીલ સમસ્યા સગપણ સમસ્યા છે તો તે અંગે ની માહીતી એકત્રિકરણ કરવી અને જરૂરીયાત મંદ ને મદદ રૂપ થવા માટે Zone વાઈઝ એક ટીમ બનાવવી જોઈએ.

આપને આપણી સમાજ માટે ના ઉમદા વિચાર આવ્યા છે તે સારી બાબત છે આપનો પત્ર આપણી શ્રી અ.ભા.ક.ક.પા.સમાજ ને સુપરત કરવામાં આવેલ છે, તેની નોંધ લેશો.

અમારી સનાતની સમાજને આપણા મુખપત્રના માધ્યમે દિપાવલીની શુભેચ્છા સાથે નૂતન વર્ષાભિનંદન....

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ રચિત

શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર – ગોવા રીઝીયન

Ocean Council

નૂતન વર્ષની મંગલ પ્રભાતે શ્રી કુળદેવી ઉમિયા માતાના ચરણોમાં એ જ પ્રાર્થના કે સૌ તને, મને ધને એ સર્વ પ્રકારે સુખ-શાંતિ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે. સૌના અંતરમાં જ્ઞાનના અજવાળા પથરાય, અજ્ઞાનના અંધારા દૂર થાય, પારિવારીક, સામાજીક સૌમાં એકતા પરસ્પર સ્નેહની ભાવના પ્રસરે, આધ્યાત્મિક સંસ્કારો દ્વારા સમાજની નવી પેઢી સંસ્કારી બને...એવી પ્રાર્થના સાથે અમારી સૌની શુભેચ્છા.....

સ્થાપક પ્રમુખ – DMG ના આદર્શ



શ્રી રવિભાઈ દેવસીભાઈ ધોળુ
ગોવા

પ્રમુખ શ્રી



શ્રી પ્રવિણભાઈ ભવાનજીભાઈ વેલાણી
કોલ્હાપૂર

IPP



શ્રી જગદીશભાઈ પ્રેમજીભાઈ નાકરાણી
મ્હાપુસા-ગોવા

ઉપ પ્રમુખ શ્રી



શ્રી દિનેશભાઈ દાનાભાઈ રૂડાણી
લાંજા

મહા મંત્રી શ્રી



શ્રી ગિરીશભાઈ મનજીભાઈ ભાવાણી
કોલ્હાપૂર

મંત્રી શ્રી



શ્રી રમણભાઈ રવજીભાઈ ઠાકરાણી
પડેલ

ખજાનચી



શ્રી ધીરજભાઈ રતનશીભાઈ પોકાર
જયસિંગપુર

સહ ખજાનચી



શ્રી મહેશભાઈ લાલજીભાઈ વાઘડીયા
કોલ્હાપૂર

PRO



શ્રી સંજયભાઈ જયંતિભાઈ છાભૈયા
દેવરૂખ

વિભાગીય પ્રમુખ



શ્રી ધીરજ રતનશી લિંબાણી
કોલ્હાપૂર

વિભાગીય પ્રમુખ



શ્રી સુરેશ માવજી પોકાર
સાંગલી

વિભાગીય પ્રમુખ



શ્રી ઈશ્વર રામજી પોકાર
મહાડ

વિભાગીય મંત્રી



શ્રી દિનેશ સામજી વાડીયા
ઈચલકરંજી

વિભાગીય મંત્રી



શ્રી મુકેશ મનુભાઈ નાકરાણી
ફલટણ

વિભાગીય મંત્રી




શ્રી સુરેશ ધનજી નાકરાણી
મડગાંવ-ગોવા

રીઝીયનમાં સમાવિષ્ટ થતાં મંડળો

૧. ચિપલૂણ	૧૨. કણકવલી	૨૩. પલૂસ
૨. દાપોલી	૧૩. કરાડ સીટી	૨૪. રાજાપુર
૩. દેવગડ	૧૪. કરાડ ગ્રામીણ	૨૫. રત્નાગિરી
૪. દેવરૂખ-સંગમેશ્વર	૧૫. ખેડ	૨૬. સાંગલી
૫. ગોવા-મડગાંવ	૧૬. કોલ્હાપૂર	૨૭. સાતારા
૬. ગોવા-મ્હાપુસા	૧૭. કુડાળ	૨૮. સાતારા સીટી
૭. ગોવા-ફોંડા	૧૮. લાંજા	૨૯. સાતારા ઉત્તર વિભાગ
૮. ગુહાગર	૧૯. મહાડ	૩૦. સાવંતવાડી
૯. ઈચલકરંજી	૨૦. માલવણ	૩૧. શિરોળ
૧૦. ઈસ્લામપુર	૨૧. મંડણગડ	૩૨. વૈભવવાડી
૧૧. ઈસ્લામપુર-ઉમિયા	૨૨. મિરજ	

દીપોત્સવી અને નૂતન વર્ષે દિલમાં પ્રગટાવવા જેવા સાત દીવા ક્યા?



એક કર્મચારી દિવાળીની રજાઓ શરુ થતાં બોલ્યાઃ હાશ! છૂટ્યા, હવે જલસા! સ્કૂલોની જેમ ઓફિસોમાં પણ ૨૧ દિવસનું વેકેશન હોવું જોઇએ.

એમની વાત સાંભળી એક સજ્જને કહ્યુંઃ આપણો દેશ રજા પ્રિય છે. કોઇ મહાન નેતાનો જન્મદિવસ આવે તો પણ રજા અને કોઇ નેતાનું આકસ્મિક મૃત્યુ થાય તો પણ રજા! આપણી રજાપ્રિયતાનો વિશ્વમાં જોટો જડે તેમ નથી! સાંભળો, કાર્યપ્રિય પ્રજા કેવી હોય તેનો વિશ્વના પ્રેરક પ્રસંગોમાં શ્રી નીલેશ મહેતાએ ટાંકેલો પ્રસંગ તમને કહું.

જાપાનમાં એક નવનિર્મિત અમેરિકન મિલના અમેરિકન મેનેજર સર જેમ્સ પાસે મિલમાં કામ કરનાર કામદારો એક દિવસ તેમને મળવા આવ્યા અને કહ્યું. સર,અમે કામ નહીં કરી શકીએ. સર, જેમ્સ બોલ્યા, કેમ, ભલા? જાપાની કામદારોએ કહ્યું, એટલા માટે કે તમે અઠવાડિયામાં બે રજાઓ રાખવાનું જાહેર કર્યું છે!

અમેરિકન મેનેજર સર જેમ્સને જાપાની કામદારોની શ્રમ ભાવનાનો ખ્યાલ ન હતો. એટલે તેમણે કહ્યું. તો તમારે સપ્તાહમાં ત્રણ દિવસ રજા જોઇએ છે? અમારા અમેરિકામાં પણ સપ્ત-ાહમાં માત્ર બે જ દિવસ રજા હોય છે.

કામદારોએ કહ્યું, અમારે સપ્તાહમાં ત્રણ દિવસની રજા નથી જોઇતી. અમે તો સપ્તાહમાં માત્ર એકજ દિવસની રજા ઇચ્છીએ છીએ. અમારા જાપાનમાં ક્યાંય સપ્તાહમાં બે દિવસની રજા હોતી નથી!

પણ બે દિવસની રજા અપાય એમાં તમને વાંધો શું છે? એમાં તમારે ગુમાવવાનું શું છે? એથી તો તમને વધુ આરામ મળશે. તમારી વાત સાંભળી મને આશ્ચર્ય થાય છે. મેનેજરે કહ્યું. કર્મચારીઓએ એક અવાજે કહ્યું. એક દિવસને બદલે અઠવાડિયામાં જો બે દિવસની રજા રાખવામાં આવે તો અમે લોકો આળસુ બની જઇએ. માણસ સ્વા-ભાવિક રીતે રજાના દિવસોમાં મોજમજા કરતો જાય છે. તેનો ખર્ચ બોજ વધી જાય છે જે અમારી શ્રમશક્તિનો ઘટાડો કરે, અમારા પર આર્થિક બોજમાં વધારો કરે એવી રજા અમારે નથી જોઇતી. અમને એક દિવસની જ રજા જોઇએ છે. જાપાનના લોકોની આવી શ્રમભાવના જોઇને અમેરિકન મેનેજર સર જેમ્સ સ્તબ્ધ બની ગયો!

આવતી કાલે કોઇ રજા પ્રિય કર્મચારી આરામ અમારો જન્મસિદ્ધ અધિકાર છે એની માગણી કરે તો નવાઇ નહીં. ટેબલો પર નિકાલ ઝંખતી ફાઇલો એ વાત શોખ પૂરે છે કે હજી આપણે ત્યાં કર્મચારીઓએ કર્મન્યાચી બનવાનું વ્રત જાપાની નાગરિકોની જેમ લેવાનું બાકી છે દિવાળીમાં પણ ઘરને દરવાજે દીવો પ્રગટાવીએ છીએ, પણ દિલમાં દિવો પ્રગટાવીએ છીએ ખરા! દીપોત્સવી ઉત્સવ તો જ બને, જો તેના થકી આપણામાં નવું કશું જન્મી અને વાસીપણું ભસ્મીભૂત થાય. ધર્મનિષ્ઠતા (કર્તવ્ય પરાયણતા) અને કર્મનિષ્ઠતાના દીપકને બુઝાવવાનો ડર નથી હોતો. કારણ કે એ દીવો માણસની શુભનિષ્ઠામાંથી ભગવાને પ્રગટાવેલો દીપક છે. એક શાયરે કહ્યું છે તેમ ફાનૂસ બનકે જિસકી હિફાજત હવા કરે.

હમને ક્યા પાયા? ક્યા ખોયા?

આ પૃથ્વી પર જીવસૃષ્ટિનો આરંભ લાખો કરોડો વર્ષો પહેલા થયેલાની નોંધ આપણા શાસ્ત્રો, પુરાણોમાં થયેલી છે. ઉત્ક્રાંતિવાદના મત પ્રમાણે જળસૃષ્ટિમાંથી ફૂગ અને સેવાળ પેદા થયા અને પછી સરીસૃપો તથા ક્રમશઃ અન્ય પ્રજાતિઓ સાકાર થતી ગઇ.

જીવસૃષ્ટિના ઇતિહાસમાં જેટલાં પ્રાણીઓ પેદા થયા એ બધાં આજે હયાત નથી. સંખ્યાબંધ નામશેષ થઇ ગયા છે અને આમ છતાં હજારો વિવિધ પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે. તેમાંની એકપણ પ્રજાતિએ ક્યારેય એના પ્રકૃતિદત્ત જીવનથી આગળ કંઇપણ વિચાર્યું હોય એવું લાગતું નથી. પોતાનું રક્ષણ તથા અન્યનું ભક્ષણ એ પ્રાણીમાત્રમાં સહજ છે. જે પ્રજાતિઓ આજ સુધીમાં સાકાર થઇ એમાંની જે નાશ પામી એનું મુખ્ય કારણ ભૌગોલિક પરિવર્તનો, કુદરતી આપત્તિઓ, અન્ય બળુકી પ્રજાતિ દ્વારા થતો સંહાર, આવા અનેક કારણો ગણાવી શકાય. આને અંગ્રેજીમાં Survival of the Fittest ના સિદ્ધાંત તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. Survival of the Fittest નો અર્થ એટલો જ થાય છે કે જે પ્રજાતિ વિપરીત સંજોગોમાં ટકી શકવા માટેનું સામર્થ્ય ધરાવતી હોય એ જીવિત રહે છે, અન્યથા એ નાશ પામે છે.

આને આપણે બીજી ભાષા-માં આપણી રીતે કહીએ તો ટકી રહેવા માટે કોઇપણ પ્રજાતિએ અંતે તો બળ જ વાપરવું પડે છે. મનુષ્ય અન્ય તમામ પ્રજાતિઓથી અહીં જુદો પડે છે. તેણે વિચારવાનું શરુ કર્યું. બીજી કોઇપણ પ્રજાતિમાં રક્ષણ અને ભક્ષણ જેવી પ્રાકૃતિક વિભાવનાથી ઉપર ઊઠીને બીજી કોઇ વિચારણા થતી હોય એવું લાગતું નથી.માણસે સહુથી પહેલા આ Survival of the Fittest ની વિભાવનાથી ઉપર ઊઠીને થોડોક વિચાર કર્યો હોવો જોઇએ એમ લાગે છે.

મોટું માછલું નાના માછલાને ગળી જાય આ ન્યાય અન્ય જીવ સૃષ્ટિમાં ભલે હોય પણ સમયાંતરે મુઠ્ઠી ઊંચેરા થોડાક માણસોએ પોતાની પ્રજાતિમાં આ ન્યાય ઉચિત નથી એવું વિચારીને ન્યાય નામની કોઇક વિભાવના પેદા કરી હશે એમ લાગે છે. સબળો નબળાને મારે કે એની પાસેથી કશુંક ઝૂંટવી લે એ પ્રાકૃતિક પદ્ધતિ છે પણ એનાથી સહ અસ્તિત્વની વિભાવના જોખમાઇ જાય છે. મનુષ્ય એ આ મત્સ્યગલાગલ ન્યાયનો અસ્વીકાર કરીને, માણસ માણસ વચ્ચે સંતુલન સધાઇ રહે એ માટે, ન્યાયની પ્રક્રિયાનો આરંભ કર્યો હતો.

માણસ જાતે પ્રાણી સૃષ્ટિમાં અન્યો કરતાં પ્રગતિ સાધી છે અને પોતાના જીવનને વધુ સુખી અવસ્થામાં મૂક્યું છે.એ વાતનો સ્વીકાર કરતી વખતે એણે શોધેલો આ ન્યાયનો સિદ્ધાંત પાયાનો સિદ્ધાંત છે. ન્યાયની આ વિભાવના સ્થળ કાળના સંદર્ભમાં અવશ્ય બદલાતી રહી છે પણ આ ન્યાય શબ્દ જ એટલો સંમોહક છે કે એનાથી સદંતર મુક્ત થઇ જવું ભલભલા સરમુખત્યાર કે આતતાયીને પણ પરવડ્યું નથી.

આ ન્યાયની સ્થાપના કરવા માટે માણસે કેટલાક નિયમો બનાવ્યા. આ નિયમોને ક્યારેક ધર્મ એવું નામ આપવામાં આવ્યું તો ક્યારેક એને શાસનની આજ્ઞા તરીકે ઓળખવામાં આવ્યા. ધર્મ બીજું કંઇ જ નથી પણ પ્રત્યેક માણસ બીજા કોઇને નડતરરુપ ન બને અને પોતે શાંતિ તથા સુખપૂર્વક જીવી શકે એવી જીવનરીતિ જ છે. આમ છતાં માણસ પણ અંતે તો પ્રાણી સૃષ્ટિનો જ એક ભાગ છે. એટલે એની વૃત્તિમાં પણ પેલા આદિમ અંશો તો હોય જ. એટલું જ નહિ, બળ અને બુદ્ધિની દૃષ્ટિએ પણ માણસમાં ઊતરતી કક્ષા અને ઉપલી કક્ષા એવા પ્રકારો પણ હોય જ! નબળા માણસો પોતાનું રક્ષણ કરી શકે નહિ અથવા આશ્રય કે ભોજન જેવી પ્રાથમિક જરુરિયાતો પામી શકે નહિ ત્યારે પોતાનાથી વધુ સબળાનો જ આશ્રય લેવાનો. નબળા માણસોની આ નબળાઇનો લાભ લેવાની કુદરતી વૃત્તિ પણ સબળા માણસોમાં હોય જ. આનું પરિણામ એ આવ્યું કે સબળ-ાઓ ધીમે ધીમે શાસકો બની બેઠા. આ શાસકોએ જ પેલા ન્યાયના રક્ષણ માટે નિયમો ઘડી કાઢ્યા અને પછી આ નિયમોનું પાલન કરવાની કે કરાવવાની જવાબદારી પણ પોતાના ખભે ઉપાડી લીધી.

રાજા,પ્રજા, સમાજ અને કાનૂની પદ્ધતિઓ કેવી રીતે માણસ જાતમાં વિકાસ પામી એનું આ અત્યંત સંક્ષિપ્ત સરળીકરણ છે. માણસે પોતાની પ્રજાતિમાં ન્યાય સ્થાપિત કરવાનો નિયમ સ્વીકાર્યો અને એ માટે એ જીવસૃષ્ટિમાં સહુથી અનોખો પ્રકાર બની રહ્યો. આ વિચાર માણસજાતની જબરદસ્ત પ્રગતિ કહેવાય એમાં કોઇ શક નથી.

જે સબળાઓ સમયાંતરે સિંહાસનો ઉપર બેસતા રહ્યા એમણે ન્યાય શબ્દનો અર્થ પોતાના લાભાર્થે જ કર્યો છે, તેનો ઇતિહાસ સાક્ષી છે. સામર્થ્ય સત્તાનું હોય, સંપત્તિનું હોય કે પછી સ્નાયુઓનું હોય માણસ જાતે જેમ જેમ સમય પચાર થતો ગયો એમ એમ પોતાના આ સામર્થ્યનો લાભ લઇને ન્યાયના પેલા મૂળ સિદ્ધાંતને રફેદફે કરી નાખ્યો છે.

માણસ જાતે સેંકડો વર્ષો સુધી ગુલામોનો, ઢોરથીય વધુ બદતર હાલતમાં, બજારમાં ખરીદી વિક્રયના ધોરણે કાનૂન અથવા ન્યાય ના નામે વ્યાપાર કર્યો છે. આવા ગુલામો બજારુ ચીજ તરીકે વેચાતા, ખરીદાતા અને માલિકની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા. આવા ગુલામો માટે કાયદેસર ધોરણો પણ હતા. ગુલામી પ્રથા જ સમૂળગી અન્યાયી હોવા છતાં, એને ન્યાયનું રુપ આપીને એના માટે ચોક્કસ કાયદાઓ ઘડવામાં આવ્યા હતા. એક પુરુષ અનેક પત્નીઓ કરે એને ન્યાયપુરઃસર ગણવ-ામાં આવ્યું હતું પણ એક સ્ત્રી પાસેથી તો એક પતિવ્રતાની જ અપેક્ષા રાખીને કાયદાઓ ઘડવામાં આવ્યા અને એને ન્યાય અથવા નીતિ કહેવામાં આવ્યું. સ્ત્રી બીજો પતિ તો ન રાખી શકે પણ વિધવા થવા છતાં પુર્નલગ્ન પણ ન કરી શકે એને ધર્મના નામે ન્યાય કહેવામાં આવ્યો.

માણસજાતે આ ન્યાય શબ્દને એટલો બધો મોહક બનાવી દીધો છે કે દરેક માણસ પોતાના કોઇપણ વર્તનને એ ન્યાયી છે એવું જ ઠરાવવા પ્રયત્ન કરે છે. હત્યારો સુદ્ધા પોતે કરેલી હત્યાને ન્યાયી જ માનતો હોય છે. અદાલતમાં લડતા પરસ્પર વિરોધી એવા બંને પક્ષો

MONEX™

An ISO 9001: 2008 Certified Company



MONEX ELECTRO PRODUCTS

Nana Angia Patiya, Ta. Nakhatrana- Kutch.
Contact - 02835 -222223, 222023, 222323 M-94277607723
E-mail : monexelectro@gmail.com Web : www.monex.co.in

Somnath™ BOARDS PVT. LTD.

Crafting Quality

Manufacture of
High quality MR grade Ply, Gurjan Ply,
Pine wood Block boards & Flush Doors.

Our Brands

Golden Sparrow – PLY - BOARDS - DOORS – Intelligent solution for Furniture
WellBOND™ – Ply | Board | Doors – Symbol of Durability
PaRpo™ – Ply | Board | Doors – Streng of Symbol
Stonewood – Strong Like a Stone
Rexona – Beauty of Home – PLY-BOARD-DOOR

Factory : Survey No-131/3, B/h Gran (Videocon) Electronic, Anjar-Bhachu Highway, Village-Varshmedi, Ta. Anjar-Kutch. M. 9825748381, 9925122023
mail : somnathboards@gmail.com web :www.somantahboards.com

Hotel Rudraksh

Nakhatrana

ટુરીઝમ ક્ષેત્રે વિકસતા કચ્છ જિલ્લાના
નખત્રાણા શહેર મધ્યે
અદ્યતન સુવિધાઓથી સજ્જ...



hotelrudraksh.co.in
info@hotelrudraksh.co.in



એ.સી.રેસ્ટોરન્ટ,એ.સી તથા નોન એ.સી.રૂમ
બોર્ડ મીટીંગ, જન્મદિવસની પાર્ટી માટે એ.સી. કોન્ફરન્સ હોલ

સીટી પોઇન્ટ, સુપર માર્કેટ, નખત્રાણા-કચ્છ
ફોન :૦૨૮૩૫-૨૨૩૨૨૩

Follows on :

MEANWHILE SOFTS®

CARVING DREAMS CREATIVELY

Web ◆ Software ◆ App

આપના બિઝનેસના વિકાસ અને પ્રસિધ્ધી માટે વેબ સાઇટ,
એન્ડ્રોઇડ આધારીત મોબાઇલ એપ્લીકેશન અને
આપના બિઝનેશ ને અનુરૂપ અકાઉન્ટીંગ, રિટેલ બિઝનેસ
અને મેન્યુફેકચરીંગ મેનેજમેન્ટ સોફ્ટવેર
તેમજ તમારી જરૂરીયાત મુજબના દરેક પ્રકારના
સોફ્ટવેર ડેવલોપ કરી આપવામાં આવશે.

Shop #3, R.N Complex, Nana Angiya Patiya Kutch-370675
Contact : +91 72270 77393
hello@meanwhilesofts.com | meanwhilesofts.com

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ-છત્તીસગઢ ઝોન


શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન


પ્રમુખશ્રી
કાંતીભાઈ લીંબાણી


મહામંત્રીશ્રી
અર્જુનભાઈ ધનાણી


ઉપપ્રમુખશ્રી
જેઠાભાઈ દિવાણી



ઉપપ્રમુખશ્રી
ભાણજીભાઈ પોકાર


ખજાનચીશ્રી
ભીમજીભાઈ સામાણી


મંત્રીશ્રી
હરીભાઈ દિવાણી


મંત્રીશ્રી
બાબુભાઈ ભગત


સહખજાનચીશ્રી
કાંતીભાઈ પોકાર


કેન્દ્રીય ટ્રસ્ટીશ્રી
નાનજીભાઈ રામાણી


પ્રમુખશ્રી ઝોન ન્યાયસમિતિ
શ્રી મગનભાઈ નાકરાણી


કન્વીનર શ્રી પાટીદાર ગૌરવ સમિતિ
શ્રી વિઠ્ઠલભાઈ નાયાણી

છત્તીસગઢ ઝોન કારોબારી સભ્યો

શ્રી મગનભાઈ નાકરાણી-રાયપુર, શ્રી બાબુભાઈ વેલાણી-રાયપુર, શ્રી વેલજીભાઈ રુડાણી-રાયપુર, શ્રી મોહનભાઈ છાભૈયા-રાયપુર, શ્રી વિશ્રામભાઈ છાભૈયા-રાયપુર, શ્રી વસંતભાઈ રામાણી-રાજનાંદગાંવ, શ્રી જયંતીભાઈ રુડાણી-જગદલપુર, શ્રી રામજીભાઈ ડાયાણી-બીલાસપુર, શ્રી રમેશભાઈ સામાણી-બીલાસપુર, શ્રી છગનભાઈ નાકરાણી-કોરબા, શ્રી રતીલાલ રામાણી-બાલોદ, શ્રી ભીમજીભાઈ દિવાણી-કુમ્હારી, શ્રી છગનભાઈ સાંખલા-કોંડાગાંવ

કૉ.ઓપ્ટ સભ્યશ્રીઓ : શ્રી લાલજીભાઈ રુડાણી, શ્રી વિઠ્ઠલભાઈ નાયાણી, શ્રી ભગવાનદાસ નાયાણી, શ્રી માવજીભાઈ નાકરાણી

કાયમી આમંત્રિત સભ્યો

શ્રી નાનજીભાઈ રામાણી-રાયપુર, શ્રી અશોકભાઈ વાલાણી-રાયપુર, શ્રી શંભુભાઈ છાભૈયા-રાયપુર, શ્રીમતિ વિજયાબેન બાથાણી-રાયપુર, શ્રીમતી જયાબેન વાલાણી-રાયપુર, શ્રી હંસરાજભાઈ પોકાર-રાયપુર, શ્રી ખીમજીભાઈ રુડાણી-કુમ્હારી, શ્રી ધીરજલાલ દિવાણી-કુમ્હારી, શ્રી રામજીભાઈ માકાણી-બાલોદ, શ્રી જગદીશભાઈ રુડાણી-બાલોદ, શ્રી મહેન્દ્રભાઈ સુરાણી-દલ્લીરાજરા, શ્રી મુકેશભાઈ પાંચાણી, શ્રી જેઠાભાઈ ધોળુ-બિલાસપુર, શ્રી હરીભાઈ ધોળુ-બિલાસપુર, શ્રી હીરાભાઈ સાંખલા-ચાંપા, શ્રી મુકેશભાઈ લીંબાણી-ચાંપા, શ્રી વાલજીભાઈ રુડાણી-જગદલપુર, શ્રી અનીલભાઈ ભગત-જગદલપુર, શ્રી દયારામભાઈ સાંખલા-કોંડાગાંવ, શ્રી કાંતિભાઈ છાભૈયા-કોંડાગાંવ, શ્રી દીપકભાઈ નાકરાણી-કન્વીનર શ્રી વેલકોમ સમિતિ-રાયપુર

ઘટક સમાજો (ઝોન અંતર્ગત આવતી સમાજો)

શ્રી ક.ક.પાટીદાર સમાજ રાયપુર, શ્રી ક.ક.પાટીદાર સમાજ રાજનાંદગાંવ, શ્રી ક.ક.પાટીદાર સમાજ બીલાસપુર, શ્રી ક.ક.પાટીદાર સમાજ કોરબા, શ્રી ક.ક.પાટીદાર સમાજ બાલોદ, શ્રી ક.ક.પાટીદાર સમાજ જગદલપુર, શ્રી ક.ક.પાટીદાર સમાજ કુમ્હારી, શ્રી ક.ક.પાટીદાર સમાજ કોંડાગાંવ, શ્રી ક.ક.પાટીદાર સમાજ દલ્લીરાજહરા, શ્રી ક.ક.પાટીદાર સમાજ ચાંપા

ઝોન દ્વારા થઈ રહેલા કાર્યો

૧) કેન્દ્રીય સમાજ અને સ્થાનીક સમાજ સાથે સાંકળરુપ બની સુચનાનું આદાન પ્રદાન કરે છે. ૨) દર વરસે દરેક સ્થાનિક સમાજોના સહયોગથી કર્મદીઠ રુ.૨૫૦/- લે ખે દિવાળી બોણીના રુપમાં એકત્રીત કરીને કેન્દ્રીય સમાજને મોકલી આપવામાં આવે છે. ૩) છ.ગ.ઝોન દ્વારા ઝોનની તમામ ઘટક સમાજોમાંથી વિવિધ ક્ષેત્રો જેવાં કે શૈક્ષણીક, સામાજીક, કલા, રાજકીય, રમતગમત, વ્યવસાયિક વગેરે ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધી મેળવી હોય તેવાં પ્રતિભાવાન વિદ્યાર્થીઓ અને ભાઈ-બહેનોને ઝોનની સામાન્ય સભામાં છત્તીસગઢ પાટીદાર ગૌરવ/સન્માનથી સન્માનિત કરવામાં આવે છે. ૪) ગત વરસે ગર્ભાશય કેન્સર નિરોધક વેકસીન લગાવવાના શિબિરનું આયોજન કરીને ૩૩૦ જેટલી કુંવારી દીકરીઓને વેકસીનના સમસ્ત ત્રણે ડોઝ અપાવવામાં આવ્યા. ૫) પ.પૂજ્ય શ્રી નારાયણજીબાપા અને શ્રી કેશરા પરમેશ્વરા બાપાની જન્મજયંતિના ઉપલક્ષમાં સ્થાનિક સમાજોમાં રક્તદાન શિબિર, દંતયજ્ઞ જેવા આયોજનો કરવામાં આવે છે. ૬) છ.ગ.ઝોન દ્વારા વેલકોમ સમિતિનું ગઠન કરેલ છે અને કાર્ય પ્રગતિપર છે. ૭) ઝોનની ઘટક સમાજોમાં શુભેચ્છા અને સંપર્ક યાત્રાનાં આયોજન કરવામાં આવે છે. ૮) ઝોન સમાજ, યુવાસંગ રીજીયન, છ.ગ. મહીલા સમાજ અને ઘટક સમાજો સાથે સંકલન સારું છે અને સમાજ ઉપયોગી તમામ પ્રવૃત્તિઓમાં એકબીજાને સહયોગ આપે છે. ૯) વર્ષમાં બે કારોબારી અને એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે અને આ સભાઓમાં કેન્દ્રીય સમાજ દ્વારા અપાતા નિર્દેશો વિષે મંથન કરવામાં આવે છે અને તેના પાલન માટે પ્રયત્નો કરવામાં આવે છે.

શ્રી ઈચલકરંજી પાટીદાર સનાતન સમાજ ઈચલકરંજી

દિપાવલી પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવે છે



સમાજના પ્રમુખ
શ્રી. લક્ષ્મીકાંત દિવાણી



સમાજના મહામંત્રી
શ્રી. રવજીભાઈ દિવાણી



મહિલા મંડળ પ્રમુખ
સૌ. પ્રતિભાબેન દિવાણી



મહિલા મંડળના મંત્રી
સૌ. ભારતીબેન દિવાણી



યુવક મંડળ પ્રમુખ
શ્રી. મોહન લિંબાણી



યુવક મંડળના મંત્રી
શ્રી. વિજય દિવાણી

નુતન વર્ષ આપ સર્વેને સુખસમૃદ્ધીમય અને આનંદમય જાય તેવી શુભકામના

શુભેચ્છક

શ્રી. ઇચલકરંજી પાટીદાર સનાતન સમાજ
શ્રી. ઇચલકરંજી પાટીદાર સનાતન મહીલા મંડળ
શ્રી. ઇચલકરંજી પાટીદાર સનાતન યુવક મંડળ
શ્રી. ઇચલકરંજી પાટીદાર સનાતન યુવતી મંડળ

BRIJESH PATEL

INSURANCE & INVESTMENT CONSULTANT
Corporate Club Member- L.I.C. of India
COT,MDRT (USA) Qualifier

* Group Gratuity Schemes
* Employers Employee Insurance

INSURANCE PLANNING | WEALTH MANAGEMENT
PRUDENT ADVICE | TECHNOLOGY ENABLED

All Above, with best in class servicing

LIC भारतीय जीवन बीमा निगम LIFE INSURANCE CORPORATION OF INDIA
Qualifying & Life Member MDRT®
ApolloMunich HEALTH INSURANCE

Log on to :- www.jeevansparsh.com



सही सलाह हर बार...

Brijesh Patel's Jeevan Sparsh

"JEEVAN SPARSH"
E-73 Sector-I, Devendra Nagar, Raipur (C. G.)
Tel. : 0771-2524774,4044774
Mob. : 94252-04774, 95841-47000
E-mail : jeevansparsh@gmail.com,www.jeevansparsh.com

હમને ક્યા પાયા? ક્યા ખોયા?

ખાતરીપૂર્વક એવું માનતા હોય છે કે ન્યાય પોતાના પક્ષે જ છે. અદાલતનો ચુકાદો જે પક્ષની તરફેણમાં આવે છે એ છાતી ઠોકીને કહેતો હોય છે કે અંતે ન્યાયનો વિજય થયો છે. પરાજિત પક્ષ પોતે અન્યાયી સિદ્ધ થયો છે એનો સ્વીકાર કરવાને બદલે ઉપલી અદાલતમાં ફરીવાર એકડે એકથી કેસ લડે છે.

ન્યાયની વિભાવના સાથે, અન્ય પ્રજાતિઓની અપેક્ષાએ માણસજાતે વધુ પ્રગતિ કરી છે, એવું આપણે ત્યારે કહીએ છીએ ત્યારે પ્રગતિ શબ્દનો અર્થ બરાબર સમજી લેવો જોઇએ. સુખની વિભાવના પણ અન્ય પ્રજાતિઓમાં નથી અને આમ છતાં સુખ દ્વારા આપણે જે અંતિમ તબક્કે મેળવવા માંગીએ છીએ એ અન્ય પ્રજાતિઓ પણ જાણે અજાણે શોધે તો છે જ. પ્રગતિ દ્વારા માણસ વધુ સુખી થઇ શકે એવી એક મનોરમ્ય કલ્પના માણસે રચી કાઢી છે. આ પ્રગતિ એટલે શું એ કદાચ માણસજાત હજુ નક્કી નથી કરી શકી.

કોઇપણ ક્ષેત્રમાં પ્રગતિ સાધવા માટે સ્પર્ધા અનિવાર્ય છે એવું માણસજાત આજકાલ ગાઇ બજાવીને કહે છે, કહેવાતા પંડિતો, વિદ્વાનો, સમાજશાસ્ત્રીઓ અને શાસકો સુદ્ધા, સ્પર્ધાને ઉત્તેજન આપે છે. સ્પર્ધા પરસ્પર દ્વેષભાવ પેદા કરે છે અને એ વાતની કોઇને ખબરેય નથી પડતી. ફળ સ્વરુપે સ્પર્ધા વધતી જાય છે. ૪૦-૪૫ વિદ્યાર્થીઓનાં વર્ગમાં આપણું સંતાન જ પ્રથમ નંબરે આવે તેવું સર્વે માતા-પિતા ઇચ્છે છે અને પોતાના સંતાનની પાસેથી પણ એ જ અપેક્ષા રખાય છે શાળાના પ્રાથમિક તબક્કે રોપાયેલાં આ બીજ સમાજમાં ફાલતાં ફૂલતાં જાય છે અને પ્રગતિના નામે સ્પર્ધા, દ્વેષ, અહંકાર અને હિંસા આ બધું કૂદકે ને ભૂસકે વૃદ્ધિ પામતું જાય છે જે ભૌતિક પદાર્થો વધતાં જાય છે એને આપણે પ્રગતિ તરીકે ઓળખીએ છીએ. પણ આ ભૌતિક પદાર્થો પ્રાપ્ત કરવા પાછળ માણસજાતે શાશ્વતીનાં કેવાં વિરાટ મૂલ્યો ગુમાવી દીધાં છે એનું સ્મરણ સુદ્ધાં નથી રહેતું.

આનો અર્થ એવો નથી કે માણસજાતે જે સિદ્ધિઓ મેળવી છે એ મૂલ્યહીન છે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે અંતે તો સુખની પ્રાપ્તિ એ જ ઉદ્દેશ છે. આ ઉદ્દેશ કૂતરો હોય, કબૂતર હોય, ભેંસ હોય કે માણસ હોય દરેક માટે વધતે ઓછે અંશ એક સરખો જ છે આમ હોવાથી માણસ પોતે માનેલી પ્રગતિ દ્વારા સુખ સંપન્ન કરવાનો પ્રયત્ન કરે તો એમાં કાંઇ જ ખોટું નથી. પણ પાંચ પંદર બળુકાઓ પાસે જ આ સુખ જમા થતું રહે અને વિશાળ સંખ્યામાં માણસો લગભગ આદિમ કહેવાય એવી જ અવસ્થામાં ભટકતા રહે તો એને પ્રગતિ ન કહેવાય.

પક્ષીઓને ક્યારેય માળા બાંધવા માટે સ્થાનની તંગી પડતી નથી. સાપથી માંડીને ઉંદર સુધીના સરીસૃપો ક્યાંયને ક્યાંય પોતપોતાનાં દર ગોતી જ કાઢે છે. જંગલી પશુઓ પણ પોતાના આશ્રયસ્થાન માટે વલખાં નથી મારતા, મેળવી જ લે છે.

પરમાત્માએ જ્યાં અને જેટલા જીવોનું નિર્માણ કર્યું છે ત્યાં અને તેટલા પ્રમાણમાં એમનાં આશ્રયસ્થાનો અને ખોરાકની વ્યવસ્થા અગાઉથી જ કરી હોય છે. તાજું જ જન્મેલું બાળક જનેતાની છાતીએ વળગાડતાં ધાવણ ધાવવા લાગે છે. આ ક્રિયા પરમાત્માએ એને ગર્ભધાન સાથે જ શીખવી દીધી હોય છે. હોઠ ચલાવતાં વેંત જે પોષક દ્રવ્યની એને અસ્તિત્વ ટકાવી રાખવા જરુર છે એ પોષક દ્રવ્ય પણ એના જન્મ સાથે જ પરમાત્માએ તૈયાર રાખ્યું છે.

એકમાત્ર માણસ જ એવી પ્રજાતિ છે કે જેને પોતાનું આશ્રય સ્થાન કહી શકાય એવું ઘર ક્યાંય મળતું નથી. માત્ર બે ટંકનો રોટલો જ કહી શકાય એટલું પેટ પૂરતું અન્ન એને મળતું નથી. એવું નથી કે પૃથ્વી ઉપર ભૂમિના પ્રમાણમાં માણસોની સંખ્યા વધુ છે. આમ છતાં જે અવ્યવસ્થા અને અસંતુલનની પરિસ્થિતિ નિર્માણ થઇ છે એ મોટે ભાગે તો માનવસર્જિત જ છે. થોડાક માણસોએ પોતાના હિતમાં આવી અવ્યવસ્થા અને અસંતુલન કાયમ માટે કાયદેસર બની રહે એવી ગોઠવણ પણ કરી છે.

જે નબળાઓના રક્ષણ માટે ન્યાય અને કાનૂન પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા એ જ ન્યાય અને કાનૂન સબળાઓના હાથમાં મુકાઇ ગયેલું એક વધારાનું શસ્ત્ર બની ગયા છે. સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં ફક્ત માણસે જ ધર્મ, ન્યાય,નીતિ કે કાનૂન જેવા શબ્દો ઉચ્ચાર્યા છે.પોતાના આ કાર્યને એણે પ્રગતિ તરીકે ખપાવ્યું પણ વહેવારમાં અંતે તો આ શબ્દોના સહારે જ વધુ ને વધુ અન્યાયો, અનીતિ અને અધર્મ આચર્યા છે. ધર્મોના નામે માણસજાતે પરસ્પરનું જેટલું લોહી રેડ્યું છે એટલું કદાચ પૃથ્વી પરનાં હિંસક પશુઓએ પોતાના આહાર તરીકે માંસ ભક્ષણ નહિ કર્યું હોય.

ન્યાયની દેવડીઓ ઉપર ઝળહળાટ કર્યો હોવા છતાં, કાયદાપોથીઓના ગંજના ગંજ ખડકી દીધા છતાં, કોઇપણ સમસ્યાના અંતિમ ઉકેલ તરીકે તો માણસે પશુઓની જેમ જ યુદ્ધનો આશરો લીધો છે. પશુઓ ન્યાય, નીતિ કે ધર્મની એકેય ચર્ચા, વિચારણા કે મંત્રણા કર્યા વિના જ સીધા પરસ્પરને કરડી ખાવા માટે યુદ્ધમાં ઊતરી પડે છે.

ભૌતિક સુખ સમૃદ્ધિને સંબંધ છે ત્યાં સુધી માણસે અન્ય પ્રજાતિઓ કરતાં પુષ્કળ વધુ પ્રાપ્ત કર્યું છે, એમાં કોઇ શક નથી. પણ આ બધું અને વધુ પ્રાપ્ત કરવા માટે જે મૂલ્ય ચૂકવ્યું છે એનોય તાળો ક્યારેક તટસ્થતાથી મેળવવા જેવો છે.

આપણે મેળવ્યાના જમા પાસે સામી બાજુએ જે ઉધાર છે એને પણ ક્યારેક ધ્યાનમાં લઇને વિચારવું જોઇએ કે હમને ક્યા પાયા? હમને ક્યા ખોયા?

આપણા વ્યવહારમાં માનવતાની સુગંધ આવે છે ?

માણસની સંસ્કારીતાનું માપ તે નાનામાં નાના માણસો સાથે કેવીરીતે વર્તે છે. તેના પરથી કાઢી શકાય. આપણે આપણા સાંસારિક જીવન વ્યવહાર અને ધંધાદારી કાર્યોને લીધે અનેક મનુષ્યોના સંબંધમાં, સંપર્કમાં અને સંસર્ગમાં આવીએ છીએ. જ્યારે આપણે આપણી સમકક્ષનાં માણસોને મળીએ ત્યારે આપણે સારી રીતે વર્તીએ તે સ્વાભાવિક છે આપણાથી મોટા માણસોને, હોદાની રુએ ઊંચા આસને બેઠેલ કે રાજકીય સત્તારુઢ માણસ હોય કે શ્રીમંત હોય, ત્યારે આપણે, વિવેકમાં ખામી ન આવે તેનું ધ્યાન રાખીએ છીએ. લળી લળીને માન આપીએ છીએ. એ બધાં પાછળ આપણી સ્વાર્થ દૃષ્ટિ પણ ક્યારેક હોય છે. પોતાનાથી કોઇપણ રીતે મોટા હોય તેમને માન આપવું એ આપણી ફરજ છે, એ આપણી સંસ્કૃતિ છે. પરંતુ માણસની સાચી ઓળખ, તે જ્યારે તેનાથી નાના માણસો સાથે કેવીરીતે વર્તે છે. તેના પરથી મળે છે. સામાજિક કે ધંધાદારી દૃષ્ટિએ આ નાના માણસો પાસે તેને કશો સ્વાર્થ કે ખાસ સ્વાર્થ જેવું નથી હોતું. તેથી તેમની સાથેના વર્તન-વ્યવહારમાં તે વિવેક-વિનય રાખવાનું કાં તો જરુરી માનતો નથી અથવા તો તે પ્રકારનું વર્તન જ તેને યોગ્ય લાગે છે.

ઘરના માણસો સાથેનાં વર્તન-વ્યવહારની વાત હમણા બાજુએ રાખીએ. બહારના માણસો નાના માણસો સાથેના વર્તનને આપણે તપાસીએ.

આપણે કોઇ સંસ્થા સાથે સંકળાયેલા હોઇએ અને તેના હોદેદાર પણ હોઇએ ત્યારે એ સાર્વજનિક સંસ્થાના પ્યૂન(પટાવાળા), કલાર્ક (મહેતાજી) શાળા હોય તો તેના અન્ય કર્મચારી વગેરેને એમના, સંસ્થાના કામ અંગે આપણા પાસે આવવાનું થાય, તેઓ આપણી આમન્યા જાળવે એટલે આવીને ઊભા રહે. જે કાગળોમાં, ચેકબુકમાં, રજીસ્ટર વગેરેમાં સહી લેવાની હોય તે આપણને ધરે. આપણે એ બધું જોઇએ, સહીઓ કરીએ ત્યાં સુધી તે માણસ ઊભો રહે.

ત્યારે આપણું ધ્યાન જવું જોઇએ અને તેમને વિવેકથી બેસોને કહેવું જોઇએ. તેમને આવો કહીને આવકાર પણ આપવો જોઇએ અને પાણીનો ગ્લાસ પણ તેમને માટે મંગાવવો જોઇએ. એ એમની ફરજ બજાવે છે તેના ભાગરુપે આવે છે માટેની ઉપેક્ષા ન કરવી જોઇએ.

જેમની સાથે આપણને સંબંધો હોય તેમને ત્યાં શુદ્ધ પ્રસંગો હોય કે અન્ય કંઇ કાર્ય હોય ત્યારે તેમના માણસો આપણે ત્યાં પત્રિકા, પુસ્તિકા, પ્રસાદના પડીકાં વગેરે આપવા આવે છે. તેઓ દૂરથી પણ આવતા હોય. તેઓ માત્ર નોકરો છે એમ માની, તેમની પાસેથી ઉપર લખી વસ્તુ લઇને તેમને જવા દેવા, એવું મોટે ભાગે થતું હોય છે. આવા પ્રસંગે તેમને ઓળખી લઇને, ઘરમાં બોલાવી બેસાડવા, પાણી પાવું, ચાની ઓફર કરવી અને જેમણે આમંત્રણ કે જે કંઇ મોકલ્યું હોય તેનો આભાર વ્યક્ત કરતો સંદેશો તે માણસ સાથે મોકલવો, તે એક સંસ્કારી મનુષ્યની ફરજ છે આપણે આમાંથી કેટલું કરીએ છીએ?

આવા નાના પ્રસંગોમાં આપણને નાના નાના માણસો સાથે મળવાનું થાય, કામ કરવાનું થાય ત્યારે તેમના પ્રતિ માન, પ્રેમ, સહાનુભૂતિ અને આભારની લાગણી વ્યક્ત કરવી તે સંસ્કારી ફરજ છે.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, દ્વારા રચિત

રાજસ્થાન ઝોન અને ઉત્તર ભારત ઝોન

દિપાવલી શુભેચ્છા અને નૂતન વર્ષના હાર્દિક અભિનંદન પાઠવે છે

RAJASTHAN ZONE

PRAMUKH- HIRALAL RATANSI VASANI, AJMER
UP PRAMUKH- GANGARAM KANJI RAVANI, JAIPUR
UP PRAMUKH- BABULAL HIRJI VASANI, BHILWARA
MAHA MANTRI- VASANTBHAI ARJAN DADGA, KOTA
SAH MANTRI- MAGANBHAI MAVJI POKAR, JODHPUR
SAH MANTRI-RAVJIBHAI KHIMJI VALANI, UDAIPUR
KHAJANCHI- PREMJIBHAI NARAYAN VASANI, KOTA
SAH KHAJANCHI- CHANDUBHAI DAYABHAI VASANI, AJMER
KAROBARI MEMBER- GOVIND RATANSI DIWANI, KISANGARH
KAROBARI MEMBER- DEVSI PARBAT RAVANI, JAIPUR
KAROBARI MEMBER-DEVJI GOPAL CHHABHAIYA, JAIPUR
KAROBARI MEMBER- GOPAL RATANSI VAGADIA, JAIPUR
KAROBARI MEMBER-VISHRAM MULJI RAVANI JAIPUR
KAROBARIMEMBER-LEELADHAR JETHA JABWANI, UDAIPUR
KAROBARI MEMBER-BHIMJIBHAI DEVJI VELANI, JODHPUR
KAROBARI MEMBER-PURUSHOTTAM KARAMSI SANKHALA, BHILWARA
KAROBARI MEMBER-CHUNNILAL KARSAN VALANI, BHILWARA
KAROBARI MEMBER- CHANDUBHAI RATANSI VASANI, AJMER
NAYAY SAMITI CHAIRMAN- NANJIBHAI RAMJI POKAR, UDAIPUR

SHRI KUTCH KADVA PATIDAR SANATAN SAMAJ JAIPUR
SHRI KUTCH KADVA PATIDAR SANATAN SAMAJ UDAIPUR
SHRI KUTCH KADVA PATIDAR SANATAN SAMAJ JODHPUR
SHRI KUTCH KADVA PATIDAR SANATAN SAMAJ AJMER
SHRI KUTCH KADVA PATIDAR SANATAN SAMAJ BHILWARA
SHRI KUTCH KADVA PATIDAR SANATAN SAMAJ KOTA

SHRI AKHIL BHARTIYA KUTCH KADVA PATIDAR SAMAJ
TRUSTY- GANGARAMBHAI HIRALAL SANKHALA, NEW DELHI
MANTRI- SHANKARLAL PARBATBHAI RAVANI, JAIPUR
EXECUTIVE MEM.- VIRCHANDBHAI MAVJI POKAR, JODHPUR
EXECUTIVE MEM.- RAVILAL KHIMJIBHAI SANKHALA, NEW DELHI

SHRI AKHIL BHARTIYA KUTCH KADVA PATIDAR MAHILA SANGH
ADVISOR- MRS. JAVERBEN GANGARAM SANKHALA, NEW DELHI
KAROBARI MEMBER- MRS. NARBADA SHANKARLAL RAVANI, JAIPUR
KAROBARI MEMBER- MRS. MANJULABEN JHAVER SANKHALA,DELHI

UTTAR BHARAT ZONE

PRAMUKH-VALJI DEVSI MAKANI, NEW DELHI
MAHA MANTRI- AMRITBHAI NARAYAN POKAR, NEW DELHI

SHRI KUTCH KADVA PATIDAR SAMAJ DELHI (REG.)
TRUSTY- LAXMANBHAI NANJI CHOUHAN
TRUSTY- GANGARAMBHAI HIRALAL SANKHALA
TRUSTY-KARSANBHAI VISHRAMBHAI POKAR
TRUSTY-KARSANBHAI VISHRAMBHAI CHOUHAN
TRUSTY-RAVILAL KHIMJI SANKHALA
PRAMUKH- DAYARAM VELJIBHAI SANKHALA
UP PRAMUKH- KANTILAL DHANNARAM SANKHALA
MAHA MANTRI- DR. RAVILALBHAI KARSAN SENGANI
MANTRI- AMRITBHAI NARAYANBHAI POKAR
MANTRI- VALJI DEVSHI MAKANI
KHAJANCHI- BHIMJIBHAI DHANJIBHAI SENGANI
SAH KHAJANCHI- GOPALBHAI RAMJIBHAI GORANI
AUDITOR- RAMJIBHAI NARAYANBHAI POKAR
KAROBARI MEMBER- DAMODARBHAI MULJI SANKHALA
KAROBARI MEMBER- HARDASBHAI RAMJI GORANI
KAROBARI MEMBER- RATANSIBHAI HIRJI DIWANI
KAROBARI MEMBER-LALCHAND PARBAT RAVANI
KAROBARI MEMBER-PRAVIN NANJI CHAUHAN
KAROBARI MEMBER-PURUSHOTTAM MANJI RAVANI
KAROBARI MEMBER-VASANT DARDAS RAVANI
KAROBARI MEMBER-GOVIND MULJI SENGHANI
KAROBARI MEMBER- HARILAL MEGJI SENGHANI
KAROBARI MEMBER- JAGDISHBHAI DEVSI POKAR
KAROBARI MEMBER-BABULAL VALJI DIWANI
KAROBARI MEMBER-ARVINDBHAI DEVJI CHHABHAIYA
KAROBARI MEMBER- NARSINHBHAI KARSAN POKAR
KAROBARI MEMBER-HARILAL NANJI CHOUHAN (FARIDABAD)
KAROBARI MEMBER-DINESHBHAI DEVSHI BHAGAT (FARIDABAD)
KAROBARI MEMBER-PURUSHOTTAM SHIVDAS GORANI
KAROBARI MEMBER-UTTAM PREJI LIMBANI
KAROBARI MEMBER- MRS. MANJULABEN JAHWARBHAI SANKHALA
KAROBARI MEMBER- MRS. RADHABEN RAVILAL SENGANI

SHRI AKHIL BHARTIYA KUTCH KADVA PATIDAR YUVASANGH , UTTAR BHARAT REGION

HODDEDARO
RC- UTTAM PREMJI LIMBANI , DELHI
IPP- SHYAM PARBAT CHHABHAIYA, JAIPUR
RVC- VINOD DEVJI CHHABHAIYA, JAIPUR
RDC-PURUSHOTTAM SHIVDAS GORANI, DELHI
RDC- DINESH RAMJI RUDANI, AJMER
RDC- YOGESH GANGARAM RAVANI, JAIPUR
RCS- VINOD RAVILAL SANKHALA, DELHI
R PRO- SAVAN ARVIND CHHABHAIYA, DELHI
RT- HARISH RAVJI SENGHANI,DELHI
RJS-KANTI MAVJI SENGHANI,DELHI
RDS-AJAY KESHAVLAL SANKHALA, DELHI
RDS- MUNESH PRABHU PAJWANI, BHILWARA
RDS- KANTI DEVSI VAGADIA, JAIPUR
RJT- PRAVIN RAMJI BHADANI, JODHPUR

CONVINER
YSK- SHANKARLAL PARBAT RAVANI
HEALTH- ARVIND RATANSI DIWANI
EDUCATION-VIPUL NANJI POKAR
BUSSINESS CELL- ASHISH VALJI MAKANI
SPORTS- RAHUL MAVJI SENGHANI
WEBCOM- DEEPAK SHANKARLAL RAVANI
YUVA UTKARSH- MRS.SANGEETA AMRAT RAVANI
POLITICAL- KANTILAL DAYABHAI SANKHALA
AGRICULTURE- PRAVEEN PREMJI JADVANI
MATRIMONIAL- MRS. RASHMI UTTAM LIMBANI
SOCIAL- HARESH DEVSI RAVANI
PRACHAR - SAVAN ARVIND CHHABHAIYA
FUND- HARISH RAVJI SENGHANI

EXECUTIVE MEMBER
AMRIT GOPAL RAVANI
DILIP CHANDULAL VAGADIA
PRAKASH MAGANLAL RAVANI
JAYANTI HARDAS VAGADIA
YOGESH SHYAM CHHABHAIYA
URMILA VINOD CHHABHAIYA
MRS.MAMTA YOGESH RAVANI
MRS.PREETI BEN KANTI VAGADIA
VINOD PREMJI VASANI
BHAVESH BABUBHAI VASANI
MRS.LAXMIBEN MUESH PAJWANI
ARVIND GOVIND KHETANI
ANIL CHANDULAL VASANI
MRS.DAKSHABEN VASANT VASANI
AJAY SHANKARLAL BHADANI
MRS.URVI PRAVEEN BHADANI
HEMANT DHANJI RAVANI

EXECUTIVE MEMBER
RAVI HARDAS GORANI
VIJAY JETHA CHHABHAIYA
KIRTI AMBALAL CHAUHAN
DHRUV RAVJI SENGANI
PIYUSH LAKHAMSI POKAR

ADVISOR
VALJI DEVSI MAKANI
SHANKAR LAL PARBAT RAVANI
RAVJI PETHA RUDANI
GOPAL RATANSI VAGADIA
KISHORE KANJI CHOPDA

CENTRAL CABINET MEMBER
JAGDISH KARSAN CHAUHAN
KISHORE GANGARAM SANKHALA
JASWANTI JAGDISH CHAUHAN

SHRI DAKSHIN BHARAT KUTCH KADAVA PATIDAR SAMAJ

(TAMILNADU - KERALA - PONDICHERRY)

OFFICE BEARERS

PRESIDENT



Shivgan Kheta Vasani
Shengottah

VICE PRESIDENT




Khimji Manji Bhawani
Chennai

VICE PRESIDENT



Shamji Ramji Limbani
Chidambaram

I.P. PRESIDENT



Ravji Bhimji Bhadani
Chennai

CHIEF SECRETARY



Mukesh Dhanji Halpani
Hosur

TREASURER



Ravilal Dahya Jadwani
Tambaram

SAMUH LAGNA SAMITI

Adhyaksh:
RAVJI HANSARAJ CHHANHAIYA - Dindigul
Secretary:
ASHWIN PREMJI POKAR - Madurai

AROGYA NIDHI SAMITI

Adhyaksh:
KHIMJI MANJI BHAWANI - Chennai
Upadyaksh:
JITENDRA AKHAI JADWANI - Cuddalore

SHIKSHAN (EDUCATION)

Adhyaksh:
KANTILAL CHUNILAL RAMJIYANI - Tanjavur

SAMAJIK NYAY SAMITI

Adhyaksh:
RAVJI BHIMJI BHADANI - Chennai
Upadyaksh:
JOGESH KARAMSI POKAR - Chennai

ADHYATMIK / SANSKRUTIK

Adhyaksh:
NATHUBHAI KHETA VASANI - Trichy
Upadyaksh:
PURSHOTTAM BHANJI RANGANI - Cochin

LEGAL ADVISORS

Adhyaksh:
KISHORE BHAVANJI MAIYAT - Rajapalayam

DAKSHIN BHARAT MAHILA SANGH

President
KANTABEN LALIT DIWANI - Shencottah
Chief Secretary
VIMALABEN KHIMJI BHAWANI

DBR YUVA SANGH

President
KISHORE HANSARAJ BHAWANI - Coimbatore
Chief Secretary
ANAND MULJI KALARIYA

CHENNAI ZONE
PRESIDENT : JOGESH KARAMSHI POKAR
VICE PRESIDENT : MULJI PREMJI KALARIYA
SECRETARY : NANJI MANJI JADAWANI

POLLACHI ZONE
PRESIDENT : GANGADAS MEGHJI JADAWANI
VICE PRESIDENT : KANTILAL MANJI RAVANI
SECRETARY : RAMESH PREMJI VASANI

NAMAKKAL ZONE
PRESIDENT : MUKESH DHANJI HALAPANI
VICE PRESIDENT : KARAMSHI ABJIBHAI VASANI
SECRETARY : DHANJI VALJI JADAWANI

MADURAI ZONE
PRESIDENT : HARISH BHAVANJI MAIYAT
VICE PRESIDENT : VINOD MAGANLAL BHAWANI
SECRETARY : BHAVANLAL DEVJI RUDANI

TRICHY ZONE
PRESIDENT : NATHUBHAI KHETA VASANI
SECRETARY : KANTILAL CHUNILAL RAMJIYANI

KANCHEEVARAM ZONE
PRESIDENT : MEGHJI MANJI JADAWANI
VICE PRESIDENT : SHAMJI KARAMASI JADAWANI
SECRETARY : VIMAL JEEVARAJ MAIYAT

PONDICHERRY ZONE
PRESIDENT : NARASHI MANJI JABUWANI
VICE PRESIDENT : RATANSHI DHANJI BHAWANI
SECRETARY : JETHALAL VALJI JABUWANI

CHIDAMBARAM ZONE
PRESIDENT : DAMJI KANJI DIWANI
VICE PRESIDENT : UMARSHI KESHARA VELANI
SECRETARY : PRAVEEN KHETA DIWANI

KERALA ZONE
PRESIDENT : MOHANLAL KANJI MAIYAT
VICE PRESIDENT : PURUSHOTTAM BHANJI RANGANI
SECRETARY : NANDALAL DEVJI BHAGAT

SHENGOTTAH ZONE
PRESIDENT : RANCHHOD MAVJI MAIYAT
SECRETARY : LALITH MAVJI DIWANI

Asst. TREASURER



Lalit Mavji Diwani
Shencottah

Asst. SECRETARY



Popatlal Karsan Pokar
Kancheepuram

SECRETARY



Jitendra Akhai Jadwani
Cuddalore

Wish You and Your Family ...



and



Happy New Year

શ્રી અખિલ ભા.ક.ક.પા. સમાજ કચ્છ ઝોન વિભાગ નખત્રાણા

શુભ દિપાવલી એવમ્ નૂતન વર્ષાભિનંદન

વ્હાલા જ્ઞાતિ બંધુઓ! જયશ્રી લક્ષ્મીનારાયણ.


નૂતન ઉમંગ-ઉત્સાહ-આશાઓ સાથે નવા વર્ષ વિ.સંવત ૨૦૭૪નું વર્ષ વિતેલા વર્ષમાં થયેલ લાભો અને આનંદની ભક્તિમય પળો માણી તેનાથી પણ વિશેષમાં વિશેષ પળો આખાય સમાજ પરિવાર સાથે માણવા મળે તેવી માં ઉમિયા તેમજ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના.

નૂતન વર્ષ આપણે તથા આપણા જ્ઞાતિ બંધુઓને સર્વે પ્રકારે સુખ-સમૃદ્ધિ બક્ષે, સૌના ઉપર આપણા ઈષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન તેમજ આપણી કુળદેવી માં ઉમિયા માતાજીની કૃપા વિશેષ પ્રમાણમાં ઉતરે સાથે સાથે આધ્યાત્મિક માર્ગમાં પણ ભક્તિ અને શક્તિ સાથે જીવન જીવવાની કૃપા કરીએ એવી પ્રાર્થના.

સમાજ દ્વારા થતાં કન્યા કેળવણી અને યુવા કેળવણીને વેગવંતી બનાવવા અપીલ. | સમાજ દ્વારા લોક ઉપયોગી કાર્યોને સમાજના ઘર ઘર સુધી પહોંચાડવાનું મહત્વ કાર્ય | સમાજ દ્વારા ઘર ઘર ચુલા ઘર ઘર દાન તેવી મહત્વની યોજના સમાજ દ્વારા હાથ ધરવા | આવેલ દરેક પ્રવૃત્તિમાં ઘર ઘરનું યોગદાન એ ઉમદા હેતુને વેગવંતુ બનાવવા કામગીરી. | નખત્રાણા ઝોન નખત્રાણા મધ્યે હોતા સમાજની દરેક પ્રવૃત્તિ તેમજ યુવાસંઘ અને | મહિલા સંઘના દરેક કાર્યક્રમમાં યોગદાન આપીને વેગવંતુ બનાવવાના પ્રયાસ | નખત્રાણા ઝોન દ્વારા દરેક ગામે ગામના પ્રસંગો તેમજ જાત મુલાકાત લઈને | સમાજના દરેક કાર્યની માહિતી પહોંચાડવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છીએ.

: શુભેચ્છકો :


પ્રમુખશ્રી
શ્રી સુરેશભાઈ કાનજીયાણી


મહામંત્રીશ્રી
શ્રી હિરાલાલ ધનાણી


ઉપપ્રમુખશ્રી
શ્રી નવિનભાઈ ચોપડા


ઉપપ્રમુખશ્રી
શ્રી હિરાલાલ ભગત


મંત્રીશ્રી
કાન્તીલાલ રૈયાણી


મંત્રીશ્રી
બાબુલાલ લીંબાણી


મંત્રીશ્રી
વિનોદભાઈ રામજીયાણી


ખજાનચીશ્રી
શ્રી અરજણભાઈ તેજાણી


સહખજાનચીશ્રી
શ્રી વેલજીબાઈ મુખી

ન્યાય સમિતિ


પ્રમુખશ્રી
શ્રી રતનશીભાઈ ભીમાણી


મહામંત્રીશ્રી
શ્રી મણીલાલ કેશરાણી


ઉપપ્રમુખશ્રી
શ્રી ગંગારામભાઈ સાંખલા


ઉપપ્રમુખશ્રી
શ્રી પરસોત્તમભાઈ વાસાણી


મંત્રીશ્રી
શ્રી વસંતકુમાર છાભૈયા


મંત્રીશ્રી
ગં.સ્વ.ઉર્મિલાબેન ખેતાણી


ખજાનચીશ્રી
શ્રી તુલશીભાઈ પોકાર


સહખજાનચીશ્રી
શ્રી જયંતીલાલ હળપાણી


મહિલા સભ્યશ્રી
શ્રીમતી ઉર્મિલાબેન ડાયાણી


મહિલા સભ્યશ્રી
શ્રીમતી કમળાબેન પોકાર

સ્થળઃ શ્રી અખિલ ભા.ક.ક.પા. સમાજ કચ્છ ઝોન વિભાગ, નખત્રાણા
પાટીદાર ભવન (છાત્રાલય) નખત્રાણા-કચ્છ.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

પશ્ચિમ બંગાળ ઝોન

પ્રમુખ :



અમૃતલાલ વેલજીભાઈ પારસીયા
કલકત્તા

ઉપપ્રમુખ :



ઈશ્વરભાઈ મુળજીભાઈ ભાવાણી
ડાનકુની

ઉપપ્રમુખ :



દેવરામભાઈ ભાણજીભાઈ લીંબાણી
મગરા

મહામંત્રી :



શિવલાલ સામજીભાઈ ચોપડા
કલકત્તા



સહમંત્રી : ઈશ્વરલાલ નારણભાઈ સુરાણી, હરીપાલ



કોષાધ્યક્ષ : તુલશીભાઈ વિશ્રામભાઈ ધોળુ, કલકત્તા

શુભ દિપાવલી અને નવ વર્ષની હાર્દીક શુભેચ્છા અને અભિનંદન

ઝોન ન્યાય સમિતિ



અધ્યક્ષ: રવજીભાઈ નાનજીભાઈ નકરાણી, કલકત્તા



ઉપાધ્યક્ષ: રામજીભાઈ પ્રેમજીભાઈ લીંબાણી, કલકત્તા

કાર્યવાહ સભ્યો

ઈશ્વરલાલ રામજી રુડાણી, કલકત્તા
વેલજીભાઈ પ્રેમજીભાઈ રુડાણી, કલકત્તા
પ્રેમજીભાઈ નાનજીભાઈ ડાયાણી, કલકત્તા
વિશ્રામભાઈ નાનજીભાઈ નાકરાણી, કલકત્તા
પ્રેમજીભાઈ લધાભાઈ ધોળું, બૈદ્યબાટી
વસંતભાઈ માવજીભાઈ રામાણી, ઉત્તરપારા
દેવજીભાઈ હંસરાજભાઈ લીંબાણી, મગરા
ચંતીલાલ સામજીભાઈ ગોરાણી, મેમારી
તુલશીભાઈ પેથાભાઈ ઠાકરાણી, શક્તિગડ
તુલશીભાઈ પ્રેમજીભાઈ વાસાણી, એગ્રા
યુવાસંઘ પ્રતિનિધિ
યોગેશ મોહનલાલ છાભૈયા, કલકત્તા
નરેન્દ્રન વાલજીભાઈ માંકાણી, કલકત્તા

કેન્દ્રીય કારોબારી સભ્ય



રમણીકલાલ દેવજીભાઈ રુડાણી કલકત્તા



કિશોરભાઈ ખીમજીભાઈ લીંબાણી કલકત્તા

ઝોન અંતર્ગત આવતી સમાજો

કલકત્તા – શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ
પ્રમુખ : રવજીભાઈ નાનજીભાઈ નાકરાણી, કલકત્તા
મહામંત્રી : ઈશ્વરલાલ રામજીભાઈ રુડાણી, હાવડા

શ્રીરામપૂર – શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ
પ્રમુખ : ઈશ્વરભાઈ મુળજીભાઈ ભાવાણી, ડાનકુની
મહામંત્રી : વસંતભાઈ માવજીભાઈ રામાણી, ઉત્તરપારા

તારકેશ્વર – શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ
પ્રમુખ : નારણભાઈ દેવજીભાઈ સુરાણી, હરીપાલ
મહામંત્રી : અમૃતલાલ વસ્તાભાઈ લીંબાણી, સિયાખાલા

મિદનાપુર – શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ
પ્રમુખ : જયંતિલાલ માંનણભાઈ ભીમાંણી, ગોમુડાં
મહામંત્રી : તુલશીભાઈ પ્રેમજીભાઈ વાસાણી, એગ્રા

મગરા – શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ
પ્રમુખ : ચંદુભાઈ મેઘજીભાઈ લીંબાણી, મગરા
મહામંત્રી : દેવરામભાઈ ભાણજીભાઈ લીંબાણી, મગરા


શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મધ્ય ગુજરાત ઝોન


શુભ દિપાવલી સાથે નવા વર્ષના સાલમુબારક

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ રચીત મધ્ય ગુજરાત ઝોન ભારતભરમાં વસતા જ્ઞાતિજનોને નવા વર્ષના સાલમુબારક જ પાઠવે છે. સંવત ૨૦૭૪ થી શરુ થતુ નવુ વર્ષ સર્વે જ્ઞાતિના પરિવારજનોને દિર્ઘાયુષ્ય બક્ષે તેમજ જીવન, સુખમય, સમુધ્ધમય, તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ઉત્તરોત્તર આર્થીક પ્રગતીશીલ બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના...

હોદેદારશ્રીઓ


પ્રમુખશ્રી
ધનજીભાઈ સાંખલા
નડીયાદ


ઉપપ્રમુખશ્રી આણંદ
વિભાગ પ્રભારી હરીભાઈ
ધોળુ-પેટલાદ


ઉપપ્રમુખશ્રી-વડોદરા
વિભાગ પ્રભારી નારણભાઈ
માકાણી-વડોદરા


ઉપપ્રમુખશ્રીખેડા
વિભાગ પ્રભારી નથુભાઈ
પોકાર-કઠલાલ


મહામંત્રીશ્રી
અમૃતભાઈ માકાણી
બોરસદ


સહમંત્રીશ્રી
જયંતીભાઈ ભગત
કપડવંજ


સહમંત્રીશ્રી
ચંદુભાઈ ભાદાણી
આણંદ


સહમંત્રીશ્રી
ભરતભાઈ લીંબાણી
પદમલા


ખજાનચીશ્રી
ખીમજીભાઈ પોકાર
માતર


સહખજાનચીશ્રી
જયંતીભાઈ પોકાર
પણસોરા


સહખજાનચીશ્રી
નરસિંહભાઈ લિંબાણી
નડીયાદ

સહખજાનચીશ્રી
ભવાનજીભાઈ વાગડીયા
વડોદરા


IPP તેજાભાઈ
નાકરાણી-આણંદ


ન્યાય સમિતિ-ચેરમેનશ્રી
મહેન્દ્રભાઈ પોકાર-આણંદ




ન્યાયસમિતિ-મંત્રીશ્રી
ધરમશીભાઈ પોકાર-વડોદરા


ન્યાય સમિતિ-ખજાનચીશ્રી
માવજીભાઈ લીંબાણી-નડીયાદ

મધ્ય ગુજરાત ઝોનમાં આવતી ઘટક સમાજો

ઘટક સમાજ	પ્રમુખશ્રીનું નામ
આણંદ	તેજાભાઈ વેલજીભાઈ નાકરાણી
આણંદ ગ્રામિણ	વાલજીભાઈ ભાણજીભાઈ પોકાર
ચિખોદરા	નારણભાઈ મેઘજીભાઈ માકાણી
પેટલાદ	પ્રેમજીભાઈ વાલજીભાઈ ભાવાણી
બોરસદ	ખીમજીભાઈ પરબતભાઈ ચૌહાણ
બોરસદ તાલુકા	નવિનચંદ્ર ગોપાલભાઈ માકાણી
ખંભાત	દેવેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ભાદાણી
તારાપુર	જીવરાજભાઈ શીવજીભાઈ જાદવાણી
સોજીત્રા	હીરાલાલ શામજીભાઈ ભીમાણી
ઊમરેઠ	ગંગારામભાઈ વાસાણી
પણસોરા	કેશવલાલ ભગત
સારસા	દિનેશભાઈ મનજીભાઈ ભગત
વાસદ	શીવદાસભાઈ વાલજીભાઈ જાદવાણી
નડીયાદ-મંજીપુરા	ધનજીભાઈ દામજીભાઈ સાંખલા

ઘટક સમાજ	પ્રમુખશ્રીનું નામ
નડીયાદ-ઉદ્યોગનગર	કેશવલાલ કાનજીભાઈ કાલરીયા
નદીયાદ-સત્સંગ	પરસોત્તમભાઈ દેવજીભાઈ વાસાણી
નડીયાદ સ્વામિનારાણ	રામજીભાઈ નારણભાઈ પટેલ
ઠાસરા	દયારામભાઈ લખમશીભાઈ છાભૈયા
ડાકોર	અમૃતભાઈ વાલજીભાઈ નાયાણી
કપડવંજ	દામોદરભાઈ લાલજીભાઈ પોકાર
કઠલાલ	નથ્થુભાઈ કે. પોકાર
માતર	પચાણભાઈ રતનશીભાઈ રામાણી
વડતાલ	અર્જુનભાઈ ભાણજીભાઈ પટેલ
બાલાસીનોર	કરમશીભાઈ ગોપાલભાઈ માકાણી
સેવાલીયા	ચંદુભાઈ નારણભાઈ પોકાર
મહેમદાવાદ	રતીલાલ રવજીભાઈ ધોળુ
હરણી-સમા વિસ્તાર	રતીલાલ વિરજીભાઈ ભાવાણી
છાણી વિસ્તાર	નારણભાઈ પ્રેમજીભાઈ માકાણી

ઘટક સમાજ	પ્રમુખશ્રીનું નામ
વડોદરા-શહેર વિસ્તાર	અમૃતભાઈ પરબતભાઈ ઠાકરાણી
વડોદરા ન્યુ વી.આઈ.પી.	વાલજીભાઈ રામજીભાઈ કાલરીયા
મકરપુરા	ભવનભાઈ માવજીભાઈ વાઘડીયા
અટલાદરા-ગોત્રી	નરસિંહભાઈ રતનશીભાઈ લીંબાણી
બાજવા-ગોરવા	જયંતીભાઈ નારણભાઈ રંગાણી
સાવલી તાલુકા	દામોદરભાઈ ડાહ્યાભાઈ હળપાણી
હાલોલ	પ્રહલાદભાઈ નારાણભાઈ પોકાર
છોટા ઉદેપુર	અરજણભાઈ શામજીભાઈ ડાયાણી
વાઘોડીયા	નરસિંહભાઈ નારણભાઈ લીંબાણી
ડભોઈ	જયંતીભાઈ અબજીભાઈ ચૌહાણ
પાદરા	બાબુભાઈ પચાણભાઈ ચૌહાણ
પોર-કરજણ	નરશીભાઈ કરમશીભાઈ છાભૈયા
દાહોદ	ખેતાભાઈ પ્રેમજીભાઈ રામાણી
સંખેડા-બોડેલી	હંસરાજભાઈ અર્જુનભાઈ મૈયાત

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

શ્રી દક્ષિણ ગુજરાત કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઝોન

સમસ્ત જ્ઞાતિજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.

-: સમાજના ઝોન ના કર્ણધારો :-

પ્રમુખ શ્રી:-	ભાણજીભાઇ વાલજીભાઇ પોકાર - કડોદરા
ઉપપ્રમુખ:-	બાબુલાલ કરમશીભાઇ જાદવાણી - બિલીમોરા
ઉપપ્રમુખ:-	મગનભાઇ ગોવિંદભાઇ રામાણી - બારડોલી
મહામંત્રી:-	રમેશભાઇ વાલજીભાઇ પારસીયા - સુરત
મંત્રી:-	દામજીભાઇ કાનજીભાઇ પોકાર - ભરૂચ
મંત્રી:-	રવજીભાઇ રતનશીભાઇ દિવાણી - પારડી
મંત્રી:-	બાબુભાઇ હરજીભાઇ રૂડાણી - વલસાડ
ખજાનચી:-	ઝવેરભાઇ માવજીભાઇ રામાણી - સુરત
સહખજાનચી:-	રાજુભાઇ લાલજીભાઇ છાભૈયા - અંકલેશ્વર

-: સમાજ ઝોન દ્વારા સામાજીક ગતિવિધી :-

→ સમૂહલગ્ન:-

ગત વર્ષે ૨૨ મા સમૂહલગ્ન માં ૪૨ યુગલો એ લાભ લીધો હતો અને દરેક યુગલને સુવર્ણ દાન અને ભગવાનશ્રી લક્ષ્મી નારાયણની ચાંદીની મુર્તિ સ્મૃતિભેટ તરીકે વિશેષમાં આપવામાં આવેલ અને સમારોહમાં ૧૦૦૦૦ થી ઉપર ભાઇ-બહેનોની સુચક હાજરી હતી.

→ શંખનાદ:-

ઝોનમા આવેલ તમામ ઘટક સમાજોમાં શ્રી સમાજની યોજના અને તમામ ગતિવિધી થી વાકેફ તથા જ્ઞાન, શીલ, એકતા દ્વારા સમાજના સમૃધિ અને સુરક્ષા બાબતે જાણકારી આપવામાં આવે છે.

SUV નોલેજ કાર્નિવલ આગામી તા. 23-24-25 December 2017 ના કાર્યક્રમમાં આપશ્રીને આવકારવા અમો આતુર છીએ.

ઝોન ની ઘટક સમાજો

સુરત, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, સાયણ, ઓલપાડ, કામરેજ, કડોદરા, કડોદ_ મઢી, બારડોલી, વ્યારા, અડાજણ,મહુવા/કરચેલીયા

મરોલી, વેસ્મા, નવસારી - શહેર, નવસારી - પૂર્વ, નવસારી - મધ્ય, ચિખલી, બિલીમોરા, વલસાડ-ઉત્તર, વલસાડ-દક્ષિણ, વાપી,કીમ

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, મુંબઈ ઝોન

અ.ભા.ક.ક.પા. સમાજ મુંબઇ ઝોનના દરેક કારોબારી સભ્યોવતી દરેક ઘટક સમાજ જ્ઞાતિજનોને દિપાવલીની હાર્દિક શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન

વ્હાલા જ્ઞાતિ બંધુઓને જયશ્રી લક્ષ્મીનારાયણ.

નૂતન ઉમંગ ઉત્સાહ આશાઓ સાથે નવા વર્ષ વિ.સંવત ૨૦૭૪નું વર્ષ વિતેલ વર્ષમાં થયેલ લાભો અને આનંદની ભક્તિમય પળો માણી, તેનાથી પણ વિશેષમાં વિશેષ પળો આખાય સમાજ પરિવાર સાથે માણવા મળે તેવી માઁ ઉમા તેમજ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના.

નૂતનવર્ષ આપણે તથા આપણા જ્ઞાતિ બંધુઓને સર્વે પ્રકારે સુખ-સમૃધ્ધી બક્ષે, સૌના ઉપર આપણા ઇષ્ટદેવશ્રીની કૃપા વિશેષ પ્રમાણમાં ઉતરે, સાથે સાથે આધ્યાત્મિક માર્ગમાં પણ ભક્તિ અને શક્તિ સાથે જીવન જીવવાની કૃપા થાય એવી પ્રાર્થના...

- પ્રમુખશ્રી

શ્રી છગનભાઇ કાનજી પોકાર

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું મુખપત્ર

પ્રચાર પ્રસાર

સનાતન ધર્મ પત્રિકા

જાગૃત ઉજાગર

નખત્રાણા-કચ્છ

પ્રચાર પ્રસાર સમિતિ વતી વિક્રમ સવંત ૨૦૭૪ નું નુતન વર્ષ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સર્વે જ્ઞાતિજનો માટે સુખદાયી, લાભદાયી, અને મંગલદાયી બની રહે અને જ્ઞાતિજનોમાં સ્નેહ, સેવા અને સહકારની ભાવના સાથે સામાજીક એકતા જળવાઈ રહે એવા શુભ આશિષ સાથે દિપાવલી અભિષ્ટચિંતન એવમ શુભકામનાઓ સહ નવાવર્ષના હાર્દિક અભિનંદન મોકલાવીએ છીએ

રંગોળી માં પૂરજો રંગ સરસ....
કે રંગીન થઈ જાશે ધનતેરસ....

રહેજો હંમેશા લાગણી ને વસ...
કે શુભ થઈ જાશે કાળીચૌદસ....

સળગાવી નાખજો નફરત ની પાળી...
કે ચમકાવતી જાશે જીંદગી દિવાળી...

રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ...
કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ...

સંબંધોમાં કદી રાખવી ન ખીજ...
કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ...

દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ...
કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ...

હરખ થી થઈ જવા લોથપોથ...
કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ...

"પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ...
વીતાવજો એકમેકથી લાભ પાંચમ...



કન્વીનર : શ્રી ચંદ્રકાંતભાઈ છાભૈયા



સહ કન્વીનર : શ્રી મોહનભાઈ ભાવાણી



શ્રી કૃષ્ણકુમાર વાગડીયા



શ્રી અમૃતભાઈ નાકરાણી



શ્રી અમૃત ભાવાણી



શ્રી જગદીશ ભોજાણી




શ્રી મનિષ રુડાણી


દીપાવલી ની હાર્દિક શુભકામનાઓ...
Ramhans™ TIMBER
Believe in the Best
NR DOOR®
The Natural Wooden Doors
NR PLY®
Ply Wood•Block Board•Flush Door
NR INTERIO®
Smart Kitchen Accessories
Follow US @
Visit us : www.nrdoors.com
Mail us : info@nrdoors.com
We Believe in Strong Bond of Relation...
realpatidar.com

2017-10-11 -Unjha Judgement in SDP Newspaper (932)









RNI No.: MAHGUJ/2016/68522 : Postal Registration No.: MNE/381/2016-18 : License to post without prepayment : MR/TECH/WPP/345/North-East/2017
Date of Publication: 11th of every month Date of Posting : 13th 14th & 15th of every month: Posted at Patrika Channel Sorting Office, GPO, Mumbai - 400 001

Published and Printed by Valjibhai Hirjibhai Patel, on behalf of Akhil Bharatiya Kutch Kadva Patidar Samaj. Published at: Room No.: 6A, Ganesh Bhuvan, Opp. Kalaniketan Showroom, Tilak Road, Ghatkopar-East, Mumbai : 400077. (India). Printed at Dangat Media Private Limited, 22, Digha M.I.D.C., TTC Industrial Area, Vishnu Nagar, Digha, Navi Mumbai : 400 708. Editor: Mavjibhai Keshrabhai Patel

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

નખત્રાણા-કચ્છ

સતપંથ ધર્મ વિવાદ

અંગે

વિશ્વના કડવા પાટીદારોની સર્વોચ્ચ એકમાત્ર ધાર્મિક સંસ્થા,

"કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા"

દ્વારા સતપંથ ધર્મના વિવાદ અંગે તા. ૦૮ ઓક્ટોબર ૨૦૧૭ના આપેલ નિર્ણય

સનાતન ધર્મ પત્રિકાના ઓક્ટોબર ૨૦૧૭ (દીપોત્સવી) અંકમાં
પ્રકાશિત આ નિર્ણયની નકલ
આપણી જાણ માટે

SHRI A.B.K.K.P.YUVASANGH · ESTD 1972

પ્રચાર પ્રસાર · જાગૃત ઉજાગર

અ.ભા.ક.ક.પાટીદાર મહિલા સંઘ

જ્ઞાતિ જોગ સંદેશ

આદરણીય જ્ઞાતિજનો..........

સતપંથ અંગે જ્ઞાતિમાં ચાલતા વિવાદ અંગેનો કેસ આપણી જ કડવા પાટીદારોની સર્વોચ્ચ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- ઊંઝા ખાતે માતાજીના ધામમાં ચાલી રહ્યો હતો. જેનો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા ગત તા. ૦૮-૧૦- ૨૦૧૭ ના રોજ બંને પક્ષકારોના પ્રતિનિધીઓની હાજરીમાં ઐતિહાસિક ચુકાદો આપેલ છે, તેને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ આવકારે છે. તેમજ સૌ જ્ઞાતિજનોને વિનંતી કરે છે કે આ ચુકાદાને આપણે માન આપીએ, તેનો આદર કરીએ. તે ઉપરાંત કોઈ પણ જાતના સાચા-ખોટા અને વિવાદિત નિવેદનો ટાળીએ અને માતાજી સંસ્થાનના આદેશને આદર આપી તેનું સૌ પાલન કરીએ તેવી આપ સૌને અરજ છે.

પ્રમુખશ્રી : અબજીભાઈ વિશ્રામ કાનાણી
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha



અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના

સનાતન અને સતપંથના વિવાદ અંગે

નિમાયેલ લવાદનો નિર્ણય

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાએ વિશ્વના કડવા પાટીદારોની સર્વોચ્ચ અને અંગત માલિકીની એકમાત્ર ધાર્મિક સંસ્થા છે તેથી પાટીદાર સમાજના હિતોનું રક્ષણ કરવાનું, સમાજમાં સંપ-સહકાર-સંગઠન-ભાવાત્મક એકતા-ભાઈચારો અને મા ઉમિયા પ્રત્યેનો ભક્તિભાવ વધે તે માટેના પ્રયાસો કરે છે. આ સંસ્થા દ્વારા સમાજમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે. આ સંસ્થાનો પારદર્શક અને વિકાસલક્ષી અભિગમ હોવાથી આ સંસ્થાનું સમાજમાં આગવું સ્થાન છે.



Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha



૨

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં વર્ષોથી ચાલતા સનાતન અને સતપંથ ના જે વિવાદ ચાલે છે તે માટે આ બન્ને સંસ્થાઓએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાને લવાદગીરી સોંપી છે જે બન્ને પક્ષોએ લવાદગીરી સ્વીકારી છે. બન્ને સંસ્થાઓ સનાતન સમાજે **તા. ૧૫-૦૯-૨૦૧૫** અને સતપંથ સમાજે **તા. ૨૮-૦૯-૨૦૧૫** ના રોજ પોતાની સંસ્થાના લેટર પેડ ઉપર લખી સંસ્થાઓના જવાબદાર **૧૧-૧૧** પ્રતિનિધિઓના નામ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝામાં રજુ કર્યા હતા. તે અંતર્ગત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાની વાર્ષિક જનરલ સભા તેમજ કારોબારી સભામાં અવાર-નવાર તેમના વિવાદો અંગે રજુઆતો કરવામાં આવેલ તેમજ બન્ને પક્ષના આગેવાનોએ રૂબરૂ અને ટેલીફોન દ્વારા આ વિવાદના ઉકેલ માટે રજુઆતો કરેલ તે અનુસંધાને આ બન્ને સંસ્થાના પ્રતિનિધિઓને અનેકવાર માતાજી સંસ્થાનમાં શાંતિથી સાંભળ્યા. બન્ને પક્ષ તરફથી ખુલાસા-પ્રતિ ખુલાસાઓ કરવામાં આવ્યા બન્ને પક્ષ સાથે અવાર-નવાર મિટીંગો કરીને સાંભળવામાં આવ્યા. આમ ખૂબ જ ઊંડાણ પૂર્વક બન્ને પક્ષોને સમજવાનો પ્રયત્ન કર્યો છે. મા ઉમિયાએ અમને જે સુઝાડયુ તેવી સુઝબુઝથી નીચેના નિર્ણય આપીએ છીએ. જે બન્ને પક્ષોએ અમલ કરવાનો રહેશે.

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha



૩

(૧) સતપંથ અને સનાતન પંથ શબ્દોને કારણે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ વિભાજીત સ્થિતિમાં છે જેને કારણે સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થયેલ છે. જેથી સનાતન અને સતપંથ ને સમરસ કરવાની અત્યંત જરૂરીયાત છે. કચ્છ સમાજના સનાતન અને સતપંથના ભાઈ-બહેનો મા ઉમિયાના સંતાનો હોવાથી હવે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ તરીકે ઓળખવાનો છે. હવેથી સતપંથ અને સનાતન પંથ શબ્દોનો પ્રયોગ કરવાનો રહેશે નહિ અને તે પ્રમાણે સમગ્ર સમાજે સામાજિક વ્યવહાર કરવાનો છે.

(૨) ઈમામશાહ શબ્દ મુસ્લીમ (ઈસ્લામધર્મ) સાથે જોડાયેલો છે જેથી મુસ્લીમ (ઈસ્લામધર્મ) ના કોઈપણ ક્રિયાકર્મો-વિધિ વિધાન સતપંથ સમાજે કરવી યોગ્ય નથી. કચ્છ કડવા પાટીદાર સમાજના સતપંથમાં માનવાવાળાઓએ સંપૂર્ણ પણે હિન્દુ ધર્મના ઈશ્વર તથા ઈશ્વરના અવતારો તથા દેવી-દેવતાઓ વગેરેનું પૂજન કરવું તથા હિન્દુ ધર્મના શાસ્ત્રોનું વાંચન તેમજ તેના પ્રવચનોમાં ભાગ લેવો જોઈએ. જેથી સતપંથ અને સનાતન સંપ્રદાયે સમરસ થઈ સાથે મળીને હિન્દુ ધર્મની ઓળખ ઊભી કરવાની છે. તેથી સમગ્ર સમાજ હિન્દુ કડવા પાટીદાર તરીકે ઓળખતો કરવાનો છે.

(૩) પીરાણાપંથની જે સંસ્થા છે તે સંસ્થામાં કચ્છ કડવા પાટીદાર સમાજના સતપંથમાં માનનારા વર્ષોથી પોતાની આવકના ૧૦ % ફાળો આપે છે જેથી આ સંસ્થાનો સંપૂર્ણ વહીવટ હિન્દુ સનાતન ધર્મ મુજબ આપણા સમાજ પાસે એટલે કે કચ્છ કડવા પાટીદાર સમાજ પાસે રહે તે ખાસ જરૂરી છે. જેથી આ ફંડ આપણા સમાજના વિકાસ માટે વાપરી શકાય.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા-૩૮૪૧૭૦. (ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha



૪

(૪) ઘણા સમયથી બન્ને પક્ષ વ્યકિતગત સામાજિક કે અન્ય સંસ્થાઓમાં એકબીજા સામે કોર્ટ કચેરીમાં જે કેસો કરવામાં આવ્યા છે તે આજ તારીખથી ૯૦ દિવસ સુધીમાં કેસો સંપૂર્ણપણે પાછા ખેંચી લેવા જેથી બન્ને પક્ષ સદભાવ અને પ્રેમ જળવાઈ રહેશે.

(૫) કચ્છ કડવા પાટીદાર સમાજમાં બહેન દિકરીઓ અને સગા વ્હાલાઓ એકબીજાના ઘરે જાય નહિ તેવા જુદા-જુદા ઠરાવો થયેલ છે તે રદ કરવા અને બહેન દિકરીઓ, ભાઈઓ અને સગા વ્હાલાઓમાં બહિષ્કારનું વાતાવરણ ઉભુ થયેલ છે તે નાબુદ કરી સમાજમાં ભાઈચારા અને પ્રેમનું વાતાવરણ ઊભુ કરવું. જેથી કરીને સામાજિક સંગઠનોને સમરસ કરી શકાય.

(૬) અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં આપણા પૂર્વજોએ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓની સ્થાપના કરેલી તે વખતે બન્ને સંપ્રદાયોની સંયુક્ત મિલકતો અને સામાજિક સંબંધો હતા. તેમાં એમની સમજ એવી હતી કે સાથે રહેવાથી ધીરે ધીરે સતપંથમાં માનનારા સનાતન હિન્દુ ધર્મના પ્રવાહમાં ભળી જશે અને તેના પરિણામો પણ આવ્યા છે. હજુ પણ કેટલાક પ્રસંગો સાથે ઉજવવામાં આવે છે. તેથી સતપંથમાં માનનારા ભાઈ-બહેનો સમજપૂર્વક મોટા પ્રવાહમાં ભળી જાય તેવી મા ઉમિયાની ઈચ્છા છે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા-૩૮૪૧૭૦. (ઉ. ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha



૫

(૭) પિરાણા પંથ વિષ્ણુ ભગવાનના દસ અવતારોમાં દસમા અવતાર તરીકે નિષ્કલંકી નારાયણમાં માને છે. જે હિન્દુ ધર્મની માન્યતા વિરૂધ્ધ છે તેના બદલે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ વિષ્ણુ ભગવાનના દસમા અવતારમાં કલકી નારાયણ તરીકે અવતરવાના છે તે મુજબ તેની આરતી/પૂજા કરવી

આપણા હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અધ્યાય **૩** માં **૩૫** મા શ્લોકમાં નીચે પ્રમાણે કહ્યું છે.

श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् ।
स्वधर्मे निधन श्रेयः परधर्मो भयावहः ॥ ३५ ॥

સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે. પોતાના ધર્મમાં મરવું પણ કલ્યાણકારી છે અને અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. ॥ **૩૫** ॥

ઉપર મુજબના લવાદોના નિર્ણયની અમલવારી બન્ને પક્ષે સાથે મળી ભાઈચારાની ભાવનાથી સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજે કરવી, જયારે મિટીંગો, સંમેલનો કરવાની જરૂર પડે ત્યારે સમાજમાં પ્રેમ અને ભાઈચારાનું વાતાવરણ ઊભુ કરવા ઝુંબેશ ચલાવવાની છે જેમાં શ્રી ઉમિયા માતાજી સસ્થાન-ઊંઝા હંમેશા કચ્છ કડવા પાટીદાર સમાજની સાથે છે અને રહેશે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા-૩૮૪૧૭૦. (ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com ● Email : umiyamatajiunjha@gmail.com ● / www.facebook.com/umiyamatajiunjha

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha



૬

આ ચુકાદાના અમલીકરણ માટે સમાજમાં વધુમાં વધુ પ્રચાર થાય તે માટે સમાજની મિટીંગોમાં અને સમાજની માસિક પત્રિકાઓમાં છાપી પ્રચાર કરવો.

ઉપરોક્ત નિર્ણય નીચે જણાવેલ લવાદ કમિટીએ સર્વાનુમતે કરેલ છે.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાની લવાદ કમિટી

૧. શ્રી નારાયણભાઈ લલ્લુદાસ પટેલ - ઊંઝા	પ્રમુખશ્રી
૨. શ્રી મણીભાઈ ઈશ્વરલાલ પટેલ - ઊંઝા	કન્વીનરશ્રી
૩. શ્રી દિલીપભાઈ મણીલાલ પટેલ - ઊંઝા	માનદમંત્રીશ્રી
૪. શ્રી વિક્રમભાઈ ધનજીદાસ પટેલ - ઊંઝા	સભ્યશ્રી
૫. શ્રી પ્રહલાદભાઈ જોઈતારામ પટેલ - મહેસાણા	સભ્યશ્રી
૬. શ્રી વસંતભાઈ નારાયણદાસ પટેલ - ઊંઝા	સભ્યશ્રી
૭. શ્રી બાબુભાઈ એચ. ધોડાસરા - રાજકોટ	સભ્યશ્રી
૮. શ્રી જયરામભાઈ ગોવિંદભાઈ વાંસજાળીયા - જામનગર	સભ્યશ્રી
૯. શ્રી જયંતિભાઈ કાલરીયા - રાજકોટ	સભ્યશ્રી
૧૦. શ્રી ગણેશભાઈ દ્વારકાદાસ પટેલ - સુરત	સભ્યશ્રી

(નારાયણભાઈ એલ. પટેલ)
પ્રમુખ
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા

સ્થળ :- ઊંઝા
તારીખ :- ૦૮-૧૦-૨૦૧૭

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

પ્રચાર પ્રસાર

જાગૃત ઉજાગર

સનાતન ધર્મ પત્રિકા

સનાતન હિંદુ ધર્મ પાળતા કચ્છ કડવા પાટીદારોની કેન્દ્રિય માતૃ સંસ્થા, એટલે "શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ" નું એકમાત્ર માસિક મુખપત્ર, જેમાં આપણને સમાજના અધિકૃત અને આધારભૂત સમાચારો અને વિચારો વાંચવા તેમજ જાણવા મળશે.

સમાજ, યુવક મંડળો, મહિલા મંડળો તેમજ અન્ય સંસ્થાઓના આગેવાનો, સ્વયંસેવકો તેમજ દરેક સમાજ જનો માટે ખુબજ અનિવાર્ય એવું આપણું સર્વેનું સનાતન ધર્મ પત્રિકા, માસિક સમાચાર પત્ર, સાથે જોડાસો અને આપણા સમાજને સહયોગ આપશો.

પત્રિકાનું આજીવન (૧૫ વર્ષ) લવાજમ ભરી તેમજ આપણા ધંધાની જાહેરાત આપી, આપણા સર્વે પર ચડેલું સમાજના ઋણનો ભાર હળવો કરવાનો એક સુંદર મૌકો છે, જે જડપી લેશો.

લવાજમ માટે સંપર્કઃ

શ્રી અમૃતભાઈ નાકરાણી, અંકેલશ્વર

98250 43056

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા નિયુક્ત
પ્રચાર પ્રસાર સમિતિ વતી

કન્વીનર શ્રી ચંદ્રકાંત કાન્તિલાલ છાભૈયા

સહ-કન્વીનર શ્રી મોહનભાઈ પ્રેમજી ભાવાણી

Website: sanatandharmpatrika.com Office Mobile : 77189 77774